

મુજાગતી જણુનારાચો માટે,

ઃ એ ગાઈડ ૩૬૧

ફેસ્ટિવલ No 361

દુલ્લભીશ ટ્રીપર.

ભાગ ૧, અને ૨ સાથે.

વગર માસ્ટરે પોતાની મંગે કુરસતના વખતે
ઇંગ્રેજ શરીખવાની ચોયડી.

ભાગીડી અસિદ્ધ કરી
સાકરસાથ બુલાઈદાસ બુકસેલર.
રીચીસોટ-અમન્ડાવા.

૨૦૦૦.

૧૬૨૬.

આદત ૩.

કોમત ર. ૧-૮૩૦.

ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય

[ગુજરાતી કૌણીરાઓને નિભાગ]

અનુક્રમાક ૧૩૧૩૮- બાંસાક

પુસ્તકનંનું નમન રૂપાંતર ૨૭૨૧૯

વિષય ૦૮૪૫

ગુજરાતી લખુનારાઓ માટે.

એ ગાઈડ ટૂ ઇંગ્લિશ ટીચર.

ભાગ ૧-૨.

—००—

(એઠે શિક્ષકની મહા વગર પોતાની મેળે ઇંગ્રેજ
શીખવાની આપવી.)

વિદ્યાર્થીઓ અને ઇંગ્રેજ નહિ જાણુનારાઓ
માટે ગુજરાતી “અને ઇંગ્રેજમાં.

એમાં જુદી જુદી આનંદાં ગુજરાતી વાક્યો નના અંગ્રેજ
તરફુમે તથા ઉચ્ચાર તથા દૈક્ષ વાક્યોમાં આવેલા ઇંગ્રેજ
શબ્દોના ગુજરાતી અર્થ, અને ઉચ્ચાર, હમેસા
વપરાશમાં આપતી બીજાનંદી નામ, તાર, તથા
ઇંગ્રેજ દુષ્કી ચિહ્નીઓ, લખવાના નમુના,
ગુજરાતી અર્થ સાથે આપવામાં
આવેલાં છે.

—००—

By

C. S. Thakore Esq.

કીમત રૂ. ૧-૧-૦.

સને ૧૯૬૭ ના રૂપ મા એકટ મુજબ રજીસ્ટર કરવેલું છે.
(સર્વ હજુ સ્વધિન)

આચિત ૨ ગ.

મંદિર ૧૯૮૨.

પ્રત ૨૦૦૦.

સને ૧૯૨૬.

ગુરુત વિદ્યાપીઠ ગાંધીજી

આચિત

ગુજરાતી કૌપીરાઈટ-સંગ્રહ

૧૯૧૩૯ નાથી

શપાદી પ્રસિદ્ધ કરનાર
ખુકસેલર સાંકરલાલ પુલાભીદાસ
ગીયરાડ—અમદાવાદ.

મુદ્રક:-પટેલ પુષ્પાતમ સાંકરલાલ.

શ્રી “કિરુદ્ધ મુર્દુલાલય” ગાંધીનગર-અમદાવાદ.

પ્રસ્તાવના.

પોતાની મેળે અંગ્રેજ શીખવાનાં પુસ્તકો લાભમાં એક પછી એક નીકળતાં જન્ય છે, અને તેનો નંદોળો ફેલાવાં પણ થતો જન્ય છે. તેથી મેં પણ ધર્યું મહેનને આ પુસ્તક તૈયાર કરાવ્યું છે. આજકાલ લગભગ ધર્યું રથે અંગ્રેજ સરકારનું રાજ્ય હોવાથી લેઝિને દંગ્રેજ શીખવાની ધર્યું છેણી થાય છે તેમાં નવાઈ નથી. કારણું કે જેવું રાજ્ય નેચી ભાવા અવશ્ય કરીને જાગ્રત્તી લેઝિને; પણ કેટલાક ગરીબ મા બાપના છોકરાઓ થાંડું ધર્યું ગુજરાતી શીખને પછી અભ્યાસ છેણી હે છે. તેઓ વેર એક શિક્ષકની મદ્દુદ શિવાય ઓં ખર્ય આ પુસ્તકમાંથી દુંગ્રેજ ભાગાનું જાન લઈ શકે નેમ છે. તેમજ નેપાલી વર્ગની પણ આ પુસ્તક ધર્યું ઉપયોગી છે.

અન્યાર ગુખીમા આવી જનનાં પાંચ છ પુસ્તકો નીકળી ચુક્યાં છે, પણ શરૂઆતની દુંગ્રેજ શીખનારને નેચી અવઃના લેઝિને નેવા અવહનાની ખામી છે. આ પુસ્તકમાં વ્યાકરણની સમજુતી રાંધી પાડ આપેલા છે. તેથી શીખનારને ધર્યું સહેલું થઈ પડ્યે.

આ પુસ્તક તૈયાર કરવામાં થાણાં અંગ્રેજ પુસ્તકાતી મહદે લીધી છે. જેને માયે નેના લેઝિનો અંતઃકરણથી આભાર માનવામાં આવે છે.

આ પુસ્તક ધર્યું હુક્કી સુલભમાં બદાર પાડવાથી તેમાં જે કંઈ બુઝ રહી ગઈ હોય તે વાંચકા સુધ્યારીને વાંચશે. એવી માનવ જ્ઞાન વિનનિ છે.

કૃ. રીતીરેણ-અમનાવાહ. } • સુક્ષેપાર, }
તા. ૧ દી જાનેવારી ૧૯૨૧. } સાકરલાલ પુલાભીદાસ.

શીખનારને સૂચના.

~~~~~

શરૂઆતથી છેલ્લ શીખનારને પ્રથમ પહેલી તથા બીજી એ, બી, સી, ડી, ઓગાખનાં તથા લખનાં શીખની કોઈ ચોપડીના અસુરની નરત સમજણું પડ્યા. પછી ત્રીજી તથા ચોથી એ, બી, સી, ડી, ને લખનાના ખાડમાં આવે છે ને ઓગાખનાં તથા લખનાં અગામર પાકી શીખની. પછી નેમના ગુજરાતી શાશ્વત ઉચ્ચાર થાય છે તે શીખના. પછી અંગેલ શખદના ઉચ્ચાર તથા જોડળી તથા અર્થ શીખના.

ખંડન થોડા ખાડમાં શાંદો આપેલા છે. તેમના ઉચ્ચાર શીખના પછી વધારે પદ્ધતાના (મેટા રામ) શીખનાની આશિષ કરવી. દરેક પાછી માણે બાકરણુંની પણ સમજુની આપેલી છે. તેના ઉપર ખામ ઘાન આપવું, કારણ કે બાકરણુના નાનથી આપા જટ શીખની શકાય છે તેમજ રૂપું ઓસતના પણ આવંડ છે.

છેલ્લ શીખનારને પોતાના અભ્યાગમાં ઉત્તારળ કરવી નહિ. થોડા ગાડમાં ચાંડુ ગીયાં પણ અગામર પાકું શીખાં.

આ મુસ્તકમાં કે શાંદ ઓકવાર ખાડમાં આણી ગોંડાય તો પછીથી આપો નથી મારે વાંચનારે તે પહેલાના ખાડમાંથી જોઈ લેંનો.

અંગેલમાં જોડણી ગુજરાતીની માદક નથી. ગુજરાતીમાં હસ્તને બદલે દુર્દીં આપે પણ છેલ્લમાં તેમ થાં નથી; મારે જોડણી ઉપર ખામ ઘાન આપવું જોઈજે. તો શીખનારને હોડી મુશ્ટિખલ પડશે.

૯.

~~~~~

અનુકૂળાંશિકા.

વિધય.	જ્ઞાન પદ્ધતો.	પૃષ્ઠ.
(એ બી સી ડી) ભાગેણું બાંચના ઈચ્છે ભૂળાકસો (મારી નાની) ૨		
(એ બી સી ડી) કખવાળી ઈચ્છે ભૂળાકસો (મારા નાની) ઈચ્છે અંકડા ૩		
અચેણ ગૂળાકસો તથા તેમના ગુજરાતીમાં થના હચ્ચાર... ૪-૫		
સ્વરૂપ તથા વ્યાંજન વિષે ૬		
ઈચ્છે ભૂળાકસો જેડિને નામ જામ વિન્દેણે કખવાળી સમલુટી નેડાકસર વિષે. ગુજરાતી સ્વરૂપો તેમની ઈચ્છે જેડલી સાથે, તથા		
ગુજરાતી વ્યાંજનો તેમની ઈચ્છે જેડલી સાથે... ૮		
ખારાખડી ૮-૧૧		
અચેણ સ ઘણા ૧૧-૧૩		
સ્વરૂપોના હચ્ચાર વિષે કણહો તથા વાક્યો ૧૬-૧૫		
પુરુષવાચક શરૂહો ૧૫		
કિંચાપહના વર્તમાન તથા ભૂતકાળના ઇપ ૧૬-૧૬		
ઈચ્છે વાક્ય રચના વિષે ૧૬		
ગુપ્તિબદ્ધ લેટર્સ (મારા અક્ષર) વિષે... ૩૦-૩૨		
આર્થિકસ (પ્રાયધ) વિષે... ૨૨-૨૪		
વચન વિષે ૨૪-૨૭		
ભૂતકાળ તથા ભૂતકૃદત વિષે ૨૭-૩૪		
પૂર્ણ વર્તમાનકાળ વિષે ૩૪-૩૫		
અવિધયકાળ વિષે ૩૬		
વાંચન પાઠ ૧ લો. ૩૬-૩૭		
વાંચન પાઠ ૨ લો. ૩૭		
વાંચન પાઠ ૩ લો. ૩૮		
વાંચન પાઠ ૪ લો. ૪૭-૪૯		
વાંચન પાઠ ૫ લો. ૪૯-૫૩		
વાંચન પાઠ ૬ લો. ૫૩-૫૫		

વાંચન પાડ ૭ મો	૪૪-૪૭
વાંચન પાડ ૮ મો	૪૭-૪૮
વાંચન પાડ ૯ મો	૪૮-૪૯
વાંચન પાડ ૧૦ મો	૪૯-૫૩
વાંચન પાડ ૧૧ મો	૫૩-૫૬
વાંચન પાડ ૧૨ મો	૫૬-૫૯
વાંચન પાડ ૧૩ મો	૫૬-૫૮
પુરુષ વિષે	૫૮
‘તે’ શર્યાદી સમજનું વિષે	૫૯
કાળ વિષે	૬૦-૬૧
સાહાલાણ ઓળખાખવાળી વૃત્તિ	૬૨
વાંચન પાડ ૧૪ મો	૬૩
વાંચન પાડ ૧૫ મો	૬૪
વાંચન પાડ ૧૬ મો	૬૫
વાંચન પાડ ૧૭ મો	૬૦
વાંચન પાડ ૧૮ મો	૭૨
વાંચન પાડ ૧૯ મો	૭૪
વાંચન પાડ ૨૦ મો	૭૬
વિભક્તિ વિષે	૭૮
‘S’ (એચેરેડોટી) એસ વિષે	૮૦
વાંચન પાડ ૨૧ મો	૮૧
વાંચન પાડ ૨૨ મો	૮૨
વાંચન પાડ ૨૩ મો	૮૬
વાંચન પાડ ૨૪ મો	૮૬
વાંચન પાડ ૨૫ મો	૯૧
વાંચન પાડ ૨૬ મો	૯૩
વાંચન પાડ ૨૭ મો	૯૭
વાંચન પાડ ૨૮ મો	૧૦૧
અતિ વિષે	૧૦૪

બાંધન પાઠ ૩૦ મો	૧૧૦
બિશેષખ વિષે...	૧૧૨
બાંધન પાઠ ૩૧ મો	૧૧૩
બાંધન પાઠ ૩૨ મો	૧૧૫
બાંધન પાઠ ૩૩ મો	૧૨૦
બાંધન પાઠ ૩૪ મો	૧૨૪
બાંધન પાઠ ૩૫ મો	૧૨૭
બાંધન પાઠ ૩૬ મો	૧૩૦
બાંધન પાઠ ૩૭ મો	૧૩૬
બાંધન પાઠ ૩૮ મો	૧૩૮
બાંધન પાઠ ૩૯ મો	૧૪૧
બાંધન પાઠ ૪૦ મો	૧૪૧
બાંધન પાઠ ૪૧ મો	૧૪૮
બાંધન પાઠ ૪૨ મો	૧૪૯
બાંધન પાઠ ૪૩ મો	૧૪૯
બાંધન પાઠ ૪૪ મો	૧૪૯
બાંધન પાઠ ૪૫ મો	૧૫૦
બાંધન પાઠ ૪૬ મો	૧૫૨
બાંધન પાઠ ૪૭ મો	૧૫૪
બાંધન પાઠ ૪૮ મો	૧૫૪
બાંધન પાઠ ૪૯ મો	૧૫૫
બાંધન પાઠ ૫૦ મો	૧૫૬
બાંધન પાઠ ૫૧ મો	૧૫૮
બાંધન પાઠ ૫૨ મો	૧૫૯

માટે અંગે.

વિશેષજ્ઞની રાત્રી વિષે	૧૭૦
બાંધન પાઠ ૪૫ મો	૧૭૨
બાંધન પાઠ ૪૬ મો	૧૭૩
અરસુરણ વાક્ય	૧૮૧
નામ વિષે	૨૧૩
બાંધન પાઠ ૫૧ મો	૨૧૫
કિશેલિસેપથ વિષે	૨૧૭
કેવળપ્રમોગી અભ્યાસ વિષે...	૨૧૮

વાંચન પાડ પર મો	૨૧૯
વાંચન પાડ પર મો	૨૨૨
વાંચન પાડ પર મો	૨૩૪
વાંચન પાડ પર મો	૨૩૯
વાંચન પાડ પર મો	૨૪૦
વાંચન પાડ પર મો	૨૪૮
વાંચન પાડ પર મા	૨૩૭
વાંચન પાડ પર મો	૨૪૧
વાંચન પાડ હો	૨૬૩
વાંચન પાડ હો	૨૫૧
વાંચન પાડ હો	૨૫૦
સલ્લાકેદ આણાર્ય તથા છનારીનીટીએ સુડ વિષ	૨૫૮
વાંચન પાડ હો મો	૨૫૮
પરસુરામ રાજ્યોનો જથા તથા વાક્યો...	૨૬૩
સુલાક્ષણને લગતા વાક્યો	૨૮૬
ઘીલાં પરસુરામ વાક્યો	૨૮૫
નિયાળને લગતા વાક્યો	૨૮૬
કુલાનને લગતા વાક્યો	૩૦૭
રેલ્વે તથા અભયોટની સુસાઇનીં પાક્યો	૩૨૩
કુષેલ વરસના મહીના	૩૩૨
શુદ્ધ, રાણિ તથા ઝટુંયો	૩૩૪
દરીઓમેઠીક વાક્યો	૩૩૪
શુદ્ધરાતી તથા ઝુશેલ ઝેણો	૩૩૮
દાર વિષે સુષૂરના	૩૪૬
છેણોમાં કશળ તથા સરસનામાં વંખચા વિષે	૩૫૭
શુદ્ધરાતી અંશેલ અધ્યાતો જથી	૩૫૩-૩૬૪

ધી ઇંગ્લિશ ટીચર.

THE ENGLISH TEACHER, FOR STUDENTS AND OTHERS. IN GUJARATI AND ENGLISH.

(Containing a large Number of Words & Phrases
to enable a beginner to learn English Language
Without the help of a Tutor)

(શિક્ષકની મદ્દ સિવાય ઈંગ્રેજ શીખવાનું મુશ્કલ.)

મુળાકાર વિષે.

THE ALPHABET. [ધી આલ્પાબેટ.]

ગુજરાતી ભાષામાં વાચવા તથા લખવામાં કેમ એક જ જાતના
મુળાક્ષરો કાગરાય છે, તેમ ઈંગ્રેજ ભાષામાં નથી. ઈંગ્રેજ ભાષામાં
આર જાતના મુળાક્ષરો વપરાય છે. નેમાંના પુલેલી એ જાતનાં મુળાક્ષરો
વાંચવાના (છાપવાના) કામમાં આવે છે: અને બાકીના એ જાતનું
કામવાના કામમાં આવે છે.

ઇંગ્રેજ ભાષામાં દરેક મુળાક્ષરની સંખ્યા ૨૬ (છ્યાસ) છે.

ઇંગ્રેઝ ભૂળાક્ષર (છાપવાના) મોટા.

એ.	બી.	સી.	ડી.	ઇ.	એફ.	જ.	એચ.	આઈ.
A	B	C	D	E	F	G	H	I
જે.	ડે.	એલ.	એમ.	એન.	એઓ.	પી.	ક્રુ.	આર.
J	K	L	M	N	O	P	Q	R
એસ.	ડી.	યુ.	વી.	ઉઅલ્યુ.	એક્સ.	વાય.	ઝેડ.	
S	T	U	V	W	X	Y	Z	

ઉપર લખેલા જીસ અક્ષરો છાપવાના કામમાં આવે છે અને
તેને મોટી એ. બી. સી. ડી. (ડેપીટલ લેટર્સ) કહે છે.

ઇંગ્રેઝ ભૂળાક્ષર (છાપવાના) નાના.

એ.	બી.	સી.	ડી.	ઇ.	એફ.	જ.	એચ.	આઈ.
a	b	c	d	e	f	g	h	i
જે.	ડે.	એલ.	એમ.	એન.	એઓ.	પી.	ક્રુ.	આર.
j	k	l	m	n	o	p	q	r
એસ.	ડી.	યુ.	વી.	ઉઅલ્યુ.	એક્સ.	વાય.	ઝેડ.	
s	t	u	v	w	x	y	z	

ઉપર લખેલા અક્ષરો પણ છાપવાના કામમાં વપરાય છે અને
તેને નાની એ. બી. સી. ડી. (સ્મોલ લેટર્સ) કહે છે.

છાપવાના એ જાલના ભૂળાક્ષરો છે તે નીચે પ્રમાણે:-

ઇંગ્રેઝ લખવાના મોટા મૂળાક્ષર.

એ.	બી.	સી.	ડી.	ઇ.	એફ.	જ.	એચ.
<i>A</i>	<i>B</i>	<i>C</i>	<i>D</i>	<i>E</i>	<i>F</i>	<i>G</i>	<i>H</i>
આઅ.	બે.	સે.	ડી.	ઇન્ફ.	એફ.	જી.	એચ.
<i>I</i>	<i>J</i>	<i>K</i>	<i>L</i>	<i>M</i>	<i>N</i>	<i>O</i>	<i>P</i>
ક્યુ.	આર.	એસ.	ડી.	યુ.	વી.	ડિયલ્યુ.	
<i>Q</i>	<i>R</i>	<i>S</i>	<i>T</i>	<i>U</i>	<i>V</i>	<i>W</i>	
એક્સી.	વાય.	એડ.					
<i>X</i>	<i>Y</i>	<i>Z</i>					

ઇંગ્રેઝ લખવાના નાના મૂળાક્ષર.

એ.	બી.	સી.	ડી.	ઇ.	એફ.	જ.	એચ.	આઈ.
<i>a</i>	<i>b</i>	<i>c</i>	<i>d</i>	<i>e</i>	<i>f</i>	<i>g</i>	<i>h</i>	<i>i</i>
ને.	કે.	એલ્ફ.	એમ.	એન.	એપો.	વી.	ક્યુ.	આર.
<i>j</i>	<i>k</i>	<i>l</i>	<i>m</i>	<i>n</i>	<i>o</i>	<i>p</i>	<i>q</i>	<i>r</i>
એસ.	ડી.	યુ.	વી.	ડિયલ્યુ.	એક્સી.	વાય.	એડ.	
<i>s</i>	<i>t</i>	<i>u</i>	<i>v</i>	<i>w</i>	<i>x</i>	<i>y</i>	<i>z</i>	

ઇંગ્રેઝ આંકડા.

૧	૨	૩	૪	૫	૬	૭	૮	૯	૧૦
1	2	3	4	5	6	7	8	9	10

અગ્રેલ મુળાક્ષરનો તથા તેમના ગુજરાતીમાં થતા ઉચ્ચાર.

શબ્દ-નામાંખાલ	સ્વર-નામાંખાલ	સ્વર-નામાંખાલ	સ્વર-નામાંખાલ	અગ્રેલ મુળાક્ષરના ગુજરાતીમાં થતા ઉચ્ચાર.	રીમાડ.
A	a	A	a	એ	એ-આ-એ-એ-એ
B	b	B	b	બી	બી
C	c	C	c	સી	સ-શ-સી
D	d	D	d	ડી	ડ-ડી
E	e	E	e	એ	એ-એ-એ-એ
F	f	F	f	એફ	એ
G	g	G	g	ગી	ગ-ગી
H	h	H	h	એચ	એ
I	i	I	i	ઇ	ઇ-ઇ
J	j	J	j	જી	જ
K	k	K	k	કી	ક

પદ્ધતિ તથા ગુજરાતી શ્રોતુને આદ્યસ્વરો અભ્યવનાની ઝામણાં જીને કીણાં તથા દોષાં કોણમના અદ્યારે લખવામાં વપરાય છે.

L	I	L	I	એક	લ-િ
M	m	M	m	એમ	મ
N	n	N	n	એન	ન-ા
O	o	O	o	એઓ	ઓ-એ-ઉ-અ
P	p	P	p	પી	પ
Q	q	Q	q	ક્વુ	ક્વી-એ
R	r	R	r	આર	ર
S	s	S	s	એસ	સ-થ-રૂ
T	t	T	t	તી	ટ
U	u	U	u	યુ	અ-યુ-ઉ-એ
V	v	V	v	વી	વ
W	w	W	w	ડાલ્યુ	ડિલ્યુ
X	x	X	x	એક્સ	ક્ષ
Y	y	Y	y	વાય	ધ-આઈ-ય
Z	z	Z	z	એડ	ઝ

સ્વર તથા વ્યંજન વિષે.

અંગ્રેજ મુળાક્ષર શીખ્યા પછી તેમાં સ્વર ક્યા તથા વ્યંજન ક્યા તે શીખ્યાનું જોઈએ, તે નીચે જુદા પાણવામાં આવ્યા છે.

Vowels (વાવેલ્સ) સ્વર અક્ષરો.

એ	ઇ	આઈ	ଓ	ઉ	વાય
A	E	I	O	U	Y

ભાકી રહેલા અક્ષરો વ્યંજન (ડાન્સાન્ટસ) Consonants કહેવાય છે તે નીચે પ્રમાણે:—

Consonants (ડાન્સાન્ટસ) વ્યંજન.

ઝી	સી	ડી	એફ	જી	ઓચ	ની	કે	એલ
B	C	D	F	G	H	J	K	L
એમ	એન	પી	ક્રી	આર	એસ	ટી	વી	
M	N	P	Q	R	S	T	V	

ડાલ્યુ	એમ્સ	એડ
W	X	Z

ઇંગ્રેજમાં નીચેના અક્ષરો માટે ખાસ જોડાક્ષરો વપરાય છે.

ખ	ધ	ચ	છ	ઠ-થ
Kh	Gh	Ch	Chh	Th
દ્વ-ખ	દ્વ-ધ	દ્વ-ચ	દ્વ-છ	દ્વ-થ
Dh	Ph	Bh	Sh	

ઇંગ્રેજ મુળાક્ષરો જોડીને નામ, ગામ, ટેકાણું વગેરે
લખવાની સમજુતી.

આગળ ને ચાર જાતના મુળાક્ષરો આપી ગયા છીએ તેમાં
પહેલા એ જાતના અક્ષરો ફૂક્ત છાપેલું વાંચવામાં વપરાય છે, અને
થીજા એ જાતના મુગળ પત્રો વગેરે લખવામાં વપરાય છે, એમાં પહેલા
અક્ષરો “કોટલ” (મોટા) કહેવાય છે, અને તેની જોડેના અક્ષરો
“ર્માંવ” (નાના) કહેવાય છે. વાક્ય, વિશેષનામ, દિવસ, મહિના,
ભાગ, કવિતા, ઈન્દ્રિયનું નામ, વાપરીનો ખ્યાતાન તુથા દીઢી વગેરેમાં
પહેલા અક્ષર “કોટલ” (મોટા) વપરાય છે; અને લાર પદી
બાકીના થીજા “નાના” અક્ષરો વપરાય છે.

જેમ્ઝે—Cat. Hat. Raman. May. ’ Surat. God.
એ દરેકમાં પહેલા અક્ષર “કોટલ” (મોટા) છે, અને બાકીના
થીજા અક્ષરો “નાના” છે. ■■■

છાપેલા અક્ષરનો નમુનો Calcutta.
લખવાના „ „ „ „ Calcutta.

માણુસનાં નામ, ગામનાં નામું, ટેકાળાં વગેરે લખનાં શીખવા
માટે ગુજરાતી મુળાક્ષરો તથા બારોખડી નીચે આપેયા છે, તે પ્રમાણે
અક્ષરો જોઈ ઇંગ્રેજમાં નામની જોડણી કરવી. નામ અને ગામની જોડણી
ઇંગ્રેજમાં એકજ રીતે થતી નથી, પણ ધ્યાન થીજી રીતે પણ કરે છે, જેથી
ઉચ્ચાર અરોખર થઈ શકે એવી રીતે અક્ષરોની જોડણી કરવી જેમકે—:

Sitaram	{ Si-ta ram }	Ramoo	{ Ra-moo }
સીતારામ	{ શી-તા રામ }	રામુ	{ રા-મુ }
Surat	{ Su=rat }	Naroda	{ Na-ro-da }
સુરત	{ સુ-રત }	નરોડા	{ નર-રો-ડા } .

એ પ્રમાણે ધ્યાન આપવાથી નામે, સરનામાં, વગેરેની જોડણી
શીખવાનું ધણું સેહેલું થઈ પડશે.

બોડક્ષર વિધે.

ગુજરાતીમાં ને એ અક્ષરો જોડાયેલા આવે તેની અંગ્રેજીમાં જોડણી કરતી વર્ણને તે એ અક્ષરોને માટે ને અંગ્રેજ અક્ષર હોય તે જોડે લખવા પણ તેમની વિધે સ્વર સુધ્યાં નાંદિ. જેમણે Pro (પ્રો) Sri (શ્રી) વાગેર.

ગુજરાતી સ્વરો તેની દુંગ્રેજ જોડણી સાથે.

a	a	i	ee	u	oo	e	ai	o	au	am	ah
એ	આ	ઇ	ઈ	ઉ	ଓ	એ	ઇ	ଓ	ઔ	અ	અઃ

ગુજરાતી વ્યાઙ્જનો તેની દુંગ્રેજ જોડણી સાથે.

ka	kha	ga	gha	gna	cha	chha	ja	lha	ta	tha	
ક	ખ	ગ	ખ	ગન્ન	ચ	ખ	જ	લ	ત	થ	
da	dha	na	ta	tha	da	dha	na	pa	pha	ba	bha
ડ	ધ	ન	ત	થ	ડ	ધ	ન	પ	ફ	બ	ભ
ya	ra	la	va	sha	shha	sa	ha	la	ksha	dnya	
ય	ર	લ	વ	શ	શખ	સ	હ	લ	કશ	દન્ય	

ભારાઘડી Syilable (સીલેખલ)

ka	ka	ki	kee	ku	koo	ke	kai	ko	kau	kam	kah
ક	કા	કિ	કી	કુ	કૂ	કે	કાઈ	કો	કૌ	કામ	કાઃ
kha	kha	khi	khee	khu	khoo	khe	khai	kho	khau	kham	khah
ખ	ખા	ખિ	ખી	ખુ	ખૂ	ખે	ખાઈ	ખો	ખાઉ	ખામ	ખાઃ
ga	ga	gi	gee	gu	goo	ge	gai	go	gau	gam	gah
ગ	ગા	ગિ	ગી	ગુ	ગૂ	ગે	ગાઈ	ગો	ગાઉ	ગામ	ગાઃ
gha	gha	ghi	ghee	ghu	ghoo	ghe	ghai	gho	ghau	gham	ghah
ખ	ખા	ખિ	ખી	ખુ	ખૂ	ખે	ખાઈ	ખો	ખાઉ	ખામ	ખાઃ

cha cha chi chee chu choo che chai cho chau cham chah
 ਚ ਚਾ ਚਿ ਚੀ ਚੁ ਚ੍ਹੂ ਚੇ ਚੈ ਚੌ ਚਮ ਚਾਹ
 chha chha chhi chhee chhu chho chhe chhai chho chhau chham chhah
 ਚਾ ਚਾ ਚਿ ਚੀ ਚ੍ਹੂ ਚ੍ਹੂ ਚੈ ਚੈ ਚੌ ਚਮ ਚਾਹ
 ja ja ji jee ju joo je jai jo jau jam jah
 ਜ ਜਾ ਜਿ ਜੀ ਜੁ ਜ੍ਹੂ ਜੇ ਜੈ ਜੋ ਜਾਂ ਜਮ ਜਾਹ
 jha jha jhi jhee jhu jho jhe jhai jho jhau jham jhah
 ਜਾ ਜਾ ਜਿ ਜੀ ਜ੍ਹੂ ਜ੍ਹੂ ਜੈ ਜੈ ਜੋ ਜੈ ਜਮ ਜਾਹ
 ta ta ti tee tu too te tai to tau tam tah
 ਤ ਤਾ ਤਿ ਤੀ ਤੁ ਤ੍ਹੂ ਤੈ ਤੈ ਤੋ ਤ੍ਹੈ ਤਮ ਤਾਹ
 tha tha thi thee thu thoo the thai tho than tham thah
 ਥ ਥਾ ਥਿ ਥੀ ਥੁ ਥ੍ਹੂ ਥੈ ਥੈ ਥੋ ਥ੍ਹੈ ਥਮ ਥਾਹ
 da da di dee du doo de dai do dau dam dah
 ਦ ਦਾ ਦਿ ਦੀ ਦੁ ਦ੍ਹੂ ਦੈ ਦੈ ਦੋ ਦ੍ਹੈ ਦਮ ਦਾਹ
 dha dha dhi dhee dhu dhoo dhe dhai dho dhau dhan dhah
 ਧ ਧਾ ਧਿ ਧੀ ਧੁ ਧ੍ਹੂ ਧੈ ਧੈ ਧੋ ਧ੍ਹੈ ਧਮ ਧਾਹ
 na na ni nee nu noo ne nai no nau nam nah
 ਨ ਨਾ ਨਿ ਨੀ ਨੁ ਨ੍ਹੂ ਨੇ ਨੈ ਨੋ ਨ੍ਹੈ ਨਾਮ ਨਾਹ
 ta ta ti tee tu too te tai to tau tam tah
 ਤ ਤਾ ਤਿ ਤੀ ਤੁ ਤ੍ਹੂ ਤੈ ਤੈ ਤੋ ਤ੍ਹੈ ਤਾਹ
 tha tha thi thee thu thoo the thai tho than tham thah
 ਥ ਥਾ ਥਿ ਥੀ ਥੁ ਥ੍ਹੂ ਥੈ ਥੈ ਥੋ ਥ੍ਹੈ ਥਾਹ
 da da di dee du doo de dai do dau dam dah
 ਦ ਦਾ ਦਿ ਦੀ ਦੁ ਦ੍ਹੂ ਦੈ ਦੈ ਦੋ ਦ੍ਹੈ ਦਮ ਦਾਹ
 dha dha dhi dhee dhu dhoo dhe dhai dho dhau dhan dhah
 ਧ ਧਾ ਧਿ ਧੀ ਧੁ ਧ੍ਹੂ ਧੈ ਧੈ ਧੋ ਧ੍ਹੈ ਧਮ ਧਾਹ
 na na ni nee nu noo ne nai no nau nam nah
 ਨ ਨਾ ਨਿ ਨੀ ਨੁ ਨ੍ਹੂ ਨੇ ਨੈ ਨੋ ਨ੍ਹੈ ਨਾਮ ਨਾਹ

pa pa pi pee pu poo pe pai po pau pam pah
 ਪ ਪਾ ਪਿ ਪੀ ਪੁ ਪੂ ਪੇ ਪੈ ਪੈਵਾ ਪੈਵੀ ਪਿੰ ਪ੍ਰਿ
 pha Pha Phi Phee Phu phoo Phe ihai pho phau pham phah
 ਫ਼ ਫ਼ਾ ਫਿ ਫੀ ਫੁ ਫੂ ਫੇ ਫੈ ਫੈਹਾ ਫੋ ਫਾਊ ਫਾਮ ਫਾਹ
 ba ba bi bee bu boo be bai bo bau bam bah
 ਬ ਬਾ ਬਿ ਬੀ ਬੁ ਬੂ ਬੇ ਬੈ ਬੈਹਾ ਬੋ ਬਾਊ ਬਾਮ ਬਾਹ
 bha bha bhi bhee bhu bhoo bhe bhai bho bhau bham bhah
 ਭ ਭਾ ਭਿ ਭੀ ਭੁ ਭੂ ਭੇ ਭੈ ਭੈਹਾ ਭੋ ਭਾਊ ਭਾਮ ਭਾਹ
 ma ma mi mee mu moo me mai mo mau mam mah
 ਮ ਮਾ ਮਿ ਮੀ ਮੁ ਮ੍ਰਿ ਮੇ ਮੈ ਮੋ ਮਾਊ ਮਾਮ ਮਾਹ
 ya ya yi yee yu yoo ye yai yo yau yam yah
 ਧ ਧਾ ਧਿ ਧੀ ਧੁ ਧੂ ਧੇ ਧੈ ਧੈਧਾ ਧੌ ਧੌ ਧਿੰ ਧ੍ਰਿ
 ra ra ri res ru roo re rai ro rau ram rah
 ਰ ਰਾ ਰਿ ਰੀ ਰੇਸ ਰੂ ਰੂਦ ਰੇ ਰੈ ਰੈਡ ਰੋ ਰੌ ਰੌਦ ਰਾਮ ਰਾਹ
 la la li lee lu loo le lai lo lau lam jah
 ਲ ਲਾ ਲਿ ਲੀ ਲੁ ਲੂ ਲੇ ਲੈ ਲੈਲਾ ਲੌ ਲੈਲ ਲਾਮ ਜਾਹ
 va va vi vee vu voo ve vai vo vau vam vah
 ਵ ਵਾ ਵਿ ਵੀ ਵੁ ਵੂ ਵੇ ਵੈ ਵੈਵਾ ਵੌ ਵ੍ਰਿ ਵਿੰ ਵਿ
 sha sha shi shee shu shoo she shai sho shau sham shah
 ਸ਼ ਸ਼ਾ ਸ਼ਿ ਸ਼ੀ ਸ਼ੁ ਸ਼ੂ ਸ਼ੇ ਸ਼ੈ ਸ਼ੈਹ ਸ਼ੋ ਸ਼ਾਊ ਸ਼ਾਮ ਸ਼ਾਹ
 sa sa si see su sooo se sai so sau sam sah
 ਸ ਸਾ ਸਿ ਸੀ ਸੁ ਸੂ ਸੇ ਸੈ ਸੈਸਾ ਸੌ ਸ੍ਰਿ ਸਿੰ ਸਿ
 ha ha hi hee hu hoo he hai ho hau ham hah
 ਹ ਹਾ ਹਿ ਹੀ ਹੁ ਹੂ ਹੇ ਹੈ ਹੈਹ ਹੋ ਹੌ ਹਮ ਹਾਹ
 la la li lee lu loo le lai lo lau lam lah
 ਲ ਲਾ ਲਿ ਲੀ ਲੁ ਲੂ ਲੇ ਲੈ ਲੈਲਾ ਲੌ ਲੈਲ ਲਾਮ ਲਾਹ

ksha ksha kshi kshee kshu kshoo kshe kshai ksho kshau ksham
 ક્ષ ક્ષા ક્ષિ ક્ષી ક્ષુ ક્ષૂ ક્ષે ક્ષૈ ક્ષો ક્ષૌ ક્ષં
 dna dna dni dnee dnu dnoo dne dnai dno dnau dnam dnah
 દા દા દિ દી દુ દૂ દે દૈ દો દૌ દાં દા:

સંપ્રયા.

Figures (ફ્રીગર્સ.)

૧ એક	1 One	(વન)
૨ બે	2 Two	(દુ)
૩ ત્રણુ	3 Three	(થ્રી)
૪ ચાર	4 Four	(ફોર)
૫ પાંચ	5 Five	(ફાઇવ)
૬ છ	6 Six	(સિક્સ)
૭ સાત	7 Seven	(સેવન)
૮ આટ	8 Eight	(એટટ)
૯ નવ	9 Nine	(નાઈન)
૧૦ દશ	10 Ten	(ટેન)
૧૧ અગ્રિઆર	11 Eleven	(ઇલેવન)
૧૨ હાર	12 Twelve	(ટુંલેવન)
૧૩ તેર	13 Thirteen	(થર્ટિન)
૧૪ ચઉદે	14 Fourteen	(ફોર્ટીન)
૧૫ પંદર	15 Fifteen	(ફિફ્ટીન)
૧૬ સેણ	16 Sixteen	(સિક્સેટીન)
૧૭ સત્તર	17 Seventeen	(સેવેન્ટીન)
૧૮ અદ્દાર	18 Eighteen	(એટીટીન)

૧૯ ઓગણીસ	19 Nineteen (નાઇન્ટીન)
૨૦ વીસ	20 Twenty (ટુર્ટી)
૨૧ એકવીસ	21 Twenty one (ટુર્ટી વન)
૨૨ બાંચીસ	22 Twenty two (ટુર્ટી કુ)
૨૩ ત્રેવીસ	23 Twenty three (ટુર્ટી શ્રી)
૨૪ ચોંચીસ	24 Twenty four (ટુર્ટી ફેર)
૨૫ પચીસ	25 Twenty five (ટુર્ટી ફાઇવ)
૨૬ છીસ	26 Twenty six (ટુર્ટી સિઝ)
૨૭ સત્તાનીસ	27 Twenty seven (ટુર્ટી સેવન)
૨૮ અષ્ટાનીસ	28 Twenty eight (ટુર્ટી એષ્ટાટ)
૨૯ ઓગણ્યુનીસ	29 Twenty nine (ટુર્ટી નાઇન)
૩૦ તીસ	30 Thirty (થર્ટી)
૩૧ એકતીસ	31 Thirty one (થર્ટી વન)
૩૨ બતીસ	32 Thirty two (થર્ટી કુ)
૩૩ તેતીસ	33 Thirty three (થર્ટી શ્રી)
૩૪ ચોતીસ	34 Thirty four (થર્ટી ફેર)
૩૫ પાંતીસ	35 Thirty five (થર્ટી ફાઇવ)
૩૬ છતીસ	36 Thirty six (થર્ટી સિઝ)
૩૭ સાડતીસ	37 Thirty seven (થર્ટી સેવન)
૩૮ આડતીસ	38 Thirty eight (થર્ટી એષ્ટાટ)
૩૯ ઓગણ્યુચાળીસ	39 Thirty nine (થર્ટી નાઇન)
૪૦ ચાલીસ	40 Forty (ફોર્ટી)
૪૧ એકતાળીસ	41 Forty one (ફોર્ટી વન)
૪૨ એતાળીસ	42 Forty two (ફોર્ટી કુ)
૪૩ તેતાળીસ	43 Forty three (ફોર્ટી શ્રી)

૪૪ ચુંમાળીસ	44 Forty four (ફોર્ટી ફોર્ઝ)
૪૫ પીસતાળીસ	45 Forty five (ફોર્ટી ફોફિવ)
૪૬ છીતાળીસ	46 Forty six (ફોર્ટી સિક્સ)
૪૭ સુડતાળીસ	47 Forty seven (ફોર્ટી સેવન)
૪૮ અડતાળીસ	48 Forty eight (ફોર્ટી એધિટ)
૪૯ ઓગણ્ય પચાસ	49 Forty nine (ફોર્ટી નાઇન)
૫૦ પચાસ	50 Fifty (ફીફી)
૬૦ સાડ	60 Sixty (સિક્સી)
૭૦ સીતેર	70 Seventy (સેવની)
૮૦ એંસી	80 Eighty (એધી)
૯૦ નેતું	90 Ninety (નાઇની)
૧૦૦ સો	100 Hundred (હન્ડ્રેડ)
૨૦૦ ભસો	200 Two hundred (કુ હન્ડ્રેડ)
૩૦૦ ત્રણુસો	300 Three hundred (શ્રી હન્ડ્રેડ)
૪૦૦ ચારસો	400 Four hundred (ફોર હન્ડ્રેડ)
૫૦૦ પાંચસો	500 Five hundred (ફોફિવ હન્ડ્રેડ)
૧૦૦૦ હજાર	1000 Thousand (થાઉન્ડ)
૧૦૦૦૦ દશ હજાર	10000 Ten thousand (ટેન થાઉન્ડ)
૧૦૦૦૦૦ લાખ	100000 Lac (લેક)
૧૦૦૦૦૦૦ દશ લાખ	1000000 Million (મીલીઅન)
૧૦૦૦૦૦૦૦ કરોડ	10000000 Ten millions (ટેનમીલીઅન્સ)
૧૦૦૦૦૦૦૦૦ દશ કરોડ	100000000 Hundred millions (હન્ડ્રેડ મીલીઅન્સ)
૧૦૦૦૦૦૦૦૦૦ અધ્યા	1000000000 Billion (બિલિયન)



સ્વરોના ઉત્ત્યાર વિષે શાખા.

(A) એ ના ઉત્ત્યાર વિષે	(E) ઈ ના ઉત્ત્યાર વિષે
An (અન) એક	Be (બી) થવું હોવું,
Am (અમ)	Me (મી) મને
As (અઝ)	We (વી) અમે
At (અટ) તરફ	Ye (યી) તમે
And (એન્ડ) અને	He (હી) તે
આમાં (A) એનો ઉત્ત્યાર અંથાય છે.	
અને (E) નો ઉત્ત્યાર ઈથાય છે.	

(I) આઈ ના ઉત્ત્યાર વિષે	(O) ઓએ ના ઉત્ત્યાર વિષે
I (આઈ) હું	O (ଓએ) અરે
Is (ઇસ) છે	On (આન) ઉપર
It (ઇટ) તે	Of (ଓફ) નો, તી, નું વિષે
In (ઇન) અંદર	Or (ଓર) અથવા
If (ઇફ) જે	Or (ଓর) અળગદ

આમાં (I) આઈનો ઉત્ત્યાર ઈ તથા (O) ઓએ નો ઉત્ત્યાર ઓં થાય છે

(U) યુ ના ઉત્ત્યાર વિષે	(Y) વાય ના ઉત્ત્યાર વિષે
Up (અપ) ઉપર	By (બાય) પાસેથી.
Us (અસ) અમને	My (માય) મારે

આમાં (U) નો ઉત્ત્યાર અ તથા (Y) નો ઉત્ત્યાર આય થાય છે.

ઉપરના શાખા શીખ્યા પછી નીચેનાં વાક્યો ધ્યાનમાં લેધાને શીખવાં, અગ્રેજ તથા ગુજરાતી વાક્યની ગોડવણીમાં થોડાજ ફેર છે. ગુજરાતીમાં પહેલો કર્તા પછી કર્થ કે વિશેષણ અને પછી કિયાપદ આવે છે. પણ અગ્રેજમાં પહેલો કર્તા પછી કિયાપદ અને પછી કર્મ કે વિશેષણ આવે છે. તેની વધારે સમજ આગળ આપવામાં આવી છે.

નાનાં વાક્યો.

હું છું I am (આઈ એમ)	તેમાં In it (ઇન ઇટ)
એક ખણદ An ox (અન એક્સ) મારો ખણદ My ox (માય એક્સ)	
મારી પાસે By me (ભાય મી)	મારી તરફ At me (અટ મી)
તે વિષે Of it (ઓફ ઇટ)	તે છે It is (ઇટ ઇઝ)
તે ઉપર On it (ઓન ઇટ)	મારા ઉપર On me (ઓન મી)
(A) એ નો “આ” ઉચ્ચાર વિષે.	(O) એ નો ‘ઉ’ ઉચ્ચાર વિષે.
Are (આર) છો	Do (ડો) કરવું
Arm (આર્મ) હાથ	To (ટો) ને, પાસે
Art (આર્ટ) કુનર	Love (લૂવ) જાવું
Ask (આર્સ્ક) પૂછવું	
After (આર્ટર) પછી	

પુરુષ વાચક શબ્દો.

અકૃત્યન.

હું I (આઈ)	અમે We (ઉન્ની)
તું Thou (ધાઉ)	તમે You (યુ)
તે He (હી)	તંતો અથવા }
તેણી She (શી)	તેણીઓ } They (ધે)

મને Me (મી)	તેઓનો, તેઓની, તેઓનું Their (ધેર)
મારો, મારી, મારું My (માય)	Theirs (ધર્સ)
Mine (માધન)	તમને You (યુ)
અમારો, અમારી, અમારું { Our (અવર)	તેને Him (હીમ)
અમારો, આપણો, આપણું { Ours (અવર્સ)	અમને, આપણું Us (અસ)
આપણી, આપણું {	તેણોને Them (ધેમ)
તમારો, તમારી, તમારું { Your (યોર)	તેણીને Her (હેર)
તમારો, તમારી, તમારું { Yours (યોર્સ)	તેણીનો, તેણીની, તેણીનું Her (હેર)
તનો, તની, તનું, His (હિસ)	Hers (હર્સ)

કિયાપદના શાખાઓ

હું. Am (અમ)	
તું, છીએ Are (આર)	
એ. Is (ઇઝ)	
હતો. Was (ઉર્ઝાઝ)	
હતા. Were (ઉર્ઝેર)	
કરતું, To do (ક કુ)	

કરે છે. Does (ડેઝ)
કર્ષું Did (ડીડ)
ની પાસે એ. Have (હેવ)
છે, પાસે છે. Has (હેઝ)
ની પાસે હતું. Had (હેડ)

(Be) નાં વર્તમાનકાળનાં રૂપ.

એકુલચન.

બાહુલચન.

હું હું. I am (આઈ અમ)	અમે છીએ. We are (ઉવી આર)
તું હું Thou art (ધાઉ આર્ટ)	તમે છો You are (યુ આર)
તે છે He is (હી ઇઝ)	તેઓ છે They are (ધે આર)

(Be) નાં લુટકાળનાં રૂપ.

હું હતો I was (આઈ ઉર્ઝાઝ)	અમે હતા We were (ઉવીઉર્ઝાર)
તું હતો Thou wast (ધાઉવેસ્ટ)	તમે હતા You were (યુ ઉવેસ્ટ)
તે હતો He was (હી ઉર્ઝાઝ)	તેઓ હતા They were (ધે ઉવેસ્ટ)

Do (કુ) નાં વર્તમાનકાળનાં રૂપ.

હું કરે હું I do (આઈ કુ)	અમે કરીએ છીએ Wedo (ઉવી કુ)
તું કરે છે Thou dost (ધાઉડોસ્ટ)	તમો કરો છો You do (યુ કુ)
તે કરે છે He does (હી ડો)	તેઓ કરે છે They do (ધે કુ)

. Do (કુ) નાં લુટકાળનાં રૂપ.

મેં કર્ષું I did (આઈ ડીડ)	અમે કર્ષું We did (ઉવી ડીડ)
તો કર્ષું Thou didst (ધાઉ ડીડસ્ટ)	તમે કર્ષું You did (યુ ડીડ)
તેણે કર્ષું He did (હી ડીડ)	તેઓએ કર્ષું They did (ધે ડીડ)

Have (હુંવ) ના વર્તમાનકાગ્નિનાં ઇંગ.

મારી પાસે છે. I have (આઈ હેવ) અમારી પાસે છે. We have
 (ઉન્ની હવ) તમારી પાસે છે Thou hast (ધાઉ હેસ્ટ) તમારી પાસે છે You have
 (યુ હવ)

તેની પાસે છે He has (હી હવ) તેઓની પાસે છે They have
 (ફે હવ)

Have (હુંવ) ના ભૂતકાગ્નિનાં ઇંગ.

મારી પાસ હવ I had (આઈ હડ) અમારી પાસ હતું We had
 (ઉન્ની હડ)

તુંથી પાસ હતું Thou hadst તમારી પાસ હતું You had
 (ધાઉ હડ્સ્ટ) (યુ હડ)

તેની પાસ હતું He had (હી હડ) તેઓની પાસ હતું They had
 (ફે હડ્સ)

શાખા.

જતું Go (ગો)	આપતું Give (ગીવ)
આવતું Come (કમ)	શાખતું Learn (લર્ન)
ઐસતું Sit (સીટ)	કામ કરતું Work (વર્ક)
કહેતું Say (સે)	ચાલતું Walk (વૉલ્ક)

વર્તમાનકાગ્નિનાં ઇંગ.

અનુબ્યાન.

અનુબ્યાન.

હું જાઓ છું I go (આઈ ગો) અમે જાઓ છીએ We go
 (ઉન્ની ગો)

તુંજાય છે Thou goest (ધાઉ ગોઅન્સ્ટ) તમે જાઓ છો You go
 (યુ ગો)

તે જાય છે He goes (હી ગોઝ) . તેઓ જાય છે They go (ફે ગો)

એકવચન.

બૃહ્યવચન.

હું આતું છું I come (આઈ કમ) અમે આરીએ ધીએ We come (ઉવી કમ)

તું આવે છે Thou comest (ધાઉ કમેસ્ટ) તમે આવા છો You come (યુ કમ)

તે આવે છે He comes (હી કમા) તેઓ આવે છે They come (ધે કમ)

હું બેસું છું I sit (આઈ સીટ) અમે બેમિએ ધીએ We sit (ઉવી સીટ)

તું બેસે છે Thou sittest (ધાઉ સીટેસ્ટ) તમે બેમો છો You sit (યુ સીટ)

તે બેસે છે He sits (હી સીટસ) તેઓ બેસે છે They sit (ધે સીટ)

હું કહું છું I say (આઈ સે) અમે કહીએ ધીએ We say (ઉવી સે)

તું કહે છે Thou sayest (ધાઉ સેયેસ્ટ) તમે કહો છો You say (યુ સે)

તે કહે છે He says (હી સેઝ) તેઓ કહે છે They say (ધે સે)

હું આપું છું I give (આઈ ગીવ)

અમે આપીએ ધીએ We give (ઉવી ગીવ)

તું આપે છે Thou givest

તમે આપો છો You give (યુ ગીવેસ્ટ)

તે આપે છે He gives (હી ગીવેઝ)

તેઓ આપે છે They give (ધે ગીવ)

હું શીખું છું I learn (આઈ લર્ન)

અમે શીખીએ ધીએ We learn (ઉવી લર્ન)

તું શીખે છે Thou learnest

તમે શીખો છો You learn (યુ લર્નેસ્ટ)

તે શીખે છે He learns (હી લર્ન્સ)

તેઓ શીખે છે They learn (ધે લર્ન)

હું ચાલું છું I walk (આઈ વૉઝ)	અમે ચાલીએ છીએ We walk (ઉની વૉઝ)
તું ચાલે છે Thou walkest (ધાઉ વૉક્સેટ)	તમે ચાલો છો You walk (યુ વૉઝ)
તે ચાલે છે He walks (હી વૉક્સ)	તેઓ ચાલે છે They walk (થે વૉઝ)

હું કામ કરે છું I work (આઈ વર્ક)	અમૈ કામ કરીએ છીએ We work (ઉની વર્ક)
તું કામ કરે છે Thou workest (ધાઉ વર્કેસ્ટ)	તમે કામ કરો છો You work (યુ વર્ક)
તે કામ કરે છે He works (હી વર્ક્સ)	તેઓ કામ કરે છે They work (થે વર્ક)

ઉપર જે વર્તમાનકાળનાં રૂપો આપ્યાં તેમાં બીજુ પુરુષ એક વચ્ચનમાં est પ્રલય લાગે છે અને ત્રીજુ પુરુષ એક વચ્ચનમાં s અથવા es પ્રલય લાગે છે, બાકી બીજનમાં પ્રલય લાગતો નથી.

દ્વિતીય વાક્યરૂપના વિષે.

ગુજરાતીમાં વાક્ય ગોડવાની રીત એવી છે કે પહેલા કર્તાં આવે, પછી કર્મ કે વિશેષય, અને પછી કિયાપદ આવે છે, એમ કે સાહેભે બંધુક ફેરી તેમાં 'સાહેભ' શબ્દ કર્તાં છે તે વાક્યમાં પહેલો આવ્યો પછી 'બંધુક' શબ્દ કર્મ છે, તે કર્તાં પછી આવ્યું અને 'ફેરી' શબ્દ કિયાપદ છે તે વાક્યને છેડે આવ્યું છે. પણ દ્વિતીય વાક્ય રૂપના તેથી જુદી છે. તેમાં પહેલો કર્તાં આવે છે પછી કિયાપદ, અનો છેલ્લું કર્મ હે વિશેષય આવે છે. એમકે તે પાછ શીખે છે He learns

a lesson (એ લાન્ચ આ લેસન) તેમાં ગુજરાતીમાં (ન) કર્તા છે ને વાક્યની શરૂઆતમાં આવ્યો છે તેમજ અંગ્રેજમાં He (હી) કર્તા છે ને વાક્યની શરૂઆતમાં આવ્યો છે. પછી ગુજરાતીમાં કર્તા પણી કર્મ (પાડ) આવ્યું છે પણ અંગ્રેજમાં કર્તા He (હી) પણી કિયાપદ learns (લાન્ચ) આવ્યું છે. અને ગુજરાતીમાં છેલ્યું કિયાપદ (શાંખ છે,) આવ્યું છે પણ અંગ્રેજમાં છેલ્યું કર્મ (Lesson) (લેસન) આવ્યું છે. . .

Capital letter (કૅપીટલ લેટર) માટે અક્ષર.

છેન્યું ભાષામાં લખવામાં તથા વાચવામાં નરકરાં એ એ, બી, એની, એની, એનીએ છ. એક માત્ર અને એક નાની માટે નાની એ, બી, ગી, ગીનીએ અક્ષર કયાં વાપરનો તથા નાનીએ, બી, ગી, ગીનીએ અક્ષર કયાં વાપરનો તે નીચેની સુચનાઓપરથી માત્રમાં પહોંચે.

૧. હરેક વાક્યનો પહેલો અક્ષર Capital (કૅપીટલ) મેંથી વાપરનો કેમણે This is a book (ધીસ ડાઝ એ બુક) આ ચ્યાપડી છે. આ વાક્યમાં (T) એ વાક્યનો પહેલો અક્ષર છે માટે કૅપીટલ (માટે) છે.

૨. ક્રમિતાનો હરેક લીટરનો પહેલો અક્ષર માટે જોઈએ. જેમકે, None will trust a liars word,
Even though his word be true,
He who lies to hide a fault,
Turns a single fault to two.

ઉપર્યુક્ત ક્રમિતામાં પહેલી લીટરમાં (N) એન, બીજમાં (E) ઇ, તૃજમાં (H) એચ અને ચ્યાથીમાં (T) એ પહેલો અક્ષર છે, માટે Capital (કૅપીટલ) માટે મુક્ખ્ય છે.

3. બોલવામાં વાક્યનો પહેલો અક્ષર મોટો નોંધાયે, નેમણે Mohan said 'To-day is the day of festival.' (મોહન સેઈડ હુ કે દાડ ખી તે ઓછા ફેસ્ટિવલ) મોહને કંચું આજે તહેવારનો દીવસ છે. આમાં 'આજે તહેવારનો દીવસ છે' એ ગાંધીના બોલેવા શાંતો છે ભાગે તેગનો પહેલો અક્ષર (T) કેપીટલ કર્યો છે.

4. પરમેશ્વરના નામ તથા તેણી જંગ્યાંઝ વર્પગતા સવનામતો પહેલો અક્ષર કેપીટલ નોંધાયો. નેમણે, 'The' 'sun' is made by God. (ખી મન ધર્દ મેઈદ બાય ગાડું) જ્ઞાન ધર્મરૂપ અનાંયા છે. આમાં ધર્મરસને બદલે God (ગ્રાંડ) શાંત આંયા છે ગાટે તે વાક્યમાં ગમે તે ડેક્ષાંગ આંયા હોય તાપણું તો પહેલો અક્ષર મોટો કરવા. વળી God Who created this world (ગાડ હુ કુંગારેટ ધીસ વર્દ્દ) ધર્મર કંચું આ રુપિયા પાતારી હું. આમાં 'દે' તે બદલો ઈંગ્રેજીમાં 'Who' શાંત આંયા હું, અનું તે ધર્મર (God) જાપને બાદલે વર્પગાંધો છે ભાગે તેના પહેલો અદ્ધાર પણ માંદો કરવા.

5. દંડ વીણેપ નામના પહેલો અક્ષર કેપીટલ (મોટો) લખવા તથા તેના ઉપર્થી જે વીણેપણું થયા હોય તેના પહેલો અન્નું પળું માંદો લખવા, નેમણે Motilal (માંતીલાલ), Madra, (માદ્રા), Sabarmati (સાબરમતી), China (ચાઇના) =નીન, India (ઇન્ડિયા) =ઇન્ડિસ્તાની. એ દરેકમાં પહેલો અક્ષર માંદો કર્યો હું.

હવે Indian (ઇન્ડિયન) ઇન્ડિસ્તાની, Chinese (ચાઇનીઝ) ચીનાનું એ રહ્યો India (ઇન્ડિયા) ઇન્ડિસ્તાનું તથા China (ચાઇના) ચીન એ વીણેપ નામો ઉપર્થી થયા છે ભાગે તે દરેકના પહેલો અક્ષર મોટો નોંધાયો.

૬. સર્વનામ I (આઈ) હું તથા ડેવળપ્રોગ્રી O (ଓ) એ એ શાખાના વાક્યમાં ગમે તે ડેકાણે આબા હોય તો પણ કેપીટલ મુક્તા.

૭. અડવાડીયાના દીવસો તથા વરસના મહીનાનો પહેલો અક્ષર મોટો જોઈએ. જેમકે, Monday (મનડુ) સોમવાર, Friday (ફ્રાઇડે) શુક્રવાર, January (જાન્યુઆરી), April (એપ્રીલ), વીજેરેમાં પહેલો અક્ષર મોટો જોઈએ.

૮. ખીતાણ અથવા ડીચીને માટે વપરાતા દરેક અક્ષર મોટા મુક્તા, જેમકે, C. I. E., C. S. I.; M. A.; B. A. વીજેરે.

Articles (આર્ટિકલ્સ) પ્રત્યય વિષે.

ઇંગ્રેજીમાં ડાઈ પદાર્થ કે પ્રાણીનું નામ એક વચ્ચનમાં એકલું આવે નહીં, પણ તેના અર્થની હું ખતાવવા સારુ તે નામની પહેલાં આર્ટિકલ હુમેરાં લગાડવો જોઈએ.

ઇંગ્રેજીમાં આર્ટિકલ એ છે. 'An' (એન) અથવા 'A' (એ) અને 'The' (થી).

હવે An (એન) તથા A (એ)નો અર્થ એક અથવા એકાદુ છે માટે તે એક વચ્ચનના નામની સાથે વપરાય છે. અને The (થી) વંતે વચ્ચનના નામની સાથે વાપરી શકાય છે. જેમકે,

A book (આ ખુક) એક ચોપડી. A pen (આ પેન) એક કંદમ. A cat (આ કેટ) એક બિલાડી. A hat (આ હેટ) એક ટોપી.

* An (એન) એકાદુ. હવે એન ક્યાં લગાડવો ?

ઇંગ્રેજીમાં નામના જે શાખા સ્વરથી શકું થાય છે તે નામની

આગળ An (અન) લગાડવો, જેમકે, An egg (અન અગ) એક હુંકુ. An ox (અન ઓક્સ) એક બળદ. An orange (અન ઓરિંજ) એક નારંગી. An elephant (અન એલીફંટ) એક હાથી. An ass (અન અસ) એક ગઢેડો.

અને અંગ્રેજુમાં જે નામના શબ્દો વંજતથી શરીર થાય છે તેને (A) એ લગાડવો, જેમકે, A cat (આ કેટ), A hen (આ હેન), A man (આ મેન) વીગેરે.

અંગ્રેજુમાં The (ધી) એટલે “તે” અથવા “પેલું” કે જે સામાચારો જણે છે, સુકરર પ્રાણી કે પદર્થ જણ્ણાવવા સાર તેના નામની આગળ કેંમેશાં The (ધી) લગાડવો જોઈએ.

જેમકે The book (ધી શુક) તે ચોપડી. The cage (ધી ડેઝ) તે પાંજડુ. The bird (ધી બર્ડ) તે પક્ષી.

પણ જે સંખ્યા બતાવવી હોય તો A અથવા An કાઢી નાખી તેની જગ્યાએ One (વન) વાપરવા. જેમકે—Give me one slate (ગીવ મી વન સ્લેટ) મને એક પાડી આપો. Give me one orange (ગીવ મી વન ઓરિંજ) મને એક નારંગી આપો. I want one anna (આઈ વોન્ટ વન આના) મને એક આનો જોઈએ.

This (ધિસ) એ “આ” [એક વચ્ચન] માં ભીજુ ચીને સાથે સરખાવતાં વધારે નજીક હોય તેને લાગે છે-

જેમકે—This house (ધિસ હાઉસ) આ ઘર. This book (ધિસ શુક) આ ચોપડી. This pen (ધિસ પેન) “આ કલમ. These “એ This (ધિસ) નું” (અનુભવન) છે તે ભીજુ ચીને સાથે સરખાવતાં જે વધારે નજીબીક હોય તેને લાગે છે.

નેમહે—These houses (ધિજ દાઉસિસ) આ ધરો. These books (ધિસ શુકરા) આ ચ્યાપડીઓ. These pens (ધિજ પેન્સ) આ કલમો. એમાં ધરો, ચ્યાપડીઓ તથા કલમો બાદુંવચનમાં છે, તેથી These (ધિઝ) લગાડવા જોઈએ.

That (ધટ) તે, પેલો, પેલી, પેલું, (એકવચન)માં ખીલ ચીને સાથે સરખાવતાં ને વધારે દૂર હોય તેને લાગે છે. નેમહે—That boy (ધટ ખ્યાય) પેલો છોકરો. That girl (ધટ ગર્લ) પેલી છોડી. That dog (ધટ ડોગ) પેલો કુત્રા.

Those (ધાજ) અંથ That (ધટ)નું (બાદુંવચન) છે. તે ખીલ ચીને સાથે વરખાવતાં ને વધારે દૂર હોય તેને લાગે છે. Those boys (ધાજ ખ્યાયજ) પેલા છોકરાઓ. Those girls (ધાજ ગર્લ્સ) પેલી છોડીઓ. Those dogs (ધાજ ડોગ્સ) પેલા કુત્રાઓ.

વચન વિષે.

વચન એ છે.—એકવચન અને બાદુંવચન.

એકવચન—એકપાણું બતાવે તે એકવચન.

બાદુંવચન—અંગેક (એકથી વધારેપાણું) રેખાડે તે બાદુંવચન કહેવાય છે.

ગુજરાતીમાં આ પ્રત્યય લગાડવાથી નામનું બાદુંવચન થાય છે એવા સામાન્ય નીચમ છે. નેમહે—છોકરો—એનું બાદુંવચન છોકરાઓ, ચ્યાપડી—ચ્યાપડીઓ, ટોપી—ટોપીઓ વિગેરે, પણ અંગેજમાં નામનું બાદુંવચન ‘ડ’ (એસ) પ્રત્યય લગાઓથી થાય છે. નેમહે—

એકવચન.

Cup (કપ) કાઢું.

Cap (કપ) ટોપી.

બાદુંભચન.

Cups (કેસ) ખાલા.

Caps (કેપ્સ) ટોપીઓ.

Cow (કાઉ) થાય.	Cows (કાઉઝ) આથો.
Horse (હોર્સ) થોડો.	Horses(હોર્સ્ઝિસ) થોડાઓ.
Pin (પીન) ટાંકણી.	Pins (પીન્સ) ટાંકણીઓ.
Chair (ચેર) ખુરશી.	Chairs (ચેર્ઝ) ખુરશીઓ.
Book (બુક) ચોપડી.	Books (બુક્ઝ) ચોપડીઓ.
Boy (બોય) છોકરો.	Boys (બોયઝ) છોકરાઓ.
Girl (ગર્લ) છોડી.	Girls (ગર્લ્ઝ) છોડીઓ.

પણ જે નામનેછેડે 'ઃ' (ઉથલ એસ) 'sh' (એસ એથ) 'ch' (રી એથ) 'x' (એકરા) અથવા 'o' (ઓઓ) આવે તેનું બજુબચન 'િસ' (ધ એસ) પ્રત્યય લગાડવાથી થાય છે કારણું કે તેવા શબ્દને એકલો એસે લગાડવાથી બગાળાર ઉચ્ચાર થનો નથી. જેમણે:—

Ass (એસ) ગંધડા.	Asses (એસ્ઝિસ) ગંધડા.
Fish (રીશ) માછલી.	Fishes (રીશ્ઝિસ) માછલીઓ.
Church (ચર્ચ) દેવાળા.	Churches (ચર્ચ્ઝિઝ) દેવલો.
Box (બોક્ઝ) પેટી,	Boxes (બોક્ઝ્ઝિસ) પેટીઓ.
Mango (મન્ગો) ડેરી.	Mangoes (મન્ગોઝ) ડેરીઓ.

જે નામને છેડે I: અથવા Fe આન્ધું હોય તેનું બજુબચન કરતી વખતે I: અથવા Fe નો ves થાય છે. જેમણે:—

Wife (વાઈફ) વહુ.	Wives (વાઈફઝ) વહુઓ.
Life (લાઇફ) છંદગી.	Lives (લાઇફઝ) છંદગીઓ.

વળી જે નામને છેડે 'Y' (વાય) દોય અને તેની પહેલાં બંધન દોય તો અને તેનું બજુબચન કરતું હોય તો Y (વાય) નો 'I' (આઇ) કરીને તેને Es (ધ એસ) લગાડવો. જેમણે:—

Lady (લેડી) બાપડી,
City (સીડી) શહેર.
Duty (ડ્યુટી) ફરજ.

કેટલેક ડેકાલો y (વાય) રાખને છેડે આવે છે તેને es (ઇ એસ) અથવા ed (ઇડી) પ્રત્યે લગાઓ પહેલાં પણ y (વાય)નો i (આઇ) કરવો જોઈએ જેમણે:—

અભમાવતું Try (ટ્રાઇ)
સુધેવતું Dry (ડ્રેઇ)
રહતું Cry (ક્રેઇ)
તળતું Fry (ફ્રેઇ)
અભમાવ્યું Tried (ટ્રાઇડ)
સુધેવ્યું Dried (ડ્રેઇડ)

જે નામતું બહુવિદ્યન કરવામાં S (એસ) લાગતો નથી પણ વચ્ચેનો સ્વર બદલવો પડે છે તેવા નામો:—

એકથયન.

આખુસ A man (આ મેન)	માણુસો Men (મેન)
આખડી A woman (આ ઉલુમન)	આખડીઓ Women (ઉલીમેન)
દાંત A tooth (આ ટૂથ)	દાતો Teeth (ટીથ)
પગ A foot (આ ફૂટ)	પગો Feet (ફીટ)
ઉદ્ડર A mouse (આ માઉસ)	ઉદરો Mice (માઘસ)
જી A louse (આ લાઝિસ)	જુઓ Lice (લાઘસ)
હંસે A goose (આ ગુંગ)	હંસો Geese (ગીજ)

ઇચ્છેજીનાં જે વાક્યમાં સવાલ અથવા પ્રશ્ન પુછવામાં આવે છે, આં હિયાપણ કરીની અગાઉ આવે છે. જેમણે—What is your name? (ઓફાં ઈંડ પાર નેઘમ) તમારું નામ કોણ? આહીંનાં

Name (નામ) નામ કોટાં છે અને is (ઇઝ) ડિયાપદ છે, અને તે કર્તાની અગ્રાહ આવેલા છે. તેજ પ્રમાણે નીચેલા વાક્યોમાં પણ છે.
 How are you ? (હાઉ આર મુ ?) તમે હેમ છો ?
 Who is he ? (હુ ઇઝ હી ?) તે હોણુ છે ?
 Is that boy bad ? (ઇઝ ઘેટ બોય બેડ ?) શું તે છોકરો ખરાખ છે ?
 Is he good ? (ઇઝ હી ગુડ ?) શું તે સારો છે ?

ભૂતકાળ Past tense (પાસ્ટ ટેન્સ) તથા **ભૂતકૃદ્ધિત Past participle (પાસ્ટ પાર્ટીસીપલ)** વિષે.

અંગ્રેજીમાં સાધારણું રીતે ડિયાપણા ધારુને 'ed' (ઇડી) પ્રત્યે લગાડનાથી ભૂતકાળ તથા ભૂતકૃદ્ધિત થાય છે. પણ કેટથાંક ડિયાપદ , એવાં છે કે તેઓને ભૂતકાળ તથા ભૂતકૃદ્ધિત તદ્દન અનિયભિત રીતે થાય છે, જેમણે:-

હું તમને આપું છું I give you (આઈ ગીવ મુ)
 મેં તમને આપું I gave you (આઈ ગેવ મુ)
 મેં તમને આપેદું છે I have given you (આઈ હેવ ગીવન મુ)

એજ પ્રમાણે નીચેલા શબ્દોનાં વાક્યોમાં ભૂતકાળ વિષે, અથવા આગળ થયેલા કાળ વિષે વાત કરવી હોય તો ed લગાઓ વગર નીચે આપેલા શબ્દો પ્રમાણે ઇપ વાપરતાં શીખવું.

વર્ત્તમાનકાળ.

ભૂતકાળ.

ભૂતકૃદ્ધિત.

લેતું See (સી)	લેયું Saw (સૉએ)	લેયેદું Seen (સીન)
રૂપતું Run (રન)	રૂપાંશો Ran (રન)	રૂપાંશો Run (રન)
આવતું Come (કમ)	આવેલો Came (કેમ)	આવેલો Come (કેમ)

આપવું Give (ગીવ)	આપ્યું Gave (વેવ)	આપેલું Given (ગીવન)
ઉછીનું આપવું Lend (લન્ડ)	ઉછીનું આપ્યું Lent (લન્ટ)	ઉછીનું આપેલું Lent (લન્ટ)
ઉડવું Fly (ફ્લાય)	ઉડ્યું Flew (ફ્લ્યુ)	ઉડેલું Flown (ફ્લોન)
ઉગવું Grow (ગ્રેવ)	ઉગ્યું Grew (ગ્ર્યુ)	ઉગેલું Grown (ગ્રેન)
ઉદ્જું રહેવું Stand (સ્ટેન્ડ)	ઉદ્જો રહ્યો Stood (સ્ટૂડ)	ઉદ્જો રહેલો Stood (સ્ટૂડ)
ઉગવું, ઉદ્જું Rise (રાઈઝ)	ઉગ્યો ઉક્યો Rose (રોઝ)	ઉગેલું, ઉદ્જેલું Risen (રીઝન)
કહેવું Tell (ટેલ)	કહ્યું Told (ટોલ્ડ)	કહેલું Told (ટોલ્ડ)
કહેવું Say (સે)	કહ્યું Said (સેઇડ)	કહેલું Said (સેઇડ)
કરદાવતું Bite (બાધાર)	કરદાયું Bit (બીટ)	કરદેલું Bitten (બીટન)
કાપવું Cut (કટ)	કાપ્યું Cut (કટ)	કાપેલું Cut (કટ)
કિંમત પડવી Cost (કોસ્ટ)	કિંમત પડી Cost (કોસ્ટ)	કિંમત પડેલી Cost (કોસ્ટ)
ખરચવું Spend (સ્પેન્ડ)	ખરચ્યું Spent (સ્પેન્ટ)	ખરચેલું Spent (સ્પેન્ટ)
ખરીદવું Buy (બાય)	ખરીદ્યું Bought (બેચ)	ખરીદેલું Bought (બેચ)
ખમવું, લઘાજવું Bear (બેર)	ખમ્યું, લઘાજયો Bore (બેર)	ખમેલું, લઘ ગયેલો (બેર)
ખાવું Eat (એટ)	ખાયું Ate (એટ)	ખાદેલું Eaten (એટન)
ખેંચવું, ચિતરવું Draw (ડ્રેન)	ખેંચ્યું, ચિતર્યું Drew (ડ્રેન)	ખેંચેલું, ચિતરેલું (ડ્રેન)

ઓસું Lose (લુટ) ઓસું Lost (લોસ્ટ) ઓષેલું Lost (લોસ્ટ)

ઓદરું Dig (ડિગ) Dug (ડગ) (ડગ) ઓદેલું Dug (ડગ)

ગાંધું Sing (સિંગ) ગાયું Sang (સેંગ) ગાયેલું Sung (સંગ)

નાખું Cast (કારટ) નાખ્યું Cast (કારટ) નાખેલું Cast (કારટ)

નાખું Throw (થ્રો) નાખ્યું Threw(થ્રીયુ) નાખેલું Thrown

(થ્રોન)

ચારવું Steal (રિલીફ)

ચાર્યું Stole (રટોલા)

ચારેલું Stolen (રટોલન)

ચાટાડનું Stick (રિફ)

ચાટાડ્યું Stuck(રસ્ટફ)

ચાટાડેલું Stuck (રસ્ટફ)

છાડી દેવું Leave (લીવ)

છાડી દીધું Left (લેફ્ટ)

છાડેલું Left (લેફ્ટ)

જણવું Bear (બાર)

જણ્યું Bore (બાર)

જણેલું Born (બાર્ન)

જગાડવું Wake (ઉવેક)

જગાડ્યો Woke

જગાડેલો Waked (ઉવેક)

જડવું Find (ફાઇન્ડ)

જડ્યું Found

(ફાઉન્ડ)

(ફાઉન્ડ)

જગવું Awake (અવેક)

જગ્યો Awoke

જગેલો Awaken (અવેકન)

જણવું Know (નો)

જણ્યું Knew (-ન્યુ)

જણેલું Known (નોન)

જતવું Win (ઉવીન)

જત્યો Won (ઉવિન)

જતેલો Won (ઉવિન)

જાડવું,સાફ કરવું Sweep

જાડ્યું,સાફ કર્યું Swept

જાડેલું,સાફ કરેલું Swept (સ્વેપ)

(સ્વેપ)

કષો હેવો Chide (આપણ) કષો આપો Chid કષો આપેલો
(ચીડન) Chidden (ચીડન)

કુષું Sink (સિંક) કુષું Sank (સિંક) કુષેલું Sunk (સિંક)

* તરતું Swim (સ્વીમ) તરું Swam (સ્વોમ) તરેલું Swum (સ્વમ)

કુખ દેલું Hurt (હર્ટ) કુખ દીલું Hurt (હર્ટ) કુખ દીધેલું Hurt
(હર્ટ)

દેખું, ભાડે આપવું Let દીખું, ભાડે આપાવું Let દીધેલું, ભાડે આપેલું
(લેટ) (લેટ) (લેટ)

કુજવું, હલાવવું Shake કુજયું, હલાવયું Shook કુજેલું, હલાવેલું
(શેક) (શુક) Shaken (શેકન)

પકડવું Catch (કચ) પકડ્યું Caught (કાટ) પકડેલું Caught
(કાટ)

પહૂંચવું Hold (હોલ્ડ) પહૂંચ્યું Held (હોલ્ડ) પહૂંદલું Held (હોલ્ડ)

પડ્યું Fall (ડાલ) પડ્યું Fell (ડાલ) પડેલું Fallen (ડાલન)

પડી રહેલું Lie (લાઇ) પડી રહ્યું Lay (લે) પડી રહેલું Lain (લેન)

પસ્ટંદ કરવું Choose પસ્ટંદ કીધું Chose પસ્ટંદ કીધેલું Chosen
(ચૂઝ) (ચોઝ) (ચોઝન)

પીયું Drink (ડ્રિંક) પીધું Drank (ડ્રિંક) પીધેલું Drunk (ડ્રિંક)

પેહેરવું Wear (ઉવેર) પહેર્યું Wore (ઉવેર) પેહેરેલું Worn (ઉવોરન)

પૈસ્યું આપવા Pay (પે) પૈસા આપવા Paid (પિછા) પૈસા આપેલા
Paid (પિછા)

ફાટવું Burst (બર્સ્ટ)	ફાટવું Burst (બર્સ્ટ)	ફાટેલું Burst (બર્સ્ટ)
હાડવું Tear (ટેર)	હાડવું Tore (ટોર)	હાડેલું Torn (ટોર્ન)
અનાવવું Make (મેક)	અનાવું Made (મેચાડ)	અનાવેલું Made (મેચાડું)
ખાંધવું, [ધર] Build (બિલ્ડ)	ખાંધવું Built (બિલ્ટ)	ખાંધેલું Built (બિલ્ટ)
બાંધવું Bind (બાંધિન્ડ)	બાંધવું Bound (બાંધિન્ડ)	બાંધેલું Bound (બાંધિન્ડ)
બેસવું Sit (સીટ)	બેઠો Sat (સેટ)	બેઠેલો Sat (સેટ)
બેસાડવું Set (સેટ)	બેસાઓ Set (સેટ)	બેસાડેલો Set (સેટ)
બોલવું Speak (સ્પેક)	બોલ્યો Spoke (સ્પેક)	બોલેલો Spoken (સ્પેકન)
ભાગવું Break (બ્રેક)	ભાગવું Broke (બ્રોક)	ભાગેલું Broken (બ્રોકન)
લુલથી જાણવું, } Mis-take (મિસ્-ટેક)	લુલથી જાણવું } take (માસ્-ટેક)	લુલથી જાણેલું } Mistook (મિસ્-ટેકન)
, , ગણવું, } (મીસ્ટેક)	, , ગણવું } (મીસ્ટેક)	, , ગણેલું } Mistaken (મિસ્ટેકન)
મારવું Beat (બીટ)	માર્યો Beat (બેટ)	મારેલો Beaten (બીટન)
મારસુ પ્રાપ્ત કર્યો Strike (સ્ટ્રાઇક)	માર્યો Struck (સ્ટ્રક)	મારેલો Struck (સ્ટ્રક)
માદ કરવું Forgive (ફર્ગિવ)	માદ કર્યો Forgave (ફર્ગેવ)	માદ કરેલો For-given (ફર્ગેવન)

મુક્યું Put (પુટ)	મુક્યું Put (પુટ)	મુક્લું Put (પુટ)
મેળવું Get (ગેટ)	મેળાયું Got (ગોટ)	મેળાલું Got, Gol- ten (ગોટ, ગોટન)
મોકલ્યું Send (સંટ)	મોકલ્યું Sent (સંટ)	યોકલ્યું Sent (સંટ)
રહ્યું Weep (ઉવાપ)	રહ્યો Wept (ઉવ્પેટ)	રહેલો Wept (ઉવાટ)
રાખવું Keep (કાપ)	રાખ્યું Kept (કોટ)	રાખાયું Kept (કોટ)
લખવું Write (રાધટ)	લખ્યું Wrote (રોટ)	લખાયું Written (રીટન)
લડવું Fight (ફાટ)	લડ્યો Fought (ફાટ)	લડેલો Fought (ફાટ)
લાગવું Feel (શીલ)	લાગ્યો Felt (ફેલ)	લાગેલો Felt (ફેલ)
લાવવું Bring (થીગ)	લાવ્યો Brought (બ્રાટ)	લાવેલો Brought (ઓટ)
લેવું Take (ટેક)	લીધું Took (ડુક)	લીધેલું Taken (ટેકન)
વગાડવું Ring (રીંગ)	વગાડ્યું Rang (રેંગ)	વગાડેલું Rung (રંગ)
વાસ મારવી, Smell	વાસ મારી Smelt	વાસ મારેલું Smelt (સ્મેલ્ચ)
વીસરવું Forget	વીસર્યો Forgot	વીસરેલું Forgotten (ફોર્ગેટ)
વીદ્યુતવું Wind	વીટાજ્યું Wound	વીટાબેલું Wound (ઓવાઇન્ડ)

विचारतुं Think (थीक)	विचार्यु Thought (यॉट)	विचारेतुं Thought (थीट)
वेचतुं Sell (सेल)	वेच्यु Sold (सोल)	वेचेतुं Sold (सोल)
वेपार करते। Deal (डील)	वेपार क्राया Dealt (डीट)	वेपार क्राइलो। Dealt (डील)
सम आवा Swear (स्वर)	सम आधा Swore (स्वोर)	सम झाधिका Sworn (स्वोर्न)
स्वारी करती Ride (राइड)	स्वारी क्रीमी Rode (रोड)	स्वारी क्राइकी Ridden (रीडन)
संताडयुं Hide (हाइड)	संताडयुं Hid (हीड)	संताडेतुं Hidden (हीडन)
सांबगतुं Hear (हीयर)	सांबगत्यु Heard (हुर्ड)	सांबगेत् Heard (हुर्ड)
सून् Sleep (स्लीप)	सूतो Slept (स्लेप)	सूतेतो Slept (स्लेप)
शइ शरतुं Begin (भीगीन)	शइ क्रीषुं Began (भीजन)	शइ क्राइतुं Begun (भीजन)
शीखवतुं Teach (टीच)	शीखत्यु Taught (टॉट)	शीखेतुं Taught (टॉट)
शोधतुं Seek (सीक)	शोध्यु Sought (सॉट)	शोधेतुं Sought (सॉट)
हांडतुं Drive (ड्राइव)	हांडत्यु Drove (ड्रॉव)	हांडेतुं Driven (ड्रीवन)

See (सीना वर्तमानकाणिनां ३५.)

हુ जेह છુ I see (આઈ સી) અમે જોહાએ છીએ We see
(ઉવી સી)

તુ જુએ છે Thou see-est તમે જુએ છો You see
(ધાઉ સીએસ્ટ)

તે જુએ છે He sees (હી સીઝ) તેઓ જુએ છે They see(ધે સી)

ભૂતકाणिनां ३५.

મેં જોહુ I saw (આઈ સા) અમે જોહુ We saw (ઉવી સા)

તેં જોહુ Thou sawest તમે જોહુ You saw (યુ સા)
(ધાઉ સાએસ્ટ)

તેણે જોહુ He saw (હી સા) તેઓએ જોહુ They saw(દી સા)

પુષ્ટ વર्तमानकाणिनां ३५.

Give (ગીવ) આપણું.

મેં આપેલું છે I have given અમે આપેલું છે We have
(આઈ હેવ ગીવન)

given (ઉવી હેવ ગીવન)

તેં આપેલું છે Thou hast given તમે આપેલું છે You have
(ધાઉ હેરટ ગીવન)

given (યુ હેવ ગીવન)

તેણે આપેલું છે He has given તેઓએ આપેલું છે They
(હી હેવ ગીવન)

have given (ધેહેવ ગીવન)

[†] કિયાપદના ભૂતકૃતને 'To have' ના વર્તમાનકાળનું ३५
કાગડાચી પુષ્ટ વર્તમાનકાળ થાય છે.

Run (રન) ના વર્તમાનકાળનાં રૂપ.

હું હોકું છું I run (આઈ રન) અમે હોડીએ છીએ We run
(ઉવી રન)

તું હોડે છે Thou runnest તમે હોડો છો You run (હું રન)
(ધાઉ રનેસ્ટ)

તે હોડે છે He runs (હી રન્સ) તેઓ હોડે છે They run (ધે રન)

Run (રન) ના ભૂતકાળનાં રૂપ.

હું હોખો I ran (આઈ રન) અમે હોખા We ran (ઉવી રન)

તું હોખો Thou rannest તમે હોખા You ran (હું રન)
(ધાઉ રનેસ્ટ)

તે હોખો He ran (હી રન) તેઓ હોખા They ran (ધે રન)

Lose (લુઝ) પુણ્ય વર્તમાનકાળ.

મેં જોયું છે I have lost અમે જોયું છે We have lost
(આઈ ડંબ લોસ્ટ)

તેં જોયું છે Thou hast lost તમે જોયું છે You have lost
(ધાઉ ડંસ્ટ લોસ્ટ)

તેણે જોયું છે He has lost તેઓએ જોયું છે They have lost
(હી ડેઝ લોસ્ટ)

ગુજરાતીમાં મણશ, અને શે લગાખાથી અવિષ્યકાળ આય
છે જેમણે કરીશ, કરશો, ખરુશિ, ખાગે વીજેરે, પણું અંગ્રેજમાં અવિ-
ષ્યકાળને માટે એ શણ્દ હિયાપદની પહેલાં નાપરનાથી અવિષ્યકાળ
ઓળખાય છે. તે Shall (શેષ) તથા Will (વીલું) છે. જેમણે,
કરવું Do, (ડુ) કરીશ Will do (ઉવીલ ડુ) અથવા Shall do
(શેષ ડુ) તેમનાં રૂપ નીચે આપણાં છે.

Do (ह) ना अविष्यकाणां ३५.

हु करीश I shall do (आध रॉल हु)	अमे करीशु We shall do (उवी रॉल हु)
तु करीश Thou wilt do (धाउ वील्ट हु)	तमे करशा You will do (यु उवील हु)
ते करशे He will do (हो उवील· हु)	तेओ करशे They will do (धे उवील हु)

हु लहशि I will take (आध उवील टेहक)	अमे लहशु We will take (उवी वील टेहक)
तु लहशा Thou shalt take (धाउ शेहट टेहक)	तमे लेशा You shall take (यु रॉल टेहक)
ते लेशे He shall take (हो रॉल टेहक)	तेओ लेशे They shall take (धे रॉल टेहक)

वांचन पाठ १ ला.

शाहदा.

नहि No (ना)	ने, पासे To (ह)
पासे, थी By (थाय)	माई My, Mine (माय, माईन)
अने Me (भी)	हा Yes (यस)
अमे We (उवी)	थबुं, हेबुं Be (भी)
ज्ञे If (धू)	अने And (ओन्ड)
ते He (हो) [नरज्ञति]	जूदी Soon (सून)
ऐसबुं Sit (सीट)	साहेभ Sir (अर)

હું I (આઈ)	જતું Go (ગો)
ખું Am (એમ)	એવું So (સો)
છે Is (ઇઝ)	આવવું Come (કમ)
કરતું Do (ડુ)	તે It (ઇટ) નાન્યતર જાતિ.
અંદર In (ઇન)	

વાક્યો.

- ૧ હું જાઓ ખું I go (આઈ ગો) .
- ૨ તે અંદર છે He is in (હી ઇંન ઇન)
- ૩ જે તે કરે If he does (ઇઝ હી ઝેઝ) .
- ૪ હા સાહેખ હું કરે ખું Yes sir I do (પસ સર આઈ ડુ)
- ૫ મારી પાસે આવો Come to me (કમ કુ ભી)
- ૬ ના અમે આનીએ છીએ No we come (નો ઉંહી કમ)
- ૭ જો તે એમ હોય તો હું જાઓ If it be so I go (ઇઝ ઇટ ભી સો આઈ ગો)
- ૮ અમે અંદર જઈએ છીએ We go in (ઉંહી જો ઇન)
- ૯ ના તે મારે છે No, it is mine (નો, ઇટ ઈજ માર્ખન)
- ૧૦ સાહેખ જલદી આવો અને મારી પાસે એસો, Sir, come soon and sit by me (સર, કમ સુન એન્ડ સીટ બાય ભી)

વાંચન પાડ ર જો.

એક A (એ), An, (એન)	તે That (થેટ)
One (વન)	રમતું Play (પ્લે)
કહેવું, કહો, Say (સે)	માણસ Man (મેન)
ટેપી Cap (કેપ)	સારો Good (ગુડ)

તુ Thou (ધાઉ)

અમને Us (અસ)

કલમ Pen (પેન)

વાસ્તે Vor (ફોર)

આપવું, આપો Give (ગીવ)

તા, વિષે Of (ଓફ)

દ્વેડો, દ્વેડવું Run (રન)

તમે You (યુ)

તેઓ They (ધુ)

ખળદ Ox (ઓક્સ)

છોકરો Boy (ઓય)

મોકલવું Send (સેન્ડ)

અથવા, કે Or (ઓર)

સાથે With (ઉઠાથ)

તેણી She (શી) નારીજતિ

૧ તે માણુસ સારો છે, That man is good (ધટ મેન ધજ ગુડ)

૨ અને એક કલમ આપો, Give me one pen (ગીવ મી વન પેન)

૩ તે ટાપી ભારી છે, That cap is mine (મિટ ટેપ ધજ માઇન)

૪ તે ભારે ભારે મેકલને, Send it for me (સેન્ડ ધટ ફોર મી)

૫ એક છોકરો અને એક ખળદ, A boy and an ox (એ
ઓય એન્ડ એન્ડ એક્સ)

૬ તમે ભારી પાસે બેસો, You sit by me (યુ સીટ બાય મી)

૭ તે છોકરાને એક કલમ આપો, Give one pen to that boy
(ગીવ વન પેન ટુ સેટ ઓય)

૮ તેઓ તમારા વિષે એવું કહે છે, They say so of you
(ધે સે સો ઓફ યુ)

૯ અમને એક ખળદ આપો, Give us one ox (ગીવ અસ
વન એક્સ)

૧૦ તેઓ ભારે વાસ્તે તે માણુસની સાથે જય છે, They go for
me with that man (ધ ગો ફોર મી વીથ ધટ મેન)

વાંચન પાઠ ૩ બો.

ખરાય Bad (બેડ)	જાડો Fat (ફેટ)
છો Are (આર)	રાખતું Keep (કીપ)
ધાંધું Very (વેરી)	હમણ્ણાં Now (નાઈ)
ખીલાડી Cat (કેટ)	ટાંકણી Pin (પીન)
દો Two (ડુ)	રોખો Ran (રેન)
વારું, સારું Well (વેલ્સ)	તેને .Him (હીમ)
ગાલ્યો Wise (વાઇઝ)	લેવું, દો Take (ટેક)
કોણું Who (હુ)	ટાંકણીઓ Pins (પીન્સ)
આ This (ધીસ)	ચોપડી Book (બુક)
રાતું Red (રેડ)	રૂપીયા Rupees (રૂપીઝ)

- ૧ આ ખીલાડી ખરાય છે This cat is bad (ધીસ ડેટ હસ બેડ)
- ૨ તે છોકરો ગાલ્યો છે That boy is wise (ઘેટ એલ્યા હજ વાઇઝ)
- ૩ તેને દો ટાંકણીઓ આપો Give him two pins (ગીવ હીમ ડુ પીન્સ)
- ૪ હમણ્ણાં કોણું રોખો ? Who ran now (હુ રેન નાઈ ?)
- ૫ આ ચોપડી તમારી પાસે રાખો Keep this book with you (કીપ ધીસ બુક વીથ મુ)
- ૬ એક જાડો અળદ One fat ox (વન ફેટ ઓફસ)
- ૭ મને દો રૂપીયા આપો Give me two rupees .(ગીવ મી ડુ રૂપીઝ)
- ૮ વારું, તે કલ્પન ભારે વાસ્તે મોકલને Well; send that pen for me (વેલ સેન્ડ ડેટ પેન હ્યાર મી)

- ૬ તમે હમણા જાઓ અને તે કરો You go now and do it. (ધૂ જો નાડ એન્ડ કુ ધટ)
- ૭૦ આ રાતી કલ્યાણ ધણી સારી છે This red pen is very good. (ધીસ રેડ પેન ડાઝ વરી શુક)

વાચન પાઠ ૪ થો.

મંદ કરવી Help (હેપ્)	પુછવું, પુછો Ask (આરક)
બનાવો, બનાવવું Make (મેન્ક)	પંચી Box (ગુંકસ)
જુઓ Look (લુક)	સૂર્ય Sun (સન)
અહીંઓ Here (હીપર)	સાદી Mat (મેટ)
લાં There (ધેર)	તમારું Your (યાર)
પરમેશ્વર God (ગોડ)	ગરમ Hot (હોટ)
કુતરા Dog (ડોગ)	સધળું All ઓથ
કાષળી Bag (બગ)	બંદુક Gun (ગન)
તેતું His (હિઝ)	પખો Fell (ફેલ)
તૃણ Three (થ્રી)	શું What (વહાટ)
ઘર House (હાઉસ)	માણુસો Men (મેન)
પાછું Back (બેક)	શકવું Can (નન)
૧ લાં જુઓ Look there (લુક ધેર)	
૨ તૃણ માણુસો Three men (થ્રી મેન)	
૩ આ શું છે ? What is this (વહાટ ડાઝ ધીસ ?)	
૪ અને મંદ કરો Help me (હેપ મી)	
૫ તેતું ઘર અહીંઓ છે His house is here. (હિઝ હાઉસ ડાઝ, હિથર)	

- ੬ ਸੂਰ੍ਯ ਅਰਮ ਛੇ, (The) Sun is hot. (ਧੀ ਸਨ ਛਜ ਛਾਈ)
- ੭ ਤੇ ਵਿਖੇ ਤੇਨੇ ਪੁਛੋ Ask him of it. (ਆਵਕ ਫੀਮ ਅੱਡੇ ਧਟ)
- ੮ ਤੇ ਕੁਤਰੇ ਫੇਖੋ ਅਨੇ ਪਥੋ That dog ran and fell
(ਧੇਟ ਤੱਤ ਰੱਨ ਅੱਡ ਫੇਖ)
- ੯ ਝੀਪੀਆ ਤੇਨੀ ਡਾਖਲਾਮਾਂ ਛੇ Rupees are in his bag
(੩ਪੀਝ ਆਰ ਫਨ ਹੀਝ ਬੇਗ)
- ੧੦ ਤਮਾਰੀ ਸਾਫ਼ੀ ਪੇਟੀਮਾਂ ਛੇ Your mat is in (the) box
(ਯੋਹੰ ਮੱਟ ਛਜ ਫਨ ਧੀ ਪ੍ਰਾਕਸ)
- ੧੧ ਪਰਮੇਸ਼ਰ ਸਖਲੁੰ ਅਨਾਨੀ ਸ਼ਕ ਛੇ God can make all.
(ਝਾਂਡ ਕੇਨ ਮੇਹਕ ਅੱਕਾਲ)
- ੧੨ ਤਮੇ ਪਾਣੀ ਜਾਓ ਅਨੇ ਤੇਨੇ ਪੁਛੋ You go back and
ask him (ਧੁ ਗੇ ਏਕ ਅੱਡ ਆਵਕ ਫੀਮ)

ਵਾਂਚਨ ਪਾਠ ੫ ਮੋ।

ਨਹਿ' No, Not (ਨੋ, ਨੋਟ)	ਲੀਕੋ। Green (ਝੀਨ)
ਗਯੋ ਨਹਿ' did not go (ਝੀਡ ਨੋਟ ਗੇਵਾ)	ਹਾਥ ਛੇ Has (ਫੱਝ)
ਤੇਥੀ So (ਸੇਵਾ)	ਪਗ Legs (ਲੇਝ)
ਕਾਗੇ। Black (ਫੱਕ)	ਅਨਾਜ Corn (ਕੌਰ੍ਚ)
ਵਾਪਰਵੁੰ Use (ਫੁਝ)	ਨੀ ਪਾਸੇ ਛੇ Have (ਫੁਵ) ਘੜ੍ਹ ਵੱ
ਵਖਤ Time (ਟਾਈਮ)	ਜਾਫ Tree (ਫੀ)
ਘੋਗੇ। White (ਨਕਾਈ)	ਧਾਢਾ Many (ਮੱਨੀ)
ਛੋਕਰੇ [ਪੋਤਾਨੋ] Son (ਸਨ)	ਮਾਂਡੀ Sick (ਚੀਕ)
ਤੇ The (ਧੀ)	ਨਾਮ Name (ਨੇਉਮ)

દાથ Hand (દાથ)	આય છે Eats (ઇટસ)
ધરડો Old (ઓલ્ડ)	ગયો Went (વેન્ટ)
ક્યાં Where (બહેર)	કબુતર Dove (ડ્રેન)
હોય છે Is, Are (ઇઝ, આર)	પોપટ Parrot (પરોપટ)
જીવાન Young (યંગ)	રંગ Colour (કલર)
કાગડો Crow (ક્રો)	નો Of (ઓફ)
	મારી પાસેછે I have(આછાદન)

૧ કાગડો કાગો હોય છે The crow is black. (ધી કો ધક વર્ણક)

૨ તે કબુતર બોળું છે That dove is white. (વેટ ડ્રેન વર્ણાદિક)

૩ માણુસો અનાજ આય છે Men eat corn. (મેન ઇટ કોર્ન)

૪ તમારું નામ શું છે ? What is your name ? (વર્ણાટ ધક યાર નેચમ ?)

૫ તે ધરડા માણુસ પાસે એક રૂપીઓ છે That old man has one Rupee. (ધિટ ઓલ્ડ મેન હેંડ વન રૂપી)

૬ મારો લીલો પોપટ ક્યાં છે ? Where is my green parrot ? (બહેર ધક માય ગ્રીન પેરોપટ ?)

૭ તે જીવાન માણુસ જોડો છે That young man is fat. (ધેટ યંગ મેન ઈઝ ફ્રેન્ટ)

૮ માણુસો કામગાં દાથ વાપરે છે. Men use hand in work. (મેન યુઝ હેન્ડ ધન વર્ક)

- ੬ ਤੇਨੇ ਏ ਪਗ ਛੇ He has two legs. (ਭੀ ਟੱਕ ਕੁ ਲੋਗ)
- ੧੦ ਤੇਖੀ ਮਾਂਹੀ ਛੇ ਤੇਥੀ ਹੁ ਲਾਂ ਗਯੋ ਨਹਿ She is sick,
- ੧ ੯੦ I did not go there. (ਰਾਹੀਂ ਚਲੀਕ, ਸੋ ਆਈ ਹੀ
ਨਾਟ ਗੇ ਧੰਡ)
-

ਵਾਂਚਨ ਪਾਠ ੬ ਟੈ।

ਆਨਾਨੇ To eat [ਕੁ ਧਟ]	ਸੁਖੇਥੀ Happily [ਲੱਪਲੀ]
ਬੋਲਾਵਨੁੰ Call [ਡਾਕ]	ਕਹਿੰਦੁੰ Told [ਟਾਂਡ]
ਮੋਹਨ Mohan [ਮੋਹਨ] ਨਾਮ ਛੇ.	ਖੜਿਆ, ਪਥਰ ਰੇ ਅਵਿਅਕਾਗ ਨੀਥਾਨੀ
ਸੀਪਾਇ Police [ਪਿਲੀਸ]	Shall [ਗੁਣਥ]
ਫੇਲਕਰੀ Porter [ਪੋਟਰ]	ਕੁਗਾਂ Clothes [ਕੱਕਾਂਝ]
ਕਹੋਵੁੰ Tell [ਟੇਕ]	ਜੇਡਾ Shoes [ਥੁੜ]
ਜਾਣਨੁੰ Know [ਨੋ]	ਗਾਡੀ Carriage [ਕੇਰੈਝ]
ਮਜ਼ਬੂਤ Strong [ਸਟ੍ਰੋਂਗ]	ਕਿਥਾਂ Where [ਉਨਫੇਰ ?]
ਆਇਸੂ Idle [ਆਇਡਲ]	ਗਿਵਦਾ Gone [ਗੀਨ]
ਸੁਨ੍ਦਰ Pretty [ਪ੍ਰੈਟੀ]	ਕਾਰੇ ? When ? [ਉਨਫੇਨ ?]
ਕਹਿੰਦੁੰ Ugly [ਅਗਲੀ]	ਸਨਾਰ Morning [ਮੌਨੀਗ]
ਪੰਸਾਹਾਰ Rich [ਰੀਅਚ]	ਸਾਂਝ Evening [ਅਵਨੀਗ]
ਗਰੀਬ Poor [ਪ੍ਰਾਵਰ]	ਆਵੇਂਦਾ Came [ਕੇਵਾਮ]
ਰਹੋਵੁੰ Live [ਲੀਵ]	.

ਤੇਨੇ ਬੋਲਾਨੇ Call him [ਡਾਕ ਛੀਮ]

ਤੇਨੇ ਅਫੀਆਂ ਮੇਡਕੋ Send him here [ਸੇਨਡ ਛੀਮ ਛੀਧਰ]

तेने लां बोलावो Call him there [કळाल छीम धेर]
 भोहनने बोलावो Call Mohan [કळाल भोहन]
 सीपाईने तेडो Call the police [कळाल धी चोलीम]
 हेल्परीने बोलावो Call a porter [कळाल ए मोर्टर]
 हुं तभने कहु छुं I tell you [आए टेल यु]
 हुं ते जाणु छुं I know that [आए नो झूट]
 हुं मज्जुत छुं I am strong [आए अम रेट्रोग]
 ते आणसु छे He is idle [ही इंज आएडव]
 तेष्टी सुंदर छे She is pretty [ही इंज प्रेटी]
 ते कदम्पु छे It is ugly [ईट इंज अगली]
 तमे देसादार छो You are rich [यु आर रीच]
 ना हुं गरीब छुं No, I am poor [नो आए अम पूअर]
 हुं सुखेथा रहु छुं I live happily [आए लीव हेपीली]
 हुं तभने कहु छुं, के हा I tell you "yes" [आए
 टेल्यु यस]
 में तेने कहु डे ना I told him "no" [आए टोड
 छीम नो]
 हुं बदार गाठश I shall go out. [आए शेल जो आउट]
 ईटले वागे ? At what time ? [ऐट उवेट टाइम ?]
 ऐ वागे ? At now [ऐट यु]
 हुं बदार जाउ छुं I go out [आए जो आउट]
 भारां शुगां लावा Bring my clothes [जिंग भाइ
 क्लोथ]

મારા જોડા લાવો Bring my shoes [ખિંગ માઈ શુઝ]
 એક ગાડી બોલાવો Call one carriage [કોલ્સ વન કેરેજ]
 તેઓ બહાર જાય છે They go out [ધે જો આઉટ]
 તે બહાર ગયો છે He has gone out [હી હેંડ
 હોન આઉટ]
 કયારે ? When ? [ઉંહેન ?]

આજ સવારે અથવા આજ સાંજે This morning or this
 evening [ધિસ મોરનિંગ ઓર ધિસ ઇવનિંગ] .

તેઓ ગયા They went [ધે ઉંડન્ટ]
 તે અહીંથા આવાને આવ્યો He came here to eat
 [હી ડેફમ હીઅર કુ ઈટ]

વાચન પાઠ ઉ મે.

લાવવું Bring [ખીંગ]	ખરાય Bad [ડાડ]
તેજ The same [હી સેદમ]	જુકું Lie [લાઈ]
નેતું See [સી]	ચાલવું Love,like [લવ,લાઇક]
ઉભા રહેવું Stop [સ્ટોપ]	ચાહે છે Loves [લવ્ઝ]
ધિક્કારવું Despise [ડિસ્પાઇઝ]	ખરેખર Indeed, really [ઇન્ડીડ, રીઅલી]
શા સાર ? Why [ઉવાય]	કહે છે Tells [ટેલ્સ]

તમે અહીં ઉભા રહો You stop here [બુ સ્ટોપ હીયર]
 હું તેને ધિક્કારું છું I despise him [આ ડિસ્પાઇઝ હીમ]

ਕਾ ਮਾਰੇ ? Why ? [ਓਵਾਧੁ ?]

ਤੇ ਜੁਦੂ ਆਲੇ ਛੇ He tells a lie [ਹੀ ਟੇਲਸ ਆ ਲਾਈ]

ਛੁ ਤੇਨੇ ਚਲਾਵੁਂ ਛੁ I love him [ਆਈ ਲਨ ਹੀਮ]

ਤ ਮਨੇ ਆਵੇ ਛੇ He loves me [ਹੀ ਲਨ ਮੀ]

ਛੁ ਤੇਮਨੇ ਚਲਾਵੁਂ ਛੁ I love them [ਆਈ ਲਨ ਥੇਮ]

ਛੁ ਤਮੇ ਮਨੇ ਚਾਲਾਂਵੇਂ ਛੋ ? Do you love me ? [ਤੁ ਤੁ ਲਵ ਮੀ ?] .

ਤੇਡੇ ਤੇਨੇ ਆਵੇ ਛੇ They love him [ਹੇ ਲਵ ਹੀਮ]

ਛੁ ਅਫਿਂਅਂ ਛੁ I am here [ਆਈ ਏਮ ਹੀਅਰ]

ਤਮੇ ਲਾਂ ਉਭਾ ਰਹੋ You stop there [ਧੁ ਸਟੋਪ ਧੇਰ]

ਤੇ ਕਥਾਂ ਛੇ ? Where is he ? [ਓਫ੍ਰੋਰ ਇੱਜ ਹੀ ?]

ਤੇ ਅਫਿਂਅਂ ਛੇ ? Is he here ? [ਇੱਜ ਹੀ ਹੀਅਰ ?]

ਤੇ ਤਾਂ ਨਥੀ He is not there. [ਦੀ ਇੱਜ ਨੋਹ ਧੇਰ]

ਤੇਣੀ ਕਥਾਂ ਛੇ ? Where is she ? [ਓਫ੍ਰੋਰ ਇੱਜ ਸ਼ੀ ?]

ਤੇ ਆਫ੍ਰੋਰ ਗਈ She went out [ਸੀ ਉਵੈਨਟ ਆਓਟ]

ਤੇ ਕਥਾਂ ਛੇ ? Where is it ? [ਓਫ੍ਰੋਰ ਇੱਜ ਇਟ ?]

ਆ ਰਹਿੁੰ Here it is. [ਵੀਅਰ ਇਟ ਇੱਗ]

ਪੇਖੂ ਰਹਿੁੰ There it is. [ਧੇਰ ਇਟ ਇੱਗ]

ਤੇ ਅਫਿਂਅਂ ਏਤੁ It was here [ਇਟ ਉਤੋਝ ਹੀਅਰ]

ਤਮੇ ਤਾਂ ਜਾਓ ਨੇ ਜੁਓਾ You go there and see.

[ਧੁ ਜੋ ਧੇਰ ਏਨਾਂ ਸੀ]

ਆ ਤੇਜ਼ ਛੇ This is the same [ਵਿਝ ਇੱਜ ਧੀ ਸੇਝਮਿ]

ਤੇ ਥੁੰ ਛੇ ? What is it ? [ਓਵੋਟ ਇੱਜ ਇਟ ?]

શું તે ખરાખ છે ? Is it bad ? [એક છટ એડ ?]

તે સાર છે It is good. [છટ છગ ગુડ]

તે પાણું લાવો Bring it back. [અંગ છટ એંક]

શું ખરેખર જેમ છે ? Is it really so ?

[છજ છટ રીઅલી સો ?]

શું તે જુવાન માણુસ પૈસાદાર નથી ? Is not that young man rich ? [મઝ નોટ ધેટ યંગ મેન રીચ ?]

વાચન પાઠ ૮ મો.

ઉદ્ર Mouse [માઉસ]

રોજ Daily [દેખલી]

પીનું Drink [ડ્રિક]

કાન Ears [છયર્સ]

પાણી Water [વોટર]

અદાર Out [આઉટ]

દૂષ Milk [મીલ્ક]

માં Into [છન્કુ]

સાંભળવું Hear [લીધર]

પડગો Hell [ફેલ્]

ઓરડો Room [રૂમ]

પાડ Lesson [લેસન]

સુનું Lie down [લાઈ ડાઉન]

વર્ગ Class [ક્લાસ]

લખવું Write [રાખટ]

વાચે છે Reads [રીડા]

રતે At night [એટ નાઈટ]

શીખવું Learn [લર્ન]

આવડવું Know [નો]

દરેક Each [છંચ]

ગરીબ Poor [પુઅર]

શ્વર્ણ Word [વર્ડ]

જોઈએ Must [મરટ]

હુંવો Well [વેલ]

પહેલો First [ફિર્સ્ટ]

શીખવવું Teach [ગીય]

ઓખણું Speak [સ્પીક]

તેણી She [શી]

હું પાણી પીડ છું I drink water [આધ પ્રીક વોટર]

તે ભીલાડી દુખ પાયે છે That cat drinks Milk. [વેટ કેટ
ડ્રૂક્સ મીલ્ક]

તે કાન વડે સાંબળે છે He hears with ears. [હી હીઅર્સ
વીએ ચાર્સર્સ]

તેઓ ઓરડામાં સુર્જ રહે છે They lie down in the room.
[એ લાય ડાઉન ઇન ધી રમ]

તેણી રોજ ચોપડીઓ લખે છે She writes books daily.
[શી રાઇટ્સ યુક્સ ટેચ્લી]

રાત્રે હું અહાર જતો નથો I do not go out at night.
[આઈ હુ નોટ ગો આઉટ એટ નાઇટ]

તમને તમારા પાડ આપને છે ! Do you know your lessons ?
[હુ હુ નો યોર લેસન્સ ?]

હું રોજ ચોપડી વાંચું છું I read a book daily. [આઈ રીડ
આ ખુક ટેચ્લી]

તમારે દરેક શઠ શીખવો જોઈએ You must learn each
word [યુ મરસ્ટ લર્ન છાય વર્ડ]

તે છોકરો વર્ગમાં પહેલો છે That boy is first in the class.
[વૈટ યોય એઝ ઇસ્ટ ઇન ધી ક્લાસ]

તમારે જુદું બોલવું ન જોઈએ You must not speak lie.
[યુ મરસ્ટ નોટ સ્પેક લાઈ]

એક ઉદર કુવામાં પડ્યો One mouse fell into a well.
[વન માઉસ ફેલ ઇન્ડુ આ વેલ]

તેઓ તેને લખતાં શીખવે છે They teach him to write.
[એ ટીએ લીન હુ રાઇટ]

વાંચન પાડ હે મો.

કાગળ Paper (પેપર)	દાઢું Cold (કોલ્ડ)
શૈડો Horse (હોર્સ)	વાડ Hedge (હેજ)
સુદૂર Pretty (પ્રેટી)	આપણી Our (અધર)
શોડી Mare (મેર)	છરી Knife (નાઈફ)
કાડા Uncle (અન્કલ)	ટોપલી Basket (બાસ્કેટ)
છોકરું Child (ચાઈફલ્ડ)	ભરેલી Full (ફુલ)
મેંધું Dear (ડીઅર)	નિશાળ School (સ્કૂલ)
ચાડર Servant (સર્વનંદ)	યત્ન કરો Try (ટ્રીય)
માંડું ill (ઇલ)	દરેક Every (ઓફરી)
દેખાવવું Appear (એપીઅર)	ચીજી Thing (થીંગ)
ફહેન Sister (સીરિટર)	ફુકાળ Famine (ફેમીન)
બનાવે છે Makes (મેચ્કસ)	છાડી Girl (ગર્ભ)
ખડું Wheat (વ્હીટ)	આ This (ધીસ)
મુકે છે Puts (પુટ્ટસ)	બોગીલાલ Bhogilal (બોગીલાલ)

તે મારી બેન છે She is my sister. (શી. ઇજ માય સીસ્ટર)
 આ છાડી તેની ચોપડી વાંચે છે This girl reads her book.

(ધીસ અલ્ર્યુડ રીડિંગ હર ષુફ્ટ)
 આ છોકરો સાડે વાંચે છે This boy reads well. (ધીસ બાપ
 રીડિંગ વેલ)

હું મારો પાડ શીખું છું I learn my lesson. (આઠ લર્ન
 માય લેસન્સ)

અમે ગરીબ છીએ We are poor. (ઉની આર પુઅર)

આ કાણુ છે Who is this? (હુ ધજ ધીસ)

તે બોગીલાલ છે He is Bhogilal. (સ્રી ધજ બોગીલાલ)

હું તેને સારી પેઠે ગોળાણું જું I know him well (આધ નો ધીમ વેલ)

આ મારી છરી છે This is my knife. (ધીસ ધજ માય નાઈઝ)

આ થોડો સુંદર છે This horse is pretty. (ધીસ હોર્સ ધજ પ્રેતી)

આ કાગળ લાલ છે This paper is red. (ધીસ પેપર ધજ રેડ)

આ થોડી ધર્થી ખરાઅ છે This mare is very bad. (ધીસ મેર ધજ વેરી અડ)

આ છોકરે સારે છે This child is good. (ધીમ ચાઇફ ધજ ગુડ)

મારો કંડો પૈસાદાર છે My uncle is rich. (માય અન્કલ ધજ રીચ)

તે કુતરો આપણું વાડમાં છે That dog is in our hedge. (બેટ હોગ ધજ એન અવર લેજ)

આ પાણી હંડુ છે This water is cold. (ધીમ વોટર ધજ હોલ્ડ)

મારો થોડો જન્માન છે My horse is young. (માધ હોસ્ટ ધજ યંગ)

આ ટોપલી ભરેલી છે This basket is full (ધીમ ટાસ્કેટ ધજ ફુલ)

દુઃકાળમાં ધર્થ મોંદા હોય છે. Wheat is dear in famine. (નહીંટ ધજ ડીઅર ધન હુમીન)

તેઓ માંદા દેખાય છે They appear ill. (ધ એપીયર ધક્ષ)

તે દરેક ચીજ નિશાળમાં ભુકે છે He puts everything in the School. (હી પુટસ અંવરીથીંગ ધન ધી સ્કુલ)

ધ્યાન પાઠ ૧૦ મો.

ઘર Home (હોમ)	શીશાપેન Pencil (પિનસીલ)
કો Let (લેટ)	ભાઈ Brother (અધર)
વચન આપવું Promise (પ્રેમીઝ)	દોડે છે Runs (રન્સ).
કોઈ નહિં None (નન)	દાથ Hand (હન્ડ)
ષ વાગતે At six o'clock (એટ સીક્સ એ'ક્લોક)	આપ્યું Gave (ગેવ્ન્યુ)
મરજી છે Desires (ડિજાયર્સ)	ગુમાવી, બોલ્ડ Lost (લૉસ્ટ)
બોલવું Wait (ઉવેદાટ)	વીરી King (રોઝ)
ટોમી [નામ છે] Tommy (ટોમી)	જરી Found (ફાઉન્ડ)

કોણું જશો ? Who will go ? (કુ ઉવીલ ગો ?)

કોઈ નહિં જાય None will go. (નન ઉવીલ ગો)

તેઓ આવશે કે ? Will they come ? (ઉવીલ ધે કમ ?)

તેઓ આવ્યા છે They have come. (ધે ડંગ કમ)

તમે કયારે જશો ? When will you go ? (ઉન્ડેન ઉવીલ યુ ગો ?)

ષ વાગતે At six o'clock. (એટ સીક્સ એ'ક્લોક)

તેની આવવાની મરજી છે He desires to come. (હો ડિજાયર્સ
કુ કમ)

તેને આવવા દેવો Let him come. (લેટ હીમ કમ)

તે આવે ત્યાં સુધી બોલજે Wait till he comes. (ઉવેદાટ
ફીલ હી કમસ)

કું થોભીશ I shall wait. (આઈ સૉલ્ન ઉવેદાટ)

તમે શું કરો છો ? What do you do ? (ઉવોટ કુ શુ કુ શો ?)

તમે શું કામ ખયા ? Why did you go ? (ઉવાય હીડ યુ ગો ?)

હું ટોમી સાથે ગયો I went with Tommy. (આઈ ઓવેન્ટ ઉવીથ ટોમી)

હું ઘેર જાઉ છું I go home. (આઈ ગો હોમ)

હું હુર જગતશ નહિ I shall not go far. (આઈ રોલ નોટ ગો ફાર)

હું તમને વચન આપું છું I promise you. (આઈ પ્રેમીસ યુ)
તમે આ કામ કરી શકશો ? Can you do this work ?

(કેન યુ કુ ધિસ ઉવર્ક ?)

હો, સાહેબ, થામાટે નહિ] Yes, sir, why not ? (યસ, સર,
ઉવાય નોટ)

તમે શું કહ્યું ? What did you say ? (ઉવોટ ડિડ યુ સે ?)

તે કામ નથી કરતો He does not work. (હી ડક નોટ ઉવર્ક)

તમે શું કરો છો ? What are you doing ? (ઉવોટ આર યુ કર્યુંગ)

હું વાંચું છું I am reading. (આઈ એમ રીડિંગ)

પેલા છાકરાને જુઓ See that boy. (સી ઘેટ બોય)

હું તેઓને જોઈ રહ્યું છું I can see them. (આઈ ડેન સી ધેમ)

તે ચોણે તે જુઓ છે He sees it himself. (હી સીજ છટ હીમસેલ્દ)

તે નાસી જાય છે He runs away. (હી રન્સ આવે)

તે શું છે ? What is it ? (ઉવોટ ધક ધટ ?)

તે શાશાપેન છે કે ? Is it a pencil ? (ધક ધટ આ પેન્સિલ)

હા, તે મારી શાશાપેન છે Yes, it is my pencil. (યસ ધક
ધટ આય પેન્સિલ)

તે તેણીના હાથમાં છે It is in her hand. (ધટ ધુક ધન હર હન્ડ)

તમને કોણે આપી ? Who gave you ? (કુ જેવ યુ ?)

મારા ભાખાંને મને આપી My brother gave me. (મામ
અખર જેવ મી)

मेरे भारी बीटी जोहर्ड I lost my ring. (आधिं लोस्ट भाय रींग)
 ते जडीड ? Did you find it ? (दीड़ यु फाइन्ड फॉइंड ?)
 ते क्यां हती ? Where was it ? (ओहेर ओव्होअ एट ?)
 ते अहींआ हती It was here. (एट ओव्होअ दीहर)
 भने तमारो हाथ आपो Give me your hand. (गीव भी यार हॉन्ड)

वांचन पाठ १२ भेठा.

गांडा Mad (मैड)	भीडवुं Afraid (अफ्रेड)
छत्युं Won (जिवन)	धभरान्तुं Frightened (फ्राइटेड)
जायुं Lost (लास्ट)	मद्द Help (हेप्प)
पकडवुं Catch (कॅच)	हान्न Present (प्रेसेन्ट)
नांझतुं Throw (ब्रो)	ना Don't (डोन्ट)
उपाडवुं Take up (टेक अप)	

ते गांडा छे He is mad. (ही एड मैड)
 वात ना करो Don't talk. (डोन्ट टेक)
 ते भारी खासे लावो Bring it to me. (अर्हिंग एट हु भी)
 धनाम छाने भज्युं ? Who got the prize ? (हु जोट भी प्राइज़ ?)
 भने भज्युं I got it. (आधि ज्याट एट)
 तेष्वे ते जेायुं He lost it. (ही लास्ट एट)
 तमे ना जाओ You don't go. (यु डोन्ट जो)
 ते त्यां छे He is there. (ही एड थेड)
 भने पकडो Catch me. (कॅच भी)
 तेष्वे ते शायुं He did it. (ही डीड एट)

તમે તે ખચીત કરો You must do it. (યુ મરટ કુ ઈટ)
 તે ના કરો Don't do it. (ડોન્ટ કુ ઈટ)
 તે નાંખો હો Throw it away. (થો ઈટ આવે)
 તે ઉચ્ચા લો Take it up. (ટેઇક ઈટ અપ)
 તેની પાસે જાઓ Go to him. (ગો કુ હીમ)
 મારી પાસે આવો Come to me. (કમ કુ મી)
 તે ગલરાધ છે. She is frightened. (શી ઈંગ ફોઈટ-ન)
 મને મદદ કરો Help me. (હેપ્પ મી)
 શા મારે નહિ ? Why not ? (જ્હાય નોટ)
 તમે ક્યાં હતા ? Where were you ? (ઉંહેર વેર યુ ?)
 હું અહીંથા હતો I was here. (આઈ ઉવોઝ હીયર)
 હું હાજર હતો નહિ I was not present. (આઈ ઉવોઝ નોટ
 પ્રેસન્ટ)
 હું આવ્યો લારે તમે શું કરતા હતા ? What were you doing
 when I came. (જ્હોટ વેર યુ કુર્ચંગ વહેન આઈ ટેઇમ ?)

વાંચન પાઠ ૧૨ મે.

વાત કરવી Talk (ટોક)	હોએધણું Shall be (સોલ બી)
કાઢવું Take out (ટેઇક આઉટ)	મોંડું Late (લેઇટ)
દીશ, શ. અવિષ્યકાળની નિશાની	ચાર Four (ફોર)
Shall (સોલ]	હમણું Now (નાઉ)
રાડવું Can (કન)	મધમાણી Bee (બી)
આજ રાતે To night (કુ નાઇટ)	ધુંટો Sip (સિપ)

મળવું Meet (મીટ)	મુંબાઈ Bombay (બેંગ્લે)
પરોઢીયું Day-break (ડે એંક)	પાદ્ધા Cup (કપ)
છોડવું Leave (લીવ)	અથાળું Pickle (પીકલ્સ)
કોષ્ટ Some (સમ)	ભરી લે Get (ગેટ)
આજ સાને This evening (ધીમું રઘવનીંગ)	મુંદર Nice (નામસ)
વખત Time (ટાઈમ)	માણી Fly (ફ્લાઇ)
દરમિયાનમાં During (ડયરિંગ)	અંદર Noon (નુન)
શારૂ કરવું Start (સ્ટાર્ટ)	કાલે મચારે To morrow mornings (કુ મોરાં માનીંગ)
ઘોરનો વખત Forenoon (ફોરનુન)	.

કુ તમેને પરોઢીયે મુળીશ, I Shall meet you at day break. (આજ શાલ મીટ યુ એંક ડે એંક)

કુ તેને અહાર કાઢી શકીશ. માણી ઉડી જો I can take it out, off you કુ ફ્લાઇ. (આજ ડન ટેક છટ આઉટ, આજ યુ ગો ફ્લાઇ)

લભાળું મારા પાદ્ધા ઉપર એક મધમાણી છે Now a bee is on my cup. (નાજ આ ધી ધર આન માય કપ)

મધમાણી પાણીનો ધુંટડો લરી લે Bee get a sip of water. (ધી ગેટ આ સિપ ઓઝ વોટર)

ના, કુ દુધનો ધુંટડો લરી શકીશ No, I can get a sip of milk. (નો આજ ડન ગેટ આ સિપ આજ મીલ્ક)

તે પેટી સુંદર છે The box is nice. (ધી કોકરાંધજ નાઈસ)

ઘોરની વખતે મને ઓક્સાવને Call me during the forenoon. (કુલ ધી ડયરિંગ ધ ફોરનુન)

સાંજે આવનો Come about evening. (કાગ એવાઈન છવનીંગ)

આર વાગ્યા કરતાં મોડો થના નહિ I Don't be later than four o'clock. (કા-ટ બી લેટર થેન હોર ચોકલોાં)

હું તમોને રાત્રે જોઈશ ? Shall I see you to-night ?
(શાલ આછ સી હુ હુ નાઈટ ?)

હું આજ સાંજે નવ વાગે મુખદ છાડીશ I shall leave Bombay this evening at nine o'clock (આછ શાલ લીન હોમે વિસ છવનીંગ એટ નાઈન ચોકલોાં.)

આમે અડખી રાત્રે ઉપરીથણ We shall start at midnight.
(ઉચ્ચી શાલ સ્ટાર્ટ એટ મીડનાઈટ)

હું કાલ સવારે લાં હોઈશ I shall be there tomorrow morning. (આછ શાલ બી ધેર હુમેરો મારનીંગ)

તમે કોઈ વખત રાતની દરમયાનમાં જાઓ છો ? Do, you go some time during night (હુ હુ ગો ભાગ યાઈ ડચુરીંગ નાઈટ ?

આજ સવારે વાત કરવા જઈશ I will go to talk this morning. (આછ શાલ ગો હુ ટોક ધીમે મોરનીંગ)

વાંચન પાંડ રૂ મો.

જોયો Saw (સા)	કાદે Yesterday (યસ્ટર્ડે)
આદા રાખવી Hope (હોપ)	પાણ આપવુ Return (રીટર્ન)

અઠવાડીથું Week (ઓવીક)
રજના દીવસો Holidays
(હોલ્ડિને)

શીધી Got (ગેત)
પખવાડીથું Fortnight (ફોર્ટનાઇટ)

પાણી Sinsful (સીનફુલ)
દાય Mercy (મર્સી)
મગદ્ધિ Vanity (વનીટી)
કેદી Prisoner (પ્રીઝનર)

પાપ Sin (સીન)
જળ Snare (રનેર)
ભાસેં રાખવા To Rely
(કુ રીલાય)

પ્રખ્યાત Fam: us (ફેમસ)
રસ્તો Path, way (પાથ, વા)
મારી આપવી To pardon
(કુ પાર્ડન)

શરૂ થવું Begin (અંગીર)

કદાચ Perhaps (પરષેપ્સ)
આવતી કાલે To-morrow
(કુ મોરન)

ખીંચે Next (નેક્સ્ટ)
મહિનો Month (મન્થ)

પુના Poona (પુના)

પરમેશ્વર Cod (ગ્રાડ)

મારી Pardon (પાર્ડન)

આ This (થીસ)

ઉદારતા Generosity (ગેનરેરોસિટી)

ના Do not (કુ નોટ)

દુનિયાં World (વર્લ્ડ)

કરણું Because (અંગીએ)

રાખવું To keep (કુ ક્રીપ)

દૂર Away, far (અવે, દૂર)

આપવું Bestow, Give

(ખીરટો, ગીવ)

સ્થિતિ Condition (કન્ડીશન)

મેં તેને ગાઈ કાલે જેણો હનો I saw him yesterday.
(આઈ સા ડીમ યસ્ટર્ડો)

રજના દીવસો આવતી કાલથી શરૂ થાય છે The holidays
begin from tomorrow. (ધી હોલ્ડિને ખીગીન સ્રોમ કુમેરો)

મારે આ અડવાડીયામાં પાછા ફરવાની આંશા છે I hope to return this week. (આઈ હોપ કુ રીટર્ન ધીસ વીક)

મેં પખવાડીયાની રજ લીધી છે I have got a fortnight's leave. (આઈ હેચ ઝોટ આ ફોર્નાઇટિસ લીવ)

કદાચ હું બીજે મહીને પુના જાહીશ Perhaps I shall go to Poona next month. (પરણેસ આઈ રોલ ગેંગ કુ પુના નેક્સ્ટ મન્થ)

અરે પરમેશ્વર ! મારા પાપની ભારી આપ O God ! pardon my sins. (એં ઝોડ ! પાર્ડન માય સીન્સ)

કારણું કે અમે મગદીની જગમાં ડેઢિ થયેલા છીએ Because we are confined in the snare of vanity. (બીજોજ ઉંની આર કારણં છન ધ સ્નેર એંડ વેનીટી)

અમને પાપના માર્ગમાંથી દૂર રાખ Keep us far from the path of sin. (કીપ અસ દૂર સ્ટોમ ધ પાથ ઝોડ સીન્સ)

આ પાપી જંગળિનો ભરસો ના રાખ Do not rely upon this sinful life. (કુ નોટ રીલાય અંપોન ધીસ સીન્સુલ લાધો)

જ્યા તમને આ દુનિયામાં પ્રખ્યાત કરે છે Mercy makes you famous in this world. ભર્તી મેક્સ કુ ફેમ્સ છન ધીસ વર્ડ)

પુરુષ પ્રથ્મ છે, ૧ લો, ૨ કો અને ૩ કો.

પુરુષ પ્રથ્મ છે, ૧ લો, ૨ કો અને ૩ કો.

૧ વાત કરનાર પહેલો પુરુષ, First Person. (ફોર્સ્ટ પરસન)

૨ જેણી સાથે વાત કરીએ છીએ તે બીજો પુરુષ Second Person. (સેક્યુન્ડ પરસન)

૩ જેના વિષે વાત કરતા હોધાએ તે નીંને મુઢ્ય Third Person.
(થર્ડ પરસન)

“તે” શાખણી સમજુતી.

‘તે’ નો અર્થ ઈચ્છેલભાં He (હી), She (શી), It (ઇટ), That (થેટ) અને The (ધ) છે. માટે યાદ રાખનું કે “The” (ધ) તે, ડોક્ટર મુકરર પ્રાણી પદાર્થ જણાવતો હોય ત્યારે વપરાય છે. જેમણે:—

The book is not good. (. ધ બુક ઇઝ નોટ ગુડ) તે ચોપડી ‘સારી નથી. (જે ચોપડી વિષે આપણે વાત કરતા હોધાએ તે.)

The child is good (ધ ચાઈલ્ડ ઇઝ ગુડ) તે ખાલીક સાંદ્ર છે.

The water is dirty. (ધ વોટર ઇઝ ડર્ટી) તે પાણી મેલું છે.

‘That’ (થેટ) અને ‘Those’ (ધોઅ) વિરોધણું છે માટે જ્યાં વિરોધણું એકવયન હોય ત્યાં “That” (થેટ) અને અદ્ભુવયન હોય ત્યાં “Those” (ધોઅ) વપરાય છે. જેમણે:—That dog (થેટ ડૉગ) તે કુતરા અને Those dogs (ધોઅ ડૉગ્ઝ) તે કુતરા.

He (હી), She (શી) અને It (ઇટ) સર્વનામ છે. માટે તે શબ્દો નામની સાથે ન વપરાતાં નામને અહલે વપરાય છે. નરાતિનું નામ હોય તો “He” (હી), નારીનાતિનું નામ હોય તો “She” (શી) અને નાન્યનાતિનું નામ હોય તો “It” (ઇટ) વપરાય છે.

"He" is coming (ही इत कर्मीय) ते आवे छे. [नरलाति]

"She" is coming (शी इत कर्मीय) तेली आवे छे. [नारीलाति]

"It" is coming (इत इत कर्मीय) ते आवे छे. [नान्यतरलाति]

Tenses (टेन्सिझ) काण विषे.

मुख्य काण तथ्य छे. वर्तमानकाण Present tense (प्रेजंट टेन्स) भूतकाण Past tense (पास्ट टेन्स) अने भविष्यकाण Future Tense (इयुचर टेन्स).

वर्तमानकाण करवानी ईताः—“To” काही नांभी कियापद्दो धातु एमने एम मुझी हेवो. पथ्य थील पुढ़य एकवचनमां अने गोल पुढ़य एकवचनमां अतुहमे est (इ एस ठी) अने s (एस) प्रत्यय लगाउवारी वर्तमानकाणनां इय आय छे. पथ्य के कियापद्दो छेडे ठ, (उल्ल एस) ठ, (एस एच) ch, (सी एच) x, (एक्स) अने o (ओ) आव्या होय तेने थील पुढ़य एकवचनमां s (एस) ने घद्दो es (इ एस) लागे, एमडे, He dresses (ही ड्रेसीस) ते मुझां पहेरे छे. He marches (ही मार्चीस) ते मुख करे छे. He fixes (ही रीफ्सीस) ते गोद्दे छे. He goes (ही जोअ) ते जाय छे.

भूतकाण. Past tense (पास्ट टेन्स)

कियापद्दा धातुने “ed” प्रत्यय लगाउवारी भूतकाण आय छे. एमडे, Feared (शीर्षक) लीन्मा. Worked (वर्क्ड) काम कर्य, Cooked (कुक्ड) राँधु. अनियमित कियापद्दां आ इल आम पहो नाही.

अभ्युत्तमी.

१. नियमित कियापद Regular verbs (रेज्युलर वर्ब्स)

ને કિયાપદના ભૂતકાળ તથા ભૂતકૃતવના રૂપ ed (ઇડી) અગાઉભાષી ચાય છે તે. બાકીના અનિયમિત.

૨. Irregular (ઇર્ગ્યુલર) એવાય છે. જેમણે Walk (વાક) ચાલનું, Walked (વાક્ટ) ચાલ્યો, Walked (વાક્ટ) ચાલેલો, Speak (સ્પેક) બોલનું, Spoke (સ્પેક) બોલ્યો, Spoken (સ્પેકન) બોલેલો.

૩. વર્તમાનકાળના es (ઇ એસ) ની અગાઉ તથા ભૂતકાળના ed (ઇડી)ની અગાઉકિયાપદનો અંતયાદ્ધર e (ઇ) હોય તો હિડી જાય છે. જેમણે:- I love (આઈ લવ) હું ચાહું હું. તેનું ભૂલ રૂપ બદલાઈ ભૂતકાળમાં I loved (આઈ લવ) મેં ચાહ્યો. Thou lovest (થાઉ લવેસ્ટ) તેનો. Thou lovedst (થાઉ લવ્ડસ્ટ) ચાપ છે.

૪. Y (વાય) યા I (આઈ) ને અંત્યવિજન બેવડો કરવાનો રૂપ રહ્યું ed (ઇ ડી)ની પહેલાં લાગુ ખાડવો. જેમણે:- Cried (ક્રાઇડ), Spotted (ર્પોટડ)

ભવિષ્યકાળ Future tense (ઇસ્યુચર ટેન્સ)

રીતઃ—કિયાપદના ધ્યાતુની પહેલાં Shall (શેલ) અગર Will (ઇલિલ) ના રૂપ અગાઉભાષી ભવિષ્યકાળ ચાય છે.

નોટ—પદ ને પહેલા મુર્ઝમા Will અને બીજા તથા ત્રીજા મુર્ઝ પમાં Shall (શેલ) વાપરીએ તો વચ્ચનું નાફલું તથા કુદમ ગતાવે છે. જેમણે:

He shall run (હી શેલ રન) તેને હોડું. મણો જ.

He shall do (હી શેલ કુ) તેને કરું. મણો જ.

He shall walk (હી શેલ વૉલ્ક) તેને ચાલનું. મણો જ.

He shall speak (હી શેલ સ્પેક) તે શ્વેચદં પદતો.

શાદાકાળ એવાખવાની રીત.

1. ડિયાપદને છેડે “છીએ, છો, છું, છે” હોય તો વર્તમાન કાળ છે એમ સમજવું. જેમણે:—

અએ છીએ We are. (ઉત્તી આર)

લું છે Thou art. (ધાઉ આર્ટ)

તેઓ છે Thay are, (ધે આર)

હું છું I am. (આઈ એમ)

ત છે He is. (હી ઇઝ) તમે છો You are (યુ આર)

2. ડિયાપદને છેડે ચો, ચી' કું, અથવા હતો, હતી, હતું. હતાં હોય તો ભૂતકાળ છે એમ સમજવું. જેમણે:—

હું રહ્યો I dwelt. (આઈ ડ્વેલ્ટ)

હું હતો I was. (આઈ વૉઝ)

ત ગઈ She went. (શી વેન્ટ)

ત ગયું It went. (ઇટ વેન્ટ)

3. ડિયાપદને છેડે ધશ, શે, શું અગર શો, હોય તો ભવિષ્યકાળ છે એમ સમજવું.

હું જઈશો I shall go. (આઈ શેલ જો)

તેઓ જશો They shall go. (ધે શેલ જો)

તમે જશું You shall go. (યુ શેલ જો)

અએ જશું We shall go. (ઉત્તી શેલ જો)

“ તે જશો He shall go. (હી શેલ જો)

વાંચન પાઠ ૧૪ મો.

મળી Got (ગ્રાટ)	રહેતું Live (લીવ)
સારી Fine (ફાઈન)	ધ્રણી Many (મેની)
ની પાસે છે Has (હેઝ)	ધાર્ણી Mill (મીલ)
ગુરુસે Angry (અંન્ટ્રી)	જે Which (વીચ)
પ્રખ્યાત Famous (ફેમબસ)	હોય છે Are (આર)
જમીઓ Pictures (પીકચર્સ)	દાવા Weather (વેથર)
પણ But (બટ)	ગુન્હોંા Fault (ફોલ્ટ)
ભાંગેલું Brokен (બોકન)	મોકું Large (લાર્જ)
ગાંધું Wise (વાઈઝ)	દનો Was (વોઝ)
ચીનરવું Drow (ડ્રો)	વાડી Garden (ગાર્ડન)
ચાકર Servant (સર્વન્ટ)	દંસા Money (મની)
રસાઇધો Cook (કુક)	સાપ Snake (સ્નેઇક)
દોડો People (પીપલ)	દ્યુશ્ર ગ્રેડ God (ગ્રાડ)
માયાળું Kind (કાઈન્ડ)	દાખતું Move (મુવ)
ચીતારો Painter (પેઇન્ટર)	માણલી Fish (ફીશ)
અંધળું Blind (બ્લાઇન્ડ)	પાંખ Fin (ફીન)
રસોંા Road (રોડ)	ફેવના Fire (ફાયર)
શીકો Pale (પેઇલ)	ખાયરી Woman (વુમન)
તે કાલે થેર હતો He (હી વોઝ અંટ હોમ થસ્ટર્ડે)	was at home yesterday.
હું કાલે વાડીમાં જઈશા I shall go in the garden to-morrow. (આછ સેલ ગો દન ધી ગાર્ડન હુ મોરો)	
તે મારી સાથે ગુરુસે છે He is angry with me! (હી કષ અંન્ટ્રી વીચ મી)	

પણ આ ચાકર ડાલો છે But this servant is wise.
 (બટ ધીસ સર્વનંત મજ વાઈજ)

તે માણુસ આંધ્રયો અને શીકા છે That man is blind
 and pale. (બેટ મૈન છક જ્વાઈન્ડ એન્ડ પેઇન્ટ)

આંધ્રયો બૃગત ધાણીમાં છે A blind ox is in the mill
 (એન્ડ જ્વાઈન્ડ ઓક્સ છક છન ધી મીલ)

તે ટોપલી ભરેલી છે That basket is full. (બેટ
 બાસ્કેટ છક મુલ)

પુનામાં અમને સારી દવા મળી We got fine weather
 in Poona. (ની જાટ ફાઈન વેથર છન પુના)

રંચાખાંચા પાસે એક ગોરી જરી છે The Cook has
 one large knife. (ધી કુક લેન વન લાર્જ નાઇફ)

તમે એક પ્રખ્યાત ચીતારા છો You are a famous
 painter. (યુ આર આ ફેઝિસ પેઇન્ટર)

દશર સૌને પેસો આપે છે God gives money to all. (ગોડ
 ગાઈન મની ટુ ઓફ)

માછલીને પાંખા હોય છે The fish has fins.
 (ધી શીશ ટક શીન્સ)

તેનું ઘર લાગેલું છે His house is broken. (હીજ
 ડાઇસ છક ઓકેન)

તે ચીતારા જીવી સારી ચીતરે છે That painter draws
 pictures well. (બેટ પેઇન્ટ ફોર્ડ પીક્ચર્સ વેલ)

‘ ને ઘરમાં તમે રહો છો તે The house in which
 you live. (ધી હાઉસ છન વીચ યુ લીવ)

આરો શુન્હો આદ કરો Pardon my fault (પાર્ડન માય ફૂલ્ટ)

સાપ કાળા હોય છે Serpents are black. (મર્પન્ટસ આર બર્ક)

ધથ્થા લેકા માયાળુ હોય છે Many people are kind.

(મેનિ પીપલ આર કાઈન્ડ)

એક વાયરી દેવતામાં પડી A woman fell into fire.

(એ વુમન ફૂલ ઈન્ડ ઇન્ફર)

વાચન પાઠ ૧૫ મેં

વાખ Tiger (ટાઇગર)	કોને Whom (કુમ)
ભીષણ Fear (ફીઅર)	આગસ્તુ Careless (ફેર્લેસ)
કરણ નથી Need not (નીડ નોટ)	ધાતકી Cruel (કુઅલ)
નાશી જરુ Run away (રન આવ)	ખરાણ કરવું Annoy (અનોય)
ખીઅણ Timid (ફીમિડ)	કંદાળ ગઢેલો Tired (ટાઇડ)
અહાદુર Brave (બેવ)	નવરાશ Leisure (લીજર)
ઓંડ Wrong (રોંગ)	વાદાણ Dear (ડીઅર)
અંડ Right (રાયટ)	મેઝલણું Sent (સંટ)
ઉધીનું આપવું Lend (લેન્ડ)	સાથે With (વીથ)
	નોકર Servant (સરવાટ)
	દ્વાખમાં By post (આય પોસ્ટ)

તે ખીઅણ અને ધાતકી છે He is timid and cruel.
(હી ડાંગ ફીમિડ અંન્ડ કુઅલ)

તમે ખીન્યા છો કે ? Are you afraid ? (આર યુ અર્ફેડ ?)
 હું ખીધો છું I am afraid. (આઈ એમ અર્ફેડ)

તેઓ શા સારુ ખીણે છે ? Why do they fear ? (જ્હાય કુ
 દે શીઅર ?)

તમારે ખીખવાનું કારણ નથી You need not fear. (યુ નીડ
 નોટ શીઅર)

તમે તે વાધ્યથી ખીલો છો ? Are you afraid of that tiger ?
 (આર યુ આર્ફેડ ઓઝ બેટ ટાઇગર ?)

તમે નાશી ગયા કે ? Did you run away ? (ડીડ યુ રન આવે ?)
 હું નાશી ગયો નહીં. I did not run away. (આઈ ડીડ નોટ
 રન આવે)

તે ખીન્યો હતો He was afraid. (હી ઉડોઝ અર્ફેડ)
 હું ખીકણું નથી I am not timid. (આઈ એમ નોટ કીમિડ)
 તે બહાદુર નથી He is not brave. (હી ઈજ નોટ પ્રેવ)
 તેઓ આગસુ નથી They are not careless. (ધે આર નોટ
 ટરલેસ)

તેણી ધાતકી નથી She is not cruel. (હી ઈજ નોટ કુઅલ)
 તમે મને ખરાય કર્યો You ruined me. (યુ રિન્ડ મી)
 તે કંદળી ગયેલો છે He is tired. (હી ઈજ ટાયર્ડ)
 તેને નવરાશ નથી He has no leisure. (હી છેંજ નો લીઝર)
 તમે મને જ્હાલા લાગો છો You are dear to me. (યુ આર
 (ડીઅર હું મી))

મારું કહેનું જોહું છે I am wrong. (આઈ એમ રોંગ)

તમે ખોટા છો You are wrong. (યુ આર રોંગ)

માઝે કહેવું ખેડું છે ? Am I right ? (અમ આજ રાઈટ ?)

તમે ખરા છો You are right. (યુ આર રાઈટ)

હું ખરો હું કે ખોટા ? Am I right or wrong ? (અમ આજ રાઈટ ઓર રોંગ ?)

તે કલમ ડાની પણે છે ? Who has got that pen ? (હું હેંડ
•ગોટ વેટ પેન)

તે માણુસ પાંસ તે કલમ છે That man has got the pen.
(ઘેટ મેન હેંડ ગોટ ધી પેન)

તે કાની પાસે છે ? Who has it ? (હું હેંડ ધટ ?)

તે છાકરા પાસે છે That boy has it. (ઘેટ બાળ હેંડ ધટ)

તેની પાસે શીશાપણ છે He has a pencil. (હી હેંડ આ પેન્સિલ)

મારી પામે એક ચોપડી છે I have one book. (આઈદ્વ વન બુક)

તે મને ઉધીની આપો Lend it to me. (હેન્ડ ધટ હુ મી)

તમે તે કાની સાથે મોકલી ? With whom did you sent
it ? (ઉનીથ હુમ ટીડ યુ સેન્ટ ધટ ?)

તે મેં મારા નોકર સાથે મોકલી I sent it with my servant.
(આઈ સેન્ટ ધટ ઉનીથ માય સરવન્ટ)

તે મેં ટપાલમાં મોકલી I sent it by post. (આઈ સેન્ટ ધટ
ભાય પોસ્ટ)

મારો જ્યાલો છાકરો ક્યાં છે ? Where is my dear son ?
(વહેર ધજ માય ટીઅર સન ?)

વાંચન પાઠ ૧૬ મે.

કમાવતું Earn (આર્ન)	ધોંણો Business (બીજનેસ)
હેડી ધીધા Threw away (શું અવે)	થોડા Some (સમ)
જુખ્યો Hungry (હંગ્રી)	પૈસા Money (મની)
તરસ્યો Thirsty (થર્સ્ટી)	આર Four (ફેર)
ઉધ આવવી Sleep (રહીપ)	કામતું Of use (આએ યુઝ)
લાગતું Feel (ફીલ)	ધણ્યા Plenty (પ્રેન-ટી)
ગરમ Warm (ઉરોમ્)	ઉપયોગી Useful (યુસ્ફુલ)
ઠંડી Cold (કોલ્ડ)	મેહેરબાન Sir (સર)
તેમને Them (વેમ)	પછી Then (ધેન)
કરતાં Doing (કુર્ચિંગ)	ધ્યાન આપતું Attend (અટેન્ડ)
વાંચતાં Writing (રાઈટિંગ)	મોટેથી ઓલતું Speak out (રીપિક આઉટ)
કામ Work (વક)	મુદ્દા બતાવનાર કિયાપદ May(મે)
જલદી Soon (સત્તન)	સાંભળતું Hear (હીનર)
પુરું થતું Over (ઓવર)	ફાયદો Profit (પ્રોફિટ)

મેં તેમને હેડી ધીધા I threw them away. (આઈ શું ધેમ અવે)
 તમે જુખ્યા છો કે ? Are you hungry ? (આર યુ હંગ્રી ?)
 હા, હું જુખ્યો છું Yes, I am hungry. (યસ, આઈ એમ હંગ્રી)
 તમે તરસ્યા છો ? Are you thirsty ? (આર યુ થર્સ્ટી ?)
 હું તરસ્યો નથી I am not thirsty. (આઈ અમ નોટ થર્સ્ટી)
 તમે ઉધી છો ? Do you sleep ? (હું યુ રહીપ ?)

મને ઉધ આવે છે I feel sleepy. (આઈ શીલ સ્વીપ)

મને ઉધ આવતી નથી I do not feel sleepy. (આઈ કુ
નોટ શીલ સ્વીપી)

તેને ગરમી લાગે છે He feels warm. (હી શીલસ ઓવોર્મ)

તમને ગરમી લાગતી નથી You do not feel warm. (યુ કુ
નોટ શીલ ઓવોર્મ)

તમને હડી લાગે છે ? Do you feel cold ? (કુ યુ શીલ ડોલ્ડ ?)

મને હડી લાગતી નથી ? I do not feel cold. (આઈ કુ નોટ
શીલ ડોલ્ડ)

તે કરવાને હું તમોને મદદ કરીશ I will help you in doing
it. (આઈ ઓવીલ ડેલ્પ યુ છન ફુંડિંગ છે)

હું તમને ચાંચવામાં મદદ કરીશ I will help you in reading.
(આઈ ઓવીલ ડેલ્પ યુ છન રીડિંગ)

હું તમને કામમાં મદદ કરીશ I will help you in work.
(આઈ ઓવીલ ડેલ્પ યુ છન વર્ક)

કામ જલદી પુર થયું છે The work is soon over. (ધી વર્ક
છે સન એવર)

તે રોજ બે રૂપીઓ કમાય છે He earns two Rupees
daily. (હી અન્સ કુ રૂપીઝ તેચલી)

તેની પાસે પૈસા છે કે ? Has he money ? (હેઝ હી અની ?)

તેની પાસે બોધા પૈસા છે He has some money. (હી હેઝ
સમ અની)

તની પાસે પૈસા નથી He has no money. (હી હુજ નો મની)

તમારી પાસે પૈસા છે? Have you money? (હુવ યુ મની?)

મારી પાસે થોડા પૈસા છે I have some money. (આઉફ હુવ
સમ મની)

તેની પાસે દશ રૂપીઆ છે He has ten Rupees. (હી હુજ
ટેન રૂપીઝ)

વાંचન પાઠ ૧૭ મે.

આજ To-day (હુ તે) માટે છે Begins (ગુંગ્હિન્સ)

ઘેરો Horse (હોસ્ટ)

કરજો Bit (બીટ)

ધાસ Grass (ગ્રાસ)

કર્યું છે Have done (હુવ કન)

ખાખું છે Has eaten (હુજ હટન)

કાકાનોં છોકરો Cousin (કાકિન)

મા Mother (ગાધર)

જનનો હતો Was born

મારે છે Beats (બીટસ)

‘ (વાત બોાન્)

ભાપ Father (ગ્રાધર)

તાવ Fever (વીનાર)

માર્ચો Beat (બેટ)

જ્યાં All (ઓલસ)

ખવડાને છે Feeds (રીડક)

સુરત Surat (સુરત)

નદી River (રીવર)

જરા Rather (રાધર)

કેરી Mango મેંગો)

નાનું Small (રોખ)

મીત્ર Friend (ફ્રેન્ડ)

ધાર્યું Much (મચ)

હતું Was (હાજ)

ઘોડા ધાસ ખાય છે A horse eats grass. (એ હોર્સ છટસ આસ)

તેણે ખાખું ધાસ ખાખું છે He has eaten all the grass.

(હી હુજ હટન ઓલસ ધી આસ)

ते छोड़रे सारे नथी That boy is not good. (धेट आय
छज नॉट गुड)

तेथी तेनी आ तेने भार भारे छे So, his mother beats him.
(सो, हीज भधर बीटस हीम)

काले नेना बापे तेने भार्या [हतो] Yesterday his father
beat him. (यस्टरडे हीज फाखर एट हीम)

अमे करी आता हुता We were eating a mango. (उवी
वेर हटींग आ मॅन्गो)

मारा जुवान भीन थेर गये छे My young friend has
gone home. (भाय यंग फैन्ड हैं गॉन होम)

कुतरे तेने पगे करखो The dog bit him on his leg.
(धी डॉग गिट हीम ऑन हीज लेग)

आज में धण्ड करुं छे I have done much to day. (आध
हेव अन भय दु-डे)

हुं सुरतमां जनभ्यो हतो I was born in Surat. (आध
उर्हाझ ऑर्न इन सुरत)

भारा काकाना छोड़राने धर्शा ताव आय्यो (My cousin took
much fever. (भाय क्वाइन दुक भय धीवर)

हुं काले जरा भाँदो हतो. I was rather ill yesterday.
(आर्ह वॉज राधर धक्ष यस्टरडे)

तेए पैसादार हुता They were rich. (धे वेर रीच)
शुं तेनुं धर नानुं हतुं ? Was his house small ? (वॉज
हीज हाउस स्मॉली ?)

આજ ધણી ટાંક હતી It was very cold to-day. (હટ ઉંડોઅ
વેરી ટોંક કું તે)

આજ તે ટેપી મારી પેટીમાં હતી That cap was in my
box to-day. (બેટ કંપ વોઝ છન માય ઓફ્સ કું તે)

વાંચન પાઠ ૧૮ મો.

માયાળુ Kind (કાઈન્ડ)	બંગે Both (ભોથ)
દીકરી Daughter (ડાટર)	મરી જગ્યુ Die (ડાધ)
ધણી Husband (હસ્થન્ડ)	કણ્ણુલ કરતું Confess (કન્ફેસ)
વાડુ Wife (વાઈઝ)	શાંકારી Hunter (શાંટર)
કાડા Uncle (અંકલ)	વિચાર કરવા Think (થાંક)
કાકી, મારી, ઝુદી Aunt (આન્ટ)	દાંકી કાઢ્યો Drove (ઝોવ)
લન્નીન્લે Nephew (નેન્યુ)	વરસો Years (ધર્સ)
ભન્નીલુ Niece (નીસ)	ખીને Next (નેક્સ્ટ)
હાડકુ Bone (બોન)	જાગ્યો Awoke (અવોક)
સાપ Serpent (સર્પન્ટ)	દરવાલે Door (ડોર)
મારી નાખ્યો Killed (ક્રોઃ)	નવ વાગે At nine o'clock (અંટ નાઇન ઓ'ક્લોક)
ઉધારવું Open (ઓપન)	

મારી બેન માયાળુ હતી My sister was kind. (માય સીસ્ટર
વોઝ કાઈન્ડ)

તેનો કાડા ગરીથ છે His uncle is poor. (લીજ અંકલ ઈજ પુઅર)

મારી ભન્નીને રીસાદાર છે' My nephew is rich. (માય નેન્યુ
ઈજ રીથ)

તેની વહુ બહુ જોરાવર છે his wife is very strong (હીજ
વાઈ ઇજ વેરી સ્ટ્રોગ)

તેનો દીકરો તથા દીકરી બંને સારાં છે Both his son and
daughter are good. (આખ હીજ સન એન્ડ ટોટર આર ગુડ)
તે કુતરા પાસે બાઉન્ડ છે That dog has a bone. (બેટ ટૉન
બાઉન્ડ આ બોન)

તે શાકારીએ સાપને માર્યો That hunter killed a serpent.
(બેટ હુન્ટર ક્રીલ આ સર્પન્ટ)

સાપ ક્યાં રહે છે ? Where does a serpent live ? (બેટર
ડાન આ સર્પન્ટ લીવ ?)

તમે મને શા ભાગે મદદ કરતા નથી ? Why do you not
help me ? (નહાય કુ ચુ નોંધ હેઠાય મી ?)

મારો ભાઈ નિશાળે જાય છે My brother goes to school.
(માય અધર જોંડ કુ રકુલ)

હું મારી ચોપડી વાંચીશ I shall read my book. (આઈ
સ્લાલ રીડ માય ષુક)

તમે અંદર આવો અને મારી સાથે વાત કરો You come in
and talk with me. (યુ કમ ઇન એન્ડ ટોક ઓવીથ મી)

તેમો દરવાને નવ વાગે ઉધાડે છે They open the door at
nine o'clock. એ ઓપન ધી ટોન એટ નાઇન ઓ'કોલેક)

ગુન્હા કરૂલ કરો અને પછી જાઓ Confess the fault, and
then go. (કન્ફેસ ધી હોલ્ડ એન્ડ વેન ગો)

મેં તેને બીજે વર્ષથે હાંકી કાઢ્યો। I drove him next year.

(આઈ હોવ હીમ નેક્સ્ટ રીપર)

બીજે દાહે હું જગ્યો। I awoke next day. (આઈ અવેક નેક્સ્ટ ટે)

મને ચાર રૂપીઓ આપો Give me four rupees. (ગીવ મી ફોર રૂપીઓ)

મને આ શું કામતું છે? Of what use is this to me?
(અંક્રિએ ઉવોટ યુસ છાં ધીસ હું મી?)

મારી પાસે થોડા છે I have some. (આઈ હેવ સમ)

આ મને ઉપયોગી છે. This is useful to me. (ધીસ છું યુઅઝ્યુલ કુ મી)

હું સાંભળું તેમ મોટેથી બોલો Speak out so that I may
hear (રૂપીક આઉટ સો હર્ટ આઈ મે લીપર)

મને મારા ધાર્યામાં કાચ ફૂયદો નથી I have no profit in
my business. (આઈ હેવ નો પ્રોફિટ ધન માય બીજનોસ)

મહેરાન, મારું સાંભળો અને પણી જાઓ Sir, hear me and
then go. (સર, હીપર મી એન્ડ હન જો)

વાંચન પાઠ હુલ મા.

તદ્દન Quite (ક્વાઇટ)

ખુશી Glad (ગ્લેડ)

શક્તિવાતા Able (એબલ)

કેમ How (હાઉ)

કાને To whom (કુ હમ)

ગયો હતો Had gone (હેડ ગાન)

કહેવાને છે Sends word

કદી નહિ Never (નેવર)

(સં-ક્રસ ઉવર્ડ)

કરીથી Again (અગેન્ન)

હીમત ધરવી Dare (ડર)

- હું તદ્દન સારી પેડે છું I am quite well. (આઈ અમ કવાઈટ વેલ)
- શું તે શક્તિવાન છે ? Is he able ? (ઇજ હી એથલ)
- હું કરે છું I am doing. (આઈ અમ કુર્ઝિંગ)
- હું થું કરે છું ? What am I doing ? (વોટ અમ આઇ કુર્ઝિંગ)
- હું કોને કહું ? Whom shall I say ? (હુમ રોલ આઇ સે ?)
- હું શું કહું છું ? What do I say ? (વોટ કુ આઈ સે ?)
- હું જાઉ છું I am going. (આઈ અમ ગોઈંગ)
- શું તે આવે છે ? Is he coming ? (ઇજ હી કમીંગ ?)
- શું તમે બાહેર આવો છો ? Do you come out ? (કુ યુ કમ આઉટ ?)
- ના, હું બાહેર જાઉ છું. No, I go out. (ના, આઇ ગો આઉટ)
- હું હજ બોક્ખતો નથી I do not speak yet. (આઈ કુ નોટ
સ્પીક યટ)
- તે મને કહેનરાવે છે He sends me a word. (હી સેન્ડસ મી
આ વડ્)
- હું લાં જવાને બીન્યો I was afraid to go there. (આઈ
દેઝ અર્ફેડ કુ ગો ધેર)
- હું લાં જવાને હીમત ધરે છું I dare to go there. (આઈ
ડર કુ ગો ધેર)
- હું તે કરવાને હીમત ધરે છું I dare to do it. (આઈ ડર કુ
તે કરશે He will do. (હી વીલ કુ) [કુ ધટ])
- હું તે કરી શકીશ I can do it. (આઈ કેન કુ ધટ)
- તે કેમ કરવું તે હું જાણું છું I know how to do it. (આઈ
નો હાઉ કુ કુ ધટ)
- હું લાં ગયો હતો I had gone there. (આઈ હુડ ગોન ધેર)

હું લાં ગયો નહિ I did not go there? (આઈ ડીડ નોટ ગો ધેર) શું હું લાં ગયો હતો ? Had I been there ? દેડ આઈ બીન ધેર ?)

તેઓ લાં ગયા હતા They had been there, (ધેરેડ બીન ધેર) શું તે લાં ગયો હતો ? Had he been there. (દેડ હી બીન ધેર) હું લાં કઢી ગયો નથી I have never gone there. (આઈ હ્યા નેવર ગોન ધેર)

હું હજ તાં ગયો નથી I have not yet gone there. (આઈ હેવ નોટ યટ ગોન ધેર)

તે ઇરીથી ગયો છે He has gone again. (દી હેડ ગોન અગેઠાન) તમને જોઈને હું ખૂં ખુશી થાડ છું I am very glad to see you. (આઈ એમ દેરી હેડ કુ સી કુ)

વાંચન પાઠ ૨૦ મો.

કાંઈ નહિ Nothing (નથીગ)	મગન Magan (મગન) નામ છે.
સારી પેડી Well (વેલ)	આપણું Father's (ફાથર્સ)
કદાચ, અધર Difficult (ડિફિક્યુલ્ટ)	અટક Surname (સરનેટમિ)
ખરાબ પ્રાઇદ્ઝ Spoiled (સ્પોઇલ્ડ)	જનન્યો Born (ઝાર્ન)
અડકણું, હાથ લગાડવો Touch ટચ	નડીચાદ Nadiad (નડીચાદ)
વસ્તુ, બીજ Thing (થીંગ)	ઉંમર Age (એચ્જ)
ખુખ્ખુરત Beautiful (બુલ્લીશ)	વરસો Years (યર્સ)
સંભળણું Hear (હિયર) [કુલ]	ધંધો Occupation, Trade
નામ Name (નિધમ)	(ઓષ્યુપેશન, ટ્રેડન્ડ) વેપારી Merchant (મરથન્ડ)

- તમે થું કીધું ? What did you do ? (વોટ હીડ યુ કુ ?)
 મેં કાંઈ કીધું નહિ I did nothing. (આઈ હીડ નથીંગ)
- તે કામ સારી પેઠે કરો Do that work well. (કુ બેટ વર્ક વેલ)
- આ કામ બહુ કદણું છે This work is very difficult. (ધીસ
 વર્ક છક વેરી હીનીકદણ)
- તે ડાણે કીધું ? Who did that ? (હુ હીડ ઘેટ ?)
 મેં કીધું, સાહેબ I did it, sir. (આઈ હીડ ધટ, સર.)
- તમને તે કરવાનું હોણે કહ્યું હતું ? Who told you to do that.
 (હુ ટોલ્ડ યુ હુ હુ બેટ ?)
- તે તમારું કામ નહોનું It was not your work. (હટિ વોઅ
 નોટ યોર વર્ક)
- તમે આ બધું ખરાય કર્યું You have spoiled all this.
 (યુ હેચ સ્પોફિલ ઓલ ધીસ)
- મારી વસ્તુઓને તમારે દાથ લગાડવો નહિ જોઈજો You must
 not touch my things. (હુ મસ્ટ નોટ એચ માય થીંગ્સ)
- તમે હેવા લક્ષ્ય છો ? How good you are ? (હાઉ શુડ યુ આર ?)
- તેઓ હેવા ભર્ખ છે ? How foolish they are? (હાઉ પુલીશ
 ધે આર ?)
- તેણી ડેવી ઝુણસુરત છે ? How beautiful she is ? (હાઉ
 ઝુણસુરત શી છત ?)
- તે સાંભળશે He will here. (શી વીલ હીયર)
- તેણી આપણું સાંભળે છે She hears us. (શી હીયર્સ અસ),
 તમારું નામ શું છે ? What is your name ? (વોટ છક યોર નેધમ)

મારે નામ મગન છે My name is Magan. (માય નેધમ છજ મગન)
તમારા આપનું નામ શું? What is your father's name?
(વોટ છજ યોર ઇધર્સ નેધમ !)

તમારી અટક શું છે? What is your surname? વોટ છજ
યોર સરનેધમ ?)
તમારો જન્મ ક્યાં થયો? Where were you born? (વહેર
દર કુ ઓર્ન ?)

હું નડીઆદ જનમ્યો હતો I was born at Nauliau. (આધ
વોઅ ઓર્ન એટ નડીઆદ)

તમારી ઉંમર કેટલી છે? How old you are? (હાઉએલ કુ આર !)

તમારી ઉંમર શું? What is your age? (વોટ છજ યોર એઈજ !)
મારી ઉંમર વીશ વર્ષની છે I am twenty years old.
(આધ અમ કુવેન્ટી છપર્સ એલ)

તમારો પાપ શું ધંધો કરે છે? What is your father?
(વોટ છજ યોર ઇધર ?)

તે એક વેપારી છે. He is a merchant. (હી છજ આ ભરચન્ટ)
તમે શું ધંધો કરો છો? What is your occupation?
(વોટ છજ યોર ઓક્યુપેશન !)

હું વેપારી છું I am a merchant. (આધ અમ આ ભરચન્ટ)
તે ધંધો તમને ગમે છે? Do you like that occupation?
(હું કુ લાઈક હેટ ઓક્યુપેશન ?)



Cases (કેચર્સીસ) વિભક્તિ વિષે.

ગુજરાતીમાં નેમ પહેલી સિવાય દરેક વિભક્તિના પ્રત્યે છે તેમ ઈંગ્રેજીમાં નથી. ઈંગ્રેજીમાં ઇતા છૂટી વિભક્તિનો પ્રત્યે છે અને બાકીની વિભક્તિઓ શાખદ્યોગી અન્યથ વાપરવાથી બતાવાય છે.

શું વિભક્તિના પ્રત્યે.- ઈંઠ વિભક્તિના પ્રત્યે.

૧ લી. ગો	નથી	Nominative	.નથી.
(નોમીનેટીવ)			
૨ જી, ને		Accusative	. to
(એક્સ્ચ્યુટેટીવ)	(કુ)		
૩ જી, એ		Instrumental, by, with	
(ઇન્સ્ટ્રુમેન્ટલ)	(બાળ, વીથ)		
૪ થી, ને, માટે સારુ		Dative	for, to
(ડીવ)	(કુંડ, કુ)		
૫ મી, થી, થકી		Ablative	from, off
(એબ્લેટીવ)	(કોમ, ચોક)		
૬ હ્યી, નો, ની, હું, ના		Genitive	of, 's
(જેનેટીવ)	(ઓઝ, એપોસ્ટોપી-એસ)		
૭ મી, માં		Locative	in, at
(લોકેટીવ)	(ધન એટ)		
૮ મી, સંઘેધન		Vocative	oh
(વોકેટીવ)	(એઓ)		

ઉપરના પ્રત્યે ને ઈંગ્રેજ નામને લગાડવા હોય તે નામની

પહેલાં મુકાય છે. (પણ શુજરાતીમાં પ્રત્યય નામની પછી લાગે છે.)

નેમકે:—બરમાં in the house (થન ધી હાઉસ) આમાં શુજરાતીમાં ‘માં’ પ્રત્યય ધરની પછી મુકલો છે પણ ઈંગ્રેજમાં ‘in’ પ્રત્યય house (થર) ની પહેલાં મુકલો છે. તેવીજ રીતે બીજા પ્રત્યય લાગે છે.

પણ છૂટી વિલક્ષિતમાં કે એ પ્રત્યય ‘of’ (ઓફ) અને ‘s’ (એપોરટેડી એસ) છે. તે વિષે જરા જાણુવાનું છે તે નીચે આપીએ છીએ:—

જ્યારે ડોઝ એ ચીજનો સંબંધ બતાવવો હોય ત્યારે ‘of’ (ઓફ) પ્રત્યય વપરાય છે, નેમકે સુંગદનો ડોઝ The fort of Bombay. (ધી ફોર્ટ ઓફ બોમ્બાઇ) પણ જ્યારે ધણીપાણું અથવા કંપને બતાવવો હોય ત્યારે of (ઓફ) નહિ પણ ‘s’ (એપોરટેડી એસ) વાપરવો. નેતકે:—મારી બેનની ચોપડી (My sister's book. (માય સીસ્ટર્સ યુક) એટલે કે ચોપડી મારી બેનના કંપનમાં છે અથવા જે ચોપડીની માલીક મારી બેન છે તે ચોપડી.

‘S’ એપોરટેડી એસ નો વધુ ખુલાસો.

જે નામને છેડે (એકવચન અથવા અહૃવચનમાં) s (એસ) આંધો હોય અને તેને ‘s’ (એપોરટેડી) લગાડવો હોય તો એકલો (એપોરટેડી) લગાડ્યો. નેમકે:—Kalidas’ (કાલીદાસ), Ladies’ (લેડીઝ) વિંદે.

વાંचન પાઠ ૨૧ મો.

નેથિએ છીએ W.ant [સૉન્ટ]	બાકરીનું અચ્ચું Kid [ક્રીડ]
દેખાયું Show [શો]	મોકુ Big [બીગ]
પણ કરનું Like [લાઇક]	આગળું Before [બીફિર]
બીજાનું Bed [બેડ]	કર્યું Did [ડિડ]
* ભીખ માગવી Beg [બેગ]	ખાદ્યું Dig [ડિગ]
નાળી Net [નેટ]	અંજુર Fig [ફિગ]
વધારે More [મોર]	કલાક TIn [ટીન]
પુરનું Enough [એનાફ]	હેટલા How many [હાઉં મેન્ટી]
રાજુ King [ક્રીંગ]	ચાકર Servant [સર્વન્ટ] *
થોડી TIn [ટીન]	દશ Ten [ટેન]
મળવા Get [મેટ]	મોનુ Gold [ગોલ્ડ]
તોપણું Yet [યેટ]	માછવી Fish [ફિશ]
બીજકુલું All [અટ આલ]	કુલાડી Axe [અક્સ]
શુરીયાર Sharp [શાર્પ]	

મને તે દેખાડા Show me that. [તોંબા મી ડેટ]

નેઓ તે બાળનાને આહે છે They like that bed. [થોં લાડાડ થાં લેડ]

ગરીબ માણુસાં રાજ પાસે બાખ માગે છે Poor men beg before the king. [પુઅર મન ડેગ બીફિર ધી કિંગ]

એક માછવી જાળમાં છે A fish is in the net. [એ હૂટીલ એક ફિશ ઇન નેટ]

તમારે વધારે પાણી નેથિએ છીએ? Do you want more water? [કું કું બાન્ડ મોર વોટર કું]

તા, મારે જોઈએ તેટલું છે No, I have enough. [તો, આઈ
હું ધનિં]

આકરે આ કામ કર્યું The servant did this work. [ધી
સર્વનંદ હીડ ધીસ વર્ક]

દેખો કુણાડાવતી બોધે છે They dig with an axe. [ધી
હીંગ વીથ અન ઓક્સ]

તે દસ અંજર લાભી છે He has brought ten figs. [ધી
હું ફ્રિટ ટેન ફીગ્ઝ]

તેની પાસે સોનું તથા કલાદ અને છે He has both gold and
tin. [ધી હું બોથ ગોલ્ડ અન્ડ ટીન]

વાંચન પાઠ ૨૨ મે.

ઓફિસ Office [ઓફિસ]	પહેલા Before [બીફિઝર]
કેટલા How many [કાઢ મની]	ઉડતું Fly up [ફ્લાપ અપ]
સવાર Morning [મોરનિંગ]	કાગ્દો Coat [કોટ]
કલાક O'clock [ઓક્લેક]	તમે You [યુ]
જાગ્રતું Struck [સ્ટ્રક્ટ]	ફેટો Hit [લીટ]
ઘાર Twelve [ટ્રેંચ]	સળગાંચું Lit [લીટ]
બેડીઓળ Clock [કોક્લ]	લોડ Lip [લીપ]
કારે When [એન]	તોડી નેતું Nip [નિપ]
દરમીયાનાં Within [જીવીધીન]	હલકા લોકોનું ટોંગું Mob [મોબ]
સૂરોષી Sunrise [સનરાઇઝ]	આઠ Eight [ઓઝિટ]

સાડાઅંચ Half past twelve વાસ્તે For [ફોર]

[દાંડ પાસ્ટ ટેલ્યન]	ખાડો Pit [પિટ]
વહેલો Early [અર્લી]	ચાલાકી, શુદ્ધિ Wit [વીટ]
નવ Nine [નાઈન]	ઓળબું Dip [ડિપ]
અડધો Half [હાંડ]	કેડ Hip [હિપ]
પા [પા] Quarter [ક્વાર્ટર]	ટેચ, અણી Tip [ટિપ]
મીનીટ Minute [મીનીટ]	ઓચું Sob [સૉઝ]
વાગી ગઈ Past [પાસ્ટ]	બુટબું Rob [રિભ]
લગભગ Nearly [નીઅર્લી]	બુષાવબું Nod [નોડ]
કાંઠ Hour [અવર]	લાકડાનો કટ્કા Log [લોગ]
સળીઓ Rod [રોડ]	ખાણોચીઆવાળી જગ્યા Bog [બોગ]
કુતરો Dog [ડોગ]	
થાણું Too [દુ]	અહાર Out [આઉટ]
પાછળી Back [બેચ]	

સવારની સલામ Good morning. [ગુડ મોરનિંગ]

કેટલા વાગ્યા છે ? What o'clock is it ? એસ્ટ ઓફ્કોલ્ડ
એજ છટ ?]

દમણાં બાર વાગ્યા It has just struck twelve. [દિંદ ટેક્સી
જસ્ટ સ્ટ્રક્ટ ટેલ્યન]

મારી ઘડીઆળમાં બાર વાગ્યા છે It is twelve by my clock.
[મિંડ ઇંજ ટેલ્યન બાય માય કોલ્ક]

આગ આંડ વાગ્યા છે It is half past eight [મિંડ ઇંજ હૈંડ
પાસ્ટ એંડિંગ]

પોણ્યા નવ વાગ્યા છે It is quarter to nine. [એ છજ ક્રાં
દુર દુ નાઈન]

સવારે ચુંબોદ્ધય જોઈએ છીએ We see sunrise in the morning.

[ઉન્ના રી સનરાઈજ ધન ધી મોનીંગ]

સવાર રચ્છ છે The morning is clear. [ધી મોનીંગ ધજ
કલીઅર]

સાડાથાર વાગ્યા છે It is half past twelve. [એ ધજ દાઝ
પારટ ટ્રેન્ચ]

ચાર અને દશ મીનિટ થધ છે It is ten minutes past four.
[એ ધજ દેન મીનીટસ પારટ ફેર]

આડમાં પાંચ મીનિટ જાકી છે It is five minutes to eight.
[એ ધજ ફાઈ મીનીટસ દુ એફેટ]

તેઓ અહીંથાં લગભગ એક કલાકથી છે They have been
here nearly an hour. [થે હેન ખાન દીઅર નીઅર્લી એન અવર]

તમે ક્યારે પાછ આવશો? When will you come back?
[ન્નેન વીચ દુ કમ બેક ?]

એક કલાકમાં Within an hour. [વીધીન એન અવર]

.ઓપણી ઓછીચમાં ટોણ્યુ વહુંલા આવે છે? Who comes early
in our office? [હુ કમ્સ અર્લી ધન અવર ઓછીસ ?]

મારો ડેટ .મને થયો નહિ. My coat did not fit me.

[માય ડેટ ડિ નોટ ધીટ ની]

માધવ પાસે તે હતી અને તે દુર દોડી ગઈ She was with
Madhav and ran off. [શી વોઝ વીચ માધવ એન એફ]

અરે નાદાન ભાધવ, તેં ભારો ડોટ મંતાજો Oh foolish Madhav,

you hid my coat. [એક કલીશ ભાધવ યું હિડ ભાય ડોટ]

પરશોતમ પાસે એક અંજુર છે Purshotam has one fig.

[પરશોતમ ડેઝ વન ફીગ]

મણ્ણી વાસ્તે તે સારો જોગડ છે It is good food for mani.

[ડોટ મંજ ગુડ કુડ ફેર મણ્ણી]

મારો કુતરો આંખોચિઆવાળી જગ્યામાં છે My dog is in the

hog. [ભાયં ડેગ મંજ કુન ધી ઓગ]

હથિંગ, તું તેને જાગર કાર! Drive it out; Hathisang !

[જાઈવ ડોટ આઉટ હથિંગ !]

હથિંગે તેને અદાર કારયો. અને હું વાકડાના કટક ઉપર બેઠો,

અને મોદને પણ તેમ જ કરં Hathisang did get it
out, and I sat on the log, and so did Mohan.

[હથિંગ હીડ ગેટ ડોટ આઉટ, એન્ડ આમ મેટ ઓન ધી
લાગ, એન્ડ મોદ હોડન]

અરે ચીમન. તું ને આંખોચિઆવાળી જગ્યામાં જતો ના Oh,

Chiman do not go in the hog. [ઓ, ચીમન કુ
ગોટ ગો મંજ ધી ઓગ]

તે બઢુજ બની છે It is too wet. [ડોટ ધૂં કુ રેટ]

જધશ તો ભરી જધશ If you will go, you will die.

[ડોટ યુ રીલ ગો, યુ રીલ પાઈ]

વાંચન પાઠ રક્ત મો.

ફેરવણું Turn [ટર્ન]	નીચે Down [ડાઉન]
કુદું Hop [હોપ]	ઘોડું Dug [ડગ]
પલંગ Coach [કોચ]	પુરી Bun [બન]
વાસણું Pot [પોટ]	સૂર્ય Sun [સન]
નર્થાટ Lot [લોટ]	ગમ્મત Fun [ફુન]
પેટી Box [બેક્સ]	દોડું Run [રન]
શિયાળ Fox [ફોક્સ]	રકમ Sum [સમ]
અમરડો Top [ટોપ]	ગણુગણ્ણાટ કરવો Hum [હમ]
ફાંકડો Fop [ફોપ]	ખાલુ Cup [કપ]
કાપવું છાંટવું, જાહની કલમ કરવી Lop [લોપ]	કુંપડી Hut [હટ]
મેળવ્યું Got [ગોટ]	કાપવું Cut [કટ]
ગરમ Hot [હોટ]	ગુઢા Den [ડેન]
મીંડ Dot [ડાટ]	એંચી લઈ જવું તે Tug [ટગ]
ખળાં Ox [ઓક્સ]	કામગો, અનુસ Rug [રગ]
કુંકું Tub [ટબ]	ચાંપીને ઉધરાણી કરવી Dun [ઝન]
ખાલુ Cup [કપ]	બંદુક Gun [ગન]
સિંહ Lion [લાયન]	વાંદડી Monkey [મન્ડી]
ચંચુ Jug [જગ]	શુંદર Gum [ગમ]
ખસવું Ruп [રબ]	એક જાતનો દાર Rum [રમ]
અન્હર આવવું Get in [ગેટ ઇન]	મળગર Hinge [હિંજ]
ફળ Nut [નટ]	લાણું કરવું Sup [સપ]
	પણું But [બટ]

કુરુકુરીંદું Pup [પ્યા]	વહુ Wife [વાધી]
કુદું Jump [જર્પ]	ફુર Off [અંદું] Far [દૂર]
ભાઈ My dear [માય રીઅર]	સૂર્યનો તડકા The sunshine ..
વળી Too [દુ]	[બી કાનખાઈન]
વાસ્તે For [ફાર]	આપણે We [ઉંવી]
સાહેય Sir [ભર]	આપણું Lecture [લેક્ચર]

તે સાંકે કરી શકે છે; અને કુદી શકે છે He can mop and he can hop. [બી કેન મોપ એન્ડ બી કેન હોપ]
 હું એક લભરડો ફેરથી સરું છું I can turn a.top. [આઈ કેન ટર્ન આ ટોપ]

સાંકા ગરમ થયો, અરે એટલો બધો ગરમ Sanka got hot, oh so hot. [સાંકા ગોટ હોટ, ઓઝ સો હોટ]

તેણી પદ્માંગમાં છે She is in the coach. [શી ઇન છન બી હોટ]
 ડેમ ? તે માંદી છે Why ? She is ill. [ન્હાય ? શી ઇન ઈલ]
 એક કુંકું કામળા ઉપર છે A tub is on the rug. [આટથ ઇન ઓન બી રબ]

મારો ખાલો તેમ જ ચંચુ અંદર છે My jug is in, so is my cup. (માય જગ ઇન છન, સો ઇન માય કપ) સિંહને અંદર આવવા હો Let the lion get in. [લેટ બી લાયન ગેટ છન]

ના, સિંહ નહિ પણ કુતરો No, not the lion but the dog. [નો, નોટ બી લાયન વાં બી તોંક]
 આરું કુરુકુરીંદું ભારું છે, તે કામળા નીચે છે. My pup is good;

it is down the rug. [ભાય પ્રે છત ગુડ; છટ મજ આજેન
ધી રમ]

—તે તકામાં કુદી શકે છે, અને વળી માગી શકે છે It can jump
in sun and can beg too. [છટ કેન જમ્ય મન સન
એન્ડ કેન એગ કુ]

પુરી લારે વાસ્તે છે, 'આઈ The bun is for you, my dear.
[ધી અન છિં હોર યુ, ભાય રીઅર]

તેથી તે માગ અને આપણે દુર જઈએ So beg it, and off we
go. [સો એગ છટ એન્ડ એઝ ના ગો]

બોંકડી ગુફામાં છે The fox is in the den. [ધી હોકમ છં
ચન ધી તેન]

શિખાળનું અચ્ચું ગુફામાં નથી The cub is not in the den.
[ધી કાય દાં નોટ મન ધી તેન]

અરે શિખાળ હું તને લાગ પાસે ભળાક Oh fox, I shall meet
you by the fence. [એઝ હોકમ, આઈ શેલ ગીટ યુ ભાય ધી હેનમ]
સિંદ; તને એ ભરણી મળો? Lion did you get two-hens,?

[લાયન ડાં યુ ગેટ કુ હેનમ ?]

ના, અને મળો નહિ No, I did not get. [ના, આઈ નિડ
નોટ ગેટ]

તે ભરણી અને શિખાળ બેઉ દોખાં અને તે કુવામાં પડ્યા Both
the hen and the fox ran and fell into the
well. [એઓષ ધી હેન એન્ડ ધી હોકમ રેન એન્ડ હેલ ધંડુ
ધી વેલ]

વાંચત પાછ રહ્યા.

કિડવું Get up [ગેટ અપ]	લાંખેલા Laughed [લાઝડ]
લાંખાં There [ધેર]	ગણાં કરે છે Preserves
વાંદડ Monkey [મંકી]	[પ્રીજર્સ]
વથન આપ્યું Promised [પ્રોમીઝ્ડ]	એ વાર Twice [ટ્યાસ્ટ]
મુમાકરી કરી Travelled [દ્રાવેલ્ડ]	બમજાં Just mow [જરસ્ટ નાઉ]
મારી નાંખ્યો Killed [ક્ષાદ્દ]	કૃષણસી Sleepy [રલીપી]
વાય Tiger [ટાઇગર]	ગાય Cow [કાઉ]
મુગાદુર Traveller [ટ્રાવેલર]	નીકાયા Started [સ્ટાર્ટેડ]
ઉપકાર માનંદા Thank [થૈન્ક]	ફેટ Farmer [ફાર્મર]
ઘેનાર Field [ફીલ્ડ]	દુકાન Shop [શોપ]
પક્ષીઓ Birds [અર્ડર]	વાત કરી Talked [ટોક્સ]
જડ Camel [ક્રમલ]	આકાશ Sky [રસ્કાય]
જમીન Ground [ગ્રાઉન્ડ]	થૈરાં Sheep [શીપ]
ઉધ્યો Slept [સ્લેપ્ટ]	આંગળી Finger [ફીંગર]
કારણ કે Because [એફેઝ]	એડે છે Tills [ટીલ્સ]
કંબાર Potter [પોટર]	પણડી Tail [રાંદી]
નળાંચાં Tiles [ટાઇલ્સ]	ચાંદે છે Walks [વેલ્ક્સ]

મેં નેતે વથન આપ્યું I promised him. [આઈ પ્રોમિઝ્ડ હીમ]
તે આરે કલાક દલ્લો He slept four hours. [હી રંદેપ્ટ ક્રેચ
• અવર્મ]

આ માણસે કાલે વાબને ભાર્યો This man killed a tiger
yester-day. [ક્રીસ મેન ક્રીલ્ડ આ ટાઇગર પ્સટર-ડી]

તે મુસાઈરે એ વાર મુસાઈરી કરી That traveller travelled twice. [ઘેટ ટાવેલર દ્રાવેલડ ટ્વાઈસ]

ઇશ્વરનો ઉપકાર ભાનો, કારણું હેતુ આપણું રક્ષણું કરે છે Thank God, because He preserves us. [થેન્ક જોડ બીજોકાર હી પ્રીઝર્વ્સ અસ]

ખેડુત ખેતરમાં ખેડુ છે A farmer tills in the field. [એ હાર્ફર ગ્રીલ્સ છન ધી હીલ્ડ]

પક્ષીઓ આકાશમાં ઉડે છે Birds fly in the sky. [બડાં ઇશાય છન ધી સ્કાય]

હટ જમીન ઉપર ચાલે છે A camel walks on the ground. [એ કેમલ વોક્સ એન ધી આઉન્ડ]

કુંભાર નળીઓં બનાવે છે A potter makes tiles. [એ પોટર મેચક્સ ટાઈલ્સ]

તે અંડા છે, તેથી તેઓ તેની સામે હસ્યા He is mad, so they laughed at him. [હી છં મેડ, સો મે લાઈલડ એટ હીમ]

તમે ખણ્ણાં ડિલ્લાસી છો, ઉઠો અને હમણુંં લાં જાઓ You are very sleepy, get up and go there just now [હુ આર વેરી સ્લીપી, જેટ અપ એન્ડ ગો ઘેર જરૂર નાઉ]

આય અને બેટાં બઢાર જવાને નીકલ્યાં Cows and sheep started to go out. [કોઉસ એન્ડ શીપ સ્ટાર્ટેડ ફુ ગો આઉટ]

ઓછ હાથને પાંચ આંગળાઓ છે One hand has five fingers. [વન હેન્ડ ફેફ ફાઇવ ફીવર્સ]

વાંદરને એક મુંઘડી હોય છે A monkey has one tail. [એ મંડી હેઠ વન ટેલ]

તે ખુસાડર ક્યાં છે તેની મને ખબર નથી I do not know where is that traveller. [આઈ કુ નોટ મો જેર ડાંડર]

વાંચન પાઠ ૨૫ મો.

છે There are [ધેર આર]	અડવારીં Week [વીક]
કેટલા How many [હાઉ મેની]	મહિનો A Month [એ મન્થ]
પૈસો Wealth [વેલ્થ]	હમેસાં Always [એવેઝ]
પુષ્પ Flower [ફ્લાવર]	વાડી Garden [ગાર્ડન]
ખીંચું Coward [કાવર્ડ]	રાજ King [કિંગ]
મન Mind [માઇન્ડ]	મહેલ Palace [પેલેસ]
માનવું Believe [બીલ્યું]	લાંબો Long [લોંગ]
કદી નહિ Never [નેવર]	હવેલી Mansion [મેન્સન]
ચુપ Quiet [ક્વાઇટ]	કુટુંબ Family [ફેમિલી]
વાંશ Twenty [ટેવેંટી]	તૈયાર Ready [રીટી]
હિતાવળ Haste [હેચ્સ્ટ]	ખારી Window [વીન્ડો]
ગાડી Carriage [કોરેજ]	શાશ્વત Silver [સીલવર]
માલ્યા Goods [ગ્રુડ્ઝ]	જરૂરી Quantity [ક્વોન્ટીટી]
ધાર્ષા A great deal of	વેચાતું લેતું Buy [બાય]
[એ બ્રેન્ડ ફીલ ઓફ]	ખુરથી A Chair [એ ચેર]

તમારી દુકાનમાં ટેટલા ચાકર છે ? How many servants
are there in your shop ? (ટાઉ મેતી ગાન્ધિમ આર
દેર ઠન યોર શોપ)

તેની પાસે ધર્ણો પૈસો છે He has a great deal of wealth.
(હી ટેડ આ ચેટ હીલ્ફ ઓફ વેલ્ફ)

મારે એક છાકરો છે, તમારે ટેટલા છે ? I have one son,
how many have you ? (આખ રેવ બન ગન, ટાઉ
મેતી લેવ ન !)

તમારી પાસે રૂપાની નાગી છે ? Have you a silver ring ?
(હેંડ ન આ રીલવર નીંગ ઇ)

ના ગાડી પામે નથી No, I have not. (નો, આખ રેવ નોટ)
તમારું મન અફિયણ છે Your mind is coward. (ગોર માન્ડ
નો કાવર્ડ)

તમે ભાડે કહેયું માનશો ? કહા નહિ Will you believe me
never. (જીલ નું અનીલીત મી ? નેવર)

ત્યારે ચુપ રહો Then be quiet. (બેન બી ક્વાઇટ)

ઉતાવળ કરો અને ગાડી લઈ આવો Make haste and bring
a carriage. (મેરીક હેસ્ટ એન્ડ ડીગ આ કેરેજ)

આ મદીનામાં ચાંદીનો મોટો જથો છે A great deal of silver
is in this month. (એ ચેટ હીલ્ફ ઓફ સીલવર ધ્રુ
બન બીલ્સ મન્થ)

આ અહુવાડીઓનો એક ખુરસી વેચાણી લઈશ I shall buy

one chair in this week. (આઈ શેખ બાધ વન ચેર
છન ધીસ વીક)

માળી વાડીમાં છે The gardener is in the garden. (ધો
ગાર્ડનર મન છન ધી ગાર્ડન)

રાજ કુદુથ સર્હિન મેંકુલમાં રહે છે A king lives in the
palace with family. (એ કિંગ લીજ છન ધી પેલેસ
'થ રેમીલી)

તેની હવેલી લાંબી છે, અને તેને બાંશ ણાર્ટિઓ છે His mansion
is long and has twenty windows. (હીજ મેન્સન
છન દોંગ એન્ડ હિજ ટંની નીન્ડાઝ)

બાલાભાઈ આજ ગવાં આવણે Balabhai will come to day
in the morning. (બાલાભાઈ રાશ કમ ટુ-કે છન
'જી મોરનિંગ)

લાંબન પાઠ રહ મા.

સુપ્પી Happy (હેપી)	ખતીંદી Diligent (ડિલીજન્ડ)
જર્જ રિયું Went away (ઉંટ આવે)	જવાય Answer (અન્સર)
પ્રાર્થના કર્ણી Pray (પ્રે)	કણ્ણું Said (સેફાદ)
દેવણ Church (ચ્યાચ)	સવાલ Question (કુંબખન)
અધ Danger (ડનજર)	બીહું છે Fears (રીષાસા)
બેદેરો Face (ફેચસ)	પુછનું Asked (આસ્કડ)
	બીન્યું Afraid (અર્ફાડ)

મરણ Will (વીધ)	અસ્થિત Of course (ઓહ હોસ્ટ)
શોચું Wash (ઉંબાશ)	સાંભળો Hark, hear (હાડ્, હીઅર)
ઉપયોગી Usefull (યુસ્ફુલ)	
મેંદું Dirty (ડેફી)	માણુસ Person (પરસન)
ઉપયોગ કરવા, વાપરવું Use (યુઝ)	ગેરહાજર Absent (એથસન્ટ)
ઈંગર God (ગોડ)	માંડુ, આજારી ill (ધલ) sick (સીક)
ઓલાવ્દો Called (કોલ્ડ)	હમણ્યું Just now (જરટ નાડી)
	વિચાર કરવો Think (થીક)

ઈંગરનો આખાર માનો કે તમે સુખી છો। Thank God that you are happy. (થૈન્ક ગોડ થેટ યુ આર હેપી)
તમે રોજ પ્રાર્થના કરો છો ? Do you pray daily ? (કે ય પ્રે ટેઇલ્ફી ?)

હા, હું કરે છું Yes I do. (યસ આઇ હુ)

તેમો દેખળમાં જય છે They go to church. (થે ગો ટુ ચર્ચ)
તેનાં મેંઠાં તરફ જુઓ Look at his face. (લુક એટ હીજ ઇંદ્રસ)
તમે તમારું મોં ધૂઓ You wash your face (યુ ઉંબાશ ઓર ઇંદ્રસ)

આ મેલું છે This is dirty. (ધીસ ડર્ટી ઈંટી)

ત્યાં કોણ છે ? Who is there ? (હું ધર થેર)

દેનું નામ શું ? What is his name ? (વેટ ડર્ટ હીજ નેટમ ?)

દેનું નામ મણીલાલ છે His name is Manilal. (હીજ નેટમ ધર મણીલાલ)

तेने त्यां बोलावो Call him there. (होल दीम धेर)

तेने पाण्हा बोक्सावो Call him back. (होल दीम थोड़)

ते ज्वो रखो He went away. (ही वेन्ट अवे)

तेथी ज्वी रही She went away. (शी वेन्ट अवे)

मने जवा हो Let me go. (लेट मी गो)

ते भाषुस जाय छे That man is going. (धेट मेन छन जोर्डम)

तेने राह लेवानुं कहो Tell him to wait. (टेल दीम फु वेहट)

आ तेने आपो Give him this. (गीव-दीम धीस)

तेने ते पाखु आपो Give it back to him. (गीव छट थोड़
कु दीम)

तभारी भरज शी छ ? What is you will ? (वेन्ट छन चैर
वील ?)

तमे आ ल्यो You take this. (मु टेप्ट धीस)

ते लध गयो He took it away. (ही फुक छट अवे)

आ भारा कामनुं छ This is usefull to me (धीस छन युस-
कुल कु भी)

ते शु कामनुं छ ? Of what use is that ? (ओह छिवोट
युस छन धेट)

ते भारा कांध कामनुं नथी It is of no use to me. (छट छिं
• ओह नो युस्त कु भी)

ते अळ अंतीलो छ He is very diligent. (ही छ वेती
जीवीजन्ट)

तमे आख्यातु थो। You are lazy. (यु आर लेजी)

अनुँ डाख्यू कहे हूँ ? Who says so ? (हु सेझ सो ?)

तेओाए ऐम कह्यू They said so. (ध सेईड सो)

हु तेने पुछ्याच I will ask him. (आए वाल आस्क हीम)

तमे तेने नहि पुछ्येहो ! Will you not ask him ? (हिनीच
यु नोट आस्क हीम)

अवश्यत शा भाटे नाहि ? Of course, Why not ? (आए
होसं, ज्ञाय नोट ?)

आ तेने साझे करो। Do this for him. (ध धीस फ्राइ हीम)

भदु साहे Very well. (परी वेल)

ते अहीचां हुँ, आहुँग लिर, he is here. (यर, ही छड हीयर)

ऐज भाष्यस The same person. (धी संधम परसन)

ते जेवहाजर हुँ ? Is he absent ? (छड ही अयस्ट ?)

तेणी आजरी होंगे She must be ill. (शी भरट धी छक)

बदादुर भाष्यसा लयथा धीता नथी Brave men do not
fear danger. (श्रेष्ठ मेन हु नोट हीयर उन्नर)

तमे ऐम धारो हो ! Do you think so ? (हु यु थीक सो ?)

हु ऐम नथी धार तो ? I do not think so. (आए हु
नोट थीक सो)

आरा ज्ञावनो, ज्ञावाच आपरेह ? Will you answer my
question ? (वीक्स यु ऐनसर साव क्वेशन ?)

તે જવાબ આપતાં ભીહે છે He fears to answer. (હી રીઅર્ટ
કુ અન્સર)

ખીફતા ના. Don't be afraid. (ટોન્ટ ખી આર્ડ)

હું ધણો બીન્યો છું I am much afraid. (આઈ એમ અન્ન
આર્ડ)

હું અંદર જાઉ ? May I go in ? (મે આઈ જો ધન ?)

અંદર આવો, સાહેબ Come in, sir. (કમ ધન, સર)

હું બાહેર જાઉ ? May I go out ? (મે આઈ જો આઉટ ?)

* સાંભળો, તેઓ તમને ત્યાં બોલાવે છે Hear, they call you
there. (હીયર, ધે કોલ મુ પેર)

* તેઓએ આપણુંને અહીં બોલાવ્યા They called us here.
(ધે કોલ અસ હીયર)

હું હમણાંજ ચાંયો I have come just now. (આઈ હેવ
કમ જસ્ટ નાઉ)

ત્યારે ગમે તો તમે વાંચો You may read then. (મુ મે
રીડ વેન)

વાંચન પાઠ ૨૭ મે.

પાસે Close (ક્લોઝ)	રોકાયલો Engaged in (એ- ધર House (હાઉસ)
--------------------	--------------------------------------------

વિષે About (એબાઉટ)	ક્લાર્ક Clerk (ક્લાર્ક)
--------------------	---------------------------

કોઈ Any one (અનિ વન)	ગયા હતી Did go (ડિડ જો)
----------------------	-------------------------

શેરી Master (માર્ટર)	ફરીથી Again (અગેઝન) •
----------------------	-----------------------

સીધું Directly (ડિરેક્ટલી)	સ્વચ્છ Clean (ક્લીન)
----------------------------	----------------------

ગાડી Carriage (કરેજ)	જવાબદું find (ફાઈન્ડ)
નક્કી Positively (પાછિયાવલી)	કલેક્ટર Collector (કલેક્ટર)
મેડા ઉપર Upstairs (અપસ્ટર્સ)	દેવે Now (નાઉ)
માથી From (ફોમ)	વહેલા Early (અર્લી)
પેઢી Office, firm (ઓફિસ, ફર્મ)	ચુક્કનું Fail (ફિલ)
મોએલનું Sent (સંટ)	ધરાડો રાખવો Intend (પાનર્ટ)
રહેલું Live (લીવ)	કાર્ડ Card (કાર્ડ)
મળવું To see (કરી સી)	મેળવવું Get (ગેટ)

તમે કલેક્ટરની ઓફિસમાં કલાર્ક છો ? Are you a clerk in the Collector's office ? (આર યુ એ કલાર્ક હુન ધી કલેક્ટર ઓફિસ ?)

તેનું ધર મારા ઘરની જોડે છે His house is close to mine.
(દીજ હાઉસ ધજ કલોઝ હુ માઈન)

એ વિષે તેને અખર આપજો Let him know about it. (હેટ હીમ નો એન્યાયિટ ધર)

હુ જણને તેને કહે કહીશ I will go and tell him tomorrow. (આઈ ઉધીલ ગો એન્ડ ટેલ હીમ હુમેરો)
ત્યાં કોણ છે કે ? Is any one there ? (ધજ ઓનિ વન ધિર ?)
તમે કાણુ છો ? Who are you ? (હુ આર યુ ?)
લલુશેડ ધરમાં છે કે ? Is Mr. Laloo at home ? (ધજ મીરટર
લલુ એટ હોમ ?)
મારો તેમને મળવું છે I want to see him. (આઈ ઉયાન્ટ કુ
સી હીમ)

તે કંઈ ડામસાં રોક્કાથલા છે He is engaged in some work

(હી છજ એનગેજડ છન સમ વર્ક)

મેહેરખાની હરીને બેસો Please sit down. (પ્લીઝ સિટ આઉન)

તે મેડ છિપર છે He is upstairs. (હી છજ અપસ્ટેર્સ)

તમને છિપર બોલાવે છે You are called upstairs. (યુ આર
ટુઓડ અપસ્ટેર્સ)

તે અણાર ફરવા ગયો છે He has gone out for a walk.

(હી ડેંડ ગોન આઉટ ફ્રોડ આ ઉવોક)

તે પાછો ક્યારે આવે છે ? When does he come back.
(ઉદ્ઘેન ડજ હી ફમ એક)

મારે તને ભળવું છે I wish to see him. (આઇ ઉવીસ કુ
સી હીમ)

તે કભણ્યાજ બાહેર ગયો છે He has gone out just now.

(હી ડેંડ ગોન આઉટ જસ્ટ નાઉ)

તમે ક્યાંથી આવ્યા છો ? Where have you come from ?

(ઉદ્ઘેર ડેવ યુ ફમ સ્ટોમ ?)

કલેક્ટરની એશ્રીસમાંથી From the Collector's office. (સ્ટોમ
હી કલેક્ટરમં એષ્રીસ)

હવે મને તમારું નામ આપો Now give me your name.
(નાઉ ગીવ મી હાર નેચામ)

આ કાર્ડ તને આપને Give this card to him. (ગીવ ધીસ
• કાર્ડ કુ હીમ)

તમે ત્યા ગયા હતા કે ? Did you go there ? (ડીડ યુ ગો
થેર ?)

તમે ત્યાં જણો હો ? Will you go there? (હિનીબ કુ ઓ ધેર ?)
 હું કષે જઈશ I will go to-morrow. (આઈ હિનીબ જો દુભારો)
 સહિવારે વહેલા આવલે Come early in the morning.
 (કમ અર્થી છન ખી માનીએ)

ત્યાં નકી દરીથી આવલે Come there again positively.
 (કમ ધેર અગેધન પોચિયશી)

ત્યાં જવાને ચુક્તા નહિ Do not fail to go there. (કુ નોટ
 દેખલ કુ જો ધેર)

હું ખચીત આણીશ I will come positively. (આઈ હિનીબ
 કમ પોચિયશી)

હું જાદુશ નહિ I shall not go. (આઈ સેસ નોટ જો)

તમે કેમ જતા નથી ? Why don't you go ? (વાલ તો-એ
 કુ જો ?)

તમારી ભરળ હોય તો તમે જણો You may go if you
 like. (કુ મે જો છાડ કુ લાઢક)

મારો આજે જવાનો વિચાર નથી I do not intend to go
 to-day. (આઈ કુ નોટ છનટેન્ડ કુ જો કુઠે)

મને એક ગાડી જોઈએ છે I want one carriage. (આઈ
 ક્રોન્ટ વન કુરેઝ)

તે હું તમારે સાર લઈ આવું ? May I get it for you ?
 (મે આઈ કેટ છટ ફોર કુ !)

આજુ તેને મારે ધેર ભોકલે Send him to my house
 to-day. (સેન્ડ લીમ કુ માર લાઉન્ડ કુઠે)

तेरे कड़ले के भारे तमने भगवुं छे Tell him that I wish
to see you. (टेल छीम धैट आध उवीस दु सी यु)
कु जड़र तेरे कड़ीक्ष I will speak to him positively.
(आध उवील रपीड दु छीम पौअरीवली)
तमाँ घर रख्या राखो Keep your house clean. (कुप
योर छाउस उलीन)

वांचन पाठ २८ भा.

छापड Roof (छृ)	पगार Salary (सेवेरी)
बाववुं Bring (भिंग)	तपभीरीओ Brown (आउन)
बांधवुं [धर] Build (भिए)	आसपास Around (ओराउ-ड)
भगवुं Burn (भर्न)	दधियार Arms (आम्स)
झामभां Busy (भीझी)	उगतो Asleep (ओसलीप)
आभखु Butter (बटर)	भाँधु Ate (ओट)
भरीदवुं Buy (बाय)	काकी, भामी, भाशी Aunt (आउट)
छोड़दूँ Child (आधहड)	पसंद करवुं Choose (चूँज)
लगयो Awoke (अवॉक)	पांले Claw, paw (कड़ो, पौ)
हर Away (अवे)	चोर्खुं, रख्या Clean (उक्कीन)
पट Bell (भेल)	तामे हेवुं Belong (भिंडीग)
साई-चोर्खुं Clear (क्लीयर)	नीचे Below (बिलो)
कुशीआर Clever (क्लेवर)	पासे Beside (भीसूर्ड)
क्लिर चढ़वुं Climb (क्लाइम्ब)	सोयी 'साँ भेस्ट (भिस्ट)
जैसे करवुं Shut (शै)	वधारे साँ भेट्ट Better (भेटर)
ओहुं Big (भीव)	वाद्यु Cloud (क्लाउड)

બાંધ Bill (અખ)	પેટે આળી આવેલું Crept (કુલ્ય)
કરડવું Bite (આઈટ)	ધાતકી Cruel (કુઅમ)
કાળું Black (ફ્લેઝ)	રોવું Cry (કાય)
ચણકતું Bright (આઈટ)	પડોંની Curtain (કર્ટન)
પહેરવેશ Dress (ડેસ)	નીચે Down (ડાઉન)
સુધારેલું Dried (શાઈટ)	એંચવું-તાથવું Drag (કુંગ)
પીવું Drink (ફીન્ક)	એંચવું Draw (કુંઠ)
દાંડવું Drive (શાઈવ)	ભયાંકર Terrible (ટેરીબલ)
સ્વર્ણ આવવું Dream (ફીમ)	દૂંઢ Deep (ડીપ)
હંદર Rat (રટ)	મીલ્કત Property (પ્રોપરી)
અખૂર Hand-writing (ફુંડ રાઈટિંગ)	પાંચી મળી Recovered (રીકવર્ડ)
બિલાડીનું બજ્યું Kit (કિટ)	લખાણ Writing (રામટીંગ)

મારી પાસે છે I have. (આઈ હેવ) તેમોની પાસે છે They
તેની પાસે છે He has. (હી હું) have. (ધે હેવ)
અમારી પાસે છે We have (ઉણી હેવ) તમારી પાસે છે You have
(કુ હેવ)

તમે શું પગાર લાવો છો What salary do you draw.
(વ્હોટ સેલેરી કુ શુ ડ્રો)

તે ચણકતા પક્ષીને છોકરા પાસે લાવો Bring the bright brid
before the child. (ધીંગ ધ આઈટ બર્ડ ધીફાર ધી ચાઈટ)

આ ભરું પક્ષી મારે તાણે છે This brown bird belongs
'to me. (ધીસ આઉન બર્ડ બિલોંગ્સ કુ મી)

તમारे तमारे घर स्वच्छ राख्युं You must keep your house clean. (યુ મરટ ક્રીપ ચાર હાઉસ ક્ષીન)

આ પાણી ચાખયું છે This water is clear. (ધીમું પોઠર
છક ક્રીયા)

તે દુંશીયાર ભાણુસ છાપરાપર ચડી રહે છે. That clever man can climb the root. (ઘેટ ક્લેવર મેન કુન ક્લાઇમ્પ ધી ઝે)

પડો જલદી ઉધાડો I draw the curtain soon. (ડ્રો ધી
કર્ટન સુન)

મને લથંકર સ્વાનુ આયું I had a terrible dream. (આયુ
ક્રં એ ટેરીફલ ડીમ)

છાકરાઓ હવે તમે બેર જાઓ Boys, you may go home now. (બાળ, યુ મે ગો હોમ નાઉ)

તે છાકરા પાસે એક ડાથળી છે That boy has one bag.
(ઘેટ પ્યાય છક વન ઝેગ)

અને તે ડાથળીમાં ચાર રૂપીઓ છે And in that bag has four rupees. (અન્ડ છન્ન ઘેટ બેગ હંગ ફેર રૂપીઓ)

શું તે બિલાડી નથી ? ના. Is it not a cat ? no. (છક ઘેટ
નોટ આ હટ ? નો)

શું તે ઉદર છે ? લા. Is it a rat ? yes. (છક ઘટ આ રોટ ? બસ)

શું તે બિલાડીનું બચ્ચું છે ? Is it a kit ? (છક સ્ટ આ કિટ ?)
લા, તે મારે બિલાડીનું બચ્ચું છે Yes, it is my kit. (બસ,
હટ છક મારું કિટ)

મીલકત પાણી મળો ! Is the property recovered ? (પણ
બુન્ધાર્દી રીકર્ડ)

આ ચીઠી લાવનાર સાથે કિમત મોકલી આપણે Send the price by the bearer of this note. (સેન્ડ ખ પ્રાઇસ ભાય ખી બેરર એંડ ધીસ નોટ)

આસો મોટું થયું છે Go on, it is late. (ઓ ઓન, છટ રજ લેધાટ)
તમે જાણ છો ? Do you want to go ? (કુ કુ વાન્ટ કુ ગો ?)
મારા વહાલા ભાઈ, તું ખીભાનામાં જને My dear brother,
you can go in the bed. (ભાય ડીપર અધર, કુ કેન
તો છન્હ ખી બેડ)

ભાઈ, દિલમીર ચા નહિ Do not be sad, brother. (કુ નોટ
(ભી સેંડ, અધર)

તમારું કાખાથું થયું સાઈ છે Your writing is very good.
(યોર રાઈટિંગ છજ વેરી ગુડ)

તમારા અફ્કર બણ્ણા સારા નથી Your hand-writing is not
very good. (યોર હેન્ડ રાઈટિંગ છજ નોટ વેરી ગુડ)

વાંચન પાઠ રદ મો.

મરી અથો Died (ડાઇડ)	અરે હાય ! Alas (અલાસ)
પસે છે Has (હાસ)	પેહેરી છે Has put on (હેંપુટઓન)
તમને કેમ છો ? How do you do (હોઓ કુ કુ કુ)	ચુતાઈ ગયું Hid (હિદ)
મમત Fun (ફુન)	નળી Pipe (પાયપ)
આથું Head (હેડ)	નામ છે Lalee (લાલી)
આફ્ટે Stick (સ્ટિક),	આટિવાન Driver (ડ્રાઇવર)
	પાસે છે have (હેવ)

આખુક Whip (અધીપ)	સાથે With (ઉપરીથ)
રોંગ Bear (બેર)	અણુ Tip (શીપ)
ટેકરી Hill (હિલ)	નાનો ઝડો Rill (રિલ)
મરળ, ભવિષ્યદાળની નિયાની Will (ઉપરીથ)	ધાણી, ધંગી, મિલ જિલ્લ Mill (મિલ)
ધાંચી Miller (મીલર)	પહેરી Put on (પુછ ઓન)
જિતાવળો Fast (ફાસ્ટ)	પાસે થઈને Past (પાસ્ટ)
ખાડુ સારે Well (ઉવેલ)	પહેંચનું Get, Reach (ગેટ, રીઅ)

અરે હાય ! મારો કુતરો મરી ગયો Alas ! my dog died.
અંશાસ ! માય ડાગ ડાઇડ)

તેણું ટાપી પેહેરી છે, અને તેની પાસે ભૂંગળા પણ છે He has
put on a cap, and he has a pipe too. (શી
ઝક પુટ ઓન આ કેપ એન્ડ હી ઝક આ પાઇપ ફુ)

શું તેને આ ગમભત ભરેલું જોવાનું નથી ? Is this not a fun
for him to see ? (ઝક ધીસ નોટ એ ઇન ફેર લીમ
કુ સી ?)

તે લાલી છે, તમે તેને નથી ઓળખતા ? She is Lalee, do
you not know her ? (શી ઝક લાલી, કુ ખુ નોટ નો હર ?)

નિષાડીનાં બચ્ચાંના માથા ઉપર લાકડી સુદોં Put a stick on
the kit's head. (મુઠ આ રટીક ઓન ધા કિટસ ફેસ)

મારાથી મુકી થકારો નહિ, તે સંતાઢ ગઈ છે I can not put it,
she is hidden. (આછ કેન નોટ મુઠ છટ, શી ઝક નિષાડન)

આ લાકડી તેને મારસો નહિ Don't beat him with this
slick. (આન્ટ ઝીટ હીમ વીથ ધીસ રટીક)

તે મારે વડાનું બિલાડીનું ખચ્ચું છે It is my pet kit. (છટ છક માય પેટ કિટ)

હું એશી શકોશ અને તેની સાથે વાત કરી શકોશ I can sit and talk with her. (આઈ ડેન સિટ એન્ડ ટૉક ગાથ હર)

મારા ગાડીયાન સારુ એક ચાખક લાવો Get a whip for my driver. (ગેટ આ બ્લીપ ફ્લાર માય ડ્રાઇવર)

જુઓ, તેણે તે પકળો છે See, she has caught it. (સી, શી હેંડ કેટ ઈટ)

તમારી પાસે ડેટાં રૂપીયા છે ? How many Rupees have you ? (હાઉ મેનિ રૂપીઝ હેવ યુ ?)

તે ટેકરી ઉપર ચડો Go up the hill. (જા અપ ધી હીલ)

તેણે મારી ટોપી પહેરી છે He has put on my hat. (હેં હેં પુટ એન માય હેટ)

મેં ગરૂમત ખાતર તે પહેરી I put it on for fun. (આઈ પુટ છટ એન હોર હન)

હું તેની ટોપી મેળવીશ I shall get his cap. (આઈ રોલ જેં હીક કેપ)

ધાણી પાસેથી, ટેકરી ઉપર ચઢને By the mill climb up the hill. (આય ધી મીલ, કલાઈમન્ અપ ધી લિલ)

હું એવો ઉતાવળો દોઢો છું કે તે મને પહોંચ્યા શક્યો નહિ I ran so fast that he could not reach me. (આઈ રેન સો ઇસ્ટ ઘેટ હી હું નોટ રીચ મી)

હું, તેને બહાર કાઢીય I shall get her out. (આઈ રોલ જેં હર આઉટ)

તે અદર પડી અને મરી ગઈ She fell in and died. (શ્રી હૃષા ધન એન્ડ ડાઇડ)

Gender (જોનકર) જાતિ વિષે.

ગુજરાતીમાં જેમ નર, નારી, તથા નાન્યતર મુખ્ય વણું જાતિ છે તેમ ઈંગ્રેજીમાં પણ વણું જાતિ છે. Masculine (મેસ્ક્યુલાઇન) નરજાતિ Feminine (ફેમીનાઇન) નારીજાતિ તથા Neuter નાન્યતરજાતિ.

નિયમ—અંગ્રેજીમાં જાતિ ઇકત્તા પ્રાણીને જ લાગે છે એટથે પ્રાણીમાં કે નર હોય તેની નરજાતિ અને કે નારી હોય તેની નારીજાતિ બાકી નીરળું પદાર્થ સંધગાંતી નાન્યતર જાતિ ગણાય છે. જેમણે:—

નરજાતિ Masculine gender (મેસ્ક્યુલાઇન જેનર) ના દાખલા Man (મેન) ભાખુસ, King (રીંગ) રાજ, Horse (હોર્સ) ઘોડા વીગેરે.

નારીજાતિ Feminine gender (ફેમીનાઇન જેનર) ના દાખલા જેમણે, Woman (વુમન) આપડી, Queen (ક્વીન) રાણી, Mare (મેર) ઘોડી વીગેરે.

નાન્યતરજાતિ Neuter gender (ન્યુટર જેનર) ના દાખલા જેમણે, Bungalow (બંગલા) બંગલો, Mansion (મેન્સન) હવેલી, House (હાઉસ) ઘર વીગેરે.

ઉપર કે નાન્યતર જાતિના દાખલા આપ્યા તેની ગુજરાતી ભાષા તરફે જાતિ જોતાં ‘બંગલો’ નરજાતિ છે, ‘હવેલી’ નારીજાતિ

એ અને 'પર' નાન્યતર જાતિ છે, પણ અંગેજીમાં એ તથેને નિર્ણય (જીવ વગરના) મણ્ડુવામાં આવ્યા છે. તેથી એ તથેની જાતિ અંગેજીમાં નાન્યતર છે.

શુદ્ધરાતીમાં નરળતિના નામને 'ઈ' લગાડવાથી નારીલતિનાં નામ પણ કરીને થાય છે પણ અંગેજીમાં કે નામ નરળતિમાં હોય અને તેની નારીલતિ કરવી હોય તો તથું રીતે થાય છે.

ઓક તો તદ્દન શાખ ઘટલી નાંખવાથી નેમોકે:—

નરળતિ.

નારીલતિ.

કોડો Uncle (આંકડ)	કાકી Aunt (આંટ)
ભનીને Nephew (નેચ્યુ)	ભનીઝ Niece (નીસ)
રાજ King (કિંગ)	રાણી Queen (ક્વિન)
થોરો Horse (હોર્સ)	થોરી Mare (મેર)
પીતા Father (પાપર)	માતા Mother (મધર)
કુતરો Dog (કોગ)	કુતરી Bitch (બીચ)
ભાઈ Brother (ભખર)	ભેન Sister (સીસ્ટર)
કુકડો Cock [કોક]	મુરબી hen (હેન)
ઉમરાવ Lord (લોડ)	શાહાણી Lady (લેડી)
કુઝર Bear (બેર)	કુઝરી Sow (સો)
પણી Husband (દમધ-ડ)	પણીયાણી Wife (વાઈફ)
કુંવારો Bachelor (બેચેલર)	કુંવારિકા Maiden (મેદિકન)
દંસ Gander (મેન્ડર)	દંસણી Goose (ગુઝર)
છોડરો [પોતાનો] Son (સન)	છોડરી (પોતાની) Daughter (કોટર)

वीक्षु' नरजलतिना नामने "ess" लगाइयाची

नरजलति.

अंथकर्ता Author (ओआर) अंथकारिणी Authoress (ओआरेस)
शहेनशाह Emperor (ओमप्रेस)
(ओमपरर)

वारस Heir (ओर)
सिक्कारी Hunter (ए-टर)
छोडरा Lad (लेड)
कवि Poet (पोअटे)
नट Actor (ओक्टर)
वाघ Tiger (टाईगर)
शिक्षक Tutor (टच्यूटर)
राक्षस Giant (जायन्ट)
सिंह Lion (लायन)
सीधी Negro (निग्रो)

नारीजलति.

अंथकारिणी Authoress (ओआरेस)
शहेनशाहिणी Empress (ओमप्रेस)
वारस (अरी) Heiress (ओरेस)
सिक्कारी (अरी) Huntress (ए-ट्रेस)
छोडरी Lass (लेस)
कवि [अरी] Poetess (पोअटेस)
नटी Actress (ओक्ट्रेस)
वाघशु Tigress (टाईग्रेस)
शिक्षिका [अरी] Tutoress (टच्यूट्रेस)
राक्षसशु Giantess (जायन्टेस)
सिंहशु Lioness (लायनेस)
सीधशु Negress (निग्रेस)

वीक्षु' नरजलतिना नामने जीना शाख लगाइवाची

नरजलति.

अळरा He-goat (ही गोट)
अळसा Cock-sparrow
(होक स्पेरो)
मोर Peacock (पी-होक)
आळर Manservant (मेन
सर्वन्ट)

नारीजलति.

अळरी She-goat (शीगोट)
अळसी Hen-sparrow (हेन
स्पेरो)
देल Peahen (पी-हेन)
आळरी Maid-servant (मेड-
सर्वन्ट)

અંગ્રેજીમાં નર, નારી અને નાન્યતર ઉપરાંત સામાન્ય જાતિ Common gender (કોમન જેન્ડર) છે. તે એવાખવાની રીત એવી છે કે, જે નામ નર તથા નારીજાતિ બંનેને લાગુ પડે તે સામાન્ય જાતિમાં ગણ્યાય છે.

માતા પીતા Parent (પેરન્ટ)

સંયુ (ખ્રી અથવા પુરુષ) Relation (રીલેશન)

મિત્ર " " Friend (ફ્રેન્ડ)

હુસ્મન " " Enemy (એનીમી)

બાળક (નાની છોડી અથવા છોક્કેર) Child (ચાઇલ્ડ)

ચાડર (ખ્રી અથવા પુરુષ) Servant (સર્વન્ટ)

શિષ્ય (છોકરો અથવા છોડી) Pupil (પ્યુપિલ)

ઉપરાંતનાં સધળાંનાં નામ સામાન્ય જાતિમાં ગણ્યાય છે.

વાંચન પાઠ ૩૦ મે.

મેરી Mary (રાષ્ટ્રીનું નામ છે.) રચી છે Has composed (હેચ કમ્પોઝિશન)

ચાલ Conduct (કોન્ડ્રિક્ટ) આધને Eating (ઇટિંગ)

પરખ્યાવાને To marry (કુ મેરિ) કહેવાય છે. Is called (ઇઝ કેલ્ડ)

કણુંઓ કરવો Quarrel (ક્વોરલ) સુખેથી Happily (હેપીલી).

નેછાંએ Should (શુદ્દ) ભારે Therefore (થેરેફાર)

દરરોજ Every-day (એવરીડે) શુદ્ધરાન ચક્કાને છે Maintain

દ્યાગુ Kind (કાઈન્ડ) (મેનટેઇન)

મર્સી ગમેદ્વો Dead (ડેડ) George જોર્જ

જાડી Carriage (કરેજ) ડિસ્ટ્રિક્શનના શહેનશાહનું નામ છે.

એનો Whose (હુઅ)

પીવું Drink (ડ્રિક)

તે કુંવારો પુરુષ પરથુવાને છાંચે છે That bachelor wishes to marry (ધેટ બેચેખર વીશીશ હુ મેરિ)

આઈઓએ પોતાની એનો ઉપર દ્યાળું થતું જોઈએ Brothers should be kind to their sisters. (અધર્સ શુડ બી કાઈન્ડ હુ ધેર સીસ્ટર્સ)

ને મુરધો તથા મુરધી તમે જોયા ? Did you see the cock and the hen ? (ડીડ યુ સી ધી ડોક એન્ડ ધી લેન ?)

તે ગૃહસ્થ માણુસ તથા તેની સ્વી સુરત ગયાં That gentleman and his lady went ot Surat. (ધેટ જેન્ટલ્સ મેન એન્ડ લીડ લેડી વેન્ટ હુ સુરત)

તે ઘોડો તથા ઘોડી ધામ ખાઈને પાણી પીએ છે That horse and that mare drink water, after eating grass. (ધેટ લોસ્ટ એન્ડ ધેટ મેર ડ્રીક વોટર આફ્ટર ધર્ટીંગ માસ)

તે રાજું તથા રાણી એટ ગાડીમાં બેડા છે That King and that Queen both has sat in the carriage. (ધેટ કિંગ એન્ડ ધેટ કિંગીન બોથ હેઝ સેટ ધી કેરેજ)

તે ખલ્લી ખણીઆણી સુખેથી પોતાનું ગુજરાન ચલાવે છે. That husband and wife maintain themselves happily. (ધેટ હમાન્ડ એન્ડ વાઇફ મેનટેઇન ધેમ-સેલ્ફ હેપીલી)

મારો કાંડા તથા કાંડી રોજ કણુંએ કરે છે My uncle and my

aunt quarrel every-day. (માય અન્ટસ એન્ડ માય આન્ટ કોરસ અવરી તે)

રાઉલો પુરુષ કુંચારો કહેવાય નહિ A widower can not be called a bachelor. (એ વીડોઅર કંન નોટ બી ડોલ આ બેચલર)

જે ઓનો ધર્શી ભરી ગયો તે રાઉલી કહેવાય છે The woman whose husband is dead, is called a widow. (ધી મુમન ફુઝ હસ્તબંદ ધૂક ઢુક, ધજ કોંડ આ વીડો)

મારા પીતામે એક બોપડી રવી છે માટે તે અંચકર્તા કહેવાય છે My father has composed a book, therefore he is called an author. (માય ઇથર હું કર્પોરાઝ આ શુક, બેરફોર હી ધજ કોંડ અન ઓથર)

જોન હિંદુસ્તાનના શહેનશાહ છે George is the Emperor of India. (જોન ધજ ધી એરપરર એહ ધનીઆ)

અને હિંદુસ્તાનના શહેનશાહાનું નામ મેરી છે. And the name of the Empress of India is Mary. (એન્ડ ધી નેધમ એહ ધી એરપ્રેસ એહ ધનીઆ ધજ મેરી.)

તેણે પોતાની છાઈને શીખવવાને બી શિક્ષક રાખ્યો છે He has kept a tutoress to teach his daughter. (હી હું કર્પુ આ ટ્યુટોરેસ હુ રીચ ધીક ડોટર)

આ ઘુકરો છે કે ઘફરી ? Is this a he-goat or a she-goat ? (ધજ ધીઝુ આ હી ચોટ એસ આ શી ચોટ)

મારા પરગાં બે ચાર અને એક બ્યાકરી છે There are two,

men servants and one maid servant in my house. (ધેર આર દુ મેન સર્વન્ટ્સ એન્ડ વન મેઈડ સર્વન્ટ છન માય હાઉસ)

મારો ભાત્રીને તથા ભાત્રીજી એજ ખરાગ ચાલનાં છે Both my nephew and niece are of bad Conduct. (ખોથ માગ નેવ્યુ એન્ડ નીસ આર ઓફ ઐડ કોન્ડકટ)

Adjectives (એડજેક્ટીવ્ઝ) વિશેપણ વિષે.

નામનો ગુણુ અતાવવાને વાસ્તે ને શંદ વપરાય છે તેને વિશેપણ કહે છે. જેમણે રાનો ધોડો Red horse. (રેડ હોર્સ) આમાં 'ધોડા'ના ગુણુ અતાવવાર શાંદ 'રાનો' છે માટે 'રાનો' વિશેપણ કહેવાય.

વિશેપણ ચાર જાતનાં છે. (૧) ગુણવાચક વિશેપણ Adjective of quality (એડજેક્ટીવ ઓફ કોલીટીવ) જેમણે, કાળી છતી Black umbrella (બ્લેક અમ્પ્રેલા) આમાં 'કાળી' શંદ છતીનો ગુણુ અતાવે છે માટે તે ગુણવાચક વિશેપણ કહેવાય છે.

(૨) સંખ્યાવાચક વિશેપણ Numerical Adjective (ન્યુમરલ એડજેક્ટીવ) જેમણે, એક માણસ One man. (વન મેન), એ ચોપડીએ Two books. (દુ બુક્સ) આમાં 'એક' અને 'એ' એ શંદ સંખ્યા અતાવે છે માટે તે સંખ્યાવાચક વિશેપણ કહેવાય છે.

(૩) જથાવાચક વિશેપણ. Adjective of quantity (એડજેક્ટીવ ઓફ કોન્ટાન્ટીવી) જેમણે, ધેણું પાણી Much water. (મય વોટર), શોંકું દુધ Little milk (લીટલ મીલ્ક) આમાં

‘ધર્થુ’ તથા ‘આડુ’ શબ્દ જગ્યા બતાવે છે માટે તે જથ્થાવાચક વિરોધાંશુ કહેવાય છે.

(૪) દર્શક વિરોધાંશુ Demonstrative Adjective (દીમે-નર્સ્ટોરીવ એડજેક્ટીવ) જે ભકે આ ગાય This cow. (ધીસ કાઉ) ખેલો બળદ That ox. (ખેટ ઓક્સ) આમાં ‘આ’ અને ‘તે’ જે ગાય તથા બળદ વિસે વાત થઈ હોય તે બનાવી આપે છે માટે તે દર્શક શિરોધાંશુ કહેવાય છે.

ધર્થાંશન પાઠ ૩૧ મો.

આકર Servant (મર્વન્ટ)	પાટ Crop (ક્રોપ)
કરીઓ Mangoes (મેન્ગેજ)	તાર Telegram (ટેલીગ્રામ)
મહીનો Month (મન્થ)	માગવું નેંઘાં Want (વોન્ટ)
ગયે વરસે Last year (લાસ્ટ એચર)	ઓટલામાં In the meantime
ઉંચો Tall (ટોલ)	(ધર્ન ધ મીનટાઇધમ)
ગાડી Carriage (કેરેજ)	ત્રણું Thrree (થ્રી)
એકદમ At once (એટ વન્સ્યુ)	વધારે ફુર Farther (ફારથર)
ઉદાસ Sad (સેઝ)	કેયો What (વોટ)
ગૃહસ્થ Gentleman (ગેન્ટલમેન)	કામ કરવું, કામ Work (વર્ક)
પ્રમાણિક Just, honest (જરસ્ટ ઓનિસ્ટ)	આવૃત્તિ Edition (એડિશન)
ભઇસો રાખનો Trust (દ્રસ્ટ)	ચોખાયું, સાદું Plain (પ્લેન)
આદમી Fellow (ફેલો)	ધીમે ધીમે By and by (આપ એન્ક બાય)
કોણને Who (કુ)	નીચ Mean (મિન)

તમે તે ચાકરનો વિશ્વાસ કરો છો ? Do you trust that servant ?

(હુ યુ ટ્રસ્ટ બેટ સર્વન્ટ)

હુરી ગયે વર્ષો ધર્થી પાકી હતી Last year there was a good crop of mangoes. (લાસ્ટ ધઅર બેર વોજ એ ચુડ ડોપ એઓઝ મેંગોઝ)

તમે મને તાર કરશો ? Will you send me a telegram ?

(વીલ યુ મેન્ડ મી એ ટેલીગ્રામ)

હવે તમે મારે જવા માળો છો ? When do you want to go now ? (વહેન હુ યુ વાન્ટ હુ જો માઉિ ?)

તે માણુસ નથુ માણુસ જેટલો ઉચ્ચો હતો That man was as tall as three men. (બેટ મેન વોજ એજ ટોલ્સ એજ થી મેન)

એટલામાં ગાડી વખતે દૂર દેખાઈ In the meantime the carriage appeared a little farther. (ધન ધ મીન-સધમ ધ ડેરેજ એપેચેર્ડ એ લીટલ ફાર્થર)

તે તમને એકદમ મારી નાંખશો He will kill you at once.

(હી વીલ કીલ યુ એટ વન્સ)

આ કયો મહિનો છે ? What month is this ? (વોટ મન્થ ધજ ધીસ ?)

તેનુ ઈંગ્રેજ સાદુ છે His English is plain. (હીજ ઈંગ્લીશ ધજ પ્લેઇન)

બધા સાથે પ્રમાણિક થને, પણ ભરસો રાખના નહિ Be just to all, but do not trust all. (બીજ જરૂર હુ આંદું, બટ હુ મોટ ટ્રસ્ટ એલા)

તમે હોણુ છો ? Who are you ? (હુ આર યુ ?)

તે એક નીચ માણુથ છે He is a mean fellow. (હી ધડ
 એ મીન હોલો)
 તમે અહીંયાં શા વાસ્તે આવ્યા છા ? Why have you come
 here ? (બદાય હેવ યુ કમ ડિઅર ?)
 તે ગૃહસ્થ તમને એકાંક્ષાં છે That Gentleman calls you.
 (ધેટ નેન્ટલ્યામેન ડોલ્સ યુ)

. વાંચન પાઠ ૩૨ મા.

બંસો	Buffaloes (અફ્લોઝ)	વાછરંગ	Cult (કાલ)
સંખ્યા	Number (નંબર)	દેટલીક	Name, several - (સમ, સેવન્સ)
ઢોળ કરવો	Pretend (પ્રીટિંગ)	મુક્યો	Put (પુટ)
ગણું	Regard (રિગાર્ડ)	ધર	House (હાઉસ)
પેસું	Enter (ઇન્ટર)	પ્રયત્ન	કરવો Try (ટ્રાય)
રાત	Night (નાઇટ)	ઘણું	Wish (હવીશ)
ચોક્કું	Set (સેટ)	રમનું	Play (પ્લે)
દુકાનદાર	Shop keeper (રોપન્ડીપર)	ચોર	Thief (થીફ)
નોટલો	Loaf (લોફ)	જવાગામુખી	પલાડો Volcano (વોલ્કનોઝ)
હદરો	Mice (માઘસ)	માસિક	Magazine (મેર્જન્ઝીન)
તાજવાં	Scales (રકેલ્સ)	કિમત	બેસવી Cost (કોસ્ટ)
ન્યુસપેપર,	ચાપાતીઓ News- paper (-ન્યુસપેપર)	માઢા	Sad (સેડ)
ઇટાલી	નામનો દેશ Italy (ઇટેલી)	પાંડાં	Leaves (લીફ)
મરણ	Death (ડેથ)	મોટી	Large (લ્યાર્જ)

મજુર Labourer (લેબરર)	ક્રિયાદ કરવી Complain (ક્રિયાદિન)
ખુન કરનાર Murderer (મર્ડરર)	ઉચ્ચ High (દાઢ)
વજન કરવું Weigh (વે)	ચહેરો Face (ફેઝ)
સીધી Negroe (નીગ્રો)	નિમદ્દલાલ Faithful (ફેથફુલ)
સુદર Fair (ફેર)	એતરર Farm (ફાર્મ)
કુટુંગ Family (ફેમિલી)	ક્રારમ Form (ફોર્મ)
ખેડુન Farmer (ફાર્મર)	આગળ Forward (ફોર્વર્ડ)
અનાવેચું Formed (ફોર્મ્ડ)	છુટું, સ્વતંત્ર Free (ફી)
માલુમ પડ્યું Found (ફોઉન્ડ)	આર્ફિકા Africa (આર્ફિકા)
તાજું Fresh (ફ્રેશ)	જીતાવળો Hasty (હેસ્ટી)
હિતાવળ Haste (હિસ્ટે)	શિકાર કરવો Hunt (હાન્ટ)
ભુખ્યો Hungry (હંગ્રી)	બરફ Ice (આફસ)
ધળ કરી Hurt (હર્ટ)	માંડું Ill (મલ)
આગસ્ટપણું Idly (આઈડલી)	અંદરની ખાંનુ Inside (ઇન્સાઇડ)
ખરેખર Indeed (થનડીડ)	કુલ Flower (ફ્લોઆર)
ઉડ્યું Flew (ફેલ્યુ)	કાચ Glass (ગ્લાસ)
ખુશી Glad (ગ્લેડ)	મિત્ર Friend (ફ્રેન્ડ)
શુષ્ઠ્વાર Friday (ફ્રિડે)	ભરેલું Full (કુલ)
માંથી, પાસેથી From (ફ્રોમ)	દાથ Hand (હેન્ડ)
ઓરડો Hall (હોલ)	ભાગે Hardly (હાર્ડલી)
કઠજુ Hard (હાર્ડ)	ધાસ Grass (ગ્રાસ)
સોનાનું, સોનેરી Golden (ગોલ્ડન)	મદદ કરી Helped (હેલ્પેડ)
ગંભીર, કષ્યર Grave (ગ્રેવ)	અહિંયાં Mere (મેરી)
વહાણું સુખન Helm (હેલ્મ)	

તેણીની મેળે Herself (હરસેલ્ફ) છુપાવનું Hide (હાઇડ)

તેણે કેટલીએ ગાંગે નાના બેસો જેઠ હે saw some cows
and buffaloes. (હી સા સમ અજિઝ એન્ડ બફેલોઝ)

તેઓ આપણુંને જેચે તારદ શુવાનો ઢેળ ધાલે છે They
pretend to regard us as heathens. (એ પ્રિટેન્ડ
કુ રિગાર્ડ અસ એસ હીથન્સ)

તમને બદાટા પસંદ છે કે ? Do you like potatoes ? (કુ યુ
લાઇક પોટેટોઝ ?)

તે ગાયને બે વાળ્ડર્ડો છે That cow has two calves. (ધેર
કાઉ ડુંડ કુ કાંડન)

મેં પાંદાં ઉદર રોટલો મૂક્યો I put the loaf on the
leaves. (આઈ પુટ ધી લોફ ઓન ધી લીફ)

તેના ધરમાં રાત્રે બે ચોર પેડા Two thieves entered his
house at night, (કુ થીઝ એન્ટર્ડ હિંક હાઉસ એટ નાઇટ)

અમારા ધરમાં ખસુ ઉદર છે There are many mice in
our house. (ધેર આર મેરી માઇસ છન અવર હાઉસ)

હુ રેમનું નનું ચોકું લેવા છચ્છુ છું I wish to have a new
set of frame. (આઈ વીશ કુ હેવ એ નનુ સેટ એન્ડ
ફેરમ)

હુકાનદારને ચાર લુગડાં લાવવાનું કહેને Tell the shop-keeper
to bring four, clothes. (ટેલ્ફ ધી ચોપ-કોપર કુ બીજ
ફોર કહોંસ)

આરા ફપડાં લાવો, આરે અહાર જનું છે Bring my clothes,

I wish to go out. (અંગ માય કલોખ્સ, આઈ વીશ
કુ ગે આઉટ)

તે મારો મામો છે He is my uncle. (હી ધક માય અન્કલ)
તે છાપું ર આને મળી શકે છે પણ તે માસિકના ૬ આના બેસે
છે That newspaper can be had for two annas
but that magazine costs six annas. (ધેટ ન્યુસ-
પેપર ડન બી હેઠ ફેર કુ આનાસ ણટ ધેટ મેગાઝીન ડાટસ
સિક્સ આનાસ)

હિન્દુસ્તાનમાં ધણા જવાણામુખી ફાડો છે There are many
volcanoes in India. (ધેર આર મેની વાંકોનોઝ છન
ઈન્ડીઆ)

કેશવલાલ એના ભરણુના માડા સમાચાર લાન્ચો છે Keshavlal
has brought the sad tidings of his death.
(કેશવલાલ ડંજ ઓટ ધી સેડ ટાઇડિંગ્સ એન્ડ હીડ ટેથ)

હિન્દુસ્તાનમાં મળુરોનો પગાર વધારે નથી The wages of
labourers in india are not large. (ધી વેજસ
એન્ડ લેબરર્સ મન ઈન્ડીઆ આર નોટ લાર્જ)

ખુન કરનારાઓને આંદામાન જતું પડે છે. Murderers are send
to Andaman. (ભરકર્સ આર સેન્ટ કુ આંદામાન)

મેં તે ચાલેને તાજવામાં મુક્કોને તોળી I weighed the things
after putting them into the scales. (આઈ વેઇટ
ધી થીંગ્સ આઇટર પુરીંગ ધેમ કંદુ ધી સ્કેલ્સ)

તે એક જાયંકર હૈપ્પાય હતો It was a terrible spectacle.
(હંડ વોઝ આ ટેરીબલ સ્પેક્ટેક્લા)

આરોકામાં સીધીઓની એક મોટી મંઘ્યા છે There is a great number of Negroes in Africa. (ધેર મુજ એ ગ્રેટ નંધર ઓઝ નિગ્રોઝ છન આરોકા)

વાંચન પાઠ ૩૩ મે.

ગરજ સારવી Serve for (સર્વ ફેર)	હીલ Suit (રચુટ)
મોદું ચદાવે છે, Makes a long face (મેફિસ આ લાગ ફેફિસ)	સાંજ Evening (મુવનીંગ)
જાણી જોઈને Purposely (પરપત્રી)	દાજરી Attendance (એટેનડન્સ)
સ્વભાવ, મિનજ Temper (ટેમ્પર)	વિના Without (ઓબિધાઉટ)
કાળજ Care (કેર)	શક્યું Could (કું)
તરફ Part (પાર્ટ)	બુરસો Spirits (રસ્પીરિટ્સ)
પૂરુ પાડતું Supply (સ્પેલાય)	નરમ પડી નાય છે Sinks (સીંકસ)
ની જરૂર છે Wants (ડોન્ટ્સ)	ધીરજ Patience (પેચાન્સ)
યાદ આપી Put in mind (પુર છન માર્ચન્ડ)	મોટો Great (ગ્રેટ)
ઓધી Weak (ઉફીક)	અક્ષીસ Gift (ગ્રીફટ)
જરૂર Find, see (ફાઇન્ડ સી)	ઓન્કમત One mind, unanimous
આખો દહ્યાડો The whole day (ધી હોલ ડે)	ઓલ મનથી With all heart (ઉન્નાથ ઓલ હાર્ટ)
	યાદવાસ્ત Memory (મેમરી)
	મરજી પ્રમાણે Pleasure (પ્લેઝર)
	વહેલા Early (અલ્ફ)

સહ્યી સારુ Best (બેસ્ટ)	પુરસ્ક લેઝર Leisure (લીજર)
કામ નથી Disengaged (ડિસએનગેજડ)	ગેરદાખરી Absence (અનસન્સ)
આ મને વાણીસ તરિક આપો Give me this as a gift. (ગીવ મી ધીસ અંજ આ ગીફ્ટ)	નંમાંગે Required (રીકવાયર્ડ)
તે હેમ અનીજ શકે ? How could it be ? (હાઉ કું છટ બી ?)	
તે મોંઢું ચટાવે છે He makes a long face. (હી મેચક્સ આ ડાગ ફેચ્સ)	
મારી દીમત નરમ પડી જાય છે My spirits sink. (માય રીપ્રિટ્સ સિંક)	
તે જાળું નંધતે આ કરે છે He does this purposely. (હી કર ધીસ પરપરલી)	
તે તહુન અધીરો થઈ ગયો છે He has lost all patience. (હી ટંજ હોસ્ટ ઓફ પેશન્સ)	
તેણું ભીજન ખોયો He lost his temper. (હી હોસ્ટ હીજ ટેમ્પર)	
તે મોટા મુરખ હતો He was a great fool. (હી બોઝ આ ગ્રેટ ફુલ)	
તે મારી દરકાર કરતાં નથી, કંધ ફિકર નહિ He does not care for me, never mind. (હી કર નોટ કર હોર મ્યુ, નેવર માઇન્ડ)	
તમે મારી તરફ થશો ? Will you take my part ? (ઉદ્દીલ બુ ટેઇક માય પાર્ટ ?)	
હું તમારી તરફથી ઓલયો I took your part. (આંડ કું યોર પાર્ટ)	

તેઓ બધા એક મત હતા They were all unanimous.

(ધે વેર ઓલ યુનાનીમસ)

તે તમે કેવી રીતે જાણ્યું ? How did you come to know it ? (હાઉ ડિડ યુ કમ કુ નો છે !)

હું તમારી ઓટ પુરી પાડીશ I will supply your wants. (આઈ ઉદ્દીલ સેક્ષાય વોર વોન્ટ્સ)

તે હું ભારાં અસ અંતઃકરણુથી કરીશ I will do it with all my heart. (આઈ ઉદ્દીલ કુ છિટ ઉદ્દીથ એલ માય હાર્ટ)

તમારી યાદદાસ્ત જરા ઓધી છે Your memory is rather weak. (વોર મેમરી છિજ રાખર ઉદીક)

તમારી ભરજી પ્રમાણે કરનો Do as you like. (હું એજ યુ લાઇક)

તે મને થેર મળશે ? Shall I see him at home ? (શેલ આધ સી હીમ એટ હોમ ?)

તે થેર છે કે ? Is he at home ? (છિજ હી એટ હોમ ?)

તે થેર નથી He is not at home. (હી છિજ નોટ એટ હોમ)

તમારા પીતા કયારે બદાર જાય છે ? When does your father go out ? (જેણ ઇજ વોર ફાખર ગો આઉટ ?)

તે સવારે વહેલા બદાર જાય છે He goes out early in the morning. (હી ગોજ આઉટ અલ્ફી છિની ધી મોન્ડિંગ)

આપો દધાડો હું બદાર હતો I was out all day long. (આઈ ઉંડોજ આઉટ એલ લોંગ)

હું નહેલો થેર આવીશ હું will come home early, (આઈ ઉદ્દીલ કષ હોમ અલ્ફી)

તમને કોણ વખત ઠીક પડશો ? Which time will suit you best. (ઉચ્ચીય ટાઈમ ઉચ્ચીલ સુટ કુ એસેટ ?)

સાંજે મારે કામ નથી I am free in the evening. (આઈ
એમ ક્રી છન ધી ઈવિનીંગ)

આજે મને પુરસદ ભક્ષણ હોય. I shall be at leisure to-day.
(આઈ સાંસ બી એટ લીજર કુ તે)

હું તમારી ગેરહાજરીથી ઉદાસ હું I am sorry for your
absence. (આઈ એમ સારી ફોર મોર એબ્સેન્સ)

તમારી હાજરીની જરૂર છે Your attendance is required.
(યોર એટેનડન્સ ઈજ રીકવાયડ)

તેઓને તેના વગર ચાલતું નથી They could not do without
him. (એ કુડ નોટ કુ ઉચ્ચીધાઉટ હીમ)

જો મને વખત મળશો તો હું લાં કાર્હિશ I will go there if
I get time. (આઈ ઉચ્ચીલ ગો એર છાડ આઈ ગેટ ટાઈમ)

વાંચન પાઠ ત૪ મે.

રેહનું Remain (રીમેઇન)	ઉપદું Start (સ્ટાર્ટ)
કલાક Hour (અવર)	કરેલું Done (ડન)
અનુમાયેશ કરી Tried (ટ્રાઇડ)	ઇટેન પાંચો Succeeded
શુદ્ધી નથો Forgot (ફોર્ગોટ)	(સક્સીડે)
શુદ્ધ કરેલી Mistaken (મીરટેકન)	ક્રીમ Work (ઓન્કર્ડ)
કોઈ Any one (એની વન)	શુક્રવાર Friday (ફ્રાઇડે)
તેમાર માર Ready (રેડી)	નીકળું Set out (સેટ આઉટ)

સમજવું Understand (અનડર તમારી ઉપર Upon you
 સ્ટેચ) (અપોન યુ)

સારી પેડે Well (ઉવેલ)	મના કરવું Forbid (ફર્બિડ)
ભરસો રાખવો Rely, trust (રીલાય, ટ્રસ્ટ)	શક, વહેમ Doubt (ડાઉટ) આધાર રાખવો Depend (ડીપેન્ડ)

મારી લાં રહેવાની મરજ છે I wish to remain there.
 (આઈ ઓનિશ કુ રીમેઇન ધેર)

નહિ, તમે જરૂર એકદમ ઉપડી જણો No. you must start
 at once. (તા, યુ મસ્ટ સ્ટાર્ટ એટ વન્સ)

તમે એકદમ ઉપડી જવા માણો છો ? Do you want to start
 at once ? (કુ યુ ઓવોન્ટ કુ સ્ટાર્ટ એટ વન્સ)

હું એકદમ જવા માણું છું I wish to go at once. (આઈ
 ઓનિશ કુ ગો એટ વન્સ)

હું ત્રણું કલાકમાં પાછો આવાશ I shall return in three
 hours. (આઈ રોલ રીટર્ન કર્નિ થી અવર્મ)

તમે મને ઓલાવા મોકદ્યો છો ? Have you sent for me ?
 (ડેવ યુ સેન્ટ ફોર મી ?)

તે તમે પોતે કરો Do it yourself. (કુ ધટ યોરસેલ્ફ)

તમે શું કીધું છે ? What have you done ? (ઉવોટ ડેવ યુ અન ?)

મેં કાંઈ કીધું નથી I have done nothing. (આઈ ડેવ અન નથીંગ)

હવે મારે શું કરવું ? What am I to do now ? (ઉવોટ
 એમ આઈ કુ કુ નાઉ ?)

તમારે કામ કરવું જોઈએ You must work. (યુ મસ્ટ વર્ક)

तमे लां ज्वाने यतन करशो ? Will you try to go there ?

(ઉवील यु दाय दु गो धेर ?)

हुं तेमां इतेह पास्यो I succeeded in it. (आध सक्सीडे धन छट)
तमे ते करवानुं भुली गया You forgot to do it. (यु इर्गाट
दु दु धट)

तओा भारा विंगे ओले छे They speak of me. (धे स्पीक
ओइ भी).

तभारी भुक्त थह छे You are mistaken (यु आर भीस्टेकन)
हुं काम उपर जाउं छुं I go on work. (आध गो अॉन उवर्क)
अदीयां डाइ छे डे ? Is there any one here ? (धज धेर
ऐनी वन छीअर ?)

डाई नथी There is no one. (धेर धज नो वन)

ते आवता शुक्रवारे जशे He will go next Friday. (ही
उवील गो नेकस्ट राईडे)

तमे खाहेर क्यारे जशो ? When will you go out ? (उङ्हेन
उवील यु जो आउट ?)

हुं बाहिवारमां जधश I will go soon. (आध उवील गो सुन)
भारा लां ज्वानोा छरहोा छे. I intend to go there. (आध
छनटेन्ड दु गो धेर)

हुं नाहार नीक्कज्वाने तेयार छुं, तभारे केम छे ? I am ready
to set out, what about you ? (आध एम रेडी दु
सेट आउट, उव्हाट एणाउट यु ?)

तेष्णी तेने जेवा गई She went to see him. (ही उवेन्ट
दु सी हीम)

ਤੇ ਹੁੰ ਸਾਰੀ ਪੇਡੇ ਸਮਝੁੰ ਛੁੰ I understand it well. (ਆਖ
ਅ-ਡਰਸਟੇਂਡ ਘਟ ਉਵੇਦ)

ਤੇ ਤੇਨੀ ਉਪਰ ਆਖਾਰ ਰਾਜੇ ਛੇ He depends upon him.
(ਈ ਈਪੈਂਡਸ ਅਪੋਨ ਹੀਮ)

ਹੁੰ ਤੇਨਾ ਉਪਰ ਅਵਸੇਂ ਰਾਜੁੰ ਛੁੰ I rely upon him. (ਆਖ
ਰੀਲਾਇ ਅਪੋਨ ਹੀਮ)

ਤਮੇ ਤੇਨੀ ਉਪਰ ਅਵਸੇਂ ਰਾਜੇ। You may rely upon him.
(ਥੁ ਮੇ ਰੀਲਾਇ ਅਪੋਨ ਹੀਮ)

ਹੁੰ ਤਮਨੇ ਤੇ ਕਾਮ ਕਰਵਾਨੀ ਮਨਾ ਕੱਢੇ ਛੁੰ I forbid you to do
that work. (ਆਖ ਫਰਬਿਡ ਯੁ ਕੁ ਕੁ ਥੇਟ ਵਰਕ)

ਤੇ ਆਲੂਸ ਜਿਥੋ ਕੇ ? Has that man gone ? (ਹੱਤ ਥੇਟ ਮੱਨ ਗਾਨ ?)

ਤੇ ਜਤੇ ਰਖੀ ਛੇ He has gone away. (ਈ ਹੱਤ ਗਾਨ ਆਵੇ)
ਆਰੇ ਹੁੰ ਤੇਨੀ ਪਾਇਆ ਜਾਇਸ਼ Then I will follow him. (ਧੰਨ
ਆਖ ਉਚੀਲ ਟੱਲੀਆ ਹੀਮ)

ਤਮਨੇ ਤੇਮਾਂ ਵਹੇਮ ਛੇ ? Do you doubt that ? (ਕੁ ਥੁ ਅਓਟ ਮੈਟ ?)
ਮਨੇ ਤੇਮਾਂ ਸ਼ਕ ਛੇ I doubt it. (ਆਖ ਅਓਟ ਛੇ)

ਤਮਨੇ ਥਾਮੇਂ ਵਹੇਮ ਛੇ What do you doubt ? (ਉਵੇਟ ਕੁ ਥੁ
ਅਓਟ ?)

ਤੇਮਾਂ ਕਾਂਡ ਸ਼ਕ ਨਹਿ There is no doubt about it. (ਥੇਰ
ਛੁ ਨੋ ਅਓਟ ਏਥਾਓਟ ਛਟ)

ਤੇਮਾਂ ਅਵਨ ਕੰਧਾਂ ਛੇ ? Where is your jacket ? (ਵਹੇਰ ਛੁ
ਮੌਰ ਲਕੇਟ ?)



વાંચન પાઠ ૩૫ મો.

એ What (ઉવોટ)	દેખાડું Show (શો)
અલારું Love (લવ)	ઉપયોગનું Of use (ઓઝ યુસ)
ઘાડો Horse (હોર્સ)	કાબ્યા છો Have brought (હેવ બ્રોટ)
પૈસા આપ્યા Paid (પેડ)	ઓક્સો One hundred (વન . ઓન્ડેડ)
ક્રાયદો થયો Benefited (એનીશીટેડ)	તપાસે છે • Watches (ઉવોચીઝ)
ખરું True (દ્રુ)	કલાકે કલાકે Every hour (એવરી અવર)
નક્કી Sure (સ્થુઅર)	કામ કરે છે Is working (ડજ વર્કિંગ)
અંગ્રેજ English (ધર્જિશિયા)	
વાંદ્યા લેયો (Object (ઓઝન્ટેબ્લ)	

તમને શું જોઈએ છે ? What do you want ? (ડ્રોટ કુ યુ
ઉવોન્ટ ?)

મને તે જોઈએ છે I want it. (આઈ ઉવોન્ટ હટ)

મારે તેની જરૂર છે I am in want of it. (આઈ એમ ધન
ઉવોન્ટ ઓઝ હટ)

મને એ જોઈએ છે તે ભારી પાસે છે I have what I require.
(આઈ હેવ ઉવોટ આઈ રીક્વ્યુઅર)

તે તમને કામનું નથી It is of no use to you. (હટ ડક
ઓઝ નો યુસ કુ યુ)

તે તમને શું કામનું છે ? Of what use is that to you ?
(ઓઝ ઉવોટ યુસ ક્રિક ધેટ કુ યુ ?)

તે મને કામનું નથી It is of no use to me. (એ એ ઓછ
નો યુસ કુ ભી)

તે હું તમને કલે મોકલીશા I will send it to you to-morrow.
(આઈ ઉચ્ચિદ સેન્ડ ઇટ કુ યુ કુ-મારો)

તે હું તમને આજે દેખાડીએ I will show it to you to-day.
(આઈ ઉચ્ચિદ શા ઇટ કુ યુ કુ-કે)

તેને મારે હું નમારો ઉપકાર માનું છે I thank you for it.
(આઈ ધેન્ક યુ ક્રેર મટ)

તમે કોને બાળપો છો? "Whom do you love? (કુમ કુ યુ લવ?)
હું મારા પાપને બાળપું છું I like my father. (આઈ લાભક
માય ઇલ્લાખ)

મારો પાપ તે જાણે છે My father knows that. (માય
ઇલ્લાખ નોકન્ધિટ)

તમે મારો ઘોડા વાપરો છો કે? Do you use my horse?
(કુ યુ યુઝ માય હોર્સ?)

મારા ઘોડાની સંભાળ લેનો Take care of my horse. (ટેક
'કર ઓછ માય હોર્સ)

મેં તેને એક સા રૂપીઆ આપ્યા I paid him one hundred
rupees. (આઈ પેચડ હીમ વન હન્ડેડ ઇપિં)

તણે મને કહ્યું તે ખર્દ છે What he told me is true.
(છેવોટ દી ટોલ્ડન્ભી એક ટુ)

શું કરનું તે હું જાણુંનો નથી I do not know what to do.
(આઈ કુ નોટ નો ઉચ્ચોટ કુ કુ)

તે વિષે મારી ખાત્રી છે I am sure of it. (આઈ એમ શ્વયાર
એન્ડ હિટ)

મારે તે સારુ ક્યાં જગ્યા બેઠકેં ? Where should I go for it.
(ઉંહેર શુદ્ધ આઈ ગો ફોર હિટ)

તે શું કામ આવ્યો છે ? Why has he come ? (બાધ હોન
હી કમ !)

તે તને ભલવા આવ્યો છે He has come to see him. (હી
હેર કમ કુ સી હીમ)

- તે કામ કરે છે He is working. (હી ઈઝ વર્કિંગ)

મને હૃદયથી થાય છે I am benefited. (આઈ એમ બેનીરીટેડ)

તે કલાકે કલાકે નપણે છે He watches every hour. (હી
ઉંવાચાર એવરિ અવર)

તમે શું લાવ્યા છા ? What have you brought ? (ઉંવાટ
કુંબ કુ એંટ)

હું ફંચ લાવ્યો નથી I have brought nothing. (આઈ હેર
એન્ટ નથીગ)

તમે તે સમજા કે ? Did you understand it ? (હીડ કુ
અનડરસ્ટાન્ડ એર !)

હું તે સમજાતો નથી I do not understand it. (આઈ કુ નોટ
અનડરસ્ટાન્ડ એર)

મને સંખળો Listen to me. (લીસન કુ મી)

તે અંગ્રેજ સારુ બોલે છે કે ? Does he speak English
well ? (ડેઝ હી સ્પીક ઇંગ્લીશ વેલ્સ !) .

તેણે આરાયું ઉથાંકુ મુક્યું He left the door open. (હી લેઝર
હી ડોર એપન)

વાંચન પાઠ ૩૬ મે.

છેતરો Cheated (ગીરડ)	એ કરે છે Is mocking.
માનવું Believe (અલીય)	(ધ્રક મોક્કિગ)
માચું Truth (સુખ)	જ્ઞાતરી Sure (સ્થોર)
દમણ Laugh (શાક) (કામડ)	દમણ Laughed (શાકડ)
ગંતોં થાં સતિસિદ્ધ સતીસિદ્ધ	મેટાપર In face (મન ફેફા)
મસ્કરી કરે છે Is joking. (હં નંકીગ)	દમણું Laughs (શાકમ)
ખરેખરું Earnest (અર્નેસ્ટ)	દેંડ Every body (અન્દરી એડ્ડિંગ)
કરતાં Making (માદકીગ)	મસ્કરી Trifle (ટ્રાફલ્સ)
મસ્કરી I am (અત)	મસ્કરી કરે છે Is trifling (હં ટાઇટિંગ)
જાણ્યું, જોગાળ્યું Know (નો)	જાણાઈ By sight (જાણ માનાન)
ગારી હેડ Very well (હંડાવત)	જાણ Know (વીણ)
ગદસ્થ Gentleman (ગેન્ટલમન)	જુણી happy (હપ્પા)
જરસ્મા Years (રોલ)	જાણાળાળું Acquaintance (ગેન્ટલમનસા)
પેસાદાર Rich (રીય)	
બાંડા Fat (રૂટ)	

ક્ષામણે તેમને છેતરાં છે Some one has cheated you. (મન વન હેડ ગીરડ યુ)

તમે તે માનો છો ? Do you believe it ? (હં અલીય હે ?)
તે માનતા ના Don't believe it. (ઓન્ટ અલીય નહી)

લંઘું કે સંચું તે માનતા ના Do not believe what he
said. (હં નોટ અલીય લંઘાડ હી સેધડ)

ਹੁ ਤੇ ਨਥੀ ਮਾਨਤੇ I do not believe it. (ਆਏ ਹੁ ਨੋਟ
ਅੀਲੀਵ ਛਟ)

ਮੈਂ ਤੇ ਮਾਨਯੁਂ ਨਹਿ I did not believe it. (ਆਏ ਹੀਡ ਨੋਟ
ਅੀਲੀਵ ਛਟ)

ਹੁ ਤਮਾਈ ਮਾਨੁ ਛੁ I believe you. (ਆਏ ਅੀਲੀਵ ਹੁ)
ਤੇ ਸਾਚੁ ਛੇ It is the truth. (ਮਟ ਮਿਤੀ ਅੀ ਦੂਥ)

ਮਨੇ ਨੇਨੀ ਆਤਰੀ ਛੇ I am'sure of it. (ਆਏ ਏਮ ਸ਼ਹੁਅਰ
ਓਇ ਛਟ)

ਤਮਨੇ ਨੇ ਕਿਧੇ ਆਤਰੀ ਛੇ ? Are you 'sure of it ? (ਆਰ ਹੁ
ਸ਼ਹੁਅਰ ਓਇ ਛਟ :)

ਤਮਨੇ ਬੰਤੋਧ ਛੇ ਤੇ ਨਹਿ ? Are you satisfied or not ?
(ਆਰ ਹੁ ਜੱਗੀਸ਼ਕਾਹਿ ਆਰ ਨੋਟ :)

ਨੇ ਮਥਕਰੀ ਕੇਂਦੇ He is joking. (ਵੀ ਮਿਤੀ ਜੋਕਿਂਗ)

ਤਮੇ ਮਥਕਰੀ ਕੇਂਦੇ ਛੋ You are joking (ਹੁ ਆਰ ਜੋਕਿਂਗ)

ਪਰਮੇਖਰਨੀ ਆਨਰ For God's sake. (ਫਾਰ ਗੋਡਾਂ ਸੇਈ)

ਮਾਝੀ ਮਥਕਰੀ ਨਾ ਕੇਂਦੀ। Don't trifle with me. (ਡੋਟ ਟ੍ਰਾਈਵ
ਉਨੀਥ ਮੀ)

ਹੁ ਨੇਨੀ ਸਾਥੇ ਮਥਕਰੀ ਨਥੀ ਕੁਝਤੇ। I am not trifling with
him. (ਆਏ ਏਮ ਨੋਟ ਟ੍ਰਾਈਵਿੰਗ ਉਨੀਥ ਵੀਮ)

ਹੁ ਨੇਗਾ ਤਰ੍ਹਾਂ ਦੱਸੁ ਛੁ I laugh at it. (ਆਏ ਸਾਇ ਏਂਟ ਛਟ)
ਤਮੇ ਨੇਪਰ ਦੱਸੋ ਛੋ ? Do you laugh at it ? (ਤੁ ਹੁ ਸਾਇ
ਏਂਟ ਛਟ ?)

ਕੋਝੇ ਥਾ ਪਰ ਦੱਸੇ ਛੇ ? What do they laugh at ? (ਕੁਝੇ
ਹੁ ਥੇ ਲਾਇ ਏਂਟ ?)

અમે તેના ગામું હયા We laughed in his face (ઉચ્ચિ
લાક્ષ મન ઉન કેટસ)

તમે અમને હરયા ? Did you laugh at us ? (હિં ય
લાક્ષ એટ અસ ?)

અમે તમને નથી હયા We have not laughed at you.
(ઉચ્ચિ રોંગ નાટ લાક્ષ એટ યુ,)

અમે કદી તમને હસતા નથી We never laugh at you.
(ઉચ્ચિ નેવર લાક એટ યુ)

તે દરેક જણું તરું હયું He laughs at every-body.
(દી લાક્ષન એટ એવરી જાડી)

દું તમારી માઝરી કંનો હંતો I was making a fun of you.
(આં ઉંડાર નેરીગ આ કન એાઉ યુ)

તમે તે માખુગને આગામાંથી છાડો ? Do you know that man ?
(કુ યુ નો ઘટ ગંત ?)

હા, હું એનું આગામું છુ યુ I know him. .(ધસ, આઈ
નો હીમ)

તમે તે બાયરીને આગામાંથી છાડો ? Do you know that woman ?
(કુ યુ નો ઘટ ગુમન ?)

હું તેને ભારી રીતનું આગામું છુ I know her by sight. (આઈ
નો હુ ધાર સાફાર)

હું તેને ભારી રીતનું આગામું છુ I know him very well.
(આઈ નો હીમ વેરી ઉંડેલ)

તમને હેઠાં સારો આગામુંથી છો ? Are you acquainted with
him ? (આર યુ એહેલેનટેડ ઉચ્ચિ હીમ ?)

અને તેની સાથે ઓળખાયું નથી I am not acquainted with him. (આપું એમ નોટ એકવેનટેડ ઉચ્ચીથ હીમ)

આ ગૃહસ્થ હોયું છે ? Who is this gentleman ? (કુ મજબુત ધીમ જેન્ટલમેન ?)

અમે તમને ઓળખતાનથી We do not know you. (કું નોટ નો નુ)

તમે અદિયાં ડેને ઓળખો છો ? Who do you know here ? (હુમ કુ નુ તો વીગર ?)

તમે મીસ્ટર એલ. ને ઓળખો છો ? Do you know Mr. L ? (કુ નો મીસ્ટર એલ)

એ સાહેણ, કુ તેને ઓળખાયું છું Yes sir I knew him. (ગસ્સ સર, આપનો હીમ)

ઘણાં વરસુ થયાં કુ તેને ઓળખાયું છું I know him for many years. (આપનો હીમ કોર મંત્રી છાયર્મ)

તે ભાજું ડેવો પેભાહાર છે ? How rich is that man ? (દાઉ રીચ મજ વેટ મેન ?)

તેમો ડેટલા અધા સુપી છે ? How happy they are ? (દાઉ દે આર ?)

તમે એક રાજની માઝક રહો છો You live like a king. (યુ લીલ લાઇંક આ કીંગ)

આ બાયડી અહુજ લડી છે This woman is very fat. (ધીમ વુમન મજ દરી હું)

તે ઓડી ધારી છે That girl is wise. (પૈટ ગર્દ મજ ઉવાઈઝ)

વાચન પાઠ ૩૭ મે.

નક્કી Positively (પોક્કીડીવકી)	રજી આપવી Permit (પરમીટ)
હિતાબળ Haste (હેસ્ટ)	અડ્વારીનું Week (ઉલ્લિક)
લાં Thither (ધીધર)	આરી પર્દાંથું Arrive (અર્વાઈવ)
અગસ્ત્ય, જરૂર Need (નીડ)	કારણું કે Because (થીડું)
મદદ Help (હેલ્પ)	મારું Mine (માટેન)
ભીત્ર Friend (ફ્રેન્ડ)	અલ્લો Else (અંતસ)
મુક્કણું Put (પુટ)	દેમેશાં Always (આલવિંગ)
ના પાડવું Refuse (પાડકુર)	વધારે સાર્વી Better (નેટર)
ખુશીથી Willingly (વાકીંગલી)	ગરીબ Poor (પુઅર)
વક્તીલ Solicitor (સૉલિસિટર)	કુન્ઝા, વક્તાનાં ઘરાક Client
હાજર Present (પ્રેસન્ટ)	(કલાયન્ટ)
દંડ થંબા To be fined (દુ એ ફાઇન્ડ)	થંબું Become (બીકામ)

એને તમે કહો તો હું જાઓ If you tell me I will go. (એક
શુ રેખ માં આઈ ઉંબાં બંા)

હું જલદી પાંછા આવાયા I will return soon. (આઈ વીલ
રીટર્ન સુન)

તમે ક્યાં જવા માગો છો ! Where do you wish to go?
(વંદેર હું શુ ઉવીયા કુ ગો ?)

મારે કંઈ જાનું છે I wish to go somewhere. (આઈ ઉંબાં
કુ ગો સમ હુંડેર)

હું કંઈ જવા માંગતો નથી I do not wish to go any-
where. (આઈ હુ મોટ ઉંબાં કુ ગો એનીહિંડેર)

અમે કાલે ગણશું We will go to-morrow. (ઉવી ઉવીલ
ગો ગુ-મોરો) *

હું નહિ આનું I will not come. (નાખ ઉવીલ નોટ કમ)

તમે લાં કયારે જાઓ જાં ? When do you go there ?
(ઉંહેન કુ હુ જો ધર ?)

હું લા રોજ સવારમા ગણશું I go there every morning.
(આમ જો દીર જાવરી ગાનીન) .

તે રોજ સવારે આવે છે He comes every morning. (હી
કમસ જાવરી માનિએ)

ના હુ પોણ ખચિત જાઈશા I myself will positively go
there. (આમ જ્ઞાપસેલ્લ ઉવીલ પારીયદી જો ધર)

હું તેમને જગાની રજ આપુછું I permit you to go. (આઈ
પરમીટ હુ કુ જો)

ઉનાનળ કરું અને જલદી પાછ આવા Make haste and
come back soon. (મેઠક હુસ્ટ એન્ડ કમ ઐક સુન)

હું લાં જાછ શકતો નથી I can not go thither. (આઈ ફેન
નોટ જો ધાધર)

હું એ આડવાડિયામાં આવીશા I will come in tow weeks.
(આઈ ઉવીલ કમ ઈન હુ ઉવીએસ)

હું એક આડવાડિયામાં આવી પહોંચીશા I will arrive in a
week. (આઈ ઉવીલ એરાઈન ઈન આ ઉવીડ)

મારે જગાની અગલ નથી There is no need of my going.
(ધેણ ઈન નો નીડ જોડી માય જોઈએ)

ते भाष्युस था भाटे नारी गयो ? Why did that man run away ? (बद्याय डीड घेट मेन रनै अवे ?)

ते नारी गयो कारणु के ते भीघो He ran away because he was afraid. (ही रेन अवे भीड़ोज ली उर्वोज आरेड) ज्यारे ते त्यां दतो लारे हुं त्यां नहोतो I was not there when he was there. (आमु उर्वोज नोट दिर उब्हेत ही उर्वोज धेर)

नमे तेने भद्द करेश ? Will you help him ? (उर्वीव यु लेह्य लीभ ?)

हुं तमने भद्द करीश I will help you. (आध उर्वीव लेह्य यु) आ मने आपो Give this to me. (गीव धीभ दु भी) आ भाइ नथी This is not mine. (धीभ धूक्त नोट भाइन) भारा भीतनुं के It is My friend's. (एक भज भाय केन्द्र) भारी पासे धीन्हुं नथी I have nothing else. (आमु हेव नथीग गोल्म)

ने लध जाओ Take it away. (टेह्क छट अवे)

ते हुं क्यां झुक्त ? Where shall I put it ? (किंवर शंख आइ पुट धट ?)

ते तेने आपो Give it to him. (गीव छट हु लीभ)

आ चोपडी, तेज्जीने आपो Give her this book. (गीव दर धीस शुक)

तमेन्हमेसां एम कहो ओ You always say so. (यु चॉलवेज से सो)

મેં કહી ના નથી પાડી I have never refused. (આજ હેવ
નેવર રીક્યુન્ડ)

તમે એને પુછી જુઓ તો હીક You had better ask him.
(યુ હેડ અટર આસક હીમ)

તમે લાં આવશો કે ? Will you come there ? (ઉતીલા યુ
કમ ઘેર ?)

ધર્મની ખુશાથી પણ ક્યારે ? Very willingly, but when ?
(વેરી વીલીંગલી, બટ ઉંડેન ?)

આ માણુસ ગરીબ છે ! Is this man poor ? (હજ ધીસ
મેન પ્રાર ?)

હું ધોરા દિલગીર હું I am very sorry. (આજ એમ વેરી સારી)
દિલગીર થના નહિ Don't be sorry. (ડાન્ટ બી મારી)

તમારે વકીલ કોણ છે ? Who is your solicitor ? (હું એજ
ગેર સોલિસિટર ?)

તમારે ધરાક લાગ્ય છે ? Is your client present ? (હજ
ગેર કલાયન્ટ પ્રેસ્ન્ટ ?)

તેનું શું થયું ? What became of him ? (ઉંડાટ વીક્ષણમ
ઓફ હીમ ?)

તેનો દસ રૂપીઓ દંડ થયો He was fined ten rupees.
(ડી ઉંડાઝ રૂધન્ડ ટેન રૂપિઝ)

તેને જમીન ઉપર છોડવામાં આવ્યો ! He was bailed. (ડી
ઉંડાઝ એલડ)

વાંચન પાડ તર મો.

નેથું, નેમેલું Seen (સીન)	દરેક જણુ Every body (અંગરી બોડી)
સુખના, ચેતવણી Hint (હિન્)	
વિષે About (એભાઉટ)	પેસા Money (મની)
ઝાડી થયો Waited (હિવેટ)	લીધા છે Taken (ટેકન)
બજાર Market (મારકેટ)	રૂંડ છે Crying (ક્રાઇંગ)
શુસ્તે Angry (અનન્દી),	કંઈ કોઈ Something (સમયીંગ)
કામ Task (ટાસ્ક)	ખાવાને To eat (કુ રહ્યા)
એવો, એવી, એવું Such (સાચ)	દેનું Owe (ઓએ)
પૂરું કરવું Finish (શીનીસા)	બોલું Word (ઓર્ડ)
દ્વારા આપવો Blame (બલામ)	નસીબવાનાં Fortunate (ફોર્ટચુન્ટ)
લખું છું Am writing (એમ રાઈટિંગ)	તપાસ કરવી Inquire (ઇન્ક્વયર)
ભાઈ Brother (બ્રથ)	ફરીથી Again (અંગેઠન)
	સિવાય, વિના Without (જવાધાઉટ)

તેને ધાણું કામ કરવાનું હતું He had much work to do.
(હી હુડ મચ ઓર્ક કુ કુ)

તે હું કેમ જાણું ? How can I know it ? (દાઉ કન આઈ
નો રહ ?)

તમે તેનું ઘર નેથું છે ? Have you seen his house ? (હેવ
કુ સીન હીલ હાઉસ ?)

તે વિષે તેને સુખના ચ્છપણે Give him a hint about it.
(ગીવ હીમ આ હીન્ટ એભાઉટ રહ)

બરમાં ડોછ હતું નહિ There was none in the house.

(ધેર ઉવોડ નન ધન ધી હાઉસ)

કું તમારે સારુ એક કલાક ખાડી થયા I waited for you an hour. (આઈ ઉંવટેડ ફૂર યુ અન અવર)

તે બજારમા ગયો હતો He had gone to the market.
(હી ડેડ નાન દુ ધી મારકેટ)

તમે ત્યા કેટલે વાગતે આવ્યા હતા ? At what time did you come there ? (એટ ઉવોટ ટાઈમ રીડ યુ કમ ધેર ?)

આજ સવારે સાત વાગતે To day at 7 A. M. (દુ રી એટ સવન એ. એમ.)

તે ધંધું ગુસ્સે થયો He became very angry. (હી બીકેધમ વરી અનથી)

તે તમારી સાથે શુસ્તં છે He is angry with you. (હી છી અનથી ઉત્તાથ યુ)

દરેક જાણ તે જાણું છે Everybody knows that. (એવાં જાડી નોઝ હેઠ)

મારા પૈસા ક્યાં છે ? Where is my money ? (ઉંહેર છક માય મની ?)

તમે તમારા પૈસા લીધા છે ? Have you taken your money ?
(હેવ યુ ટેકન મોર મની ?)

લેણી થા સારુ રડે છે ? What is she crying for ? (લેણે ધક્કા રી ક્રાઇંગ ફૂરે ?)

તે માણુસ ભુખ્યો છે ? Is the man hungry ? (ઇજ ધી મેન દંગ્રો ?)

તને થોડું ખાવાનું આપો Give him something to eat.
(ગીવ લીમ સમથીંગ કુ છટ)

તે થોડા પૈસા માગે છે He asks for some money. (હી આર્ડેસ કોર સમ મની)

મારે તેનું ચું હંવું છે ? What do I owe him ? (ઉવ્યાટ કુ આઈ ઓ લીમ ?)

સામયાર સુધી થાંબો Wait till Monday. (ઉવેમટ લીવ મનડે)

તે પોતાના એકસન્ન માણુસ છે He is a man of his word.
(હી ઇજ આ મેન એક લીજ ઉવડ)

તમે નસ્તિયાન છો You are fortunate. (યુ આર ફેરચ્યુનેટ)

કું મારા ભાઈને કાગળ લખું છું I am writing a letter to
my brother. (આઈ એમ રાષ્ટ્રિંગ આ લેટર કુ માય અધર)

તે એક નીમહલદાલ માણુસ છે He is a faithful man.
(હી ઇજ આ હેથહુલ મેન)

મેં એવો માણુસ કહી જોયો નથી I never saw such a man
before. (આઈ નેવર સો સચ આ મેન ભીફોર)

તમને કંઈ કામ કરવાનું નથી ? Have you nothing to do ?
(હેવ યુ નથીંગ કુ કુ ?)

તમે તમારું કામ કર્યાં કે ? Have you done your task ?
(હેવ યુ અન ચોર ટાઈક)

તમેને કયારે પુરું કરશો ? When will you finish it ?
(ઉંહેન ઉવીલ યુ શીનીશ છટ ?)

તમે તેને ચું કામ ડપેંડ આપો છો ? Why do you blame him ? (ઉચાય કુ યુ બ્લેમ હીમ ?)

હું તમારી ઉપર લક્ષેત્રો રાખું છું I rely upon you. (આઈ રીલાય અપોન યુ)

તે હું ધર્થી ઘુણીથી કરીશ I shall do it very willingly. (આઈ જેલ કુ નટ કેરી વીલીગલી)

જઈને તેની તપામ કરો (કુ and inquire about it. (ગો એવા ધનકવાયર એયાઉટ નટ))

તમે ને વિષે તપામ કરેશ ? Will you inquire about it ? (ઉચીલ કુ ધનકવાયર એયાઉટ નટ !)

હા, ને વિષે હું તપામ કરીશ Yes, I will inquire about it. (યન, આદ ઉચીલ ધનકવાયર એયાઉટ નટ)

હું તમારા વગર લાં જાસ નહિ I will not go there without you. (આઈ કુ હાત ગો ધર ઉચીધાઉટ યુ)

વાંચન પાઠ ૩૮ મા.

અય વગરની nonsense (નોનસેન્સ) એકમત થતું Agree (અંગ્રી)

કામ Business (બિજનેસ) યાદ રાખતું Remember

હિંચનું સમજતું Humbug (ફાયગ) (રૂમેઝાર)

પુરતું Enough (ધનાદ) ખરીદતું Buy (બાય)

દરેકને Every one (એવરી વન) લાઢી Stick (સ્ટીક) •

આનતું Believe (ભીલીવ) દાઢા પાઠ Days (ડેઝ)

ઉદ્ધું વાળયું Upset (અપસેટ)	પછવાડે આવતાં Following
કાંઈ Affairs (અંકસર્ય)	(ફાલોઈંગ)
પગે On foot (એન ફુટ)	જાણ્યાવવું Inform (ઇન્ફોર્મ)
ગાડી Carriage (ટેરેજ)	મેસેજ Message (મેસેજ)
થોડાવાળો Coachman (કોચમેન)	મેહેનત Trouble (ટ્રબ્લેન્સ)
આવી પહોંચયું Arrive (એચાઈવ)	મોટું Great (ગ્રેટ)
મેહેરાની Favour (ફ્લેવર)	દાખા Kindness (કાઈન્ડનેચર)
ખાનત Matter (મેટર)	ગેરકાજર Absent (ગેઅસન્ટ)

તમે વંદેશા આવો છો કે નહિં ? Are you coming early or not ? (આર યુ કમીગ અલ્લી એઓ નોટ ?)

તે કામપર આવ્યો છે He has come on business. (તી હેડ કમ એન બીજનેસ)

તમે કેવી અર્થ વગરની વાત કરો છો ? What nonsense you talk ? (ઉંઘાટ નોનન્સ યુ ટોક)

તમે મને ઉદ્ધુચ્યું સમજાવો છો You humbug me. (યુ દાયાગ મી)
તે જે કહે છે તે હું માનતો નથી I don't believe in what he says. (આર્ડ ડેન્ટ બીલીન મની ઉંઘાટ હી સેઝ)

તમે તેનું બધું ઉદ્ધું વાખ્યું છે You have upset all his affairs. (યુ ટેન અપસેટ એઓ લીજ અફેર્સ)

તેઓએ શું કહ્યું ? What did they say ? (ઉંઘાટ ડીડ પે સેટ)
તેઓએ કાંઈ કહ્યું નહિં They said nothing. (પે સેમન નથીગ)

હું તને આ મોકલીયા I will send this to him. (આઈ
દુલીલ સેન્ડ ધીસ હું કીએ)

तभे तेने ते क्यारे भोक्खरो ? When will you send it to him ?

(ઉંહેન ઉવીલ યુ સેન્ડ છટ કુ હીમ ?)

હું तेने ते कાલે ગોક્કલીય I will send it to him to-morrow.

(આએ ઉવીલ સેન્ડ કર્ટ કુ હીમ દુમોરો)

હું બજારમાં જાઉ છું I am going to the market. (આએ
એમ ગોઈંગ કુ ધી માર્કેટ)

તेनે સારુ એક લાકડી લાવજો Buy a stick for him. (આએ
આ સ્ટીક ફોર હીમ)

તેની પાંસ પુરતા પેસા નથી He has not enough money.

(હી ટંક નોટ ધનાંડ અની)

મેં નંન થાડા હથાડા ઉપર જોયા હતો I saw him somedays
ago. (આએ સા હીમ સમ ડેઝ એગો)

કાલે તમે ત્યાં જણો કે ? Will you go there to morrow ?

(ઉવીલ યુ જો ધિર દુમોરો ?)

તેણો ક્યાં છે ? Where are they ? (ઉંહેર આર ધે ?)

તેણો આપણી પછવાડે ચાલતા હતા They were following
us. (વે ઉંહેર દ્રોલોઈંગ અસ)

હું તેની સાથે આવ્યો છું I have come with him. (આએ
એન કમ ઉવીલ હીમ)

તમે ગાડીમાં આવ્યા કે ? Did you come in the carriage ?

(હીડ યુ કમ ધાન ધી ટરિલ)

નાહિ. હું ચાલતો આવ્યો No, I came on foot. (નો, આએ
કેશમ ઓન પુટ)

તમारा थोड़ावाको क्या है ? Where is your coachman ?

(उँहेर छँज यार डॉयमेन !)

गाड़ी आनी है के ? Has the carriage arrived ? (दंड धी
कुरेज एराइड !)

गाड़ी हजु आनी नथी, साहेब. The carriage has not yet
arrived, sir. (धी कुरेज दंड नॉट पट अराइड, सर)

मारा उपर एटली मेहरधानी करा Do me this favour.
(कु भी धीस इवर)

मारी ने करवानी भरण नथी I do not wish to do it.
(आए कु नॉट उवीश कु कु छट)

तमारी भरण आइक करा Do as you like. (कु अज यु लाइक)
हुं तेनी साथे अंकभत थांना नथी I do not agree with him.
(आए कु नॉट अंग्री उवीथ टीम)

हुं तमारी साथे अंकभत थाउ छु I agree with you. (आए
अंग्री उवीथ यु)

ने विषे भने जखावने Inform me of it. (बन्हार्म भी आइ इट)
हुं तेमने जखावीश I will let them know. (आए वील
दृट वेम नो)

हुं तमने शंदरो भोक्लीश I will send you a message.
(आए उवील बैन्ड यु आ मैसेज)

तेशु भने धाणी हेरानश्चति आप्ही He gave me much trouble.
(दी गेधव भी भय दूषक)

તમે મારા ઉપર મોડી હથ કરી You did me a great kindness. (યુ હીડ મી આ શૈટ કાઈન્ડનેસ)

હુ દસ દીવસ ઉપર જેરાજાજર હનો I was absent ten days ago. (આઈ ઉવોઝ એબસન્ડ ટેન ડેઝ અગો)

એમ કહેણું તે અર્થ વગરનું છે It is nonsense to say so.
(છટ ધક નોનસન્સ હુ સે સો)

વાચન પાઠ ૪૦ મો.

ભાડે કરવી Hire (હાયર)	વિચાર કરવો Think over
સાફ આડ્યુસ્ટે અડ્યાએસ)	(થી-ક એવર)
ખાનગી Private (પ્રાઇવેટ)	કંઈ Something (સમયીંગ)
ચદ્ર Moon (મુન)	જઘડો Heavily (હંનીલી)
ઉચાડું Open (ઓપન)	દાદ Cold (ડેલ્ડ)
ખારી Window (ઉથી-નો)	ગઈકાલે Yesterday (પસ્ટરડે)
પવનવાળું Windy (ઉથી-ડી)	ખંખું કરતું Shut (શાટ)
લાગતું Feel (શીલ)	તાળું ઢેલું Lock (લોક)
તોષાન Storm (સ્ટોર્મ)	દરવાનો, બારણું Door (ડોર)
વરસાદ વરસે છે Rains (રેઇન્સ)	વધારે લાંબું Longer (લોન્ગર)
વરસાદ પડે છે Is raining (ધક રેઇનિંગ)	દવા, ભાગ Weather (વેથર)
અનો Umbrella (અમૃદ્દલા)	સારી Fine (ફાઈન)
	ગરમી Warm (ઉવોઅમ)

આદો આપણે ગાડીઓ જઈએ Let us go in a carriage.
(હંડ અસ ગો ધન આ કરેજ)

એક ગાડી જલ્દી મંગવો Send for a carriage soon.

(ગંઠ કોર આ કરેજ સન)

હું એક ગાડી ભાડે કરવા માગું છુ I wish to hire one carriage. (આઈ ઉભીથ કુ હાયર વળ રેઝ)

તમે અદીઓં થ કામ આવ્યા છો ? Why have you come here ? (હાય એવ યુ કમ દીઓર)

તમારે મને કામ કહેન છે ? Have you anything to tell me ? (ચાન , મેરીઓંગ કુ કહ તી ?)

તમે ગાડી માટે વળ કરવા માગો રહો ? Do you wish to talk with me ? (ચાન , કરો કુ કરો (ન હી ?)

હ કુ તમનું કરો માંગ કુ Yes, I wish to tell you something. (હાય કરો કરો , કરો કલમથોળ)

તે ખાનગી કુ હું privity (હાય પ્રવિદ્ય)

તમારી સવાલ શ ? What is your advice ? (હાય કુ રેઝ કોણાં સે)

તમે તે વિષે કા ધ્યાન રહો ? What do you think about it ? (હાય , કા ધ્યાન રહો રહો)

તમારે થં કરત રહો ? What have you to do ? (હાય કરત રહો કરત ?)

કુ કંઈ કરી મળતો નહીં I can do nothing. (હાય કંઈ નહીંબાં)

કુ કુરસુ તો કુ જાણતો નહીં I do not know what to do. (આઈ કુ જોણ તો ઉંબાટ કુ કુ)

• तमे ते विषे विचार करने You think over it. (यु थीक
ओपर छट)

हूं भाँड़ छुं के ओभ करवूं हीक पढ़ो I think it best to do.
(आम थीक छट अस्ट कु कु)

आर्हा उचांडा Open the window. (ओपन भी उचीन्डा)

एव्हा उचाडी राण्या Keep it always open. (क्रीप छे
ओलजिवेन ओपन)

“आराम् ओकदम् एक्स करो ! Shut the door at once !
(शट भी होर ओट वन्स :)

तो आराम् एक्स करो ! Did you shut the door ?
(दीः क्य शट भी होर !)

आराम्हाते ताल् दो Lock the door. (लॉक फी दोर)

दिनों लांगा अना जाय हूं The days are becoming
longer. (भी तेक चार एकमीग दैगर)

आर्हे अठु करी है ? How is the weather to day ?
(एउ एक बी उत्तेग कु है ?)

आर्हे नस्ती It is not fine. (नह फी नोर दास्तन)

आर्हे एक्स अम्ही है It is very warm to day. (एक एक
करी दार्म कु है)

आर्हे धष्टी टाट हरी It was very cold yesterday. (ए
डॉक्स वरी ट्रेक्स यस्टरडे)

आर्हे धण्डा खन्न एक्स है It is windy to-day. (एक्स एक
उचीन्डी कु है)

આજે ધારી હડી છે It is very cold to day. (એ છાજ
વરી ડાક્ક કુંદ)

તમને હડી લગે છે ? Do you feel cold ? (એ કુંદ કોઈ)
તે કેવું માંદું તેણાન છે ! What a great storm it is !
(ઉપાટ આ ગ્રેટ સ્ટોમ કાટ છીએ !)

વરસાદ આવે છે It rains. (એ રેનસ)

શું વરસાદ આવે છે Is it raining ? (એ એ રેનિંગ ?)

ઉગ્રી ઉગડો Open the umbrella. (આપન વી અમણીકા)
જરૂરો વરસાદ આવે છે It rains very heavily. (એ રેનસ
વરી હંડીલી)

આંથા આપણે તાં ઉભા રહ્યાંને Let us stop there. (એ
અસ સ્ટોપ ફિર)

હા, આદો Yes, go on. (ધન જો આન)

વરસાદ જલદી રહ્યી જશે The rain will soon stop. (ધી
રેન ઉવીલ સુન રોપ)

ચંદ કરતાં સર્વ મંદો છે The Sun is larger than the
Moon. (ધી સન છજ લાંજ ધન ધી સુન)

વાંચન પાઠ ૪૨ મા.

પાંસ છે Has, have (હસ)

ખવરાવવું Feed (ફાડ)

પગો Feet (ફેટ)

માથું Head (હેડ)

પણો Fell (ફેલ)

માણસ—આદમી Fellow (ફેલો)

અંતઃકરણું Heart (હાર્ટ)

લાગ્યું Felt (ફેલ્ટ)

स्वर्ग Heaven (हेवन)

वाड Hedge (हेज)

हजारु Heel (हील)

पकड़ी लाइंग Held (हेल)

मद्दत Help (हेप)

पूर्फन Jacket (जैकेट)

गधीरु Fear (फ्रिअर)

अलेक्झांडर तेना संकटो मोक्षमां भोटो। पुरुष हनो। Alexander was the greatest man of his century. [अलेक्झांडर दौज धी ग्रेटर मेन एक्स हीज सेंचुरी]

आ चोड़ि कलाकमा ६ आचल तेजो This horse ran six miles in an hour. (धीभ डोर्म रेन सीक्स आचल्स हनि एन अवर)

महान् पुरुषोंने पुरुल ने भोटोने मान आयो। Worship the great men and respect the elders. (वरशीप धी श्रद्ध मेन एन्ड रिस्पेक्ट धी एंड अस्ट)

मैं सांझे पृष्ठल खाराक लीधो। I took enough food in the evening. (आच कुक धनह ५५ हनि धी इवनिंग)

ते भने यक्षीस तरिके आयो Give me that as a present. (ग्रीष भी धर्ट एंज आ प्रेसेंट)

स्त्रीओनां हृदय डामण होय छे The hearts of women are tender. (धी हार्टस एक्स उमिमेन आर टेंडर)

तमाङ्ग रामायण क्यां छे? Where is your Ramayana? (वहेह ईज यार रामायण ?

थिए Few (हयु)

फेलर Field (फील्ड)

घातकी Fierce (रीचर्स)

सेंकें Century (सेंचुरी)

टेंडर Tender (टेंडर)

मां, थर्नो Through (थ्रु)

पुरुलीयुं Puppy (पपी)

તે છોકરો ખેતરમાં થઈને બગીયામા સોડી ગયો The boy ran away through the field into the garden. (ધી બોધ રેન આવે વુ થ શીદુ છાંડુ ધી ગાડો)

૧. કારણ નામ ગવણુ એ. The name of the giant was Kavan. (ધી નામ આંડ ધી ગવણ રોજ નાણુ)

તે તાઢાની છોકરાનુ નામ ગાંડો પાડુ એ. The naughty boy was named the ass. (ધી નાડી હ્ય હાડ નાંડ ધી અસ)



નાંદા પાડ ર મા.

દિપી Hill (હિલ)	ઉલાં Open (નોચન)
પોતાની મેળી Himalaya (હિમાયા)	ફુકમ, નિગમ Order (શા-ક)
સાથર Deer (સાથર)	અલગ Other (અધર)
જાડાનુ Hold (ઝાંડ)	પુરુ Over (નાચન)
કાંચુ Hole (દુલા)	નોડ Pair (પર)
રાજ King (કીંગ)	મહલ Palace (પલેસ)
વાયુ Knife (નાંડ)	શીફો Pale (પેઝ)
જાણું Know (જાણ)	કાપળ Paper (પેપર)
લી Lady (લિડી)	વખાણું, વખાણું Praise (પ્રેચ)
મુકાંદી Laid (લાઇ)	વિનાતી કરવી Pray (પ્રૈ)
દેશ, દૃષ્ટીન Land (લાંડ)	દાજર Present (પ્રેજન્ટ)
સુંદર, નાયુક Pretty (પ્રેટી)	માર્ભસ Marble (માર્ભસ)

શિકાર Prey (૩)	ગાજુકમાર Prince (પ્રિન્સ)	
નિગરી કરી, Mark (મા)	ડેરી Prison : (પ્રિઝન)	
પગારૂદો Married (મર્ગ્યા)	બૃન્દ બાગારૂ બચન Promise ગારુ મહેતાજ માર્ગ્યા (મા રૂ)	(પ્રામીસ)
મગડ + Proud (પ્રાઉડ)	ટુલાણી Match (મળ)	
ખાચી Pull (પુલ)	ઘેરા ન હા (મા'ન)	
* રૂચ Rop (રૂચ)	ચુલ્લા માણા ન હા (અનિ)	
ગુપ્ત્રાણુષ્ઠ્રો Rose (રૂષ)	માન્ય • Migrat (મીટ)	
અભિયાદુષ્ઠ્રો Rough (રૂધ)	સંપૂર્ણ • Protect (પ્રેરણ)	
ગૂરુ Round (રૂંડ)	સ્વફ્ટ Liberty (લીન્ડી)	
નુરૂચાનકારુષ્ઠ્રો Injunction (નિર્દેશનથ્ય)	નિર્ધાર, Rule (સ્ક્રા)	
માન + Milk (મા ન)	ને રૂચ જાણુષ્ઠ્રો Leave (લીફ)	
* Milk (મિલ્ક)	પા ન હા (ના) (શી ન)	
* માન વાયુ મિન્ડ Mind (માન-ન)	ના'ન લાંઘની Length ('લાંઘ)	
* માન Mine (માન)	પાન લાંઘની (લાંસન)	
પ્રાપ્તા Proper (પ્રાપ્તા)	પડીએલ જુદુ બાંધનુષ્ઠ્રો Lie (લી)	
નાખુષ્ઠ્રો Cock (કુદ)	માનતુષ્ઠ્રો Cimat (નિટ)	
ખુલ્લા Book, corner (નુદુ, કોર્ન્ફે)	ના મારુ Why (યાય)	
આનુષ્ઠ્રો Come (કુન)	દીન સાન Saw (સા)	
દીનુષ્ઠ્રો Took (કુનુ)	નાથી આપો Get (ગેટ)	
નુદુ Look (નુદુ)	મંતુષ્ઠ્રો તોની થાય છું I am hot * (બાઈ ર્ન્યમ હાટુ)	
ખગડો Rook (રૂક)	સુદુ Nice (નાઇસ)	

કહ્યુ Said (સેઈડ)	એકા, માત્ર Only (ઓનલી)
તમારું Your (યાર)	ઉત્તસપણું Sadly (સેંડલી)
બસવું Rush (રશ)	લટક્યું Hung (હંગ)
જીંગરી Life (લાઘડ)	ખાણું Meal (મીલ)
આનંદી Merry (મેરી)	ઉદ્ધર Mice (માંદિ)
શાખવું Learn (લન)	વચ્ચું Middle (મીડિયલ)
વિદ્યાનું Learned (લર્નેડ)	

તે આખર ટેકરી ઉપર ટોડ્યું The deer ran up the hill
 (ધી હીઅર રેન અપ ધી હીલ)

અમારી પાસે એક ચાપુ છે We have a knife. (વી ટે
 એ નાઈફી)

લાં બણ્યા આરસના પથરો હતા There were many marbles.
 (ધેર વેર મેની માર્బલ્સ)

મારા શેડ આ બદરીને પરણ્યા છે My master has married
 this lady. (માય માસ્ટર ડેડ એરિડ ધીસ લેડી)

તમે કયારે તમાર ખાણું ખાશો ? When will you take
 your meals ? (નહેન વીલ ચુ ટેક વેર મીલ્સ ?)

માંસ ચોરાક તરિકે હેરાન કર્તાં હોય છે Flesh is injurious
 as food. (ઇલેશ છજ કંજૂરીયસ એઝ કુડ)

તે મહેલ સર્વેને ખુલ્લો છે પણ ભાગ નથી The palace is
 open to all but not the garden. (ધી પેલેન છજ
 એપન કુ એંગ પટ નોંઠ ધી ગાડાન)

હું કિન્તિ કરે છું કે મને ડેટલાઈ કાગળ આપો। Pray, have me some papers. (ત્રૈ, દ્વાબ મી અમ પેપર્સ)

તેનાં વખાણ મંબળાને તં નેંદું દસ્યું The pair laughed at his praise. (ધી પર લાઈ એટ હિં પ્રેફર્ડ)

મેં તે અધારુર છેદીને મંપુર્ખ છુટો ભુકવાને વચ્ચન આપ્યું છે I have promised the proud prisoner a perfect liberty.

(આઈ લેવ પ્રોમીસિં ધી પ્રાઉંડ પ્રિઝનર આ પરફેક્ટ લીઝર્ટી)

નેણી મારે ગળો વળગી પડી She hung round my neck. (શી દંગ રાઉન્ડ માય નેક)

આ પાડની લાંઘાઈ અરેખર નથી The length of this lesson is not proper. (ધી ડંગથ ઓછ મીન લેખન એક ગોટ પ્રોપર)

ને ગુલાયનાં ઉલા નારાં છે The roses are thine. (ધી રોઝીઝ આર ધારન)

હું મારી ચોપડી લનેને ખુણામાં બેચું છું I sat in a nook with my book.. (આઈ સીટ ધન આ નુક ઉદીથ માય લુક)

આ મુદુર ખુણો છે This is a nice nook. (ધીસ ધન આ નાઇસ નુક)

ઓક કાગડો મારી તરફ લોવા આંદ્રા છે A rook has come to look at me. (આ રૂક રોક કમ તુ લુક એટ મી)

મને પંખો લાવી આપ, મગન! મને અહું તાપ લાગે છે Get me a fan, Magan! I am so hot. (જેટ મી આ હેઠ, મગન ! આઈ એમ સો ફાન)

તેને, ઓક ચાહનો પ્યાલો લાવી આપો Get him a cup of tea. (જેટ હીમ આ ટ્યુ એટ ડિ)

અરે મારા ચાદરમાં ઓહ માખીંનો Oh, a fly is in my tea.

(નુસાર, આ ફ્લાય છઈ છન માય ઈ)

હમણ્ણા મારા ચાદરા ઉપર એક મધ્યમાખીંનો Now a bee is
on my cup. (નાચિ આ બી કે ગ્રાન રાણ ક્રા)

મધ્યમાખીંની લાગી જ ઓની you હું bee. (એક યુ જી બી)

મનો ચાદરનો એક ચાદરા મણદરા થો I + my have a cup
of tea. (લેટ મી ની આ ક્રા આદ ઈ)

અરે મારા લાઘવા માખીંનો Oh a fly is in my hand
(ઓહ આ ફ્લાય છઈ હન માય (-૬))

વાંચન પાઠ ફર્જ મા.

આડ, જોડ, Evil (એફિલ)	તોડી Read (રેડી) -
ઉત્ત આપ્યો Allow (અવો)	મન્દુ,લાવી લી, જાણ (ફી-લાવ)
બંધ કરું Shut (શટ)	કોરી Control (કોન્ટ્રોલ)
મીનીટ Minute (મીનીટ)	ણમતું Buffer (બાફર)
ઉંઘુરુ Open (અપનુ)	પાણી Water (વાટર)
નાયાધીંના Judge (જડાન)	થ્રે House (હાઉસ)
લથુર To fight (કુ ફ્લાઇટ)	એક દિવસં One day (વાન ડે)
પરચુરણ Change (ચેન્જ)	ભુંઘું Hungry (હાર્દી)
રૂપીંના Rupee (રૂપી)	આ Tea (ટી)
છુટું સુદ્ધું Lest (લેસ્ટ)	આંખ Eye (આઇ)
લથુર Fight (ફાઇટ)	વાંદ્ર Fold (ફોલ્ડ)
ભરું Fill (ફીલ)	પાણી આવણું Follow (ફોલો)

કાયદો, મેળવવું Grain (ગેઠન)	શૈખાલો Fond (કોણ)
રમત Game (ગેમ)	ખારાક Food (કૃત્તિ)
જાડી Garden (ગાડન)	બેનકુરી લરેલું Foolish (કુદીશ)
સાધું Gentle (સાધન્દ)	પણ Foot (કુદ)
મેળવતું Getting (ગટીય)	જાન Forest (ફોરેસ્ટ)
રાદુસ Giant (ગ્રાયન્ટ)	ગલ્કોઝ Loke (નંક)
નનદાય Must (મસ્ટ)	ઉપરી Superior (સુપરીયર)
પણા મંથંધી Money matter (મની મેટર)	મડળી Society (સાસાયરી) - માળી Gardener (ગાર્ડનર)
પસંદ કરવું Choose (ચુક)	ફ્લેર Flower (ફ્લેબર)
મારવું Beat (બિટ)	ઉદ્ધેષ Insolent (બુન્માલન્ટ)
માણસ Man (મન)	ગુટ્ટવું Pick up (પીક અપ)
ધ્રાપકું Wicked (કાઢન્ટ)	જાથનું Road (રિસ)
આવતીકાલો To morrow (કુ-માન)	સાંકલનું Spend (સિંપ)
વ્યાજભી Just (જાએટ)	નામ Name (નેમ)
ગાખવું Keep (કાપ)	નામની Named (નેચાની)
જન-માથળું Kind [કાઢન્ટ]	નોકાની Naughty (નોકી)
માયાળુપણું Kindness (કાઈ-નેન્સ)	પાસે Near (નીચે)
ખોલું Lose (લુક)	નરદળ Neck (નેક)
બેટિથી Loudly (ભાડિલી)	જરૂર Need (નીચ)
જાહેરું Love (જવ)	માળો Nest (નેસ્ટ)
જ્વાળું Lovely (અવલી)	કંદિ નાહિં Never (નિયર)
મારીમેળે Myself (માયસેલ્ફ)	ખીંચું Next (નેક્સ્ટ)

ને એહું કરશે તે દુઃખ બોગવશે He, who will do evil,
shall suffer. (હી, હુ ઉવીલ કુ છીલિસ, રોક્સ સફ્ટ)

હુ તેને ભારા ધરમાં આવવા મણી I will allow him to
come into my house. (આહ ઉવીલ એલાઇ હીમ
કુ કમ મન્ડુ ભાય હાઉસ)

મારે તમારી નેતે લદ્દાની છબ્બાછે I desire to fight with
you. (આઈ ડીજાયર કુ કાફિટ ઉવીથ કુ)

આ રૂપીઆનું પરચુરણ લારી આપો Get me change for
this rupee. (ગેટ મી રૂપી કુંગ ધીમ ગા)

હુ ધેરા ભુઘ્યે હતો I was very hungry. (આઈ ગાજ વર્ગ હંગ્રી)

આ તૈયાર છે ? Is tea ready ? (એ મી ની)

એક દિવસ તે ચોપડી વાચના હતો One day he was reading
a book. (વન કે લી વેક રાડિગ જે મુક)

ભારગુ જથું કરો Shut the door. (શાટ ધી કાર)

હુ એક મીનીટગા આવી પંડાચીશ I will arrive in a minute.
(આઈ ઉવીલ એગારવિ માન જો મીનીટ)

નાણુ આગણુ ઉધારું મુકું છે He has left the door open.
(હી હંજ લેફ્ટ મી ડાર એપન)

વાળિઓ તેની પાછળ થયો A Bania followed him. (બે
નીયા કોલિડ ઈમ)

તેણુ તેને ધરમાં લારી છે She has brought him into the
house. (શી 'હું ખાઈ હીમ છન્હ પી હાઉસ)

હું તમને વચન આપું છું કે હું થાલે ને મોકલીશ I promise you
that I shall send it to-morrow. (આઈ પ્રોમીસ
કું ધેર આજ રોલ સેન્ડ છે કુ-મારો)

તેણે કલ્યાં કે હું તે પરમ ફળાં લાવીશ He said "I will
bring it the day after to-morrow." (એ સેંડ
આઈ ઉવીં ખીંગ છેર ધી હું આફટર કુ-મારો)

લાંબીએ હું વાંચ્યું ? O. May, I read. વાં ? yes. (મે આઈ
રીડ, અર એ વામો)

માળા હું ડેર્ટાંડ કું નુકું ? O. Gardener, may I pick up
some flowers ? No. (ગાડ નર મે આઈ પીક અપ સમ
ક્રાવસ ? નો)

ઉદ્ધત થના નહિ Do not be insolent. (હું નોટ બો હન્સિલાન્ડ)

તમે તમારી ભંણામાં ઘાતકાંત પસદ કરતા નહિ Do not choose
the wicked in your society. (હું નોટ ચુંઝ ધી વિકિડ
ને વાર સોભાઈંદી)

આ ઉદ્ધત ભાણુસને સનન કરતા નહિ Don't punish this
insolent man. (ડોન્ટ પનીશ ધાસ હન્સિલાન્ડ મેન)

વાંચન પાઠ છે મા.

સાલાંધું Heard (હડ)

શીરી Ring (રીંગ)

ખીંચો Feared (રીંઘડ)

કુંમરો Good (શુદ્ધ)

સમાચાર News (ન્યુઝ)

વાડી Garden (ગાર્ડન)

પ્રીતિ Favour (હેલ્પર)

ઉલણી Feast (રીસટ)

કહ્યુ Said (સેઠડ)	પૂછું Asked (આર્કડ)
ઉપયોગી Useful (યુન્ટલ)	જાતઃકરણુ Heart (હાર્ટ)
નાશ કરતું Destroy (ડિસ્ટ્રોગ)	ધ્યાયો Wise (વાઈઝ)
જુદું I'atruth (અન્ટ્રુથ)	દુષ્ટિયારુ Clever (ક્લેવર)
કાંઈ નહિ Nothing (નથીંગ)	પમંદ કરતું Choose (ચુલ્ચ)
જુદું Lie (લાઘ)	સોઅત Company (કંપની)
ભાઈ Brother (ખધર)	સાચા Well-known (સેચ-નોન)
દોકું Persons (પરમશમ)	જીંદગી Lite (લાઇફ)

મેં આ ભમાચાર માંગ મિત્ર પારેથી ભાંબળા. I heard this news from my friend. (આઈ એડ મુખ્યમંત્ર રોખ ગાય હેડ)

હું મારા કાકા ભાયે વારીનો ગણો દ્વો. I went to the garden with my uncle. (આઈ ઉંચા દુંડ પર ગાર્ડન જિવીથ ગાગ અન્ડર)

મિત્ર ગિનાનો ઉપયોગી એ. A friend is useful to a friend (એ હેડ માંગ યુન્ટલ કું એન્ડ)

મેં મારું ઉપરીની પ્રીનિ મેળા. I received the favour of my superior. (આઈ ગીસીનું ધ્રુવ હેવર ગોંડ ગાય અપીરીનું)

મેં મારું મિત્રને મારી રીતી આપી લગ્ની માર્ય રીતી કું માર્ય હેડ)

મેં મિત્રની પેસા સંખ્યાનું પૂછું I asked the friend about the money matter. (આઈ આર્કડ ધ્રુવ નેન્ડ ઓફાઉન્ડ ધી સની મેટર)

તेणु भारा भिन्ने धीवडाव्यो He made my friend fear.

(દી ગેન્ડ ભાગ કેંડ શીઅર)

મેં ભિન્ને કહ્યું કે હું નમંત ઉનાની આપીશ I said to the friend that I will give you a feast. (આઈ સેફટ હું ખ કેંડ વેટ આમ નીલ ગીવ ચુ ઓ શીસ્ટ)

તમારા ભિન્નના ભાઈનું નામ નાનાલાલ છે The name of your friend's brother is Nanalal. (દી નેમાન ઓછ ગેર કેંડ ઘથ ક્રાંત નાનાલાલ)

બાર હિન ! તુ તુ ધાર્યા અતે દુનિયાર હેઠાં નો સારા માણગઠી
માળા પણ કરકે O heart ! If you are wise and
clever, choose the company of well known
persons. (દી હિન ! કર ક હાર વાઈ જોન કેંડ,
નું હુ ચાલી ગોક રેખનોન પરમાન)

તારી જાહેરીના નાન મુજબ માણગણ કર છે The ignorant
destroy your life. (દી રેખનોન ક્રીંગ્રોન ગેર લાંક)

દુષ્ટ કર્યા નાન, કંબ નાન Nothing else is worse than
untruth (લાંદીંગ જોન્સા એં વસ વન અનાન્દ્ય)

અરે ! લાન ! કદ્દિ પણ જુદુ ગોલંનો નાન ! O' brother, never
tell a lie. (દી ઘથ ! નેનર ટેલ એં લાન)

આ ડેવી ગંદર ઝંપડી છે ? What a fine cottage is this?
(ઉંબાટ આ કાઢન હોયજ એં ધીમ :)

વાંચન પાઠ ૪૫ મે.

હીમત હારવી Discouragement (ડિસક્રેજ)	પ્રાદી Distress (ડિસ્ટ્રેસ)
ગરીબાઈ Poverty (પોવરાઇ)	મીનો Friends (ફ્રેન્ડ્સ)
શરમાવનું Ashame (અશેધમ)	ગરીબ Poor (પુઅર)
ખુમ પાડવી To cry (કુ કાય)	સાચાછથી By way of truth (ભાય વે એલ્યુ ટ્રુથ)
વિનતી Prayer (પ્રૈયર)	તત્ત્રતા Humility (ચુભીલીટી)
જુદા પક્ષનું Separation (મપનેટ)	વરસગાંડ Brith-day (અર્થ-દિન)
આખુ રાખ્ય Keep up (ક્રાપ આપ)	જંધ્યો quantity (ક્રો-નીટી)
પક્ષયો Caught (ટેટ)	દાખાનું Fire works (ફાયર વર્ક્સ)
ઉભર (ઓફ) (એલ્યુ)	માન Honour (એનાન્ડ)
છોડવું To let off (કુ કટ એલ્યુ)	તાવ Fever (શીવર)
નિશાની Sign (શાન્ડા)	નાગનું To feel (કુ ગીલ)
ઝડપો Motion (માયન)	દરરોજ Every day અવરી દે
બેચેન Uneasy (ગ્રાન્ઝિ)	કિંડ સુખી : Easy (છાફી)
કેમ છે ? How are you ? । (લાવ આર યુ)	વધારવું To add (કુ એડ)
ને તું ગરીબ હોવ તો દુઃખથી જાહેરાતા ના If you are poor do not fear distress. (છાફ યુ આર પુઅર, કુ નોટ શીઅર ડિસ્ટ્રેસ)	
આખો માણુસ ગરીબાઈથી હીમત હારતો નથી A wise man is not discouraged of poverty. (આ વાઈડ મેન કુઝ નાટ ડિસક્રેજ એંડ પોવરાઇ)	
સુખથી પ્રાર્થના આખુ રાખો Keep up your prayer by way of truth. (ક્રાપ આપ યોર પ્રૈયર ભાય વે એલ્યુ કુય)	

ભાઈઓથી છુરા પડતું એ દીક્ષારી ઉપઅવયા નેતું છે It causes sorrow to be separated from friends. (દોષ કોઈઓ સાચે કું બી સંપરેટેડ રોગ કેન્દ્ર)

નમતા તારા માનમાં વધારો કરશો Humility will add to your honour. (શુભીકૃતી વીજ એટ કુ યોર એનર)

મારી વરસ્યાં આજે છે My birthday is to day. (માય બાયંટે ઈજ કુ ટે)

કું જ્યારે આતું છું લારે ને ખદાર હોય છે. He is out when I come. (દી ઈજ આઉટ ન્હેન આછ કમ)

મને ને કયારે ઘેર મળશે? When shall I see him at home? (ન્હેન રિસ આછ રી લીમ .મંટ હોમ !)

મં નેં ખદાર આવતાં પકડો I just caught him as he was coming out. (આણ જરટ ટોટ લીમ એજ દી વોં કર્મિંગ બાઉટ)

દક્કો જાતના લોડો ફાદાતું બાજુ રોડે છે The lower caste let off a great quantity of fire-works. (ધ લોઅર કાગ લેટ એઇ એ ફ્રેટ કોન્ટીની એઇ હાપર વક્સે)

કેમ ગી. મણીલાલ કેમ છો ? Well, Mr. Manilal, how are, you ? (જિનેલ, મિસ્ટર મણીલાલ, હાજ આર કુ ?)

તમને તાવ કેંદો છે ? What about your fever ? (ન્હેન એપાઉટ યોર ફીવર ?)

મારે થરીર હીક લાગે છે I feel very easy. (આછ રીંગ વેરિ એકી) કું આખો દીવસ એચેન રણો છું I was uneasy for the whole day. (આછ એક અનાધી હોર ધ હોલ્ડ રી)

- બીજ કંડા નિશાનીઓ તમે જોઈ શકો છો? Can you see any other signs? (કેન યુ સી એનિ અથર માન્સ?)
 હા, મારુ પેટ ધોંગું લારે છે યાં, I am very constive.
 (યમ આઈ એમ રૂરિ ડૉસ્ટીવ)
 દરરોજ ત્રણુ જાડા થાય છે I must have three motions every day. (આઈ લેવ થી માન્સ એવરિ રૈ)

વાચન પાઠ છક મેલ.

કામ, પાઠ Task (ટાર્ક)	માયાળુ Kind (કાર્ટિન)
કલાક O'clock (ઓફલાક)	પુરી Pudding (પુંડિંગ)
જાપવુ To give (ક ભીવ)	નિશાળ School (સ્કૂલ)
દરરોજ Every day (એવરિ રૈ)	ચાપડી Book (બુક)
પરમેશ્વર God (ગોડ)	આય Cow (કોઉ)
પાણી Water (વોટર)	ઝાનું Lose, miss (લુઝ, મીસ)
પણો Fell (ફલ)	ઝાંખો Ran (રેન)
સીસાપેન Pencil (પેનસિલ)	પાય Sin (સીન)
ઉડતું To get up (ક જોટ અપ)	

- તે ભાયને બોંદુ ધાસ આપો Give the cow some grass.
 (ગીર ખ કાઉ સમ અસ)
- આ પુરી ધણી સારી, નથી This pudding is not very good. (ધીસ પુંડિંગ એક નોટ વરી ગુંડ)
- તે કુદ્રામાંથી પાણી લાવો Get water from the well. (એટ કુદ્રાર ફોલ બી લાવો)

તમारी पेटीमा भने जोवा हो Let me look at your box.

(लेट भी लुड ओट दार ओँकस)

परमेश्वर सभगा उपर दयालु छे God is kind to all. (ओइ
उपर काईनडु कु ओआ)

ऐत्तरा वाग्या छे ? What o'clock is it ? (नेपेट ओहॉक्कोड
धन मट ?)

आठ वाज्या छे Is it eight o'clock. (धट धन ओहॉट ओहॉक्कोड)

दुकाने जबानो वज्जन थयो छे It is time to go to the
shop. (धट मट वाइम दु ओ हुंधी सोएप)

हरदोउ निशाचे आवाहनु Come to school every day. (कम
दु रक्ख ओवरि ते)

तमे तमारो पाठ कर्यो छे ? Have you done your task.
(हन यु अल दौर टारक ?)

सभगा भाष्यस उपर दया राखो Be kind to all men. (ओहॉ
काईनडु कु ओआव मैन)

ओक माथुस दुवामां पञ्चो A man fell in to a well. (ओ
मैन हेल पन दु आ उवेल)

मने ओक रम्पर आपो Give me one rubber. (ओहॉ मौ
वन रम्पर)

शा वास्ते तमे भने पेनसील आपता नथी ? Why, do you
not give me a pencil ? (न्हाय, कुँकु नैष जीव
भी ए पेनसील !)

तेब्बा पांच वागे उडे छे They get up at five. (ओहॉ अप
ओट दाउड्चि)

તમે તેવા વાગે ઉંડો છો ? At what time do you get up ?

(એટ ન્હોટ ટાઇમ કુ હુ બેટ આપ ?)

જો લેયો મને સુવા જવાને કહેણો તો હું જરૂરીયા If they tell me
to go bed I will go. (છક હે ટેચ મી કુ જો કુ બેટ
આપ રીત જો)

આપ ખરાં છે, મારા છાકરા તમ નાં bad my lad. (સુન
દુઃખ અંગ, માય લેડ)

મેં તે વધાણ જેયુ I saw the ship (આએ સા થ શિપા)
તે રૂપીનો જેમના નદિ Do not lose the rupee. (હુનોટ રૂપાંધી = પૈસા)
તે ખરાં છાકરા પડો The bad boy fell. (થ અંગ મોટા કંચ)
તે માણુલ હુર દોઓ The man ran far. (વ મેન રેન ફાર)
કા, તે હોણો છે Yes, he has run. (પણ, હી હુર રન)

પાંચન પાઠ ૪૭ મા.

છેડ્યુ' Leave (લી-વ)	ચારી Robbery (ગુખરી)
આલાર માનવા Thank,	ઉઘાણુ Open (ઓપન)
oblige (થેન્-ટે, ઓલાઈજ)	ટ્યાલમાં કાળ નાંખવો Post
ગોપાલ Gopal (ગોપાલ)	(પોસ્ટ)
મહિબ્ખાઈ Mahibhai (મહીભાઈ)	ઉમેદવારો Candidates
પઢી કૃષી (સ્થાયી)	(કેન્દ્રીકરણ)
ખરું લણી How long (લાંડિ લેણાં)	બંધ કરું To shut (ક શાટ)
ન્યારી ક્રાન્ચી Wonder (નાંદુ)	ભોવાઈ Lost (લેઝટ)
	મોરિલ મોરિલ Moryal (મેરિલિયાલ)

ભાષાભાઈ Bhanabhai (આચારાભાઈ)	ટેપી Cap (ત્ય)
ઉધારું Open (ઓપન)	ગોરું Late (લેર્ડ)
ઉચ્ચાર Pronunciation (પ્રોનન્સિશન)	ઉની ટેપી Hat (હેટ)
આરણું ઉધારું રહેવા હો Leave the door open. (લીવ દેર ઓપન)	કેટલા How many (હાઉં મેની)
આરણું અંધું કરતા નહિ Don't shut the door. (ડોર શાટ દેર)	આરણું ડોર થોર હોડીં ધીસ વર્દ)

આ શાખનો ઉચ્ચાર શો ! What is the pronunciation of this word ? (ઉચ્ચો પ્રાર એન્ફ પ્રોનન્સિશન ઓછ ધીસ વર્દ)

મેં તમારી ચાપડી ખોલ્યો છો I have lost your book. (આઈ દેવ લોન્ટ ખોલ લુંઝ)

કયારની એનાઈ ગાડી છું ? How long it has been lost ?
(લાઉ ઢોન્ગ ન્ટાઈ છું બીન લોન્ટ)

તમે બહુ વાતોડા છો You talk a great deal. (યુ ટોક એ ગ્રેન રીલ)

તમે કાંન મયા હતા ? Where had you been ? (હેર રેસ યુ બીન ?)

હું તમારો એટો ઉપકાર માનું છું I am greatly obliged to you. (આઈ એમ ગ્રેટલી એપલાઇબ કુ છુ)

લાલો જાણે, કદલું કયાં ગયો છો ? I wonder where Laloo has gone ? (આઈ વન્ડર ઉન્દેર કદલું હેલું ગાન ?)

તમેને ખજર છે કે આ ચોરણી ટોની છે ? Do you know whose room is this ? (હુ તુ ને તું રમ છજ ધીમ ?)

પરમ દાઢે અછીઓં ચોરી થઈ હોડી A robbery was committed here the day before yesterday. (એ રોજરી વેઝ કમીટેડ હીન્નર મ કે ભીફાર મસ્ટર્ડે)

થાડુ પાણી લાભો Bring some water. (ખીંગ સમ વાટર)

ટપાથમાં આ ખગળ નાંખનો Post this letter. (ચોરટ ધીસ લેટર)

આ વરસ કેટલા ઉમેદવાર છે ? How many candidates are there this year ? (હાઉ મેની કે-ડિઓસ આર ધીસ છ્યર ?)

મને મોદ્દ સુધી બહાર રહેણું જરૂર છે I like to be out late. (આછ લાઇક કુ બી આઉટ લેટ)

વાંચન પાઠ ૪૮ મા.

વટેમાર્ગુ Traveller (દાવેલર)	ક્લાર્ક Clerck (ક્લાર્ક)
કેટલા વખતથી How long	ઉચ્ચારી જવું To take away
(હાઉ ઝાંગ)	(કુ ટેચક આવો)
શેરણી Sugar-cane (સ્યુગર-	અધરું Difficult (કીરીકલ્પ)
ક્રેન)	રત Night (નાદર)
આખુ Wholly (હોલી)	દલાવવું Shake (શેક)
નવ Nine (નાઈન)	અવિષ્યકાગની નિશાગની Shall
નાંદ Nose (નિંબ)	(સંસ)

કહી નહિ Nothing (નથીઅ)	ભાગ-ભાગ Share (શેર)
કથાં નહિ No-where (નો-હેર)	ટીકણું Sharp (શાર્પ)
સૂખ્યા Number (નંબર)	સિયાં Soldier (સોડિર)
એકવાર Once (ઓન્સ)	કેવાં Some (સમુદ્દ્ર)
ધાળી Plate (પ્લેટ)	આધન Song (સિંગ)
રમતું, રમત Play (પ્લે)	જાતદી Soon (સુન)
આનંદી, ખુશમીઝાળ Pleasant (પ્લેન્ટ)	નક્કી Sure (શ્વયર)
ખુસ્તી થાં Please (પ્લેસ)	વધારે જાતદી Sooner (ચુનર)
ધાણું Plenty (પ્લેન્ટી)	દીકારીની Sorrow (સ્થારી)
આળુ Plum (પ્રામ)	આતમા-જીવ Soul (સોલ)
જગતું Pocket (પેટેટ)	દક્ષિણ South (સાદ્ધિય)
તળાન Pond (પોન્ડ)	ઓલગુ Speak (સ્પેક)
મરીઅ Poor (પુરા)	અગ્રયતું Spending (રાંગ-ડીન)
પાકું Ripe (રાધ્ય)	અઠતું-અઠતી Rise (રાઈસ)
પોંઠ Stripe (રસ્ટ્રાઇફ)	નહીં River (રીવર)
ટોકો Stroke (સ્ટ્રોક)	રસ્નો Road (રોડ)
મજબૂત Strong (રસ્ટ્રોગ)	ગંગના છરણા Roaring (રિઝરવાર)
વાગેસ્ટું Struck (રસ્ટ્રાક)	અંદું Rock (રોક)
ખાતરું Suck (મંક)	મળગું Rolled (રાદે)
ઉતાવળું, એકદમ Sudden (સુડન)	ઊપરું Roof (રોફ)
અંકાઅક Suddenly, (સુડની)	એચરી Room (રૂમ)
ઉનાગો Summer (સમર)	મુઢું Root (રૂટ)

તડકा Sunshine (સનશીઅન) મેલ્કબાંસનું Send (સેન્ડ)
 શરતનું ચાંગું Supper (સપર) નોકરી કરવી Serve (સર્વ)
 ધારનું Suppose (મખોત) ચાકર Servant (સર્વનાટ)
 તમે પેકી ચોપડી વાચી છો ? Have you read that book ?

(દેખ યું રેડ પેટ ષુફુ)

હા, એં વાચી છો. Yes, I have read it. (યસ, આઇ હેવ રેડ ઇટ)
 તમને સુનાઈ ભૂકે કેટથું થયું છો ? How long is it since
 you left Bombay. (હાઉં લોન્ગ માઝ માટ સીન્સ યુ
 લેટ ઓફો)

તમને અમદાવાદમાં આવે કેટલો વખત થયો ? How long have
 you been in Ahmedabad ? (હાઉં લોન્ગ ટેન યુ
 બીન ઇન અહમદાબાદ !

આરી રમત તમારે રમતી જોઈને You ought to play such
 a game. (યુ ઓફ કુ પેંસ મન્ય આ જોઈનુ)

તમારાથી ખૂને તેટથું કુચકી જાઓ. Take away as much as
 you can. (ટેક આવે એંગ મન્ય એક યુ કેનુ)

આટલી બધી રોડળીને શું કરશો ? What will you do with
 so many sugar-caness : (કુંઠિય યુ કુ ઉલ્લિય.
 સો બેનિ સુનગર-કેનસ ?)

તે નદીનું ખૂની એક અભાતમારી છે The river has it's root
 in a bay. (ધી સિવર હેઝ ઇલ્લસ રટ ઇન એંગે)

તમારા નોકરને નર વાગે ભારી પાસે મેલ્કબાંસે Send your
 servant to me at nine o'clock. (સેન્ડ પોર્ટ કર્દીન
 યુ ભી એટ નાઈન ષેન્કલ્યાન્ડ)

તે સુંદર જાપરાવાળી ઓરડી હતી It was a room with a nice roof. (ધૂટ દોક એ રૂમ વીથ એ નાદસ હે)

અમે રાત્રે રમીશું We shall play at night. (જીવી રંગ એ એટ નાઈટ)

દરેક લહેરીયાનો બયાંમાં ભાર છે Every soldier has a share in the battle. (અનુરિ સોલ્ફર ડેક એ રોર મન ધી અન્ટચ)

જીવને સુખ કે દુઃખ આનંદ કે વિશ્વાસીરી કંચ નથી The soul feels no pleasure or pain, delight or sorrow.

(ધ સોલ શીલસ નો પેન્નર ઓર પેન્નનુ હિલાઈ ઓર મોસા)

તમે આ ધરમાં ડેટકા ઝિયા અરચનાના છો ? How many rupees are you spending in this house ?

(દાઉ મેની ડાયિંગ આર યુ સ્પેન્ડિંગ મન ધીસ લાઉસ ?)

મને [રાનનુ] વાળુ કરી લેવા હો Let me have my supper.
(લેટ ની હેવ માય સપર)

તમે જેમ ધારો છો Do you suppose so. (કુ યુ સર્પોઝ સો)

ને છોકરું જેની માને ધારતું નથી. The baby does not suck its mother. (ધી બેખી કર નોટ સરક છટસ ભથ્યર)

તે ડેટસાંક ગાયનો ગાયનો He will sing several songs. (કી વીજ સૌંગ સેવરસ .સેનાન્ય)

જ્યાગ પહેલો સમાન.

ભાગ ૨ નો.

વિશેષજ્ઞની ડીગ્રી વિષે.

ધલુંખરાં વિશેષજ્ઞોનાં ત્રણ પ્રકારનાં રૂપ થઈ શક છે. (૧) સાદુ રૂપ. (૨) 'વધારે અથવા એષાંસુ' યુતાવનારે રૂપ. ને (૩) સૌથી વધારે અથવા એષાંસુ યુતાવનારે રૂપ તેને હેચેલમાં Positive degree (પોઝિટિવ ડીગ્રી), Comparative degree (કોપરેટીવ ડીગ્રી) ને Superlative degree (સુપરલેટીવ ડીગ્રી) કહે છે.

દુંકા વિશેષજ્ઞોને સાંચા રૂપને er લગાડવાથી કોપરેટીવ ડીગ્રીનું રૂપ થાય છે ને est લગાડવાથી સુપરલેટીવ ડીગ્રીનું રૂપ થાય છે. વધારે પદવાળા વિશેષજ્ઞોને પદેદાં more (મેર) એટલે 'વધારે' લગાડવાથી કોપરેટીવ અને most (મોસ્ટ) એટલે 'સૌથી વધારે' લગાડવાથી સુપરલેટીવનાં રૂપ થાય છે. નેમણે:-

Positive	Comparative	Superlative
પોઝિટિવ	કોપરેટીવ	સુપરલેટીવ
Able	Abler	Abliest
અધિક	અધિકર	અધિકરાટ
શક્તિવાળ	વધારે શક્તિવાળ	સૌથી વધારે શક્તિવાળ
Broad	Broader	Broadest
શ્રીએ	શ્રીએર	શ્રીએરાટ
પદેણું	વધારે પદેણું	સૌથી વધારે પદેણું
Cool	Cooler	Coolest
કુલુ	કુલુ	કુલુસ્ટ
ઠંકુ	વધારે ઠંકુ	સૌથી વધારે ઠંકુ

Dear	Dearer	Dearest
મીયર	મીયરર	મીયરેસ્ટ
વાણું	વધારે વાણું	સૌથી વાણું
Eloquent	More eloquent	Most eloquent
ઇલેક્ષન્ટ	મોર ઇલેક્ષન્ટ	મોરસ્ટ ઇલેક્ષન્ટ
જ્યાદાર	વધારે જટાડાર	સૌથી વધારે જટાડાર
Foolish	More foolish	Most foolish
કુલિશ	મોર કુલિશ	મોરસ્ટ કુલિશ
મુખ્યાઈ ભરેણું	વધારે મુખ્યાઈ ભરેણું	ધાર્યું મુખ્યાઈ ભરેણું
Generous	More generous	Most generous
જનરસ	મોર જનરસ	મોરસ્ટ જનરસ
ઉદાર	વધારે ઉદાર	સૌથી વધારે ઉદાર
Wise	Wiser	Wisest
વાઈઝ	વાઈઝર	વાઈઝેસ્ટ
અણું	વધારે અણું	સૌથી અણું

સાદા ઇપને જાયારે એ હોય છે તારે વિશેષજ્ઞની એ ઉત્તી જાય છે.

કેટલાંડ વિશેપણનાં કંપેરેટીવ તે સુપરટીવનાં ડ્રો અનિયમિત રીતન ચાય છે કેમકે:-

Positive	Comparative	Superlative
ખરાળ Bad	Wor " વર	Worst વર્સ્ટ
માંડ Ill હિં	"	"
ખરાળ Evil છખિલ	"	"
દૂર Far ફાર	Farther ફાર્થર	Farthest ફાર્થેસ્ટ
આપ્રો Fore ફોર્ચ	Former ફોર્મર	Foremost ફોર્મોસ્ટ
		First ફસ્ટ

સર્વ Good શુદ્ધ	Better બેટર	Best બેસ્ટ
મોહુ Late લેટર	Later લેટર } Latter લેટર	Latest લેટેસ્ટ Last લાસ્ટ
શોહુ Little કિંદમ	Less લેસ	Least લીસ્ટ
ધર્થણ Much મચ	More મેર	Most મોઝ્ટ
ખાણાં Many	"	"
ખર્દું } Old ઓલ્ડ	Older ઓલ્ડર } Elder એલ્ડર	Oldest ઓલ્ડેસ્ટ Fullest એલ્ડેસ્ટ
માં In ઇન (Prep)	Inner ઇન્નર	Innermost ઇન્નરમોસ્ટ Inmost ઇન્મોસ્ટ
ખાર Our આઉટ (adv)	Outer આઉટર	Outmost આઉટમોસ્ટ Utmost અટમોસ્ટ
	Uttler અટર	Uttermost આટમોસ્ટ

ખાંચન પાઠ ૪૯ મો.

છિયાપદ Verb (વર્ગ)	તેજા, હ મેશાં Always (સંદર્ભાં)
પવનવાળું Windy (વિન્ડી)	નહાડા Sunshine (અનયામન)
કૃપુ Beauty (બ્યુટિ),	ગાંધીયા સ્પોટ (કર્પાટ)
શુદ્ધુ Quality (કોન્ફિન્ટી)	લસ્કરી ટોપી Helmet (લેસ્મેટ)
જંગ્યો Quantity (કર્નાન્ડિટી)	કંદું Family (કંગ્રિટી)
ક્રદ્ધુ How much (કાઉં મચ)	પારીડું Board (પૂર્ટ)
જાગ્રુ ઉપર On board (ઓન પોર)	ક્રેતું Of what sort (ઓઇ જ્વાલ નળી Pipe (પાઈપ)

મળ્યુ Received (રિસીવ)	તંત્રાણ પ્રાણ Spark (રષાં)
પેન્દુ, દુરલુ Yonder (યોનડર)	ઉંઘો Flow (ક્રષ્ણુ)
અગ હાનિ હેઠાં	વખતાંગે Soulful (સેટલર)
આવાં Such (અથ)	માદ્રાચ Commodities (કોમ્પોડિટીઝ)
અન્યાં, (અથવા) Other (અથવા)	ગ્રહણ કરવું Protect (પ્રોટેક્ટ)
૩૫ Degree (અંદ્રી) [ત્રિથંડા]	કિરણ Ray (રી)
પાછું અંગ્રી લેવું Withdraw	નભળું નરમ Feeble (શીખલ)
દીન, રૂપ Style (ન્યાયક)	નિચી Low (લો)
સાદુ Simple (સિંપલ)	અંગ્રાધિયી Jealously (નેલસલી)
અનિયાસાંત્રી Damp (અંગ્ર)	નચાર્જ કરું Wonderfully (વનદાયક)
હાજી Hard (હડા)	
અગાર Morning (માનિ ગ)	બનાર Event (ઈવેન્ટ)
અંગ્ર Mourning (માનિ ગ)	અન્દું Occur (આકર)
અભાગથી Carefully (કેરફ્લિ)	ચુંબી Hearth (હાથ)
અસ્ત અસ્ત અસ્ત Setting (સેટિંગ)	ઉદ્ધવ Rise (રાઈઝ)
અનિવાર્ય Unavoidable (અનઅવેર્નાઇઝ)	અભિયાસગત Behaviour (એલેવીયર)
નિચો, નાખમ Low (લો)	તાકું Aim at (અંટિભ એટ)
આથમાં Set (રોટ)	ગંપતી Prosperity (પ્રોસ્પેરિટી)
વિપત્તિ Adversity, Misery (અડવર્સ્ટી, મિઝરી)	નિશ્ચય Unchanged • (અનઅંચન-જન્દ)
વર્ષાં Behave (બીહેવ)	અને નહિ Nor (નોર)
અધાર Shall be (શાલ બી)	ઉદ્દેશ, વારણુ Project (પ્રોજેક્ટ)

ਮੋਹੂ Magnanimous (ਮੇਮਾਨਿਮਾ)	ਜੁਸ੍ਤੋ, ਉਤਸਾਹ Spirit (ਸਪੀਰਿਟ)
ਕੁਝਨੂੰ Sink (ਸਿੰਕ)	ਅਮਾਨੂੰ ਅਤੇ ਨਹਿ Neither (ਨਾਈਥਰ)
ਸਮਰਤਾ Moderation (ਮੋਡਰੇਸ਼ਨ)	ਦੁਖੀ ਥਾਂ, ਥਾਂਕਾਤੁਰ ਥਾਂ To be grieved (ਫੁ ਥੀ ਗ੍ਰੀਵੇ)
ਪਗਲਾਵ Failure (ਫੈਲਾਊਂ)	

ਜੁਥੀ ਅਨੂੰ ਛੱਲਾਂ ਨਰਮ ਕਿਰਣ ਲਾਭ ਲੇ ਛੇ The Sun withdraws
his last feeble ray. ('ਇਸ ਦੀ ਵੀਥੋਂਡਾਂ ਥਿਆ ਲਾਈ ਪ੍ਰੀਅਤੀ ਵੇ)।
ਕੁਝੁ ਧਨਾਵਨਾਰਾ ਵਿਸ਼ੇ਷ਤਾਵਾਂ ਤਮੇ ਥੁੰ ਸਮਝਨ ਛੋ : What do you
understand by adjectives of quality ? (ਵੀਏ ;
ਕੁ ਅਨੁਤੱਤੇਂ ਬਾਅਦ ਅਤੇ ਕਿਵੀਂ ਆਈ ਕੋਲੀਡੀ ?)

ਤੇ ਕਾਗਜਾਂ ਸਾਵਾਂ ਸਾਡੀ ਵਾਂ ਲਾਖੇਕੀ ਛੇ The letter is
written in the simplest style. (ਪ੍ਰੀ ਲੇਟਰ ਮਹਿ ਰੀਟਰ
ਮਨ ਥਾ ਸੀਪਲਸਟ ਸਟਾਈਲ)

ਤਾਂਕਮਾਂ ਫੇਰੇਂਦਾਂ ਅੜਕਾਦ ਪਾਣੇ ਧਾਰ ਹੁਅ ਹੋ ਛੇ Always there is a
black spot in sunshine. (ਘੋਥਕਵੈਚਾਅ ਦੀਰ ਮੁੜ ਏ ਹੋਇ
ਰੱਦ ਇਨ ਸੁਨਤਾਈਨਾ)

ਛੁ ਤੇ ਲਕੜੀ ਟੋਪੀ ਲੋਡ ਕੁੰ I see the helmet. (ਆਇ ਰੀ
ਧੀ ਹੈਲਮੈਟ)

ਤੇ ਬਖਾਂ ਜਲਾਵੇਂਮਾਂ ਕੁਝੇਂਹੋ ਹਨ। All those ships had families
on board. (ਆਕ ਧਿਆਂ ਸਿੱਖ ਟੱਡ ਇਮਲੀਅਤ ਓਨ ਐਵਰ)

'ਮੇ' ਦੱਸ ਆਨਾ ਮੇਰੀਵਾ ਛੇ I have received ten annas.
(ਆਇ ਫੇਰ ਰਿਸੀਵ ਟੈਨ ਆਨਾਅ)

એક રતો તથાપો ચુક્ષામંથી ઉઠો A red spark flew from the hearth. (એ રેડ સ્પાર્ક હૃદ્યુ રોમ ધી ર્થ્ય)

દરેક બાપે ડોકરા જાયા હતા Each father had lost his sons. (એ હૃદ્યર ડેડ ફોલ્ટ ટીક અન્સ)

ખધા રહેણારાઓ પોતાના માત્રનું જન્માળથી રક્ષણું કરતા હતા. All settlers protected their commodities very carefully. (આસ સેટલર્સ પ્રોટેક્ટેડ ધીર કોમેડિયિઝ બેરી કૃષ્ણાલી)

આજનું સવાર પરનવાળું દન્તું This morning was windy. ધીસ માઈન્ડ ગ્રેડ વિન્ડી)

તે નીચેની લીનાશવાળી જમીન કંબું હતી The low damp ground was hard. (ધી લો ડેમ્પ આઉન્ડ પોંડ હાર્ડ)

આ કિયાપદ કંઈ જાતનું છે ? Of what sort is this verb ? (એવાર નંદાટ સાર્ટ એડ ધીસ વર્થ્ય)

સુરત કરતાં અમદાવાદ બધું મોહું છે Ahmedabad is larger than Surat. (એહેમદાબાડ એડ લાર્ગ ધેન સુરત)

આજે એક ઘણોાજ નવાઈ જેવો જનાવ બન્યો છે A most wonderful event has occurred to-day. (એ મોર્ટ વન્ડરફુલ ઇવેન્ટ હેડ અકર્ડ કુ-નુ)

ઉત્ત્ય અને અસ્ત અનિવાર્ય છે Rise and fall are unavoidable. (રાઇઝ એન્ડ ફોલ આર અનિવાર્ય અસ્ત)

તારી વર્તાણું નિયે રાખ પણ તારો ઉદેશ ઉત્ત્ય રાખ Keep thy behaviour low, but thy projects high. (શ્રી ધાર્મ ભીદેવીયર લો વર્ક ધાર પોનેકલસ હાઈ)

નેરી તુ વ્યાજુ અને મહાત્મ થઈયા So shalt thou be kind and magnanimous. (સા દોષ ધારું બી કાઈન્ડ એન્ડ મેર્ગનિમિસ)

ઉત્સાહને ખુલ્લવા ન હોય Sink not in spirit. (સિન્ક નાથ હન રપીરીટ)

ને કાઢ આકાશમાં અચ્છ મારણે ને જાડો માર તોંબા કદ્દા પ્રાણી
ચું મારી સકે છે He Who aims at the sky
shoots much higher than he who aims at a tree. (હી તુ એદુસ એટ ની રક્ષા તુટ્યા મય હાપરાંન
એ તુ એદુસ એટ એ રી)

દૂધ ઉગે છે તે વર્ષને રાત્રા હોય છે ન અરન થાય છે તે વર્ષને
નેરીએ હોય છે The Sun is red when it rises
and of the same colour when it sets. (ની
મન દ્વારા રૂપ બંધેન છટ રાઘવીન એન્ડ ગ્રાહ ની એદમ કદર
બંધેન છટ સેટસ)

શ્રીપતિ અને વિપનિમાં પણ માલાપુરુષોનું એક ધ્યાનજ હોય છે In
prosperity and in adversity alike great men
remain unchanged. (ધન ગ્રેસપેરીટી એન્ડ ધન એડવસિટી
એશાઇક એટ મેન રીમેન અનચેનજન્ડ)

મહાત્મા પુરુષ સારા અને નારા લાગ્ય નીચે ભ્રમચરિતથી બાલે છે The
magnanimous man behaves with moderation
under good and bad fortune. (બી મેરેનીમસ
મેન પિલેન્મ ઉનીથ મોડરેશન અનડર ગુડ એન્ડ બુડ ફોર્મુન)

જ્યુ થયાથી તે ખદુ રાજુ થશે અને પરાજય થયાથી સોધિતું થશે
 He will be delighted with success and grieved
 with failure. (શ્રી વીજ બીજ ડીલાઈડ વીજ, સુકસેસ એન્ડ
 શ્રીઓ બાય ફેલજર)

વાંચન પાઠ ૫૦ મે.

મહાં Religion (રિલીજિન)	પાયો Foundation (ફાઉન્ડેશન)
નીતિ Morality (મેરેલીટી)	પૂજા Worship (વર્ષાપ)
પ્રદોષા Wealth (નાન્ય)	વર્ગ Class (ક્લાસ)
ધારણા Conception (કન્સેપ્શન)	નમનું Bow (બાણ)
આરૂનિ Form (ફોર્મ)	છદ્ધ Chosen (ચોઝન)
ધનાવે કેવું Indicative (ઇન્ડિકેટીવ)	આવે છે Comes (કમ્સ)
કર્માં Lo us (કોટ્સ)	કોમેથ Cometh (કમેથ)
અધ્યકૃતું Touch 'ટચ)	દરિયો Ocean (ઓચન)
રૂપીઓા Rupees (રૂપીઝ)	અધુરું Unfinished (અનશીનીઝ)
છેતરાયું Cheated (ચીટેડ)	માંદો Sick (સીક)
નક્કોા Bargain (બાર્ગેઇન)	દરમિયાનમાં During (ડ્રયરીંગ)
તદ્દન Quite (ક્વાઇએટ)	પાણો Return (રીટર્ન)
કાગળોા Letters (લેટર્સ)	રોકાનું Prevented (પ્રીવેન્ડ્સ)
શરૂ કરું Begin (બિન્ગન)	સવાર Morning (મોરનિંગ)
સિવાય Without (બિવિધાઉટ)	સવારનું ખાણું Breakfast (બ્રાકફાસ્ટ)
રાખો છે Keeps (ક્રીપ્સ)	દેવતા Fair (રોપર)
કરું Make (મેચ્ક)	બળા, જળ Strength (ર્ટ્રોઝ)

ખર્ચ એ નીતિનો પાયો છે Religion is the foundation of morality. (રિલીજિયન ઈજ ધી ઇન્ડિન્ડેશન એંડ મોરલીટી)

હીંદુઓ લક્ષ્મીને દેવી તરિકે પુજે છે The Hindoos worship Laxmi as goddess. (ધી હીંદુ વરસીય લક્ષ્મી એંડ ગોડેસ)

એ ધનની દેવી ગણ્ય છે. She is the goddess of wealth.
(શી ઈંડ ધ ગોડેસ એંડ વલ્યુ)

તેનું સ્વરૂપ આપેકૃત છે The conception of her form is indicative. (ધી કંસાશન એંડ હર કેર્ન ઈંડ ચન્ડીનીન)

તેનું રહેઠાણું ભાવભાબર ને ખીચેવા કર્મગમાં છે. Her residence is in the great ocean and a blooming lotus. (હર રેડીન્સ ધન ધન ધી શ્રેષ્ઠ જ્ઞાશન એન્ડ એ પણુમીગ લોટસ)

તેમો દેવ અને દેવીઓને માનતા હતા They believed in gods and goddesses. (ધે ધીલીંડ ધન ગોડેસ અને જોંડુમીસ)

દાઢી વર્ષમાં દેવિઓને માનવાનો ચાલ હોય છે The custom of goddess worship is found amongst the lower-classes. (ધી કર્ટમ એંડ ગોડેસ વર્ષીય ધન ઇન્ડિન્ડ એન્ડ કર્ટમ ધી લોઅસ કચાસીન)

તમારું ધ્રષ્ટ દેખ દેવીને નમરકાર કરો Bow to your chosen god and goddess. (ધ્રાઉ કુ ચોર ચોકા ગોડ એન્ડ ગોડેસ)

દુષ્પરના અરણું સ્પર્શથી શક્તિ આવે છે Strength cometh from touching the feet of God. (સ્ટ્રેંગ્ ક્રેચ ફોમ ટ્યુંગ ધી રીટ એન્ડ ગોડ)

તમારી પાસે ડેટલા રૂપીઆ હતા ? How many rupees had you ? (દાખ મેનિ રૂપીઝ હેડ યુ ?)

મારી પાસે દશ રૂપીઆ હતા I had ten rupees. (આઠ હેડ ટેન રૂપીઝ)

છેદ્ધાં એ વરસ થયાં તે ભાંદ્ધાં હતો He had been ill for the last two year. (ફી હેડ બીન દંદ હેર ધ લારટ કુ ધર્યાર્સ)

તમે કાંચ ગયા હતા ? Where had you been ? (વહેર હેડ યુ બીન ?)

રજના દિવસોમાં બને તેટલું પાછદું વાંચી જાઓ Revise as much as possible during holidays. (રીવાઇઝ એજ મચ એજ પ્રાસિઅલ ડયરિંગ હેલિટેડ)

મેં તમારો કાગળ લખ્યો છે I have written your letter. (આઠ હેર રીટન યોર લેટર)

અધુદે મુકના ના Don't leave it unfinished. (ડોન્ટ લીવ છટ અનરીનીસ્ડ)

તેનું શું એકું ? How much did it cost you ? (દાઉ મચ હીડ છટ કોસ્ટ યુ ?)

તમે છેતરાયા છો You are cheated. • (યુ આર ચેટડ) •

મેં તો મદ્દત છે It is quite free. (જી ધર કવાઇધ ની)

તે ક્યારે પાછો આવશે ? When will he return ? (ઉંહેન જીવિક હી રીતની)

હું સારા કાગળ લખું છું I write good letters. (આછ રાઈથ યુડ લેટર્સ)

આજથી વાંચવાનું શરૂ કરો Begin to read from to-day.
(બીજીન હુ રીડ સ્ટ્રોમ હુ-ં)

આજ સવારે મેં સવારનું ખાણું લીધું નથી I have not taken
this morning my breakfast. (આછ લેન નોટ ટેકન
ધીસ મોરનિંગ આપ એન્ડ્રાઇટ)

કોણું બણે ને આજે દેમ રોકાયો I wonder what prevented
him to day. (આછ ઉન્વર ડ્રોયાટ પ્રીવેન્ટેડ ધીમ હુ ં)

હેઠાત્તા કરો Light up fire. (કાઈટ અપ ફાયર)

નડીઅદમાં તેની જીને તાવ આવ્યો His wife took fever
in Nadiad. (હીજ વાઈફ હુક શીવર છંત નડીઅદ)

કાલ સવારે જેઠાભાઈને લાં એફક છે There is a party at
Jethabhai's house to morrow morning. (ધેર
છજ એ પાર્ટી એટ જેઠાભાઈસ હાઉસ હુ-મોરો મોરનિંગ)

મારી પાસે દસ રૂપીઓ છે I have ten rupees. (આછ હન
ટેન રૂપીઝ)

પરચુરણુ વાક્યો.

તે પોતાના ભાગથુમાં થોડા શબ્દો વાપરે છે He uses few words in his speech. (હી યુઅિજ ઇચ્ચ વર્ગસ ધન હીજ સ્પીચ)

વેનું બેચું ધારવાળું છે His knife is sharp. (હીજ નાઈ હીજ શાર્પ)

ઉલંગરો અનિશય નુકશાનકારક છે Awaking is very injurious. (અવેક્ઝિંગ હજ વેરી ઇન્જુરીઅસ)

આ છોકરાને થું દુઃખ આય છે ? What ails this lad ?
(વોટ એઇલ્સ ધીસ લેડ ?)

દવા અદર્શ છે Air is invisible. (એર હજ ધનવીજીઅલ્સ)

હમેશાં સાચું બોલો Always speak the truth. (એલ્વેઝ સ્પીક ધ ટુથ)

રાજ પછી વારસ ગાડી મેળવે છે The king is succeeded by the heir. (ધ કીંગ હજ સફરિઓ બાય ધ એર)

તમારે નિયમીત થવું You should be regular, (હુ શુડ બી રેન્યુલર)

સીવવાના કામમાં સોય આવે છે A needle is used for sewing. (એ નીડલ હજ યુગડ ફેર સોઈંગ)

કોડી ધણી ઉલોગી છે An ant is very diligent. (શેન આંટ હજ વેરી ડીલીજન્ટ)

મારાં ભાર્થી ધણું જુવાન છે My aunt is very young.
 (માય આન્ટ ઈડ વેરી યંગ)

આ પદીમાં ધણી કીમતી વગતુંએ છે This box contains
 very valuable articles. (ધીમ બોક્સ કનેચનસ વરી
 વંયુએલ્યુ આર્ટિફિલ્સ)

નેંબોએ મારી વિનતી કણુંલ ન કરી They assented not to
 my request. (ધે એસેન્ટેડ નોટ દુ માય રીક્વેસ્ટ)

તેઓ ખધા રોટખા ખાઈ ગયા They ate up all the loaves.
 (ધે એટ અપ એલ ધી લોઝ)

તમે તે શાખ આડ વાર ફરી બોલો You repeat the word
 eight times. (ધુ રીપીટ ધ વર્ડ એષ્ટ ટાઇસ)

તમારે ધીમેથી વાંચવું જોઈએ You ought to read slowly
 (ધુ એટ દુ રીડ સ્લોલી)

તોડાની છેઅરા નઢારા નીવડે છે Mischievous boys turn
 out bad. (મીસ્ચીવુસ બોયઝ ટર્ન આઉટ બેડ)

મેં તેને જવાનું ફરમાયું I bade him go. (આદ એડ હીમ જો)

ઇના પાટખા લારે હોથ છે Colton bales are heavy (ડોટન
 બેઇલ્સ આર હોથા)

મને જસીનપર છેંડવામાં આવ્યો I was bailed. (આઈ
 વાડ એફિલ્ડ)

ચાઠના સીલ્ક એ એક કાતનું લુગંડુ છે China-silk is a kind
 of cloth. (ચાઠના સીલ્ક ધજ એ કાધનું એલ કાંચાથ)

લાંકામાં દાથી ધણ્યા છે There are many elephants in Ceylon. (ધેર આર મેની એલીફન્ટ્સ છન સીલોન)

દુનિયામાં ધણ્યા દેશ છે There are many countries in the world. (ધેર આર મેની કંદ્રીક છન ધ વર્ડ)

ખાલણુંને લાકુ અણુ ગમે છે Brahmins like sweet balls very much. (ખાહીન્સ લાઘક સીટ બોલ્સ વેરી અચ)

આ સહી સારી નથી This ink is not good. (ધીસ છન્ક છજ રોટ ચુક)

તેઓ ડિપર હું દાખ રાખું છું I keep check over them. (આઈ ક્રીપ ચેક ઓવર ધેમ)

મારી પાસે ભુંઘ બેંકની હુંડી છે I have a cheque of Bombay Bank. (આઇ ડેવ એ ચેક ઓફ ભૂંઘે બેન્ક)

ખુરશી લાક્ષ્યાની બનાવેલી છે Chair is made of wood. (ચેર છજ મેદાઉં ઓફ વુડ)

એકદમ ઐમી જાઓ Sit down at once. (સીટ અણિન એટ વન્સ)

આ એક ઉમાં ગૃહસ્થ છે This is a noble man. (ધીસ છજ આ ગોખલ મેન)

તમારી કવિતા બોલો Recite your poetry. (રીસાઈટ દાર પોઝીશી)

આ ધરનું સ્થળ લગાનક છે The site of this house is fearful. (ધ સાઈટ ઓફ ધીસ જ્ઞાનિસ છજ ફીઅરફુલ)

નદી જોયાથી ધણ્યો આનંદ થાય છે Sight of a river pleases. (સાઈટ ઓફ એ રીવર પ્લીઝીસ)

તे मराठा कुणो छे He belongs to the maratha family.

(धी भीलो-गळ कु ख मराटा इभिलि)

आरो कारकुन खेंगा निमकदराम छे My clerck is very faithless.

(भाय क्षार्क छळ वेरी इधयलेस)

जिंदला पंज तीक्ष्ण होय छे Claws of a lion are sharp,

(जँडाज ओह ए लायन आर शार्प)

आ गामनी दवा मने अनुकूल छे The climate of this city

is agreeable to me. (धी क इमेट ओह धीस सीटी
एक ओथ्राम्बे यत कु भी)

तेझो पर्वतपर घेटे छे They climb upon a mountain.

(धे कलाधर्म अपोन ए भाउटन)

आरे आई धर उधाउरु छे I want to open my house.

(आध दोन्ट कु ओपन भाय लाउस)

भारां लुगडां धारां भेलां छे My clothes are very dirty. (भार

क्लोधस आर वेरी डर्फी)

विश्वायती मुगानु काक थाय छे The coll is u ed for v-ge able.

(प डाल छळ मुजड दोर वेल्टेअल)

अंजलने डेलसा पूरवामां आवे छे Coals are fed to the

engines. (डेलस आर देऊ कु धी एन्जन्स)

दरियामां आदीओ धर्य देख्य छे There are many channels

in the ocean. (धेर आर भेती भेनलस छन धी ओशन)

आरो लेडा अभयम भौले छे My shoe creaks. (भाय शु केक्स)

દુનાળામાં દીવમણ ધંધા લાંબા હોય છે Days are longer in the summer. (ડેઝ આર લોંગર ઈન ધ સમર)

શ્રીયાણામાં જાકળ પડે છે Dew falls in winter. (ઇયુ ફ્રોસ્ટ ઈન વીનર)

હુ તમારી પાસે સો રૂપીઆ માણું છું Hundred rupees are due to you by me. (ફેડેડ રૂપીએ આર ઇયુ હુ મુ આય મી) *

તે માંદો માણુગ મરી ગયો That sick man died. (થેટ સીક મેન ડજ ડાફ)

તે ભારી પાધડી રંગે છે He dyes my turban. (દી ડાઇક માન રંગન)

ભારી ઓરડીમાં એક માય છે There is one cow in my room. (થેર ઇંડ વન કાઉ ઈન માય રમ)

તેણું મોટેચી ખુમ પાડી He spoke out loudly. (છી રોએ આઉટ લાઉફલી)

તે ઉધાડે માથે ગયો He weat bare headed. (છી વે-ટ ઐર હુદેડ)

રોંઘ ધણું જંગલી જનાવર છે Boar is a very wild beast. (નેર ઇંજ એ વેરી વાઈલ્ડ બીરસ)

આ ધરનો પાયો પાડો છે The foundation of this house is strong. (ધી ઇન્ફેન્ચન એદું ધીસ લાઉફ ઈંજ રફ્રોંગ)

આ પુષ્ટ ધર્મો સાંકડો છે This bridge is very narrow. (ધીઅ ધીજ ઇંજ વેરી નેરો)

ખીય એ એક જાતનું જાડ છે Beech is a kind of tree.
(ખીય છજ એ કાઈનડ એઓઝ દ્વી)

દરીઆનું પાણી ખાડે હોય છે The water of the sea is
salt. (ધ વોટર એઓઝ ધી સી છજ સોલ્ટ)

“ બી ” નું ભૂત રૂપનું “ બીન ” છે Been is the past
participle of “ be ” (બીન છજ ધી પાસ્ટ પાર્ટિક્યુલર
�ઓઝ બી) •

હું વટાણા ખાડે છું I eat pase. (આઈ એટ પીઝ)

માસ્તર નીથાળીઓને મારે છે The teacher beats the boy.
(ધી ટીચર બીટમ ધ બોય)

તેનું તીર કામડું જગડે હતું His bow was strong. (હીજ
એઓ પોઝ સ્ટ્રોંગ)

ખાં ફેચ શામદ છે Beau is a french word. (ફોં ડાં એ
ફેચ વર્ડ)

મહમાણી ઉઘોગી છે The bee is industrious. (ધી બી
છજ ઇન્ડ્સ્ટ્રીયુસ)

રાજ થતું ભદ્ર સુસ્કેલ છે It is very difficult to be a
king. (હટ છજ વેરી ડિફિક્યુલ્ટ હું બી એ ટીંગ)

જવનો દાડ નુકશાનકારક છે Bear is injurious. (બીર છજ
દન્જન્યુરીયુસ)

તેઓ મહદું નનામીમાં લાદ જાય છે They carry the corpse
in bier. (હિ હેરી ધી ડાયર્સ છન બીઅર)

ધંડ વાગે છે The bell rings. (ધ એલ રીંગ્ડ)

નીશાળીઓ સુંદર ખી તરફ જોવું નહિ A student should not look to a beautiful lady. (એ રડુકન્ટ શુડ નોટ લુક કુ એ પ્રયોગીકુલ લેડી)

પક્ષીઓ એરી હળ ઉપર જવેછે Birds live upon berries. (બીડસ લીવ અપોન એરીઝ)

તેને ધણા માનથી દાટવામાં આવો He was buried with high honours. (દી પોઝ એરીડ વીથ હાઇ ઓનર્સ)

મરધી ઈડાં મૃકે છે The hen lays eggs. (ધ હેન લેઝ એગ્સ) ભીઆરાનો અખાત આરોકામાં છે Bay of Biafra is in Africa. (એ એઝ ભીઆરા ડક મન આરોકા)

સાપ માણુસને કરડે છે A serpent bites a man. (એ સર્પ-ન્ડ બાઈટસ એ મેન)

પવન ધણા જેરથી વાય છે The wind blows violently. (ધ વીડ પ્રોજ વાયોલ-ટ્રેન)

આકાશ આસમાની છે Sky is blue. (સ્ક્રાય ડક પ્રુ)

તેણે ધણાં દુઃખ સહન કર્યો છે He has borne many miseries. (ધ હેંડ એર્ન મેની મીઝરીઝ)

જંગલી કુફર માંસ આય છે Wild boar eats flesh. (વાઈલ બોર ઇટસ ફ્લેશ)

નીશાળીઓ રિષ્ટકને નમતું જોઈએ A pupil ought to bow down to the teacher. (એ પ્રુગીઝ એટ કુ ભૂજિ ગાઉન કુ ધી ટીચર)

ઝાડની ડાળી વળી ગઢ છે Bough of a tree is bent down. (એલ એઝ એ ટ્રી હર્ડ એન્ટ ડાઉન)

ગધેડાં ધણો ભાર ઉચ્છી જથ છે Heavy burden is borne
by donkeys. (હેવી ભરકાન દક્ક બોર્ન બાઈ ડોન્કીઝ)

મારા જેતરની ૬૬ ધણી લાંખી છે The boundary of my
field is very long. (ધી બાઉન્ડરી એલ માય ફીલ્ડ
દક્ક વેરી લાંગ)

ગધેડા ભુ'કે છે The ass brays. (ધ એસ પ્રોક)

તેઓ ધર તોડી નાંબે છે They break the house. (ધ પ્રોક
ધ લાઉસ)

આપણાં માત પીતાએ આપણને ઉછેરી નાનેથી મોટાં કર્યા છે
Our parents have bred us from our childhood.
(ચાન્દર પેરન્ટ્સ હેન પ્રોક અસ રોમ અનર ચાન્દકંડું)

ઘડની રોટલી ચાય છે Bread is made of wheat. (પ્રોક દક્ક
મેદક એલ ચીટ)

તે દાડ પીએ છે He drinks wine. (હી ટ્રીક્સ વાધન)

તેનો લાથ પૈડાં નીચે કચરાઠ ગયો છે His hand is bruised
under wheel. (હીજ ડેન્ડ દક્ક લ્યુદ્જન્ડ અન્ડર વ્હીલ)

તમે ભુખ છો You are a fool. (યુ આર એ મુખ)

ગમાર ખુમ કેમ પાડે છે ? Why do you call out you
rustic ? (ઝાય કુ યુ કોથ ચાઉટ યુ રસ્ટિક ?)

વનમાં ધણી શુદ્ધાએ હોય છે There are many caves in
a forest. (દેર આર એનિ કેવ્ઝ કલ એ ફોરેસ્ટ)

મારે આતું નહિ પણ ત્યાં જવું I should not eat, but I
should go there. (આઈ ચુક નોંધ કાંઈ, બર આઈ ચુક
ગો ધેર)

ਕੇਨੇ ਦਾੜਨਾ ਪੀਪਮਾਂ ਕੁਆਂਨੀ ਮਾਰੋਂ He was drowned into
a but of wine. (ਈ ਕੋਝ ਝੂਡਿ-ਤ ਛਨਕੂ ਏ ਘਟ ਓਹ ਵਾਧਨ)

ਤਮਾਰੇ ਆ ਰਸ਼ਤੇਥੀ ਆਵਉਂ You must come by this way.
(ਧੂ ਮਰਟ ਕਮ ਬਾਧ ਧੀਸ ਵੇ)

ਤੇਅੇ ਨਵਾਂ ਲੁਗਡਾਂ ਖਰੀਵੇ ਛੇ They buy new clothes. (ਧੂ
ਬਾਧ ਨਵੁ ਕਾਚੋਖਸ)

ਤੇਅੇ ਮਨੇ ਬੋਲਾਵੇ ਛੇ They call me. (ਧੂ ਭੋਲ ਮੀ)

ਨਾਨਾ ਧਾਗਕਨੁ ਮਾਥੁ ਵਾਨੁ ਸੁਵਾਗੁ ਫੋਖ ਛੇ The head of a baby
is very soft. (ਧੀ ਹੋਡ ਓਹ ਏਖੀ ਛਤ ਕੇਰੀ ਸੋਇਟ)

ਤਾਪ ਧਣੀ ਮਾਰੀ ਦਾਧ ਛੇ A cannon is very big. (ਏ ਤੇਨਨ
ਈਝ ਕੇਹੀ ਧੀਗ)

ਪਲੁ ਘੰਟੂਕ ਨਾਨੀ ਫੋਖ ਛੇ But a gun is small. (ਅਟ ਆ
ਗਨ ਛਤ ਸੱਮਾਲ)

ਤੇਅੇ ਮਾਰੀ ਤਰ੍ਹ ਪਤਥਰ ਫੇਕੇ ਛੇ They cast stones towards
me. (ਧੇ ਕਾਰਟ ਰੋਨ-ਸ ਟੋਵਾਂਝ ਮੀ)

ਫੀਦੂਓਆਂ ਬਣੀ ਜਾਤੇ ਛੇ There are many castes among
Hindoos. (ਬੱਦ ਆਰ ਮੌਨੀ ਕਾਰਟਸ ਅਭਾਂਗ ਫੀਦੂਸ)

ਦਾੜਨੁ ਪੀਪ ਧਣੀ ਵਾਸ ਆਰੇ ਛੇ Cask of wine gives out a
very bad smell. (ਕਾਰਕ ਓਹ ਵਾਧਨ ਗੀਝ ਆਉਟ ਏ
ਕੇਰੀ ਬੋਡ ਸੇਵਾ)

ਅਸਤੀ ਜਿਪਾਇ ਟੋਪ ਪਛੋਂ ਛੇ Soldiers put on casque.
(ਸੋਲੋਵਾਈ ਪੁਟ ਓਨ ਟੋਪ)

આ ઘરની છત કુદી ગયલી છે The ceiling of this house
in torn. (ધ સીકોંગ એાદ ધીસ લાઉસ એટ ટૉર્ન)

મને પીતનો રોગ છે I am suffering from gall. (આજ)
એમ સફરીંગ ડ્રોમ જોંક્સ)

જુલીઅસસે જોલ જ્યાં હતું Julius had won Gaul. (જુલીઅમ
હડ વન જોલ)

હું મારી વીરીને દોલ સદાવવાનો હું I am to gilt my ring.
(આઈ એમ હુ. ગીલ્ટ માય રીંગ)

અમદાવાદમાં ધણુલિાર ભદ્રાજન બંગું થાય છે In Ahmedabad
the meetings of the guild are often held. (હનિ
અહમેડાબાદ ધ મીટિંગજ એાદ ધી ગીલ્ડ આર એઝિન હેલ્ડ)

મારું ધડીઅણ સાનેથી રસેલું છે My watch is gilt in gold.
(માય વ્યાચ એઝ ગીલ્ટ ઇન જોલ્ડ)

તેને તેના અપરાધ માટે સજ કરવામાં આવી હતી He was
sentenced for his guilt. (હી દોંડ સેન્ટન્ડ હુર
હીંગ ગીલ્ટ)

મારી ઘરમાં સળીઆની જળી છે There is a grate in my
house. (ધેર છજ એ ગ્રેટ ધનિ માય લાઉસ)

તે મોટા ભાણું ગણાય છે He is a great man. (હી ધજ એ ગ્રેટ મેન)
તે તેના બાપ કરતાં મોટા ભાણુસ હતો He was a greater
man than his father. (હી વ્યાચ આ ગ્રેટર મેન હેન
હીંગ ફાખર)

આ છીકણી સારી નથી This snuff is not good (ધીસ સના ભરી નોટ રૂડ)

ગુરૈપમાં ગ્રીસ દેશ છે Greece is a country in Europe.
(ગ્રીસ ભરી એ કન્ફ્રી ઇન યુરોપ)

કાર્ટુસો ચરખીથી ચાપડેવી હતી Cartridges were anointed
with grease. (કાર્ટ્રિજ વર એનોયાય નીથ ગ્રીઝ)

તેના વાળ પાળ હતા His hands were white. (હિન હર
દર વાઈટ)

આ વન લયાનક દે This forest is terrible (ધીસ હારેસ્ટ
ના ટેરીઅલ)

આ જાડ થોડા દિવસમાં ઉંઘુ છે This tree has grown in
a few days. (ધીસ ડ્રી હેડ માન ધન આ ફ્લુ હાડ)

હું ગાંધી છું I am a grocer. (ગાંધ એમ એ ગ્રેસર)

આ બેંયાડ ઊં છે This cell is deep. (ધીસ સેલ ફર્ડ ડીપ)

મારું શરીર તંહરસ્ત નથી My body is not hale. (આપ
ણાડી ફર્ડ નોટ હાલે)

હરીને નમરાકાર A bow to Hari. એ બાઉ હું હરી)

સભણું ધરણી ઉતાવળાથી દોડે છે (A hare runs very sweetly.
(એ હેર રન્સ વેરી સ્વીએટ્લી)

આરા વાળ કાળા છે My hair are black. (માય હેર આર બલેક)

આ ઓરડો રંગલો છે This room is coloured. (ધીસ ઇમ
ફર્ડ કલર્ડ)

તેઓ જોરથી હોડું એંચ છે They carry the rope strongly.

(એ ડરી ધ રોપ રંગવી)

મૃગનો રિકાર થાય છે A deer is hunted. (એ હીઅર ધજ હન્ટેક)

તમારે અંતઃકરણ બોકખું લોઇએ Your heart must be pure.

(યોર હાઈ મરટ ભી રખું)

મારી એડી અખુદાર છે My heel is sharp. (માય લિંગ છડ શાર્પ)

દાકાર માખુસનો રોગ મયાડે છે The doctor heals the man of his disease. (ધ ડેક્ટર લીફસ ધ મેન ઓઝ ધીસીન)

આ ટેકની આડી છે This hill is cross. (ધીસ લીલ એક કોસ)

આડી આવા Come hear. (હમ હીએર)

હું કહું તે સાંભળો Hear what I say. (હીઅર હોઈ આઈ સે)

બકરાનું ટોળું ચર છે The herd of goats is grazing.

(ધ હડ ઓઝ ગોટસ ધજ શૈકીંગ)

મેં મારે કામ પૂરું કર્યું છે I have finished my work.

(આઈ હેર રીતીસ માય વર્ક)

આકાશમાં ધૂળાં વાદળાં થઈ ગવાં હતાં Clouds of dust were floating in the sky. (કાશાઉદ્સ ઓઝ હુસ્ટ વેર ઇલોઈંગ ધન ધ સકોય)

તુમ તુ કામ કરે છે કે નહિ ? Do you work or not ?

(હુ તુ વર્ક ઓહર નોટ !)

તેઓ ઓકાં આય છે They are dozing. (એ આર ઓગીંગ),

મૃગની માતાને મૃગલીઓએ કહે છે Female deer are called does. (શ્રીમેદુ ડીઅર આર ડોડ ટોંક)

તેણે ખુટકે ખુટકે દાડ પીંધા He drank wine by draught.
(બી ક્રોંક વાધન ભાય ફ્રોંક)

તે શરીરે કમજેર છે He is feeble boilded. (બી છક શીઅબ
ઓડીડ)

તે ટોંગથી રૂએ છે He pretends to cry. (બી પ્રીટેન્ડસ કુ કાય)
કેમ આણે છે ? How do you fare ? (બાંડ કુ મુ કેર !)

મારા નરીમિ આમ થયું છે My fate has done all this.
(ભાય ફેચ્ટ હેડ અન આદ ધીમ)

લેણું જારી પરિજામતી આણી He gave a good fate. (બી
નેવ એ ગુડ ફેચ્ટ)

મારા પગ જાંખા છે My feet are long. (ભાય શીટ આર હોંગ)
તેણે ધણ્ણાં પરાક્રમ કર્યા છે He has done many exploits.
(બી હક અન મેતી અંકરાંદોઘટસ)

તું મુર્ખ છે Thou art a fool. (ખાડિ આર્ટ એ પુલ)

આ ધડા પાણીથી ભરેલો છે This pot is full of water.
(ખીસ પોટ છક મુલ એલ વેલર)

તેના આગઢા પગ તુંડા છે His forefeet are short. (હીજ
ફાર શીટ આર હોંડ) . . .

મારા શુંલમાં પંચ રૂપિયા છે I have five rupees in my
pocket. (આઈ હેલ ફોર્પિં રૂપીઝ છની ભાય ચેહિટ)

તમે સથળા આગળ આવી જાઓ। All of you come forward.
(આજ ઓછ યુ કમ ફ્રોર્વર્ડ)

મારો નંબર પહેલો છે My number is first. (માણ નંબર દાખ ફર્ટ)

વાડીમાં મરબાં બોલે છે The fowls crow in the garden.
(ધ ડાઉલ્સ ડો એન ધી ગાઈન)

જુદું એચાવનું તે મહા પાપ છે Lying is a great sin. (જાંખેંગ
દાખ એ ગ્રેટ શીન)

બાહેરામખાન પોર્ટુગિઝનાં ટંટાગોમાં ગરી ગમો Baheram Khan
was killed in trays with Portuguese. (બેદેરામખાન
દાખ ક્રીઝ એન કંડ રીથ પોર્ટુગિઝ)

આ વાક્ય ખરું છે This phrase is correct. (ધીમ દાખ
દર કરેકટ)

દાઢી પાળી ઈ જાણ છે Water freezes on account
of cold. (વાટર ક્રીઝીઝ એન એક્ષાઇન્ટ ઓછ ડાય)

ભીલાડીનાં રૂંધાણાં હોય છે Furs of a cat are very
soft. (કર્મ એઓછ એ તેટ આર વેરી ડાય)

તેણું પાતાનું ધર ધરાણું મુક્યું He mortgaged his house.
(ની બોર્ડગેરડ દીંગ સાંસ)

જોન ઓછ આર્ક ઓલ્સિન-અની મેદાં કલેવારી John of Ark
was called maid of Orleans. (જોન ઓછ આર્ક
ડોન્ફ ડાય મેડ એઓછ ઓલ્સિન)

નાનિઓ એ છે. નર અને નારી There are two sexes;
• male and female. (મેર આર દુસીઓ; મેલ એન્ડ ફેમિલી)

મેલ ટ્રેન હજેથાં ઉપડે છે The mail train starts daily.

(હ મેલ ટ્રેન સ્ટાર્ટ્સ ઉપદ્ધી)

સીલની યાળ લાંબી હોય છે Mane of a lion is long. (મેન ઓફ એ લાયન છેડ લાગ)

ઓક્સિજન હવાનો મુખ્ય અંશ છે Oxygen is the main ingredient of air. (ઓક્સિજન એઝ હ મેન એન્ઝ્યુજિઅન ઓફ એર)

મારી પામે લાંબો ગઢણો એ I have a long mantle. (આઈ હેઠ એ લોંગ મેન્ટલ)

અભિમન્યુ સાતમા ડેડ મુદ્દો Abhimanyu died in the eleventh maze. (અભિમન્યુ ડેડ એચ એ સેન્ટ્યુ મેઝ)

મકાન લીટુસ્તાનમાં વપરાય છે Maize is used in India. (મેઝ એજ યુક્ટ એન ઇન્ડિયા)

તેઓ તેમને દીવાનખાનામાં લઈ ગયા They took them in the castle hall. (થે કુક બેંબ એન્ટ્સ દેસલ રોચ)

હેનરી બીલ્સ લશકરી અળને માટે પ્રાભ્યાત છે Henry the second is famous for his martial spirit. (હેનરી બી સેક્લ છેડ ઇમસ હોર લીડ માર્શિયલ રીપીરીટ)

આંકૃત્ય લક્ષ્ય છે This is a mean act. (ધીસ છે એ મીન એકટ)

તેનો હેખાવ ઘીહામણો હતો His sight was fearful. (હીન સાઇટ વોઝ રીઅરફૂલ)

કાખુલી લોડા જવરા છે The Kabulis are strong. (ધ
કાખુલીન આર રદ્રાંગ)

તે બીડમાં મરાયો He was killed in the meadow. (હી
વોજ ક્રીલ ધન ધ મેડા)

તે ત્યાં તેને મળશે He will meet him there. (હી વીલ
મીટ હીમ ધેર)

આ માંસ છે This is meat. (ધીસ ધજ નીટ)

હું આ એતર માંથું ધું I mete this field. (આઈ માટ
ધીસ શીદ)

મને લગાર ઉલદા ધો Let me take a nap. (લેટ મી ટેન્ડ
એ નપ)

હું તમને લાન મારીશ I will give you a kick. (ાઘ વીલ
ગીવ યુ એ ક્રીક)

હું જાદશ, અરે ખાંદશ પણ અંના I will go, nay I will eat
100. (ાઘ વીલ જાંન નો આઘ વીલ દટ કુ)

ધોંડા ચુંખારે છે The horse neighs. (ધ હેર્ફ નેંડ)

ખરીપર પેડાના આધાર છે Wheels are supported by a
nave (ધીસ આર સપોર્ટિડ બાય એ નેવ)

આ કુચ્ચો છે This is a nave. (ધીસ ધજ એ નેવ)

મારે પેસાની જરૂર છે I am in need of money. (આઘ
એમ ધન નીડ એસ્ટ મની)

આ નવી ચોપડી છે This is a new book. (ધીસ ધજ એ
ન્યુ કુક)

મેં બધું જાણ્યું I knew all. (ાઘ ન્યુ એલ)

રાતે નારા ઉગે છે The stars rise at night. (ધ સ્ટાર્સ રાઇસ એટ નાઇટ)

તને લખકરી સીપાઈનો ખીતાય મળ્યો He got the title of a knight. (દી ગોટ ધ ટાઇટલ ઓફ એ નાઇટ)

હું તાં નાલિ આવું I shall not come there. (આઈ હેલ નોટ કમ ધેર)

તમે કહ્યું તે મેં ભાંબળ્યું છે I have heard what you said. (આઈ હેવ હડ વોટ યુ સેચાડ)

આ ટેકરી ઉચ્ચી છે This hill is high. (મીસ ડીલ્ડ હંજ હાઈ) હું તાં જગતી I will go there. (આઈ વીથ જો ધેર.)

મારી આંખ લાલ છે My eye is red. (માન આઈ રંજ રૈડ) ધરમાં આવો Come in the house. (કમ ધન ધી દાઉમ)

તેઓ ધર્મયાગમાં જમે છે They dine in an inn. (ધે ડાઇન ધન એન ઇન)

રોમ શહેર છે Rome is a town. (રોમ ધજ એ ટાઉન)

અમારા શિક્ષક જયુરીમાં જાય છે Our teacher attends Jury. (અન્ન રીચર એટે-ડસ જયુરી)

સાચું હોય તે એલો Speak what is true. (સ્પીક એલો એજ દુ

એક અકવાડીયું કુન્નામેન્ટ વગર ગયું નથી Not a week has passed without tournament. (નોટ એ વીક હેજ પારટ વીધાઉટ કુન્નામેન્ટ)

મારી પાસે કુંચીનું જુમણું છે I have a bunch of keys. (આઈ હેવ એ અંચ ઓફ કીઝ)

બહાણુ બંદરમાં ઉલ્લં રહે છે The ship is anchored is the quay. (ધ રીપ છજ એનકડ ધન ધ કરે)

તઓ તમને મારી નાંખસો They will kill you. (ધે જિવાલ ઝીંખ થુ) ચુનો ભડીમાં બળે છે Lime is burnt in a kiln. (લાદમ છજ બર્ટ ધન આ કુલા)

મારી પાસે લાખબો રૂપીઆ છે I have thousands of rupees.
* (આઈ હેવ ધાઉઅન્ડસ એમોઇ રૂપીસા)

તમારી વર્ણાંક સારી નથી You lack in your conduct.
(ધુ ટેક ધન રોડ કોન્કાન)

હું મારા તંતુ નરમ કરું છું I soften my nerves. (આઈ સેક્સન માય નર્વ્સ)

તેઓએ ગવડા ઉપર બોલો લર્યો They loaded an ass with burden. (ધે લોડડ એન એમસ વીથ બર્ડન)

મેં મેજપર ટકસ મુશી I laid the pen on the table.
(આઈ લેટડ ધ પેન એન ધ ટેબલ)

તેને મેજપર મુકવામાં આવ્યું હતું It was laid on the table.
(એટ વોઅ લેટડ એન ધ ટેબલ)

તે પાણીમાં લખસી પણો He sliped in water. (હી રીપદ ધન વોલર)

આ ગલી સાંકડી છે This lane is narrow. (ધીસ લેંડન ધજ નરો) આ પાંદું અણીબાળું છે This leaf is forked. (ધીસ ફાંડી ધજ ફાંકી)

તેમા આંખળાને દોરી ગમા They led a blind man. (ધે લેડ
એ નાઇન્ડ મેન)

સીયુ કાગાવપર હોય છે Lead is rather dark. (લેડ પણ
રાખર ડાર્ક)

આ રીપ કાળું છે This tub leaks. (લીપ ટુબ લીક્સ)

તેમા કર મુકે છે They impose taxes. (ધે ઇન્ફોઝ ટેક્સિઝ)

ને શરીરે ખાડાંગો છે He is defective in his limb. (હી
થી ડિફેક્ટિવ હન હાડ વીન્ય)

જુંગા, પંચા માણસ જન્ય છે I.e., that man is going.
(લા ધેટ મેન દંડ ગોઈંગ)

ધ્યાનથી બાંસો બ્નેચ સ્લોલી

તે અકાંકો રહે છે He lives alone. (હી લાસ અલોન)

આ નાગામાં બણ્ણાં ભાણજાં છે This tank contains many
fishes. (લીસ ટેન્ડ કન્ટેનરસ મની ફિશીસ)

પેટાન તાળુ વાસો Lock the box. (લૉક ધે બોક્સ)

લોક્ટે નામ સરોનર છે There is a lake named Lockney.
(ધેર ધજ એ લેક નેચર લોક્ટે)

દ્વિતીય આ દુનીઆ બનાવી છે God has made this world.
(ગંડ હેડ મેદાડ ધીસ વર્ડ)

સુનારે આ પેરી બનાવી Carpenter made this box.
(કાર્પેન્ટર મેન્ડિંગ બીસ બોક્સ)

આરો' પાસે કાળી સીસાપેન છે I have a black pencil.
(આઈ હેવ એ બ્લેક પેન્સિલ)

થોડા ઉપર તુલસી કુમણું હતું The cloth on the horse was pensile. (હુદ્દોથ ઓન હુ હોર્સ વેળ પેનસિલ)

આ જગ્યા સારી છે This place is agreeable. (ધીસ ખેસ ડાંગ એગ્રીએબલ)

આ બજુ લાંબી માણથી છે This is a very long fish. (ધીસ મજ એ વેરી લોંગ રીષ)

આ રદ્દો અગ્રિદાર છે This plane is sharp. (ધી ખેન ડક શાર્પ)

આ લીસો આરસ છે This is a plain marble. (ધીમ એન એ પ્લેટન માર્ਬલ)

હું તેને ખુશી કરીશ I will please him. (આછ વીલ એવીજ ફીમ)
તેણે ધણ્યાં પદાનાં કાઢ્યાં He found out many pleas. (ધી ફાઇન્ડ આઉટ મેની પ્લીઝ)

આ લાડડી લાંબી છે This is a long pole. (ધીસ લિંગ એ લોંગ પોલ)

સુદીનેરો ઔરંગજેબનો નાંખ્યો Aurangzeb laid a poll tax.
(ઔરંગજેબ લેટ્ડ એ પોલ ટેકસ)

શરીરમાં ધણ્યાં જિંદું છે There are many pores in the body. (ધેર આર મેની, પોર્સ મન ધી જાડી)

તે પાણી ઢેડ છે He pours water. (ધી ચોર્સ વેટર)

હું આખી રાત પ્લેટફોર્મ સુધ રહી I slept on the platform
the whole night. (આછ સ્લેપ ઓન ધી પ્લેટફોર્મ એનાઈ)

તે ચિત્રાનું પાણીએ રજેલું છે The painter's board is coloured. (હ પેટાન્ટર્સ બોર્ડ ઇન કલર્)

તેના ધોઘપર જુનું જીન છે On his horse is a old pannel. (ઓન હીઝ હોર્સ ઇન એ ઓલ્ડ પેનલ)

આ પાણીઓનો કકડો ભાગેલો છે This panel is broken. (થિસ પેનલ ઇન પ્રોક્ટ)

શેડીનાર ઉભા રહ્યો Wait for a while. (વેટ ફોર એ ન્યૂન)

તેના મુલ્લકમાં સદ્ગાયથાંનિ હારી There was peace in his dominion. (ધર વોઝ પીમ મન હીઝ ઇન્દીનીઅન)

આકનો કકડો લારો Bring a piece of chalk. (થિંગ એ પીમ ઓફ ચ્યાક)

યુરોપમાં મોટાં ભીખરો છે There are big summits in Europe. (ધર આર થિંગ મનીટ્સ મન યુરોપ)

આમડીને ગરમ અગર દાઢું લાગે છે The skin feels cold or hot. (હ મ્યૂન હીલ્સ ફોલ્ડ ઓર લેટ)

આ ધંટની વીંઠ લોલાની છે This peal is made of iron. (થિસ થિલ ઇન મેટલ ઓફ આરન)

પાકને વરસાન મહદ કરે છે Rain helps crops. (રેન રેન્સ હોપ્સ)

અફિયરે ૪૯ વરસા રાજ્ય કર્યું Akbar reigned for forty nine years. (અફિયર રેઈન્ડ ફોર્ટ્યુન્ન નાઇન ઇયર્સ)

તે ધોઘ ઉપર દાખ સખ્ખી શક્તો He could rein the horse. (હ હૂડ રેન્ન થી હોસ્ટ)

આ ગાડ મહેરભાની કરી છાપશો Will you please untie
this knot. (દીક્ષા કુ પ્રીત અનયાધ ધીસ નોટ)

ના હું નથી છાંડું No I shall not. (નો, આપુ રોક નોટ)

અહીં કોઈ નથી None is here. (નન છુ હીએર)

આ બાળ ખરાળ છે This nun is vicious. (ધીસ નન છુ વાસીઅમ)

તમારું નાડ કાપી નાણીનું I will cut your nose. (આઠ કે
યાર નોટ)

આ આપનાર સારા માણુસ છે This metre is a good man.
(ધીસ મીટર છુજ એ ગુડ મેન)

આ છુ રમણીક છે This metre is charming. (ધીમ માર
છુ ચાર્મિંગ)

પાણીમા જીવ હોય છે There are living beings in water.
(ધીર આર લીવિંગ ધીન્ડિસ છન રોટર)

તે તેના નિરન્તર લીધે પ્રભ્યાન છે He is known for his
might. (ધી છુજ નોન કોર હીજ માટ્ટ)

દુર્દ્વાર બળવાન છે God is mighty (કોઈ છુ માટ્ટા)

હું મારા કામને માટે પદ્ધતાપ કર છું I repent for my actions.
(આઠ રીપેન્ટ ફોર માપ ઓકશાન્સ)

તેઓએ ધાર્ય કાચું છે They have mown grass. (ધે લેન
મોન ગ્રાસ)

મારી આંખમાં મોતીઓ છે There is a cataract in my eye.
(ધીર છુજ એ કેટરેક્ટ છન આય માટ્ટ)

આ ખાડી હડી નથી This mout is not deep. (ધીસ મોટ
ઇજ નોટ ડીપ)

મેં અચ્ચરપર સ્વારી કરી I rode upon a mule. (આઈ રોડ
અપોન એ મુક્ષ)

શિયાળ બાળકની પેડે રહે છે Jakol mews like a child.
(લેકાલ મુઝ લાઈક એ બાઈક)

કેપટન બેડો વખત વિચાર કરોঁ The captain minded for a
little while. (ધ કેપટન મુજબ ફેર એ લીટલ જાઈબ)

તે બધું જાણે છે He knows all. (છી નોઝ ઓઝ)

કાચું સોનું દીકુસાનમાંથી નીકળે છે Ore of gold is found
out in India. (ઓર આઈ જોઈ છન કુન્ડિન આઉટ
છન ઇન્ડીયા)

ખસામી હલેસાથી વહાણ ચક્કાન છે The sailors move the
ship with oars (ધ સંઘર્ષન્ મુજ ધ શાપ વીથ આર્સ)

તેણું દરી દરી વાંચ્યુ He read it over and over again.
(છી રેડ ઇટ ઓવર એન્ડ ઓવર અગેન્ન)

આ ઘર તમારું છે This is your house. (ધીસ ઇજ યોર હાઉસ)
એક કંચાક પઢી આરીશ I will come after an hour.
(આઈ વીલ કમ આફટર એન અફર)

તમારો ચહેરા શીકો છે Your face is pale. (ચાર ઇધાસ છક પેલાસ)
લાકડાના વાસણું પાણી છે There is water in a pail.

(ફેર ઇજ બોટર છન એ પેલાસ)

એ કાચનો કંકો ભાગેલો છે That pane is broken.
(લેટ પેઈન છન ફોકન)

આરા પેટમાં દરદ છે I have a pain in my belly. (આઈ
લેવ એ પેટન ધન આય એલિ)

આરે ખુટ લેવા છે I am to buy a pair of boots. (આઈ
ઓબ કુ ભાય એ પેર ઓફ ખુટસ)

આ ફળ સરેલું છે This fruit is putrified. (ધીઝ કુટ ફાડ
પુફીલાંડિ)

શાબ્દકો

મહારો Message (મેસેજ)	વારંવાર Often (ଓ'ફેન)
ખીરી પીરી Smoke (ગ્રેનેક)	ગાળાંતો Pass (પાસ)
ઘંટ Bell (બેલ)	ટીમન મેન Cast (કેસ્ટ)
ચીલે Articles (આરટીચિલ)	ફેરનારું Alter (આલટર)
જરૂરત Duty (ડયરી)	લાંઢી Stick (સ્ટીક)
કાકાનો Uncle's (અંકળમ)	મુજી મયા Left (લેફ્ટ)
વારમુ Heir (હેર)	ઓરાણો Room (રૂમ)
અવાજ Noise (નોઝ)	પુરજ કાન્ફેન્ડન્સ
બાગ Garden (ગાર્ડન)	ખરું True (ટ્રુ)
આવી પહોંચી Arrived (એરાફિન્ડ)	વર્ચયુ Sold (સોલ્ડ)
દ્વાર Poort (પોર્ટ)	તેલવાર Holiday (હોલેડી)
દુલ્હન Milkman (મીલ્કમેન)	થોડે એમનું Ride (રાઇડ)
ધર્યાડી Customers (કસ્ટમર્સ)	ઓળંગનું Cross (ક્રોસ)
નરી River (રીવર)	કાપારનું Already (ઓલરેડી)
	આમંત્રણું ડોષું Invited (ઇનવાઇટેડ)

પદ્ધતિથી Regiment (રેગ્મેન્ટ)	સાથે આવવાને To accompany
ને તાથે હોયં Belong (બીજાંથા)	(કુ એકમળી)
નવી New (-નુ)	વધારાનું Spare (સ્પેર)
દુકાન Shop (શાખ)	અથું Altogether (ઓલફુંગથર)
પહેલાં First (ફસ્ટ)	ફાટ Fort (ફાર્ટ)
થહેર City (સિટી)	મેવા Fruit (ફુટ)
લખયો Written (રીટન)	સાધનું Seek (સીક)
કૃધ્યો Made out (મેચ્યું આઉટ)	બોયું Lost (લોસ)
હિસાબ Account (એક્ઝાઇન્ટ)	વાંચા છા આre reading (આર રીડિંગ)
સન્નામ કૃધી Saluted (સેલ્યુટેડ)	
મહેતાજી Teacher (શીયર)	ઉપડાનું Start (રસાઈ)
અનાદણો Stranger (રંગ્ટ-નજી)	કોનો Whose (કુઝ)
ખોન્યા Afraid (અર્ફાઈડ)	જમતું Dine (જાહેમ)
દરિયો Sea (સી)	ભરોસો રાખવો Rely (રીલાઇ)
શોખીન Fond (કો-ન્ડ)	તરવું Swim (સ્વીમ)
શિકરના Hunting (હાર્ટિંગ)	કુદવું Jump (જરૂર)
આગામી Steamer (સ્ટીમર)	ઉપર Over (ઓવર)
વાંચ્યા Read (રેડ)	ફ્રાન્સનો French (ફ્રેન્ચ)
રમત Game (ગેંધામ)	બગાડયું Spoiled (સ્પોલ્ડિંગ)
રમતું Play (પલે)	વધારે More (મોર)
કપડાં Dress (ડુસ)	દીથ કરવી Delay (અસે)
બોલો છો Speak of (સ્પીક બોલ્ડ)	કાડી નાંખેલું Torn (ટોર્ન)
રોકાયલા Busy (બીજીંગી)	હોં છો Laughing (લાઘુંગ)

પાનું Page (પેઇજ)	કામ કરતા Working (ઉવર્કિંગ)
ધર્તો, મોહકીની Street (સ્ટ્રીટ)	ધમકાયો Scolded (રોકડેડ)
આવક Income (ઇનકમ)	મદદ કરવી Help, Assist
જાતાવરું Show (શો)	(હેલ્પ, એસીસ્ટ)
અનન્ય Performed (પરફોર્મેડ)	સ્વપ્નું Dream (ડ્રીમ)
રત Night (નાચર)	વિકારવું Hate (હૈટ)
પગાર Salary (સેલરી)	ઓળ્હાળને Each other (અથ્વા
રકમ Amount (અમાઉન્ટ)	અધર)
છેદી નાંખોએ Struck off (સ્ટ્રેક એફ)	પગાર Wages (ઉવેઝસ)
કુજવું Tremble (ટ્રેમ્બલ)	રસોાંઓ Cook (કુક)
તરણું યુવત્ય Youth (યુથ)	બીજું Extra (એક્સ્ટ્રા)
આપ Curse (કર્સ)	ખરચ Expense (એક્સપેન્સ)
બેતનાથી Warning (ઉદ્વારનીય)	રહેઠાળું Residence (રેસિડન્સ)
દિલગીર Sorry (સોર્રી)	આધું Dined (ડાઇન)
દીવાસળાની પેટી Match-box (મેચ એક્સ્પ્રેસ)	વિચાર છે Mean (મીન)
બીડી Cigar (સિગાર)	નીકાગવાનો To start (કર્સાઈ)
સૌથી પામે Nearest (નીપરેસ્ટ)	અસેડ્યુ મુક્કેડ્યુ Remove (રિમુવ્યુ)
	શીખવું Taught (ટોલ્ડ)

પ્રશ્નાથી શાખાએ.

Am (અનું) હું	Shall (સોલ) અવિષ્કાળની નિશાની
Are (આર) છે, છી	Can (કેન) શકવું
Was (ઉવેઝ) હતા	Did (ડિડ) હાદું, કર્યું

What (કિવોટ)	યું	Do (ડુ)	કરતું
Where (કિંદેર)	જાયાં, ક્યાં	Don't (ડીન્ટ)	ના, નહિં
When (કિંફેન)	જાતારે, કયારે	Does (ડુઝ)	કરે છે
Who (કુ)	કોણું	Had (હુડ)	હતો
Whom (કુમ)	કોને	Has (હુઝ)	છે, પાસે છે
Whose (કુઝ)	કોનો, કોની	Have (હુવ)	છે, પાસે છે
Whence (કિંફુન્સ)	કયાંથી	How (હાઉ)	કેમ
Whether (કિંફિલ્બર)	ક્યાં	Is (ઇઝ)	છે
Why (કિંખાય)	થા માટે	May (મે)	વિનંતિ દેખાડનાં કિયાપદ
Will (કિંનિષ)	ભવિષ્ય- કાળની નિશાની	Which (કિંનિય)	કોનો, કોઈ, કયું

તમે મહેતાજી છો ? Are you a teacher ? (આર યુ આ ટીચર ?)
 યંતે રસ્તાઓ સારા નથી ? Are the roads not good ?
 (આર ધી રોડ્સ નોંઠ ગુડ ?)

તમે અગ્રભાયી છો ? Are you a stranger ? (આર યુ આ ર્ફોન્ગર ?)

તમો હસ્તીઓથી પિંડો છો ? Are you afraid of the sea ?
 (આર યુ અર્ડ ઓફ ધી સી ?)

તમને તે ખાતું સાચે એણાખાણું છો ? Are you acquainted
 with that lady ? (આર યુ એક્વેન્ટેડ ઉનીથ વેન્ટ લેડી ?)

તમે હેમલ્યું કાગળ લ્યો છો ? Are you writing the letter
 now ? (આર યુ રામલીંગ ધી લેટર નોંઠ ?)

તેમો શિકારના રોખીન છે ? Are they fond of hunting ?

(આર એ ફોન્ડ એર્ટ હન્ટિંગ ?)

આગસેટ કેટણે વાગને ઉપડશે ? At what time will the steamer start ? (એટ ઉપોટ ટાઈમ વીલ ધી રાઈમ રાઈટ ?)

મારે કેટણે વાગતે ઉંઘું લેખશે ? At what time shall I have to get up ? (એટ ઉંવોટ ટાઈમ સૉલ્યુઅર્ટ હું ગેટ અપ ?)

સવારે તમે હ્યારે ઉંડો ઢો ? At what time do you get up in the morning ? (એટ ઉંવોટ ટાઈમ કુ મુ જેટ અપ ધન ધી મારનીંગ ?)

તમે આજે કોને, બેદ જાણ્યા ? At whose house did you dine to day ? (એટ હુક્ક હાઉસ હીડ મુ જાણા કુ-તે ?)

માણે તમે કેટણે વાગને જરૂરી ? At what o'clock will you go to tomorrow ? (એટ ઉંવોટ એંકોઝ વીલ મુ જો કુ-મારો ?)

તમે તે કરી શકશો ? Can you do that ? (કેન મુ કુ ચેટ ?)

આપણાથી અંડર જવારો ? Can we go in ? (કેન ઉલ્લ જો ધન ?)

હું તમારી ઉપર ભરોસો રાખું ? Can I rely on you ?
(કેન આઠ રીલ્યાએ એંન મુ ?)

તમે તરી ચડો ઢો ? Can you swim ? (ડેન સુ સ્વિમ ?)

તમારા ભાઈને રજ ધીખા છે કે નહિ ? Has your brother taken leave or not ? (હુક્ક બેર ભાઈ કેન ધીખા એર મોટ ?)

મારી શીસાપેન ડોઈની પાંસે છે કે ? Has anybody got my pencil ? (હેઠ એનીઓડી નોટ માય પેનસીલ ?)

તંતુ પુછ્યું કે તમે તંતુ આમંત્રણ કર્યું ? He asked him about his invitation ? (હી આરક્ષ હીમ એભાઉટ હેઠ દનિવીટિયાન ?)

તમે તે આગામી બંધ છે કે ? Have you seen that steamer ?
(હેવ યુ સીન બેટ રીમર ?)

તમે ખીલ કાંચા ? Have you brought the bill ? (હેવ
યુ બ્રાય થી ખીલ ?)

તમને મારી સાથે આવવાને મુર્સદ છે Have you leisure to
accompany me ? (હેવ યુ લીજર કુ એકમાપની મી ?)

તમે કાંઈ વાર લાંન ગયા છો ? Have you ever been to
London ? (હેવ યુ અવર બીન કુ લાંન ?)

તમારી પાંસ કાંઈ વધારાની પેટી છે ? Have you any spare
box ? (હેવ યુ એની સ્પેર બોક્સ ?)

તમે તે ખાંચું પૂરું કર્યું છો ? Have you finished it ? (હેવ
યુ શીનીસ્ડ છે ?)

તમારી પાસે કાંઈ પરચુરણ છે ? Have you any change ?
(હેવ યુ એની ચેન્જ ?)

તમે તે આગમાં ગયા નથી કે ? Have you not been in
that garden ? (હેવ યુ નોટ બીન ઇન ઘેટ બાઈન ?)

તમે મારા બ્યાપને જેણો છો ? Have you seen my father ?
(હેવ યુ સીન માય ફાપર ?)

- તમે તેને ચોપડી આપી નથી કે ? Have you not given him the book ? (હેવ યુ નોટ જીવન લીમ ધી સુક ?)
- તમે તેને કાગળ લખ્યો કે ? Have you written a letter to him ? (હેવ યુ રીટન એ ડાર કુ લીમ ?)
- તમે મારો લિસાય કર્યો નથી ? Have you not made out my account ? (હેવ યુ નોટ મેડ આઉટ માય એકાઉન્ટ ?)
- તમે મારા ભિન્નને સખામ કરી કે ? Have you saluted my friend ? (હેવ યુ સેલ્યુટેડ માય ફેન્ડ ?)
- તમે કેવી રીતે ગયા ? How did you go ? (હાઉ હીડ યુ ગો ?)
- અહીંથી બંડન કેટથું દુર છે ? How far is London from here ? (હાઉ ક્રાર છેજ બંડન ફોમ હીથર ?)
- તમને આ શહેર કેવું લાગે છે ? How do you like this town ? (હાઉ કુ યુ લાઇક ધીમ ટાઉન ?)
- તમે અહીંથાં કેવી વખત આવ્યા છો ? How often have you been here ? (હાઉ એન્ટન લંગ યુ બીન લીધર ?)
- તમે અહીંથાં કયાં ચુંખી રહેશો ? How long will you be here ? (હાઉ દાંગ વીજ યુ બી હીથર ?)
- આપણે વખત કેમ શુલગ્યા ? How shall we pass the time ? (હાઉ શેડ ઉની પાસ પી ટાઈ ?)
- મારે કેવી વખત રહ્યા લોરી પડ્યો ? How long shall I have to wait ? (હાઉ બાંગ રોમ આઈ રેવ કુ કેવેટ ?)
- તે પેટીની તમને કું કિંમત મેરી ? How much did that box cost you ? (હાઉ મય કીં ચેંડ કામસ કોસ્ટ કુ ?)

આની શ્રી કિંગન બેઠી ? How much did this cost you ?

(હાજી મચ ડીડ ધીંક ટોસ્ટ યુ !)

તણે તમને ટેલ્ફોન આપ્યું ? How much did he give you ?

(હાજી મચ ડીડ હી ગીવ યુ ?)

તમે મને કહી શકશો કે “પી” ક્યાં રહે છે ? Can you tell me where P. lives ? (તેન યુ ટેલ્ફોન મી ઓફિસ પી લીઝ ?)

તમે તેને દેર જાઈ શકશો ? Can you take him to his house ?

(તેન યુ ટેલ્ફોન લીમ કુ હીંગ લાઉન્ઝ ?).

તમે ચેલી ઘુરથી ઉપરથી કુટકો આરી શકશો ? Can you jump from that chair ? (તેન યુ જમ્પ સ્ટ્રોમ ઘેર એર ?)

તમે તેને તે સંદેશો આપ્યો છે ? Did you give him the message ? (ડીડ યુ ગીવ હીમ મી મેસેજ ?)

તમે એઠી પીંગો છો ? Do you smoke ? (કુ યુ સ્મોક ?)

તમે તે ધાંટ સાંભળો છો ? Do you hear the bell ? (કુ યુ લીધર મી બેલ ?)

તમે મીરિતર “ને.” ને ઓળખો છો ? Do you know Mr. J. ? (કુ યુ તો મીરિતર ને. ?)

તમને ખાયર છે કે તે ને ખાં છે ? Do you know where he is ? (કુ યુ તો ઓફિસ હી ઇંન્નો ?)

થું આ માલની કંદ જલાન પડે છે ? Do these articles require duty to be paid ? (કુ મીંડ આરીકસમ રીકવાપર ડાયારી કુ બી પેઠડ ?)

તમે મને કહેશો ? Will you tell me ? (વીજ યુ રેષ ભી ?)

તમે જાણ્યા છો કે તે ડાંસુ કીદું ? Do you know who did
that ? (કુ યુ નો કુ ડીડ વ્હે ?)

તમે તેને એણખતા નથી ? Do you not know him ? (કુ
નોટ નો હીમ ?)

આરા લાઈ પાસે ડોના પેસા છે ? Whose money my brother
has ? (કુઝ મની ભાય અધર હે ?)

તમે આ અવાજ સાંલણો છો ? Do you hear this noise ?
(કુ યુ હીથર ધીસ નોઇજ ?)

તમારો આરા આપને ડંહેવાના વિચાર છે ? Do you intend
to tell my father ? (કુયુ એનટેન્ડ કુટેલ ભાય ઇધર ?)

તે ને કહે છે તે તમે સમજતા નથી ? Don't you understand
what he says ? (ડાન્ટ યુ અનડરસ્ટાન્ડ ઉંવાટ હી સેજ ?)

શું તમારો છોકરો ઇંગ્રેઝ શાખ છે ? Does your son learn
English ? (કા યોર સન લન્ ઇંગ્લીશ ?)

ને આટલામાંજ રહે છે ? Does he live somewhere here ?
(એ હી લીવ સમજન્ડેર હીથર ?)

શું તે આગમાં રહે છે ? Does he live in the garden ?
(એ હી લીવ ધન ધી ગાર્ડન ?)

આગમાડી આવી પહોંચી છે શું ? Has the train arrived ?
(કુઝ ધી ટ્રેન એરાઇડ)

તે ઇધવાળો આવ્યો કે ? Has the milkman come ? (હેઅ
ધી મિલ્કમેન કમ !)

તમારો દોસ્તદાર ગયો ? Has your friend gone ? (હું રોડ
કેન્દ્ર ગોન ?)

કાઈને દરણને એલાચવા મોકલ્યો છે કે ? Has anybody been
sent for the tailor ? (હેઅ ઓનીઓાડી એન મેન્ટ
કાર ધી ટેલર !)

તેના ધરણ ધરાક છે કે ? Has he got many customers ?
(હું એ ગોટ મેતી કાટમર્સ ?)



The Noun. (ધી નાઉન) નામ વિદે.

A noun is the name of any person, place or
thing કોઈ પુઢ્ય. સ્થળ, અથવા વસ્તુના નામને નામ કહે છે; as
Gopal, (ગોપાલ) છોકરાનું નામ છે. Surat (સુરત) શહેરનું નામ
નિઃ. Horse (હાર્મ) ધોંડા. Gold (ગોડ) સોનું વિગેરે.

Nouns are of five kinds —નામ પાંચ જુતનાં દેખ છે.

(1) A Proper Noun (એ પ્રોપર નાઉન) વિશેષ નામ
is the name of only one person or thing —વિશેષ
નામ એટદે એકજ પુરુષ અથવા સ્થળનું નૂમ જેમકા:—John
(જોહન) ભાણુસનું નામ છે. India (ઇન્ડીયા) દેશનું નામ છે.
Ganges (ગેન્જસ) ગંગા નદી.

(૨) A Common noun (એ ક્રમન નામણ) (સામાન્ય નામ) is the name which can be given to all things of the same kind; જે શબ્દ એક વર્ગના દરેકને લાગુ પડે તેને સામાન્ય નામ કહે છે. જેમણે—Horse (હાર્ફ) ખોડા, Cow (કાઉ) ગાય, Man (મૈન) માણુસ.

(૩) A Collective Noun (એ કંલેક્ટીવ નામણ) (સમુહવાચક નામ) denotes a number of persons or things taken; as one, as, flock, army, crowd &c. જેમણે—Flock (ફોક) ટેળું, Army (આર્મી) ફોર � Crowd (ક્રોડ) ટેળું.

જે શબ્દ પુરુષ અથવા વરતુના નામનો સાચુદ બતાવે છે તે શબ્દને સમુહવાચક નામ કહે છે.

(૪) A Material Noun (એ મેરીઝિયલ નામણ) પદાર્થ સૂચક નામ denotes the name of substances; as, iron (આરન) લોહું, gold (ગોલ્ડ) સાંનું, stone (સ્ટોન) પથ્થર, wood (વુડ) લાકડું. પદાર્થ સૂચક ડોચ પદાર્થનું નામ બતાવે છે.

(૫) An Abstract Noun (એન અબસ્ટ્રાઇક્ટ નામણ) (ભાવવાચક નામ) is the name of a quality or action.— જે નામ આણ્ણી, પદાર્થ ન હેઠાડાનાં તેઓભાં રહેલો શુશ્ચ, સિદ્ધતિ, વિભેદ બતાવે છે તેને ભાવવાચક નામ કહે છે. જેમણે, whiteness (આધારનેસ) પોળાપણું, Bravery (પ્રેરણી) બહારુરી, Truth (દૃષ્ટિ) સાચ.

વાંચન પાઠ ૫૧ મે.

શક્તિગમ્ય	Able (અભિ)	સાદી	Cane (કેઢન)
નોબતું	To speak (કર્ણિક)	વાપરવી	To use (કર્ણ લુણ)
રવિવાર	Sunday (સનને)	તાર	Fever (શીવર)
મોટેથી	Loudly (લાઉડલી)	કાગડો	Crow (કો)
જમીન	Ground (આઉન્ડ)	ખાડલા	Cot (કોટ)
પકડું	Caught (કોટ)	બોંધણે	Celler (સેલર)
નયનાર	Seller (સેલર)	તાન	Chord (કોર્ડ)
દોરકુ	Cord (કોર્ડ)	બળદ	Bullock (બુલ્લુક)
રીતમાન	Manners (મનરા)	રદમીયાન	Course (કોર્સ)
કામ	Work (કાર્ટ)	ખાનરી	Sure (સ્યુર)
દૂધ	Milk (મીલ્ક)	સાંભળતું	To hear (કર્ણ દીઘાર)
પડું	To fall (કર્ણ હા)	જન્મથી	By birth (ખાય જથું)
જાણું	Even (જાણન)	ચાહતું	Deign (કેઢન)
ભાગેજ	Seldom (સંદર્ભ)	અંધારે	Dark (ડાર્ક)
ભાગતું	To break (કર્ણ ફીંક)		

મીયાનો એક છોકરો વહી હનો One of the sons of Miya
was Valli. (વન એહ ધી સંસ એહ મીયાં વાગ વહી)

તેનાથી બોકાય એતું પણ નહતું He was not able to speak
even. (એ વાગ નોટ એબદિ કુ ર્ઝીક ધ્વનુ)

કોણું જણે તે કોનો છોકરો હનો None knows whose son
he was. (નન નોંધસ કુઝ સન હી વાગ)

સોટી ભણી કવચિત् વાપરવી A cane should be used very seldom. (એ કેઠન શુડ બી મુંડ વરિ સેહમ)

ગયે સોમવારથી એને તાર આવે છે He has caught fever since Monday last. (હી દંગ કોટ રીજ સીન્સ મન્ડે લારટ)

કુંલાં આન્ધો લારે તે ખાલ્ખા ઉપર પજો પજો ઉધનો હતો
When I came there, he lay asleep on a cot.

(હેઠન આએ ડેમિન ઘેર, હી લે એન્ધીપ ઓન એ કોટ)

એલો કાગડો મેરેથી કાકા કરે છે, તે તમે સાંભળો છો ? Do you hear how loudly that rook crows ? (હું પુછીએ
કાઉ કાંઝલી ઘેટ કંક કોંગ)

જમીન ઉપર પદાર્થ પડે છે તેનું કારણું તેઓને માલુમ નથી They don't know the cause of articles falling to the ground. (ધે એન્ટ નો મું હોંગ ઓછ આરનીમણમ
કુલ્લિં હું ધ આઉંડ)

તે ને બોંધયામાં ઉતરો તેમાં અંધાર હજ The cellar into which he went down was dark. (મું સેલર ફંડુ
ન્ધીય હી વેન્ટ આઉન હોંગ પાર્ક)

આ માણ્યમ ખરા વચ્ચનાર છે This man is a seller of ice.
(ધીસ મેનુ ધગ એ સેથર ઓછ આન્સિ)

મેં તે તાત્ત તોણો હશે I would have broken the chord.
(આઈ, શુડ હેવ પ્લાન્ટ હું કોંડ)

ખલણે દોરકું ખાંધું તે તેણે તોડી નાંધું છે The bullock has broken the cord which held him. (હી જુંદાં હેઠ
પ્લાન ૫ કોર્ડ વિષ હેઠ હીએ)

તેની શીતલાત ખણ્ડી જંગલી હતી His manners were very coarse. (હીજ મેનર્સ વર વેરિ રોર્સ)

આજા દાઢામાં જમે લારે એ કામ કરીશ I will do this work in the course of the day. (આજ વિલ કુંધિમ વર્ક છન ધ ટ્રાર્ફ ઓછ ધી તે)

આફેડ ધી બ્રેટ એ જાને સાક્ષાત હતો, તેન નહેણો Alfred the great was a Saxon, not a Dane by birth. (ઓફેડ ધી બ્રેટ પોત એ મેક્ષાત, નોંધ એ ડેન ભાગ બર્થ)

મને નથી લાગતું કે તે જોમ કરશે I do not think he will do so. (આઈ કું નોટ ધીક હી ઉવિશ કું મા)

The Adverb (અર્થાર્થ) કિયાનિશેઅળ વિષે.

An Adverb (કિયાનિશેઅળ અન્યા) is a word which qualifies a verb, an adjective or another adverb. કે શંક કાઈ કિયાપણ, નિશેઅળ કે પીજા કાઈ કિયા નિશેઅણના અર્થમાં વધારો અતાવં હતે; જેમકે:-Walk quickly, it is *too* large, he studies very *diligently*. Adverbs, ની ગુણ્ય ચાર જનો છે તે નીચે પ્રમાણે.

(1) Adverbs of time-After, Afterwards, again, ago, already, always, before, by-and-by, daily, early, ever, formerly, hereafter, hereupon, hourly, immediately, late, lately, long, monthly mostly

never, next, now-a-days, after, once, presently, seldom, since, sometimes, soon, there upon, to day, too, to morrow, until, weekly, when, while, yearly, yesterday &c.

(2) Adverbs of place— Above, abroad, after, ahead, any where, apart, around, ashore, aside, away, back, before, behind, below, beneath, beyond, down, elsewhere, every-where, far, forth, forward, fro hence, here, hither, in, into, left, near, whence, where &c.

(3) Adverbs of Manner—Thus, so, well, quickly, as (જેમ) how, well, ill, badly, aloud, rightly &c.

(4) Adverbs of Degree—Almost, altogether enough, especially, exceedingly, greatly, hardly highly, how, least, less, more, most, nearly, only, quite, scarcely, too very, wholly &c.

The Interjection (ઇન્ટરજેક્શન) કૃપામયોગી અવાય.

એ કુદા કંઈ અલ્લભાન મનોવિકાર બતાવે છે તેને કેવળ
પ્રેર્ણાતી અવાય હેઠે જીમણે:—Oh! (ઓઝ) અરે! Ah! Alas!

Hurrah! (હુરરા) શાખાય! Lo! Behold!
Welcome &c.

Oh ! It is so ! (ओह दृष्टि ठिक सो) अरे ! ते ओनु छे.

Oh ! Jaimesh has also come late (ओह ! जेमेस लेझ ओसेसो कम लेहट) अरेरे ! जेमेस पछु मिडा आयो हो. Alas we could not go in time. (अजास ना कुड नोह गो। धन टाइम) अहसेस ! अमे वणतसर जर्ह शक्या नहि.

Hurrah to that gentleman. (हुररा कु धेट जेन्टलमेन) शाखा ते उभराव भाण्यसने.

Lo ! we go ! (ला ! उनी जो) नं अमे जर्हमे छीअ.

Behold ! I am going. (भीडाह ! आध ओम जोहिंग) जुआ दु नडि छु.

Welcome ! to all who may come. (उनेक्कम ! कु आव तु मे कम) ने सधगा आवे ते लडे आवो.

वाचन पाठ पर आ.

मुस्केल Difficult (दीर्घीकट)	भरेभर Really (रीअलि)
नक्षी कर्तु To determine (डिटर्मीन)	थाक्की अक्केला Tired (टायड)
झुखियार Clever (कंबवर)	शाखु Learn (लर्न)
साचु Truth (त्रुथ)	उब्बु To sleep (कु र्लीप)
धध्या Many (मैनि)	युरोपीयन European (युरोपीयन)
क्षेत्रा Then (एन)	धायुं आइ Far better (हार्डेटर)
हदी Never (नेवर)	शीखवनु To teach (कु ट्रिच)
कम Business (गोजनेस)	पहेलां Before (पीड़ूर)
आगल Forward (फॉरवर्ड)	

ધાર્યું કરીને Nearly (નિઅલ્ફી)	પછીથી Afterwards
ધાર્યું કરીને Mostly (મોસ્ટલી)	(આઇટરવર્ડ)
ધાર્યું કરીને Generally (જનરલી)	આગળો ઉપર on (ઓન)
આમ કરીને Particularly (પર્ટિક્યુલરી)	જંગલી, એન્જિન રૂડ્ડ (રૂડ)
મુખ્યત્વં કરીને Especially (અસેશિઅલી)	વર્ષન Time (વાર્ષિક)
પણ Too (કુ)	આગળો ચાલું To walk (.કુ વાલ)
એવી વખતે Such a time (સચ એ ટાઈમ)	કુચિયાર Clever (કલેવર)
વર્ગ Class (કલાસ)	આગસ્ત્ય Idle (આઇડલ)
પણ Even (એવન)	પણ Alાનો (ઓલાનો)
	માંઠ Sick (સીટ)
	નાનાં નાનાં Young (યંગ)

ને વાત નક્કી કરી મુશ્કેલ છે It is difficult to determine
 ' that case. (ઇટ ઇઝ ડિરીક્સન હુ ડીટરમીન પૈટ ડેફલ્સ)
 તમારી પાસે આન્યાંથી ને થું શિખે છે ? What does he learn
 by coming to you ? (ગેંટ ઇઝ હી લર્ન બાય કમ્બીંગ
 હુ ચુ ?)

થાકી ગયો ત્યાં લગી મેં વાંચ્યું, અને પછી ઉલ્લી ગયો I read till
 I was tired and then went to sleep. (આઇ રેડ
 રીલ આઇ વોઝ ટાઇડ એન્ડ વેન બન્ડ હુ સિલ્પ)

તું ધાર્યું હેઠિયાર છો, પૂછુ અગેસર યુગેલીઅનતી પેઢ જોખતા
 નથી You are very clever, but can't speak just
 like a European. (પુ આર રેન્ડ કલેજ, ઓટ ઇન્ડ
 સીલિક જર્સ્ટ લાઇક ગો પુરોપિઅન)

સાચું કહેવાંના તો તે તમારામાંના બણ્ણાં કરતાં તે બહુ સારું લખે
છે To tell you the truth, he writes far better
than many of you. (કુ ટેલ યુ ધ દુષ્ટ હી રાએદ્યા
ફાર એટર મિન મેનિ ઓફ યુ)

મારા કરતાં ને અહું સારી શાંત શિખયે છે He teaches far
better than me. (હી ટીવીજ ફાર એટર વેન મી)
મેં તંતે આગળ કરી દીકો નહોંતો I never saw thee before.
(આઈ નેવર સા ધી બીફાર)

મારું કામ એ છે કે, તમારી આગળ આજનું My business is
to walk before you. (માય બીગનલ્ય ઈજ કુ પોક
બીફાર યુ)

તમે કેમ આગળ ચાલો છો ? Why do you go forward ?
(જાય, કુ યુ ગો કોરવર્ડ ?)

તે તમે પણી કરો તો સારું I wish you do it afterwards
(આઈ વાસ યુ કુ છટ આફટરવર્ડઝ)

તો કહો કે આગળ વાંચ્યતો નાલિ Tell him not to go on
reading. (ટેલ લિભ નોટ કુ ગો એન રીડિંગ)

ધારું અહું તેઓએ બધું પુરું કીધું છે They have finished
nearly the whole. (ઘે દ૱દ શીનીસડ નીઅર્લી ધ હોલ્ય)

તેઓ ધારું કરીને વાણીયા હતા They were mostly banias.
(ઘે વેર મોસટદી બનીયાઝ)

નાનાં નાનાં છોકરાં બણ્ણું કરીને હોંશિયાર હોય છે Young boys
are generally clever (પંગ બોયું આર જનરલી કોચર)

ધારું કરીને તે ખારમી તારીખે જણો He will probably go on the 12th (હી વીલ પ્રોફેચર્શી ગો ઓન ધ ટુવેલ્થ)

આ વર્ગના છોકરાએં ધારું હંશિયાર છે The boys of this class are very clever. (ধ બોયન એસ ધીસ કલાસ આર વરી કલેવર)

ધારું કરીને એવી વખતે એમ કહેણું ધારું બેઅહાથી ભરેણું છે It is very rude to say so, especially at such a time. (હી મંજ વંદી ડડ ટુ'સે સો, એક્સપેશનાથી એટ સચ ગો ટાંગ)

તે ફુશિયાર પણ આગામી છે He is diligent but careless. (હી કાઝ ડીલીજન્ટ બટ કેરલેસ)

તેઓ પણ જણો They will also go. (પે ઉચ્ચીં એલસો ગો) તે પણ માંની હતી She too was sick. (શી હુ બેગ સીક)

વાંચન પાઠ ૫૩ મે.

વાંદો, તકરાર Dispute (ડિસ્પ્યુટ)	પહેલો First (ફર્સ્ટ)
ઉભા રહેણું To stand (ટુ સ્ટેન્ડ)	ધારુંકરીને Generally (જનરલ)
ગ્રાજું Crowd (ક્રેડિટ)	વર્ગ Class (કલાસ)
જાણું-માણુસ Persons (પર્સન્સ)	જાણનું To keep (ટુ કીપ)
સિવાય Without (વિધાઉટ)	વચ્ચે Between (બિટવિન)
સિવાય Unless (અનલેસ)	વચ્ચે, અધ્યમાં Middle (મીડિયન)
સિવાય But (બિટ)	વચ્ચે Among (એમેંબ)
સિવાય Except (એક્સેપ્ટ)	કણાએં Quarrel (ક્વોરલ)

તે હિપરાંડ Besides (અનીસાઈડાડ)	કળગો થનો To break out
ધનામ મળવું To get reward	(કુ એક રીવર્ડ) (કુ એક આઉટ)
બોક્સ Book (બુક)	હાજર Present (પ્રેશન્ટ)
આપવું To give (કુ ગીવ)	તને Thee (ધી)
વચ્ચે Amidst (ગેમિડસ્ટ)	સખાના All (ઓલ)

મારી અને તેની વચ્ચે વાંધા છે There is a dispute between me and him. (ધેર મણ એ હિસ્ટ્યુટ થીટ્વીન મી એન્ટ ધીમ)

આ લોકરો બાળોખરો વર્ગમાં પંદલા રહે છે This boy generally keeps first in the class. (નિસ હોય જનરલી ક્રીસ ઇન્ફર્ટ દાન ધી ક્લાસ)

તે માલુમો વચ્ચે કળગો થનો A quarrel broke out among those persons. (એ કંતોરલ્ લિાંડ આઉટ એમંગ ધિઅ પર્સન્સ)

તે લોકની વચ્ચે ઉંમો હનો He was standing amidst the people. (હી ધોં રેન્ડિગ એમીડસ્ટ ધ પીપલ્સ)

તેના સિવાય તેઓ દેર પાછા ગયા They returned home without him. (ધે રીટર્ન હોમ વીધાઉટ ધીમ)

તારા જીવાય અધ્યા હાજર હતા All were present but thee. (ઓલ વેર પ્રેશન્ટ વાટ ધી)

તે એકી સિવાય સખાનાને ધનામ મળવું All were rewarded besides that girl. (ઓલ વેર રીકાર્ડ અનીસાઈડાડ ધેટ ગર્ડ)

તે એપણી આવા સિવાય હું તેને જવા નહિ હજ I will not let him go, unless he gives me that book. (આચ જીવીં નોંધ લેટ હીમ ગો, અનલેખ હી જીવી મી ધેર છુક)
મારા સિવાય બધા માંદા પણા All took ill except me.
(એથી હુક ઈજ એકસેપ્ટ મી)

મેતીકાલ અને ચમનલાઈ વરંચ તકરાર છે Their is a dispute between Motilal and Chimanbhai. (ધેર ધજ અન્નાનુઠ વીટાનિન, મેતીકાલ અન્ન ચમનલાઈ)

વાંચન પાઠ ૬૭ મા.

હિન્દી Only (એનાની)	જાઈ Lady (લેડી)
શાવર Shower (શાવર)	લેમાય છે Looks (લુફ્ટસ)
ભીડળવું Wet (હેઠે)	એકદીં Alone (અલોન)
બદલતું Change (ચંચા)	માગનાર Temper (ટેમ્પર)
કપડાં Clothes (કલાદિ)	સુકન્વા Dry (ઢાય)
સુરજ Sun (અન)	પાડ Lesson (લેસન)
ચંદ્ર Moon (ભૂન)	શીખનાં Learning (લાર્નિંગ)
પ્રદાશે છે Shines (શાદનસ)	અભ્યાસ કરવો Study (સ્ટડી)
ઝુસિયાર Intelligent, Clever (ઇન્ટેલીજન્ટ, ક્લેવર)	દેખાતું Appear (એપીએર)
મરજી Desire (ડીડાયર)	બેહેન Sister (સીસ્ટર)
દનામ Reward (રીવાઉન્ડ)	અરસે Angry (અંગરી)

તેંદુકા જાપણું ૬૭ It was only a shower. (દુઃખ વોનાની આ શાવર)

તમે લીનાઈ રહ્યો You will get wet. (યુ જીવિક ગેટ ઉવેટ)
 શું તમે લીનાઈ ગયા ? Did you get wet? (ડીડ યુ ગેટ ઉવેટ)
 હું લીનાઈ ગયો છું I have got wet. (આઈ હેવ ગોટ ઉવેટ)
 તેનાં કપડાં બદલો। Change his clothes. (ચેંચ-જ હીજ કલોએડ)
 આ કપડાં સુકનો Dry these clothes. (જીય ધીસ કલોએડ)
 તરફાં ચઢ્યા માંઝો છે The Sun is coming out. (ધી સન
 એજ કમીગ આઉટ)

ચંદ્ર પ્રકારો છે The Moon shines. (હી મુન શાર્ટ-મ)
 ચાંદરાત કયારે દેખાશે ? When will the new moon
 appear ? (વહેન ઉરીસ થી ન્યુ મૂન એપીયર એ)
 આ આઈ કોણ છે ? Who is this lady ? (હું ઇન ધીગ લેડી એ)
 તે ભારી એકેન હતી She was my sister. (શી કાર ભાઈ રીન્ટર)
 તેને જાહને પુંચા Go and ask her. (ની જાહન ચારક દર)
 તે ભારી સાથે ગુરુસ હે She is angry with me. (શી એ
 એન્થી જિનીથ ગી)

તે તમારી સાથે કેમ ગુરસે છે ? Why is she angry with
 you ? (જ્ઞાગ એજ શી એન્થી જીવિથ યુ ?)

આજે ભારા શેડ ધણ્ણા ગુરસે દેખાય છે My master looks
 very angry to-day. (માય મારટર લુકસ વેરી
 એન્થી કુ-ટે)

અને છેડના ના, અને મિનજ ગંયદો છે Let him be alone,
 he has lost his temper. (લેટ હીમ થી અલોન, હી
 લેટ હોસ્ટ હીજ ટ્રેપર)

તેણું મારી સાથે કળ્યાં કર્યો He fell out with me. (ડી
ફેલ આઉટ ઉવીથ ભી)

તમારે મારી સાથે ગુરુસે બનું નહીં જોઈએ You should not
be angry with me. (મુશુક નોટ બી એન્થી
ઉવીથ ભી)

તે મારી સાથે ગુરુસે હતો ? He was angry with me. (ડી
ઉર્ફાઝ એનથી ઉવીથ ભી)

તમે શાને માટે ગુરુસે છો ? What are you angry about ?
(ઉર્ફાટ આર યુ એન્થી એઆઉટ ?)

તમે અહીંથાં શું કરો છો ? What are you doing here ?
(વોટ આર યુ દુંધગ લિઅર ?)

હું મારો પાડ શીખું હું I am learning my lesson. (આમ
એમ લર્નિંગ માચ લેસન)

તેને અભ્યાસ કરવો ગમે છે He likes to study. (ડી લાઈઝ
હું રસ્ટડી)

વાંચન પાડ પણ મો.

બન્યું, થયું Happened (દંપણ)	પા Quarter (કર્ફાર્ટ)
અક્સમાત Accident (એક્સસીડન્ટ)	થઈ ગેલો Past (પારસ્ટ)
અરધી Half (દાઢ)	હાથ Hands (હુ-ડાથ)
મીનિટો Minutes (મીનિટ્સ)	કાર્ય, સંભાળ Care (કર)
ટોપ Gun (ગુન)	દુંગ Cold (ડાલ)
ફાર્ડી Fired (ફાઇર્ડ)	વખત Time (ટાઈમ)
ટેન Ten (ટેન)	ઘડીઆળ Clock (ક્રોક્સ)

જુલી ગયો Forgot (હરગોટ)	ખાંચું કણાતી Too fast (હંકાર)
કુંચી આપરી Wind (ઉવાઈન્ડ)	ધરણું ધીમું Too slow (હુસ્લે)
બંધું પણ્યું Stopped (સ્ટોપ)	અગડેલું Out of order (આઉટ બરેઅર Right (રાઇટ)
માંડતું Set (સેટ)	જરૂરા, ઓરડેન્ચ Room (રૂમ)
પથારી Bed (બેડ)	કુંચી Key (ક્રી)
દીવો Lamp (લેમ્પ)	ઉડતું Rise (ગ્રાહણ)
અતી Light (લાઇટ)	ઓઝવાઈ બની Extinguished
સૂરજ/ઉગતાં Sun-rise (સન-રાઈસ)	(એક્સટિંગ્શિશન)
હોકારી નાંખડી Put out (પુર આઉટ)	સુધી Till (ટ્રીલ)
તેલ Oil (ઓલ લી)	ઉડ્યું Get up (ગેટ અપ)

લાં કંઈ બન્યું છે Something has happened there.

(રામથીગ હેડ હેપ-એર)

કંઈ બન્યું નથી Nothing has happened. (નથીગ હેડ હેપ-એર)
શું બન્યું હતું ? What had happened ? (ઉગોટ હેડ હેપ-એર ?)
એ કારે બન્યું ? When did that happen ? (ઉઘેન ડીડ
ધેટ હેપન ?)

તેને શું થયું છે ? What has happened to him ? (ઉગોટ
હેડ હેપ-એર હું લીમ ?)

તેલ્લીને અક્રમાન થયો છે She had an accident. (થી હેડ
એન એક્સીડન્ટ)

મારા હાથ ઠંડા છે My hands are cold. (માય હેન્ડ્સ
આર ઠંડા)

હું તેણી સંભાળ કરશા I will take care of him. (આપ ઉચ્ચીલ ટેક કર એહ હીમ)

તે મારી એજાખીયિંતી હતી She was my acquaintance. (શી વોઝ આજાય એકરેન્ટસ)

તમે શું કહો છો ? What do you say ? (ઉંવાટ કુ યુ સે ?)
શેદ્ધા વાગ્યા ? What's the time ? (ઉંવોટસ ધી વાટસ ?)

સાથ સાત Quarter past seven. (કનાર્ટર પારટ સેન)
સાથ દાં Half past ten. (દાં પારટ ટેન)

સાતને પંચ મીનિટ Five minutes past seven. (કનેન
મીનિટસ પારટ સેન)

આઠમાં ચાર મીનિટ કમ Four minutes to eight. (કાર
મીનિટસ કુ એફાઈ)

હજુ દશ વાગ્યા નથી It is not ten yet. (દાં દાં નોટ ટેન નથી)

તોચ પડી કે ? Has the gun fired ? (ટેંક ધી ગન ફાઇર્ડ ?)

હજુ પડી નથી It is not yet fired. (દાં દાં નોટ પટ ફાઇર્ડ)

કેટલા વાગતે તોચ પડે છે ? At what hour is the gun
fired ? (ઓટ ઉંવોટ અનર પટ ધી ગન ફાઇર્ડ ?)

બાર વાગતે At twelve o'clock. (ઓટ ટ્વેલ્વ એંક્લોક)

તમારું ખડીઆળ ધાંયું ઉત્તાવળું છે Your clock is too fast.

તંતુ ઘડીઆળ બગડેલું છે His clock is out of order.

(હીજ કોર્ક ચીજ આઉટ એસ્ટ એર્ડર)

હુ ને કુંચી આપવાની જુદી બયો I forgot to wind it up.

(આઇ ફર્ગોટ હુ ઉવાઇન્ડ ઇપ અપ)

ઘડીઆળ અંધુ પણ હતુ The clock had stopped. (મી
કોર્ક હંડ સ્ટોપ)

ઘડીઆળને કુંચી આપો Wind up the clock. (ઉવાઇન્ડ
અપ ધી કોર્ક) .

મનો મારા ઓસરડાની કુંચી આપો Give me the key of my
room. (ગીવ મી ધી ક્રી એસ્ટ માર્ય ઇમ)

તમારી પાસે તે કુંચી છે કે નહિ? Have you got the key
or not? (હેવ હુ ગોંડ ધી ક્રી એસ નોટ?)

એ, મારી પાસે તે કુંચી છે Yes, I have got the key.
(યસ, આઇ હેવ ગોંડ ધી ક્રી)

અમારી ઓસરડામાં દીવો છે We have a lamp in our room.
(ઉરી હેવ આ લેમ્પ ઇન અવર ઇમ)

બની એક્ષન્ટાઈ ગઈ હતી The light was extinguished.
(ધી લાઇટ વેઅ એક્સટાઈખિસ્ટ)

દીવો લાવો Bring a lamp. (ભી-ન આ લેમ્પ)

ખતી જગતાવો Light the lamp. (લાઇટ ધી લેમ્પ)

ખતી હોલ્ડાની નાંબો Put out the light. (યુ આઉટ ધી લાઇટ)

દીવામાં તેજ નથી There is no oil in the lamp. (ધેર
ઇજ નો ઓઇલ ઇન ધી લેમ્પ)

અમે સુખા જાઈએ છીએ We go to bed. (હજી ચો કુ બેડ)

કષ્ટ સુવાનો વખત નથી It is not yet time to go to bed.

(ઈં દાં નોટ પટ શાઈમ કુ ચો કુ બેડ)

તમે વહેલા ઉડાના નથી ? Do you not rise early ? (કુ યુ
નોટ રાઈઝ અર્દી ?)

શુરૂ ઉગતાં હું ઉઠું હું I rise at sunrise. (આઈ રાઈઝ
એટ સનરાઈઝ)

મને આજે વહેલા ઉડાડને Wake me up early to morrow.
(ઉવેક મી અપ અર્દી દુ-મોરો)

મને નવ વાગ્યા સુધી ઉડાડના નહિ Do not wake me up
till 9 o'clock. (કુ નોટ ઉવેક મી અપ રીલ નાર્ડન
ગોંકલોાંક)

ઉડવાનો વખત થયો છે ? Is it time to get up ? (એજ એ
ટાઈમ કુ ગેટ અપ !)

વાંચન પાઠ પણ મો.

કપડા પહેરવાં Dress (ડેસ) પેસાયખાતું, સંપત્તિ Waller

ઓ Sleep (રહીય) closet (ઉવેટર-કર્નાચેર)

ઉઠું Rise up (રાઈઝ અપ) નાહયાની જગ્યા Bath-room

મોહું Late (લેટ) (ખાથ-નથ)

લાગું Feel (ફીલ) નાહાતું Bathe (બેથ)

અં During (પ્રયુક્તિન) એલાયાન મેલ્લાતું Send for

જાગેણ Awake (અવેક) (સેન્ટ ફેર)

શાત Night (નાઇટ) બાલમ Barber (બાર્બર)

અખતાં Sleeping (રહીપીંગ)	ગરમ Hot (હોટ)
શેડ Master (માસ્ટર)	પાણી Water (વાટર)
ગામ Village (નીલેજ)	ચાખુ Soap (સોપ)
ઉભા રહેણું Stay (રે)	ચુક્ણુ Put (પુટ)
થોડા Few (કુટુ)	ફ્લાપ્પ નેપ્પિન Napkin (નેપ્પિન)
સગાં Relatives (રાંગેરીઓ)	ઓળાણું Comb (કાળાં)
તરફ At (આટ)	વાળી Hair (હૈર)
લઈ જન્યુ Take (ટેક)	બુલ્લા Brush (બુલ્લા)
દ્વાં ખાવા Change of air (બેન્જ એન્ડ એર)	રહેણું Beside (જીમાઇડ)
ઉંડા ને કયડાં પહેરો Get up and dress yourself. (ગેટ અપ એન્ડ ડ્રેસ યોર્સેલ્ફ)	પાણી ફરજું Return (રીટર્ન)
તેને ઉધ કેમ આવી ? How did he sleep ? (હાઉ હીડ થી રહીપ ?)	
તમે એટખા મોદા કેમ ઉડાા ? Why did you get up so late ? (બાય હીડ કુ ગેટ અપ રો લેટર ?)	
હું ધણો મોદા સુતો I went to bed very late. (આધ ઓન્ટ કુ એડ વરી લેટર)	
મનો ઉચ આવતી નથી I do not feel sleepy. (આધ કુ નોટ શીલ રહીપી)	
દાવસં સુવું સારે નથી It is not good to sleep during the day. (ઇટ છાં નોટ શુફ કુ રહીપ રહુરીંગ ધી તે)	
હું પાંચ વાગને જાગોા I awoke at five o'clock. (આધ અવોઅ ઓટ ફ્લાઇવ એકલોઅ)	

આજે સફારે તે વહેલો ઉડ્યો. He got up early this morning. (હી ગોટ આપ અર્જી ધીસ મોનીંગ)

તે ઉડ્યો કે ? Has he got up ? (હેજ હી ગોટ અપ ?)

તે ઉદ્ધે છે He is sleeping. (હી ઘણ સ્થીપીંગ)

તેને ઉકાડો Wake him up. (ઉવેક લિમ અપ)

મારા શેડ ઉકયા કે ? Has my master got up ? (હેજ માય માર્ટર ગોટ અપ ?)

તેઓને જઠને ઉકાડો Go and wake them up. (જો એન્ડ ઉવેક ધેમ અપ)

પેશાઅ કરવાની જગ્યા ક્યાં છે ? Where is the water-closet ?
(ઉન્ડેર ધજ ભી ઉયોટર-ક્રોનેક ?)

નાલાવા ની જગ્યા ક્યાં છે ? Where is the bath room ?
(ઉન્ડેર ધજ ધી બાથ-રૂમ ?)

તમારે નાનું છે ? Do you wish to bathe ? (તુ યુ ઉનીશ કુ બેથ ?)

ધા, હું નાલાવા કરું છું Yes, I wish to bathe. (ધસ. આઈ ઉનીશ કુ બેથ)

તમે એક લખમને પોલાવા મોકલશો ? Will you send for a barber ? (ઉનીલ યુ સેન્ડ ફેર આ બાર્બર ?)

નાલાવાને ગરમ પાણી લાવો Bring hot water to bathe.
(ધીંગ હોટ ઉયોટર કુ બેથ)

હું નાલાવા જંડિ છું I am going to bathe. (આઈ એમ જોઈગ કુ બેથ)

મને પેલો સાખુ નહિ આપો ? Will you not give me that soap ? (જીવિશ કુ નોટ ગીવ ભી ધેટ સોપ ?)

તમે રૂમાન્સ મુક્યો ? Did you put the napkin ? (હીડ કુ
પુટ ધી નૅપક્રોન ?)

મારે મારા વાળ ગોણવા છે ? I wish to comb my hair ?
(આર્મ ઉનીશ કુ ડ્યાંગ માય ફર ?)

તે શા મારે જન્ય છે ? What is he going for ? (ઉંઝાટ
ઇજ લી જોઈંગ હોર ?) .

કુ નેઓ મુંગઘ જન્ય છે ? Are they going to Bombay ?
(આર કુ જોઈંગ કુ બ્યામ્પો ?)

ના, તેઓ નથી જન્ય No, they are not going. (નો, એ
આર નોટ જોઈંગ)

તમે ગામ જાંચા છો ? Are you going to a village ?
(આર કુ જોઈંગ કુ આ વીલેજ ?)

તમે તાં રહેણા જાઓ છો ? Are you going to reside
there ? (આર કુ જોઈંગ કુ રીમાછડ ધેર)

ના, મુંગઘમાં કું ફક્ત થોણ દલાંગ રહીશ No, I shall stay in
Bombay for a few days only. (નો, આછ શેલ
કે ધન એન્ને કોર આ ક્યુ તેઝ એનલી) .

તાં તમારાં કોઈ સગાં છે ? Have you any relatives there?
(હેઠ કુ એન્ની રીલેટીવ ધેર ?) .

મારો પાપ દમણાં સુરતમાં છે My father is now at Surat.
(માય દ્રાધર ઇજ નાઉ એટ સુરત)

તમે સુરત થા આર નાઓ છો ? What takes you to surat?

(નહોટ ટેઇકસ કુ કુ સુરત)

હુ ત્યાં કંઈ કામ સાર નાઈ છું I am going there on some business. (આઈ એમ ગોઈંગ ધેર એનાન સમ બીજનેસ)

હુ ત્યાં હવાભાવા નાઈ છું I am going there for a change of air. (આઈ એમ ગોઈંગ ધેર ફેર આ ચેન્જ એન એર)

તમે પાછા કયારે આવશો ? When will you return ? (ઉંહેન ઉનીલ કુ રીટર્ન ?)

હુ બોધા દાદાઓમાં પાછા આવીશ I shall return in a few days. (આઈ રોલ રીટર્ન છન આ ઇન્ડુ ડેઝ)

વાંચન પાઠ ૫૭ મા.

સુખી Happy (હેપી)	મદીનો Month (મન્થ)
સુસાઈરી Journey (જર્ની)	પણ, વળી Too (કુ)
મળયું Received (રીસિવ)	નુંબાન Young (પંગ)
શહેર Town (ટાઉન)	છાકરી Miss (મીમ)
નક્કી,ચોક્કસ Certain (સરટન)	તે પોને Herself (હર્સેલ્ફ)
બીજું,આવતું Next (નેક્સ્ટ)	ધરડી Old (એલ્ડ)
મેઠા છેકરે Master (માસ્ટર)	દણ Still (સ્ટીલ)
મોડું Large (લાર્જ)	તેન્ડું Broke off (બ્રોક એફ)
કુંઘ Family (હુમીલી)	ટાઈ Match (મેથ)
માણુસો Men (મેન)	પોતાની ભાયડી Wife (વિઝ)

પરણુલો Married (મર્યાદ) રંગલી Widow (ઉડીડા)

એકલો Single (સીંગલ) શખસ Fellow (ઇંઝો)

કુંબારી Bachelor (બેચેલર) રંગલો Widower (ઉડીડાઓ)

હું તેને સુખી ગુસાઈ ધર્થું છું I wish him a happy
journey. (આએ ઉવીલ હીમ આ હેપી જર્ની)

તે ભાર્યા ગયો છે He has gone to Broach. (હી હેજ
ગેન કુ ભોગ્ય)

તે પાછા કયારે આવશે ? When will he return ? (ઉંહેન
ઉવીલ હી રીટર્ન !)

તે આવના અડવાડીઆમાં આવશે He will come in the
next week (હી ઉવીલ કેમ ધન એ નેક્સ્ટ ઉવીડ)

તમે તે હેમ જાણ્યું ? How did you know that ? (એડ
હીડ યુ નો ઘેટ ?)

મને કાગળ મણ્યા હતો I had received a letter. (આએ
હેડ રીસેપ્ટ આ લેટર)

તમને સુરત કેવું લાગે છે ? How do you like Surat ?
(એડ કુ યુ લાઈક સુરત !)

મને તે શાહી વાગ્યું ગમે છે I like that town very much.
(આએ લાઈક ટૉન ટાઉન વરી મચ)

તમે પાછા ત્યાં કયારે જશો ? When will you go back
there ? (ઉંહેન ઉવીલ યુ જો બેક વેર ?)

તે ચોક્કસ નથી It is not certain. (એ એજ નોટ સરટન)

તુંને મહીને હું પુને જાણશી Next month I shall go Poona.
(નેક્સ્ટ મુન્ટ્ય આએ રોજ જો હું પુના)

હું તમારી સાથે આવીશ I will come with you. (આઈ
ઉવીલ કમ ઉવીથ યુ)

પેઢી જુવાન આઈ કોણ હતી ? Who was that young lady ?
(હું વોળ ઘેટ ચંગ લેણી ?)

ત તેણી પેણે છે It is she herself. (કેરી દક્ષ શ્રી દરસેલ્લી)
ને ધરતી આઈ કોણ છે ? Who is that old lady ? (હું દક્ષ
ઘેટ ઓછા લેણી)

હું તેને ઓળખતો નથી I don't know her. (આઈ ડો-ટ નો હર) ને
પેઢો જુવાન શાખસ કોણ છે ? Who is that young man ?
(હું છક ઘેટ ચંગ મેન ?)

ગામજુનો છોકરો Master Ramjee. (માસ્તર ગમજ)
તેનો મોકું કુંઠા છે He has a large family. (દી ડેઝ આ
દાર્ઢ હેમીફી)

તેઓ સારાં માણુસ છે They are good men. (પે આર ગુડ મેન)
તમે પરણુલા છો કે ? Are you married ? (આર યુ મેરીડ ?)
તેઓ પરણ્યા છે કે ? Are they married ? (આર પે મેરીડ ?)
નાંભ, હું કુંવારો નાંભ No, I am a bachelor. (નો, આઈ ઓમ
આ એચેલર)

તમે કયારે લગત કરવાના છો ? When are you going to
marry ? (ઉદ્હેન આર યુ ગોઈગિ હુ મેરી ?)

આર હમણાં પરણ્યાનું નથી, I don't like to marry now.
(આઈ ડો-ટ કાઢુક હુ મેરી નાંભ)

ଓમ કેમ ? Why so ? (ઉવાદ સા ?)

કારણ હું નાનો છું Because I am young. (એડોઝ આઈ
અમ વંગ)

તમારો ભાઈ પરણું છે કે ? Is your brother married ?
(દાંડ યોર બધર મરીડ ?)

ના, તે કુંવારા છે No, he is a bachelor. (ના, હી દક આ એચેકાર)
તે હજ કુંવારા છે ? Is he still a bachelor ? (દક હી સ્વીક
આ એચેકાર ?)

તેણું કાર્બ તોડકું He broke off the match. (હી એડ
ઓડ ધી મંચ)

મેં જાગરી કાંઈ I took a wife. (ચાઈ હુક આ ઉવાઈંડ)
તેણું પરણું છે કે ? Is she married ? (દાંડ શી મરીડ ?)

તેણું રંગમણી દું She is a widow. (શી દક આ ઉવીંડા)
અને પેંડો ? And that man ? (ટાંડ ધેટ મેન ?)

તે પણ રંગમણી છે He is also a widower. (હી દક
એલ્સો આ ઉવીંડાથર)

આ ભાઈ કોણ છે ? Who is this lady ? (હુ કંજ ધીસ લેડી ?)

વાંચન પાઠ ૫૮ આ.

લાય છે Is passing
(દક પાસીંગ)

અણાર નીકળ્યા Set out
(સેટ આઉટ)

દરજ Tailor (ટેલર)

ચુથાર Carpenter (કારપેન્ટર)

પહેરતું Put on (પુટ ઓન)

પાદરી Turban (ટર્બન)

આથે To gether (કુ ગેધર)	ઉચ્ચાઈ Height (હાઇટ)
આશા રાખવી Hope (હોપ)	મોટ પુરી Made up loss (મેડ અપ લોસ)
હોલ્ડ પામવું Succeed (સક્સીડ)	આભારી Thankful (થૈન્કફુલ)
શકતો નથી Cannot (કેન્નોટ)	નાઓદ કરવું Disappoint (ડિસપ્પોઇન્ટ)
ઉપકારી Obliged (ઓફાલાઇગ્ડ)	-
તંત્ર, સરવું Same (સેચમ)	મને To me (કુ મી)
આગ્રાહી Request (રીકેર્ડ)	તરાવીજ કરવી Try (દ્રાય)
ધાર રાખવું Remember (રીમેમન)	સૌથી માર્ગ Best (બેસ્ટ)
તે કોણ જન્ય છે ? Who is that passing ? (કુ એ હંડ પાસીંગ ?)	હંત, મહેરાલી Fair our (ફેનર)
તેણે મને જોયો નહિ He saw me not. (દી સ્ના ની નોટ)	કંઈ નાય Nothing (નથીં)
તે પોતા અદીયાં છે He himself is here. (દી દીમસેન્ડ એઝ હીઅર)	
તેઓ સાથે નીકળા They set out. together. (મિ સેટ આઉટ ટુગેધર)	
તે વેર પાછો આંગ્રો He returned home. (દી રીટર્ડ હોમ)	
શું તે ટરણ છે ? Is he a tailor ? (એ હી આ ટેલર ?)	
નહિ, તે મુખાર છે No, he is a carpenter. (નો, દી એ આ કારપેન્ટ ?)	
તેઓ ડ્રપાં પહેરે છે They put on their clothes. (દી પ્રાન ઓન પેર ફોસ્ટ)	

ਕੁ ਤੇਨੀ ਪਾਥਡੀ ਪਹੈਂਦੇ ਛੁ I put on his turban. (ਆਪ ਪੁਟ
ਅਨ ਹੀਂਡ ਰਿਣਨ)

ਤਮੇ ਤੇਨੀ ਉਮਰ ਹੁੰ ਖਾਰੋ ਢੋ ? What do you think his
age to be ? (ਓਵੋਟ ਕੁ ਧੁ ਥੀਂਕ ਹੀਂਡ ਏਜ ਕੁ ਥੀ ?)

ਤੇ ਮਾਗ ਕੇਟਕੋ ਉਚੋ ਛੇ He is of my height. (ਲੀ ਪੱਡ
ਗੋਝ ਮਾਗ ਫਾਟ)

ਤੇਣੀ ਨੇਮਾਂ ਇਨੇਕ ਪਾਮੀ She succeeded in it. (ਸੀਅਕਸ਼ੀਓਤ
ਇਨ ਇਟ)

ਕੁ ਤੇਮਾਂ ਇਤੇਹ ਪਾਮਰਾਨੀ ਆਸਾ ਰਾਖੁਂ ਛੁ I hope to succeed
in it. (ਆਪ ਹੋਪ ਕੁ ਸਕਸੀਓਤ ਇਨ ਇਟ)

ਮਾਰੀ ਘਾਨਰੀ ਛੇ ਕੇ ਤੇ ਨਮਾਚਾਥੀ ਥਹੋ ਨਹਿ I am sure you
cannot do that. (ਆਪ ਏਮ ਸਥੁਰ ਧੁ ਇਨਨੋਟ ਕੁ ਥੇਟ)

ਤੇਥੇ ਤੇਨੀ ਯੋਟ ਪੁਰੀ He made up his loss. (ਹੀ ਮੇਡ
ਅਪ ਹੀਂਡ ਲਾਸ)

ਕੁ ਤੇਨੋ ਆਭਾਰੀ ਛੁ I am thankful to him. (ਆਪ ਏਮ
ਬੇ-ਕਲੁਲ ਕੁ ਲੀਮ)

ਕੁ ਏਮ ਕਹੀ ਸ਼ਾਕਤੋ ਨਥੀ I cannot say so. (ਆਪ ਇਨਨੋਟ ਸੇ ਸ੍ਵਾ)

ਕੁ ਇਮਣਾਂ ਤਮਨੇ ਕਹੀ ਸ਼ਾਕਤੋ ਨਥੀ I cannot tell 'you now.
(ਆਪ ਇਨਨੋਟ ਟੱਕ ਧੁ ਨਾਹਿ)

ਕੁ ਪਾਣੀ ਆਵੁਂ ਲਾਂ ਸੁਖੀ ਵਾਟ ਨੇਣੇ Wait till I return.
(ਓਵੇਟ ਰੀਲ ਆਪ ਰੀਟਨ)

ਕੁ ਤਮਾਰੀ ਮੋਟੋ ਉਪਕਾਰ ਮਾਨੁਂ ਛੁ I am much obliged to
you. (ਆਪ ਏਮ ਮਤ ਸੋਭਲਾਈਓ ਕੁ ਧੁ)

તेनुં કાંઈ નહિ It does not matter. (દીક્ષા નોટ મેટર)

મારે બધું સરખું છે It is all the same to me. (દીક્ષા એવું થી સેધમ કુ મી)

તમારે મારે મારાચી બનસો તેટલું કરીશ I will try my best for you. (આઈ ઉનીલ ટાય માય એન્ટ હેઠ યુ)

તમે તેના ઉપર એક મહેન્યાની કરશો ? Will you do him a favour ? (ઉંબીલ યુ કુ હીમ આ હેવર ?)

મને ના ઉમેદ કરતા ના Do not disappoint me. (કુ નોટ હીસએપોઈન્ટ મી)

મેં તેને અરજ કીયી I requested him. (આઈ રીકંસટ હીમ)

હું તમને અરજ કરે છું I request you. (આઈ રીકંસટ યુ)

તમને તે યાદ છે ? Do you remember that ? (કુ યુ રીમેમ્બર ઘેર ?)

તમને તે યાદ છે ? I remember it. (આઈ રીમેમ્બર દીક્ષા)

તમને શું યાદ છે ? What do you remember ? (ઉંબાટ કુ યુ રીમેમ્બર ?)

તમે કાંઈ યાદ નથી I remember nothing. (આઈ રીમેમ્બર નથીંગ)

તમે પેલી ચાપડી લાગ્યા કે ? Did you bring that book ? (ડીક્ષા યુ ભીગ ઘેર યુક ?)

ના, ભૂલી ગયો No, I forgot to bring it. (નો, આઈ ઇસગોટ કુ ભીગ ધ્યા)

દાંચન ખાડે રહ્યું મેલા.

શુદ્ધી ગયો Forget (ફરગેટ)	સેફરકાર Careless (કેરલેસ)
જરૂર Positively (પોઝિટિવલી)	ગાતું Sing (સૉંગ)
ચુક્કણું Fail (ફેલ)	ગીત Song (સૉંગ)
ચાદ દેવાડ્યું Remind (રીમાઇન્ડ)	ગમણું Like (લાઇક)
બેખાંનું એક Either (ઇથર)	ત્યારે Then (થેન)
નેથેણું Seen (સીન)	શીખણું Learn (લર્ન)
લીધી Taken (ટેકન)	અંગ્રેજ English (ઇંગ્લિશ)
લાલું Low (લો)	ભાડેસો રાખવો Depend (ડિપેન્ડ)
ઓટેથી Aloud (એલાઉડ)	બોક્સ Word (વર્ડ)
ધરીયાળ Watch (ઓવેચ)	પાણવા Keep (કીપ)
જોઈએ Want (ઉચાન્ટ)	તોડું Break (બ્રેક)
વચ્ચનાથાપણું Promise (પ્રોમીસ)	આશા રાખવી Hope (હોપ)

હું તે કાવવાનું શુદ્ધી ગયો I forgot to bring it. (આછ ફરગેટ
કું થીંગ છટ)

કાઢે તે જરૂર લાવનો Bring it positively to morrow.
(થીંગ છટ પોઝિટિવલી કું-મેરો)

તે કાવવાને ચુક્કતા ના Don't fail to bring it. (રીમાઇન્ડ ની
કું થીંગ છટ)

તે વિષે ભને ચાદ દેવાડનો Remind me of it. (રીમાઇન્ડ મી
એચ છટ)

હું કાઢ તે કાચીય અથવા મીઠલીય I will either bring it
or send it. (ચાદ કિલીય કાંધિર થીંગ છટ એથર સેન્ડ છટ)

મને આ ચોપડી બેઠાંએ છીએ I want this book. (આઈ
ઉંનાંટ ધીસ છુક)

આ ચોપડી તમારા ભાઈને આપને Give this book to your
brother. (ગીવ ધીસ છુક હુ યોર અધર)

હંક જણો મારી ચોપડી લાનો Go down and bring my
book (જો અજિન એન્ડ ખીંગ માય છુક)

તમે મારી ચોપડી કંદા હો ? Have you seen my book ?
(હેવ યુ સીન માય છુક ?)

તંબે કઈ ચોપડી લીધી છે ? Which book has he taken ?
(ઉંનીય છુક હેડ હી ટેકન ?)

તે ધર્ભો એસ્ટ્રક્ટર છે He is very careless. (હિ એ કેરી ડેરલેસ)

તમે એક ગીત ગાવો You sing a song. (યુ સીંગ આ સાગ)

મને ગાતાનું નથી ગમતું I don't like to sing. (આઈ ઓન
લાઈક હુ સીગ)

તારે તમને શું ગમે છે ? What do you like then ?
(ઉવોટ હુ યુ લાઈક વેન ?)

મને અંગ્રેજ શીખાનું જમે છે I like to learn English.
(આઈ લાઈક હુ લર્ન ઇંગ્લિશ)

તમે "ઇંગ્લીશ ટીચર" વાંચો You read "English Teacher"
(યુ રીડ "ઇંગ્લિશ ટીચર")

તે ઇંગ્રેજ સાઁડ બોલે છે He speaks English well. (હી
ર્પીકસ ઇંગ્લીશ કિલેસ .)

તમે એટલું ખીસું થું કામ બોલો છો ? Why do you speak so low ? (જાય કુ હુ ર્પીક સો લો ?)

તમે મોટેથી બોલી શકતા નથી ? Can't you speak aloud ?

• (કાન્ટ હુ ર્પીક એલાઉં ?)

તમે મને તે ઘડીઆળ નહિ આપો ? Will you not give me that watch ? (ઉચીલ હુ નોટ ગીવ મી ધેટ ઉવોઅ ?)

તમને તે જોઈએ છો ? Do you want it ? (હુ હુ ઉવોઅ હેઠ ?)
હું તમને તે કાલે આપીશ I will give it to you to-morrow.

(આઈ ઉચીલ મીન દટ હુ હુ હુ-મોરો)

તમે તે આપવાને વચન આપશો ? Will you promise to give it to me ? (ઉચીલ હુ પ્રેમીસ હુ ગીવ દટ હુ મી ?)

હું હેઠે તમને વચન આપી શકતો નથી I can't promise you now. (આઈ કાન્ટ પ્રેમીસ હુ નાઉ)

હું તગારા બોલ ઉપર ભરોસો રાખું હું I depend upon your word. (આઈ ડીપેન્ડ અપોન યોર ઉર્ડ)

હું મારો બોલ પાણું હું I keep my word. (આઈ કીપ માય વર્ડ)

હું વચન તોંકું તેવો ભાથુસ નથી I am not the man to break my promise. (આઈ ગોમ નોટ ધી મેન હુ ફ્રેક માય પ્રેમીસ)

વાચન પાઠ ૬૦ મેટુ

વીંશ Twenty (ટેંન્ડી)

ઉછીનું આપવું Lend (લેન્ડ)

ઉછીનું આપું Lent (લેન્ટ)

આભિદાર Respectable

(શીર્ષકટેબલ)

ઉછીના લીધા Borrowed (ઝારોડ)

ओटलું મેટું So late (સો લેટ) બાંકડો Bill (ખીચ)

શોભ્યો Stayed (રહેલ) પૈસા આપવા Pay (પે)

ક્યાથી Whence (ઉન્હેન્સ) રવીવાર Sunday (સનડે)

રકમ Sum (સમ)

તમે જણ્ણો છો કે હું કોણું છું ? Do you know who I am ?
(હું તુ નો હુ આઈ ઓમ ?)

હું પૈસાદાર તેમજ આધુનિક હું I am rich and respectable.
(આઈ ઓમ રીલ્ય એન્ડ રીસ્પેક્ટબલ)

તમે તેવે પાંચ રૂપીઓ ઉછીના આપશો ? Will you lend him
five rupees ? (ઉચીલ યુ લેન્ડ હીમ ફાઇવ રૂપીઝ ?)

મારી પાસે નથી I have not got them. (આઈ હેન નોટ
ગોટ એમ)

મેં વ્યારા રૂપીઓ ઉછીના લીધા I borrowed twenty rupees.
(આઈ બોરોડ ટ્વેન્ટી રૂપીઝ)

હમણુંંજ મેં ઓટલી રકમ તને આપી I just now lent him
that sum. (આઈ જસ્ટ નાઉ લેન્ટ હીમ એટ સમ)

તે તમારી સાથે રહે છે ? Does he live with you ? (એ હી
લીલ ઉવીથ યુ ?)

એ, તે અમારી સાથે રહે છે Yes, he lives with us. (એસ,
હી લીલ ઉવીથ અસ)

પી. ને કહો કે આવે Tell P. to come. (ટેલ્સ પી. હુ કમ)
તેઓ અહીંઓ આવે છે They are coming here. (હે આર
' કમીંઓ હીએર)

તે કોણ છે ? Who is he ? (હુ છન હી ?)

ਤੇਜੇ ਥੁੰ ਜੋਖੇ ਛੇ ? What does he want ? (ਉਚੋਹ ਅੰਕ
ਵੀ ਉਚੋਨਟ ?)

ਤੇ ਥਾ ਸਾਰੇ ਆਗੇ ਛੇ ? Why has he come ? (ਅਲਾਇ ਫੇਝ
ਵੀ ਕਮ ?)

ਤਮਨੇ ਮੋਹੂ ਤੇਮ ਥਥੁੰ ? What made you late ? (ਉਚੋਟ ਮੇਡ
ਧੂ ਲੋਮਟ ?)

ਤੇ ਥੇਰ ਫੱਤੇ। He was at home. (ਹੀ ਉਚੋਝ ਏਟ ਫਾਮ)

ਫੂ ਅਛੂ ਵਾਰ ਥਾਭ੍ਯੋ। I stayed very long. (ਆਈ ਸਟੇਂ ਵੇਰੀ ਲ੍ਯਾਗ)

ਤਮੇ ਨੇਜੇ ਕਿਥਾਂ ਜਿਗੇ ? Where did you see him ? (ਉਨਫੇਰ
ਹੀਡ ਧੂ ਸੀ ਹੀਮ ?)

ਤੇ ਕਾਥੀ ਆਗੇ ਛੇ ? Where has he come from ?
(ਉਨਫੇਰ ਫੇਝ ਵੀ ਕਮ ਰੋਮ ?)

ਤੇਮੇ ਪੁਛੋ ਤੇ ਥੁੰ ਕਹੇ ਛੇ ? Ask him what he has to say ?
(ਆਏ ਵੀਮ ਉਚੋਟ ਵੀ ਫੇਝ ਕੁ ਸੇ ?)

ਜੋ ਆਂਕਤੋ ਲਾਭ੍ਯੋ। He brought a bill. (ਹੀ ਬ੍ਰੋਟ ਆ ਘੀਲ)

ਤਮੇ ਤਮਾਰਾ ਆਂਕਤਾਨਾ ਪੈਸਾ ਆਪਗੇ ? Will you pay your
bill ? (ਉਨੀਕ ਧੂ ਪੇ ਯੋਰ ਘੀਲ ?)

ਮਾਰੇ ਤੇ ਮਾਖੁਸਨੇ ਦਿਧ ਰੂਪੀਆ ਆਪਵਾ ਛੇ। I have to pay the
man ten rupees. (ਆਏ ਫੇਰ ਕੁ ਪੇ ਧੀ ਮੱਨ ਟੈਨ ਰੂਪੀਅ)

ਤਮੇ ਬਾਹਰ ਕਿਹੜੇ ਜਾਓ ਛੋ ? When do you go out ?
(ਉਨਫੇਰ ਕੁ ਥੁ ਜਾ ਆਊ ?)

સવાને હું આડ વાગતે બાહેર જાઉ છું I go out at eight in the morning. (આઠ ગો આઉટ એક ઓછા દિન ધી મોરનિંગ)

આજે સવારે મને ભળાને See me this morning. (રી ગી ક્લિસ મોરનિંગ)

આજે સાંજે ભારે ધેર આવાને Call at my house this evening. (ડોક એટ ભાય હાઉસ ધીસ ધ્વનિંગ)

તમારી ભરજી હોય તો હું તમારે ધેર આનું If you like I may call at your house. (રહ્ય થું લાઈક આધ મે ડોક એટ યોર હાઉસ)

વાંચન પાઠ ૧૨ મેં.

ધેર Home (હોમ)	હોડતા Are running (આર રનીંગ)
ઘર House (હાઉસ)	જરૂર, અચિત Surely (સ્યોરકી)
ચુક્તાનું Miss (મીસ)	લુઝ્યું Fail (ફેલ)
આગગાડી Train (ટ્રેન)	અનતું Suit (સટ)
એટલી ઝડપથી, જરૂરાં So fast (સો ફાસ્ટ)	પૈસા Money (મની)
આના Annas (આનાસ)	બદલતું Change (ચેન્જ)
રસ્તો Road (રોડ)	પ્રાઇસ Market (માર્કેટ)
માર્ગ, રસ્તો Way (ઉંવ)	સ્ટ્રાઇટ Straight (સ્ટ્રેટ)
જરા Rather (રોધર)	આજય On (ઓન)
બંધ Shut (શટ)	વળતું Turn (ટર્ન)
	જગતું, ખરું Night (નિચટ)

એમાર Twice (દ્વારાં)	અલું Left (લેફ્ટ)
એટી થતાં Waiting (ઉચેટીંગ)	થગો Became (બીડેચમ)
હજુથું Just now (જરસનાઓ)	ના પાડે છે Denies (ડીનાઇઝ)
જગ્યા Place (ડેટ્ચસ)	ઓઝેલો સ્પેક્નો Spoken (રૉક્નેન)
આસરે About (એણાઇટ)	તરદેખ Favour (ફેવર)
અરધી Half (હાલ્ફ)	ઇન્ટેન્ડ Intend (ઇન્ટેન્ડ)
માઈલ Mile (માઇલ)	બાંધવું Build (બીલ્ડ)
જવાય છે Leads (લીડ્સ)	માગળી Offer (ઓફર)
કેચવું Sell (સેલ)	

મારે આજે આવતું હોએંઓ I must come to day. (આએ
મરટ કમ કુંદ)

તમે મને ઘેર ક્યારે મળશો ! When can you see me at
home ? (ઉધેનું કેન યુ સી ગી એટ હોમ ?)

હંસાં સવારના Always in the morning. (ઓફરિંગ એન
ધી મેરનીંગ)

હું જરૂર આવીશ I will surely come. (આએ ઉસા રહાડી કમ)
ગઢ કાંઠે હું તમારે ઘેર દાંનો I was at your house yesterday.
(કાંઠ ઉંસાજ એટ દોર દાઉસ પસ્ટરદં)

આજે મને મળશે See me today. (સી ની કુંદ)

કાંઠ આવવાને ખુલતા ના Don't fail to come tomorrow.
(તોન્ટ ફેલ ક કમ કુ-મારનો)

સવારના તમારાથી જનરો હે ? Will the morning suit you?
(ઉવીલ ધી મેરનીંગ સુદ શુ ?)

મારે દરેક વખત સરખો છે Any time will suit me. (એવી રાત્રિમ ઉંબિસ સુધી ભી)

હું તમને તમારા ધર આગળ મળીશ I shall see you at your home. (આઘ શેલ રી યુ એટ હેર દાઉસ)

તમે એટકા ઉતાવળા ક્યાં જાગો છો ? Where are you going to? (વહેર આર યુ જાઈગ સો ફારટ ?)

તમે જનદી ચુ કરતા હોંડા છો ? Why are you running fast ? (વાય આર યુ રનીંગ ફારટ ?)

હું આગગાડી ચૂઝીશ I shall miss the train, (આઘ શેલ નીસ ધી ટ્રેન)

મારી પાસે ટ્રામના પૈમા નથી I have no money for the tram. (આઈ હેવ નો મની હોર ધી ટ્રામ)

આ એ આના લો Take these two annas. (ટેંક ધીંડ હુ આનાં)

પેલી ટ્રામ ઉભી રાખો Stop the tram. (સ્ટોપ ધી ટ્રામ)

ને ગીરગામ જાય છે It is going to Girgam. (છટ છગ જાઈગ હુ ગીરગામ)

આપણને ને બદલાડી પડશો We shall have to change it. (ઉંબી શેલ હેવ હુ એન્જ છટ)

ના, તે પરલારી નશો No, it will go direct. (નો, છટ ઉંબીં જો ડિરેક્ટર)

હું નેને મળના જાઉ હું I am going to see him. (આઘ એમ જાઈગ હુ સી હીમ)

તમે તેણું થર જોડું છો ? Have you seen his house?

(દેવ યું સીન હીજ હાઉસ)

તમે મને ઝેણો કે તે ક્યાં રહે છો ? Will you tell me where he lives ? (ઉચ્ચીલ યું ટેન મી ઉંદેર હી શીજા ?)

શું આ ભાવખા જવાનો રસ્તો છો ? Does this road lead to Byculla ? (એ ધીમ રોડ લીડ કુ ભાવખા ?)

આ રસ્તો નથી This is not the way. (ધીમ એજ નાંદ ધી ઉંબે) :

તમે માર્ગ ચૂક્કો નથી You have lost the way. (યું દેવ દોસ્ત ધી ઉંબે)

સીધા આગળ જાઓ Go straight on. (ગો સ્ટ્રેટ ઓન)

જમણા દાયપર વળો Turn to the right. (એન્ન કુ ધી રાઇટ)

જાળા દાયપર વળો Turn to the left. (એન્ન કુ ધી લેફ્ટ)

તે અદીથી ડેટણું દુર છો ? How far is it from here ?
(હાઉં ક્રાં એડ એટ કોમ હીઅર ?)

આશરે અરધો માઠથ About half a mile. (એભાઉટ હાલ આ માઠથ)

આ રસ્તેથી ક્યાં જવાય છો ? Where does this road lead to ? (ઉંદેર એ ધીમ રોડ લીડ કુ ?) .

બજાર લાંબા To the market. (કુ ધી માર્કેટ)

તમે રસ્તો ના ચુક્કા Don't miss the way. (ઓન્ટ ધીમ ધી ઉંબે)

તે અદું દુર છો It is rather far. (એડ એજ રાઇર હાર)

શું ભારણ બાબુ છો ? Is the door shui ? (એબ ધી ડોર શ્વિ)

- ਮੈਂ ਲੇਨੇ ਵੇਂ ਕਿਰਪਤ ਕੁਝ ਆਰੀ I called him twice. (ਆਪ
 ਤੋਹਾਡੇ ਹੀਮ ਟਾਏਖਸ)
- ਤੁਸੀਂ ਤਮਾਰੀ ਰਾਫ਼ ਬੇਤੇਂ ਹੋਤੇ। I was waiting for you. (ਆਪ
 ਉੱਘੜ ਉਵੇਛਟੀਂਗ ਫੋਰ ਯੂ)
- ਤੇ ਮਨੇ ਹਮਾਲ੍ਹਾਂਜ਼ ਮਲਿਆ। He met me just now. (ਹੀ ਮੱਟ
 ਮੀ ਕਲਟ ਨਾਓ)
- ਤੇ ਕਿਥਾਂ ਗਯੋ ਹਨੋ ? Where had he been ? (ਉਡੋਂਦ ਛੁ
 ਹੀ ਧੀਨ ?)
- ਤੇ ਅੰਗਰਮਾਂ ਗਯੋ ਹਨੌ ? He had gone to the market.
 (ਹੀ ਛੁ ਗੋਨ ਕੁ ਧੀ ਮਾਰਿਂਦ)
- ਤੇ ਧਕੜਾ ਹੁਸੰਦੇ ਥਯੋ। He became very angry. (ਹੀ ਪਹਿਲਾਂ
 ਕੇਵੀ ਏਨਾਂਡੀ)
- ਤੇ ਨਾ ਪਾਂਤ ਛੇ ਕੇ ਮੈਂ ਅੰਮ ਕਹੁੰ ਨਥੀ। He denies having
 said so. (ਹੀ ਹੀਨਾਏਂਤ ਲੇਖੀਗ ਸੋਹਣ ਸੋ)
- ਤਮੇ ਜਰਾ ਮਾਰੀ ਰਾਫ਼ ਬੇਚੋ। Will you wait for me a little.
 (ਧੀਥ ਯੂ ਕਵਣ ਫੋਰ ਮੀ ਆ ਲੀਟਲ)

ਵਾਂਚਨ ਪਾਠ ਫੁਰੈ ਆ।

ਵਾਸੋ। Assurance (ਐਸ਼ਕੁਰੈਨਸ)	ਫੁਆਰ। Porter (ਪੋਰਟਰ)
ਆਗਾਂਸਟ Steamer (ਸਟੀਮਰ)	ਪਾਸਾਂਵਾਂਛੇ Makes (ਮੈਂਡਕਸ)
ਵਾਰਡਨ Account (ਐਕਾਊਂਟ)	ਵਾਸਾਲੇ। Vessels (ਪੱਤਸਲਸ)
ਲਖਨੁ। To write (ਕੁ ਰਾਇਟ)	ਮਾਰੀ Clay (ਕਲੋ)
ਰੇਖਨ Silk (ਸਿਲਕ)	ਅਕਲ Wheel (ਉਕੀਲਸ)
ਚੱਕੜੁ। Gold (ਗੋਲਡ)	ਰੰਗ Colour (ਕਾਰ)

ખીણા Yellow (યેલ્ડ)	રફત, મોટાખું Clear (ક્લિયર)
વાહણી Blue (બ્રેન્ડ)	ઉતો Camels (ઉમલ્સ)
ભવિષ્ય Future (ફ્યુચર)	ધાર્દે છું Think (થીન્ક)
સાધચેત Careful (કેરફુલ)	ગતો Kinds (કાઇન્ડ્સ)
ફરીથી બોલબું Repeat (રીપીએટ)	પાડ Lesson (લેસન)
કારણ કે Because (બીકાન્સ)	દસું Silver (રીસ્લવર)
ઉછ્રીનું આપબું Lend (લેન્ડ)	માગબું Want (ઉર્ના-એ)
પથમર પાણી Slate (સ્લેટાઈટ)	માર્દી Mine (માઇન)
મજબુની Strong (રસ્ટાંગ)	ગુલામનું રૂબું Rose (રોઝ)
કૃ Cotton (ક્રોટન)	મહદ Help (હેપ્પ)
ધોખું White (બ્લાઇટ)	સુંદર Fine (ફાઇન)
કોંભતી Precious (પ્રૈસિઅસ)	દસું Silver (રીસ્લવર)
ત્રાંખુ Copper (કોપર)	લોડીં પરોન્સ (પરસન્સ)
લાલ Red (રેડ)	ભાનાશવાખું Damp (ડેમ્પ)
કુંપડા Cottages (કોટેજ્સ)	પુછતું Ask (આર્ક)

કયા ડૉક્ટરની હવા કરો છા? What doctor attends you?
 (ઉરોટ ડૉક્ટર એટેન્ડસ યુ ?)

હું તેના સોઅતીઓા લાંબો છું I have brought his
 companions. (આઈ હેન્દ ઓફ કોંપનીઓન્સ)

હું આડ પાસે ચેતું જોઉ છું I see the sheep near the tree.
 (આઈ સી ધી ધીપ નીપર ધી રી) .

આ આણી ઉકાળો Boil this water. (આચલ ધોસ વાર્દ)

હું શહેરથાં રહું છું I live in the town. (આઈ રીન ઇન
 ધી ટાઉન)

રાજ મહેસુમાં રહે છે The king lives in a palace. (ધી કૃત્તિ લીલા ધન એ પેશેદાસ)

હું ઓચીનો અટકોરો I stopped suddenly. (આઈ સ્ટોપ સ્ટેન્ડિંગ)

રેલવે અથવા આગમેટો હેલ્પર તમે લખશો ? Will you write an account of a railway or a steamer ? (વીલ યુ રાઇટ એન એક્ઝાઇન ઓફ એ રેલવે ઓર એ સીમર ?)

તમે કદિ રેશમ જોયું છે ? Have you ever seen silk ? (હેલ યુ ધરર સીન સીલક ?)

ના, મેં તે જોયું નથી No, I have not seen it. (નો, આઈ હેલ નોટ સીન ઈટ)

અષ્ટરના ઉપર કુંભાર મારીનાં વાસણું અનાવે છે A potter makes vessels of clay on a wheel. (આ ડોટર મેટ્ટકસ બેસલ્સ એફ ડેલે ઓન આ બીજ)

તમે સોનું અને ઇપું જોયું છે ? Have you seen gold and silver ? (હેલ યુ રીન ગોદ એન્ડ ભીલર ?)

તેનો રંગ પીળો હોય છે It has yellow colour. (હટ હેલ યેંડ કલર)

સુચણ આકાશ આશમાની લેણ છે Clear sky is blue. (કલ્સીનર સ્ક્યાન હાઇ પ્રેફિયર)

ઉટો જીરાં હોય છે Camels are brown. (કેમલ્સ આર બ્રાઉન)
ગોપાલ નહારો છોકરો છે Gopal is a bad boy. (ગોપાલ છબ એ બેડ બોય)

બાલભાઈ તે પચ્ચારપારી મને ઉછીની આપશો? Balabhai, will you lend me that slate? (બાલભાઈ, વાખ યુ લેન્ડ ગી ઘેટ સ્લેઇટ ?)

ગોપાલ હું તને ઉછીની આપીશ Gopal, I can lend it to you. (ગોપાલ, આઈ કેન્દ ઈટ હુ યુ)

કારણું કે તે મારી છે Because it is mine. (ભીડોજ કે ઈન્ન માર્દનું)

વાર્દ, તે હું માસ્તર પાસે માગીશ Well, I will ask the master for it. (વિશ, આઈ વીલ આરક કે માર્ટર હોર એ)

નં તમે મહેરખાનની કરો તો સાહેય, હું કંઈ કહેવા માગું છુ જી you please, sir, I want to tell you some-thing.
(એ હુ પ્લેઝ, સર, આઈ દાન્દ હુ ટેન્ યુ સમથીંગ)

હું અવિષ્યમાં સાચાચેત થઈશ I will be careful in future.
(આઈ જિવિલ થી તેરકુલ ધન કૃષુચર)

તમે તમારો પાડ ફરીથી બોકી જશો? Will you repeat your lesson? (વીલ યુ રીપીટ દાર લેસન ?)

ઓ, હું ધારે છું કે હું કરીશ Yes, I think I will. (યસ આઈ થીન્ક આઈ વીલ)

લાં ભર્યું જાતનાં કુતરાં છે There are a great many kind of dogs. (ધેર આર એ ગ્રેટ મેની ક્રાઇન્સ "ઓહ હોંક")

તે એઠો અને મજાકુત માણ્યસ હતો He was a big, and a strong man. (હી બોંગ એ બીગ એન્ડ એ સ્ટ્રોગ મેન)

આ સુંદર ગુલાખનું ખૂલ છે This is a fine rose. (ધીમ દાંડ
એ કાળન રેડ)

ગરીબને મદદ કરો Help the poor. (હેઠ વ પુઅર)
હું તેને બેસી જવાનું કરું હતું I bid him to sit down.
(આટ ધીડ હીમ કુ રીટ કાઉન)

મને જવા દો Let me go. (લેટ મી ગ્યો)

તેને આપવા દો Let him give. (લેટ હીમ ગીવ)

મહેશાની કરીને તેને ચાવા દો Please let him cry. (વીર
લેટ હીમ કાગ)

સોનાં અને ડ્રું ડિમટી ધાતુ છે Gold and Silver are
precious metals. (ગોંડ ગો-ંડ ગીલદગ આર પ્રેસી-
અસ મેટલ્સ)

૩ દોળું હોણ છે Cotton is white. (કુટન દાંડ વાલાટ)

તેની તથિયન આજ ડિક નથી જળ્યાંતી He does not look
well to day. (લી ડા નોટ લુક ઉંસ કુ તે)

ત્રાંખુ કાલ હોણ છે Copper is red. (ટ્રાંપર દાંડ રેડ)

ને ઘર બીનાશવાળું હતું The house was damp. (ધી હાઉસ
વોઝ તેમ્પા)

આ લેડા તેમનાં કુંપડાં ચોકખાં રાણે છે These persons
keep their cottages clear. (ધીમ પરસન્સ ક્રીપ ધેર
ક્રેટલ્સ કલ્લીપર)

હવે હું આવું May I come now. (મે આઈ કમ નાજિ)



Few (ફ્યુ) તથા **A few (એ ફ્યુ)** નો લક્ષણત્વ.

Few (ફ્યુ) ‘નહિં’ “બહુજ બોડા” કેમકે Many are paid but few are left. (મેળી આર ચેપછ બટ ફ્યુ આર લેફ્ટ) ધરણે પેણા આપવામાં આગ્રા છે પણ બહુજ બોડાને આપવાના ભાડી છે.

A few (એ ફ્યુ) વખતે નહિં પણ થોડા.

પરમેશ્વરે સીને એ આંદો આપી છે, પણ તેનો ખરો ઉપયોગ તો થોડાનેજ આવડે છે God has given two eyes to all but only a few know how to use well. (ગોડ હેઠ જીવન કુ આઈઝ કુ ઓદ્ધ બટ ઓનલિ એ ફ્યુ નો રાઉ કુ યુઝ ઉપેક્ષ) Few (ફ્યુ) એટને ધીલકુલ નહિં જેવું. કેમકે, He read few books. (હી રેડ ક્રિય ધૂમ) તેણે થોડી ચેપડીઓ વાંચી.

Little (લીટલ) તથા **A little (એ લીટલનો)** લક્ષણત્વ.

Little (લીટલ) બોંકુક (લગભગ નહિં જ)

A little (એ લીટલ) થોડાક (ધરણ નહિં)

Little bread (લીટલ બ્રેડ) થોડાક રોટલો.

A little bread (એ લીટલ બ્રેડ) બોંદો (ધરણ નહિં)

Little (લીટલ) અને A little (એ લીટલ) જરૂરો ખતાવે છે, માટે ક્રિયાપદ એક વચ્ચનનું સ્વિકારે છે. .

પ્રશ્નાર્થ તથા નિર્ષેષાર્થ.

ન્યારે પ્રશ્નાર્થ તથા નિર્ષેષાર્થ કરકું હોય ત્યારે પ્રશ્નાર્થની ઘેરે વાક્યને જોડવી હર્તા પછી Not (નોટ) સુફેદે.

હું અમ કરતો નથી ? Do I not work ? (હું આઈ નોટ વક્તે)
 તેઓએ અમને તળ્યા હોશે ? Will they have forsaken
 us ? (વીલ ધે હેવ ઇરસેકન અસ)
 નકાર No (નો), Not (નોટ) અને Never (નેવર) એ
 દેખાડવામાં આવે છે.

અપથાણ.

ને To be (હું ભી) અને To have (હું હેવ) મુખ્ય
 કિયાપદ હોય અને તેવાં વાક્યનો નકાર કરવો હોય, તો તેની પદ્ધતિના
 Do (હું) ન આવતાં, તેજ કિયાપદ કર્તાની પદ્ધતિના કષ્ટાય છે.
 આરી પાસે ધણા રૂપીઆ નથી I have not many rupees.
 (આઈ હેવ નોટ મેનિ રૂપીઝ)
 તેની પાસે ધણા રૂપીઆ નથી He has not many rupees.
 (હી હેવ નોટ મેનિ રૂપીઝ)
 ને Never (નેવર) વપરાણો હોય તો પણ વર્તમાન અને
 ભૂતકાળમાં ભીનું સહાપક કિયાપદ આવતું નથી, જેમણે, તે કાદિ સમ
 આતો નથી He never swears. (હી નેવર સ્વેર્સ)

નકારમાં કાળ કેમ ઓળખાય ?

રીતઃ—નકાર વાક્યને “હકાર” મુક્તી દેવું એટલે કે “નકારને”
 “હકાર” પણવાડે મુક્તેલો. જેમણે,
 હું આજે જર્બો ખું (નહિ) I have not taken my dinner
 ‘at all to-day’ (આઈ હેવ નોટ ટેકન આથ હીપર એન
 ઓલ હુ-ડે)

અધ્યાત્મિક Passive Voice (પેસિવ વોષિસ).

[૧] નં અંગ્રેજ સફરે કિયાપણું સખનેં કર્યું હોય તો તે કિયાપણા ભૂતકૃતંત્ત્વની પહેલા To be (કર્યા) નું હ્ય લગાડ્યું.

[૨] ને મૃજુકાળનું સખબેદ કર્યું હોય તો ભૂતકૃત પહેલા.
Have been, had been | અને Shall
(હ્ય બીન) (હડ બીન) | અને (હશ્ચ)

Shall have been (હશ્ચ ને + બીન) લગાડવાથી અનુકૂળે
મૂળું વર્તમાન સખનેદ થાય છે. I have been caught (આઈ
દેસ બીન ક્રેટ) We have been caught (ની દેસ બીન ક્રેટ)
એગેર. નં મૃજુકાળનું ચાલુકૃપ કર્યું હોય તો વર્તમાન કૃતંત્ત્વની
ઘણાઉ Hav : been (હ્ય બીન) Had been (હડ બીન)
અને Shall have been (હશ્ચ દેસ બીન) લગાડવાથી અનુકૂળે
ચાલુ મૂળું વર્તમાન, ચાલુ પ્રવાનું તથા ચાલુ પર્વ ભવિષ્યકાળ થાય છે.

આજ્ઞાર્થ Imperative mood (કંપણીબ સુડ).

અંગ્રેજમાં “આજ્ઞાર્થ” માત્ર બીજા પુરુષ બહુવચનમાં વપરાય
છે, વખતે બીજા પુરુષ અંકવચનમાં પણ વપરાય છે, પણ તે બન્ને
વચનમાં જ્યારે આજ્ઞાર્થ આનેલો હેઠાં ત્યારે અંગ્રેજમાં તેને બના-
વચાની રીત એ છે કે કર્તા ઉડાડી કરા કિયાપદ રાખ્યું. કેમકે તું
આવ Come (કમ), તમે લાંબા Bring it (બીંગ ઈટ) પણ
અંગ્રેજમાં વખતે પહેલે પુરુષે અગર તીને પુરુષે પણ આજ્ઞાર્થ વાપર્યું
છે, કેમકે; મને કહેવા હો Let me tell. (લેટ મી ટેલ)
કેને આંપવા હો Let him come, (લેટ હિમ કમ).

સામાન્ય Infinitive mood (ઇન્ફીન્યુન્નીવીં મૂડ).

મામાન્ય એટલે કે ગુજરાતીમાં વા, ચી, ચુ, વાળા હિયાપદના રૂપ આવે છે તનો તરફાનો To લગાડીને થાય છે. જેમણે—

મનો વાંચનું ગમે છે I like to read. (આઈ લાઇક કુ રીડ)

અંગ્રેજીમાં નીચે લખેલ હિયાપદ પણવાંટ To વપરાતો નથી.
એવા કે—

May	(મા)	Must	(મરટ)
Dare	(ડેર)	Can	(કેન)
Will	(વીલ)	Do	(ડો)
Shall	(શૉલ)	Bid	(બિડ)
Feel	(ફીલ)	Have	(હેવ)
Hear	(હીએર)	Let	(લેટ)
Make	(મેક)	Need	(નીડ)
See	(સી)	Observe	(ઓબરવ)
Watch	(વેચ)	Keep	(કીપ)
Know	(નો)	Behold	(બીહોલ)
Mark	(માર્ક)	Find	(ફાઇન્ડ)
Perceive	(પર્સિવ)		

વાંચન પાઠ ફંડ મેટ્ટ

લુચ્યો Cunning (કન્નિંગ)

મહિં સિક (સિક)

પહોળો Broad (બોડ)

મીઠો Sweet (સ્વીટ)

બેવકુર Stupid (રડુપીડ)	શત્રુ Enemy (એનિમી)
સાંકડો Narrow (નરો)	સહેલું Easy (ઈજી)
આળસુ Lazy (લેઝી)	ચેઅરો Boy (બોય)
પાડો Lessons (લેસન્સ)	દિલોગી Diligent (ડિલીજન્ટ)
વર્ગ Class (ક્લાસ)	ખુબસુંદર Beautiful (પણુરીજુલ)
ગાડ Tree (દ્વી)	પક્ષી Bird (બિંડ)
હોક્કાત, પ્સો Wealth (વેલ્થ)	એકદું કરવું To accumulate . (હુ એકપુરુષુલેટ)
ઇચ્છા, મરજી Desire (ડિઝાઇર)	ધર Home (હાઉસ)
કદ્યરો Filth (રીથ)	આગમજથી Advance (એફવાન્સ)
રાજ Willing (ઉચ્ચારિંગ)	સરદાર General (જનરલ)
પૈસો Money (મનિ)	લારે Powerful (પાવરફલ)
આમગ ચાલ્યો Advanced (એડવાનભડ)	ફોર્સ Force (ફોર્સ)
સોટી Cane (કેનિન)	સભા જરતી To assemble a meeting (હુ એમેઝ્યુલ એ મીટિંગ)
લાકડી Stick (સ્ટીક)	વાળવું To bend (હુ એન્ડ)
ક્ષેડું કરવું To commence (હુ કમેન્સ)	લાંઘ War (વોર)
નારી રાખવું Continue (કન્નીન્યુ)	શિક્ષક Teacher (શીચર)
ખુબ સખત Severely (રીનીઅરક્ષિ)	પડ્ધમો Drums (ડ્રમ્સ)
ભાષણ Lecture (લેક્ચર)	છેડો End (એન્ડ)
એકદું કરવું, નીચું કરવું To-gather (હુ.ગેપર)	વાંખાતો છેડો જાતો To end the dispute (હુ એન્ડ ધી ડિસ્પ્યુટ)

હુંદો Flowers (હૃત્યા) એકડા થયા Gathered (ગેમડ) વગાડવું To beat (હું બીટ) વીણવા Gathering (ગંધરીય) મંગી ગઈ હતી Engaged (અન્ગેજડ)

માણેકલાલ લુંચા છાકડો નથી Mane'laal is not a cunning boy. (માનેકલાલ છક નોટ એ કનીય જીય)

તંગા ખાપ માંદા હુંતા His father was sick (છોડ ક્ષયર વાગ સીક)

તમારા ભાઈ બેબકુદ છે Your brother is stupid (ગોર ક્ષયર છક રક્ખીડ) .

આ રસ્તો સાહો છે This road is narrow. (ધોયા રડ રડ નરો)

દસ્તો પણુંઝા છે The Sea is broad. (ધ રી છક શ્રીઓ)

સાકર મીડી હોય છે Sugar is sweet. (શ્વયર છક રવીએ)

મનસુખ મારો શવુ નથી Mansukh is not my enemy. (મનસુખ છક નોટ માય એનિમી) .

ગઈ કાંતો પાડ સહંખો હનો Yesterday's lesson was easy. (પસ્ટરડ'ડ લેસન વાગ એંગી)

દલસુખ આળસુ છાકડો છે Dalsukh is a lazy boy. (દલસુખ છક, એ લેંગી જીય)

તે, તેના પાડ શીખશે He will learn his lessons. (તી વીખ લર્ન છીડ લેસન્સ)

ફુલચંદ ઉઘોગી છે Fulchand is diligent. (ફુલચંદ છક ડીલીજન્ડ)

તે નેના વર્ગમાં પહેલો છે He is at the head of his class.

(દી છજ એટ ધ હેડ ઓફ હિસ ક્રાંક)

નેણું એક ખુલ્લાંગનાર પક્ષી જાડ ઉપર નેણું He saw a beautiful bird on the tree. (દી સો એ બધુનિધૂલ વર્ડ એનાં ધ રી)

પેમો એક્ટો કરવોન એજ મારી ભરળ છે To accumulate wealth is my sole desire. (દુ એક્ટુભ્યુલેટ વેલ્થ દર માય સોલ ડીગાયર) .

તમારા ઘર આગળ કબરો એક્ટો થવા હોં નહિ Don't allow fish to accumulate near your house. (ડેન એલાઉ રીલથ દુ એક્ટુભ્યુલેટ નીઅર યોર હાઉસ)

એવા આગમજરી આપવાને તે રાજ દનો He was willing to advance money. (દી વોડ ઉવનીંગ દુ એન્વાન્સ મનિ) સરજાર ભારે કોણ લઈને આગળ આહ્યો The General advanced with a powerful force. (મી જનરલ એન્વાન્સડ ઉનીથ એ પાવરફુલ ફેર્મ)

તેમાંએ સભા લરી છે They have assembled a meeting. (દે હેચ એસેમ્બલ્ડ એ મીટિંગ)

સભા કયારે ભરશો? When will the meeting assemble? (વહેન ઉલ્લિલ ધ મીટિંગ એસેમ્બલ્સ ?)

આ સંકારી મારાથી વળો છે I can bend this cane. (આએ કેન એન્ડ ધીરા ફેર્ન્ટ)

આ લાકડી નહિ વળો? Will not this stick bend? (એલિલ • તોટ ધીસ રદી એન્ડ ?)

तभाई वांचन क्यारे बध करेहा ? When will you cease your reading ? (वहेन उवीच मु सीज ऐर रीडिंग ?)

लदाच बध पडी ? Did the war cease ? (डीड ध वार सीज ?)

तमे तभाई काम क्यारे शह कर्यु ? When did you commence your work ? (वहेन डीड हु एमेन-स येर वर्क ?)

निशाणानुं काम दश वागते शह थाय छ The school work commences at ten. (ध रक्ख वर्क एमेन-सीस अट टेन)

तेने कहा के लखवा मांड Tell him to begin to write. (टेल हीम के भीगीन कु राइट)

पाठ क्यांथी शह छ ? Where does the lesson begin from ? (वहेर कज धी लेसन भीगीन दोम ?)

तेषुनि शिक्षके खुब भारी छे The teacher has beat her severely. (धी टीचर लेझ एट हर सीधीअर्ही)

सवारे पहवमे वागी हती The Drums beat in the morning. (ध ड्रम्स एट धन धी गार्निंग)

ते गोतानुं लापण्य पुँडे करेहा ? Will he end his lecture ? (उवीच नी एन-ड हीज लेक्चर ?)

ऐ क्षुङ्क्यानो क्यारे छेहा आयेहा ? When will this quarrel end ? (वहेन उवीच धीस क्वोरल एन-ड ?)

ते पुँक वीथुवामां रामाच हती She was engaged in gathering flowers. (शी वेअ एन-मेन्हड धन ग्रेधर्निंग ह्लावर्स)

અમે જાહીથી એકા થયા અને વાનો કરવા માંડી We soon gatherd to-gather and began talking. (ઉન્હી ચુન જેખદી હુગેધર એન્ડ અનિન ટોકીગ)

પરચુરણું શાખદાના જાત્યા.

Dye (ડાઇ) રંગથું	Owl (ઓઉલ) મરદો
Dun (ડન) તમાહે, આંણુ	Frigg (ફ્રિગ) હંણદી
Done (ડન) કરેલું	Phrase (ફ્રેઝ) ફ્રેશરી
Dust (ડસ્ટ) ધૂળી	Freeze (ફ્રીઝ) થિંજવું
Do'st (ડુસ્ટ) કરેછે Thou do'st	દીને બધાઈ જયું.
Doze (ડોઝ) ઝોકા આવા	Frieze (ફ્રીજે) એક જાતનું
Does (ડોઝ) મુગલીઓ, હરસુરીઓ	ઉનનું કપકડું
Dose (ડોઝ) એક બેળાનું એસડ	Furs (ફર્સ) રથાં
Furze (ફર્ઝ) કાંદાવાળા છોડવા	Gage (ગેજ) ડોાઢ, સાનમાં
Draft (ડ્રાફ્ટ) પણેઠાળી, હુંકી	મુક્કવું.
Draught (ડ્રાફ્ટ) ઘંઘણું, તાથુણું	Gauge (ગેજ) માપ કાઢવું
Faint (ફૈન્ટ) નરમ, કમનેર	Gall (ગોલ) પિન
Feint (ફેન્ટ) દૃતિમ	Gaul (ગોલુ) ક્રાન્સનું નામ
Fare (ફેર) જમણું, જાડુ	Gild (ગીલ્ડ) સેનાના ટોળ
Fair (ફેર) સુંદર, ભેણો	ચદાવવા.
Farewell (ફેરવેલ) રામરામ,	Guild (ગીલ્ડ) મહાજન,
સલામ	: ધ્રાર્મિક સમાજ.
Fate (ફેટ) નરીઓ	Gilt (ગિલ્ટ) રસેલું

Fete (ફેટ) મીજથાતી, ઉલણી	Guilt (ગિલ્ટ) અપરાધ
Feet (ફીટ) પગો	Grate (ગ્રેટ) સળાઓની જગ્ગા
Feat (ફીટ) પરાક્રમ	Great (ગ્રેટ) મોહું
Fool (ફુલ) મુખ્ય	Grater (ગ્રેટર) અમણી
Full (ફુલ) ભરેલું	Greater (ગ્રેટર) વધારે મોહું
Fore (ફોર) આગ્રામ, મોખરે આવેલું	Grizzle (ગ્રિઝલ) કંડક લુંગો
Grisly (ગ્રિસ્લી) લયાનં	Groan (ગ્રોન) દુઃખથી પીડાણું
Four (ફોર) ચાર	Grown (ગ્રોન) ઉગેલું
Fourth (ફોર્થ) ચોયું, ચંચાથી ભાગ	Grocer (ગ્રોસર) ગાંધી
Forth (ફોર્થ) આગળ	Grosser (ગ્રોસર) વધારે
Foul (ફોલ) આપનિન, મેલું	ડંબળું
Break (બ્રેક) નોડવું, લાંગવું	Check (ચેક) અટકાવ, અંકુશ
Bred (બ્રેડ) ઉંઘું	Cheque (ચેક) ફૂડી
Bread (બ્રેડ) રોટદી	Char (ચાર) ચોંકું ખળવું
Broach (બ્રોઅચ) આરી, ટામાણું, સોયું.	Char (ચાર) ઉધૂકું કામ Chair (ચેર) ખુશી
Bruise (બ્રૂસ) કચરવું, ખાંડવું	Cit (સીટ) શહેરના લંડોં
Sit (સીટ) એમવું	Cite (આઇટ) હોદાની રેસે
Site (માફટ) રથાનં, ડેઢાણું	એકાનવું.
Brute (બ્રૂટ) જડ, અચેતન	Clarke (ક્લાર્ક) અટકનું
Burrow (બર્રો) એણોલ ફુરવી,	નામ છે.
Borough (બર્ગ) અનંદીયા ગામ	Clerk (ક્લર્ક) કારકુન,
But (બટ) પણ, ઇકતા, સિવાય	Claws (ક્લોઝ) પંજ .

Butt (અટ)	છોડા, દદ, સીમા,	Clause (ક્લોઝ)	પ્રક્રણ, વાક્ય
By (બાય)	પાસે	Clime (ક્લાઇમ)	દેશ
Buy (બાય)	ખરીદું	Climb (ક્લાઇમ)	ઓળી ઓળને
Close (ક્લોઝ)	બંધ કરવું		બદલું.
Call (કોલ)	બોલાવવું	Clothes (ક્લોથ્સ)	પોશાક
Caul (કોલ)	પડ્ઢો, માથા ઉપર પહેલવાની ટોપ	Cole (કોલ)	વિલાયતી મુજોા, કોલ્ફી,
Cane (કેન)	સોડી	Coal (કોલ)	કાયદા
Cask (કાસ્ક)	પોપ	Creek (ક્રીક)	નહાની આડી
Cannon (ચેનાન)	ટોપ, મોટી અંદુક	Creak (ક્રીક)	ચમચમ ઐલાનું
Canon (કેનોન)	ધારા, નિયમ	Cast (કાસ્ટ)	દે કરવું
Caste (કાસ્ટ)	નાન, જન	Day (ડે)	દીવનું
Casque (કેસ્ક)	શિરભાણું, ટોપ	Dew (ડ્યુ)	જાહાન
Celling (સીલિંગ)	છન	Due (ડ્યુ)	દેહેવાં
Sealing (સીલિંગ)	મોહર કર- વાની લાખ	Die (ડાઇ)	મરી જણું
		Dye (ડાઇ)	રંગવું
Limn (લીમ)	ચીનગવું	Meat (મીટ)	મજાનું
Lo (લો)	જુઓ	Meat (મીટ)	માંન
Low (લો)	નીચું	Mete (મીટ)	આપનું
Lone (લોન)	એકલો	Meter (મીટર)	માપનાર
Loan (લોન)	ઉણીની લીધેલી શીજ	Metre (મીટર)	માય

Lock (લૉક) તાળુ	Mite (માધટ) નાંદુ શ્વહુ
Lake (લેક) સરોવર	Might (માધટ) જોર
Made (મેધા) અત્યાર્થુ	Mity (માધટી) અજુ અવસ્તુયાંયુ
Maid (મેધા) કંચારીધા	Mighty (માધટી) અગ્રવાન
Male (મેધા) નર	Moan (મોન) પણાતાપ કરવો
Mail (મેધાસ) ટપામના કાગળો લઇ જવાની ગાડી	Mown (મોન) કાપ્યું
Mane (મેધાન) યાગ	Mote (મોટ) રંજકણુ
Main (મેધાન) મુખ્ય વગ	Moat (મોટ) ઊરી આછ
Mantel (મેન્ટલ) ચુલ્હાની બંગ	Mule (મુલ) ઘ્યાચર
Mantle (મેન્ટલ) અફમો	Mewl (મુખ) છોકરાની પેડે રોણું
Maze (મેઝ) ગુંચાવણું	Muse (મુઝ) મનન કરવું
Maize (મેઝ) હિંદુસ્તાનના અનાજની એક જાત-મકાદ	Mews (મુઝ) જાળકુડીઓ
Marshal (માર્શિલ) ફોજનો ઉપરી	Nap (નપ) કુંઠી ઉષ
Martial (માર્શિલ) લડાયક	Knap (નપ) લખદાંડ
Mean (મીન) હલ્કુ	Naught (નોટ) કંઈ નહિ
Mien (મીન) ફાય, ફેખાર	Nay (નિ) નહિ
Meed (મીડ) ધનામ	Neigh (ને) ખોંખારણું
Meal (મીલ) ખાણું	Nave (નેવ) ધરી
Grot (ગ્રોટ) ભાંયણું	Knave (નેવ) લુંઢ્યો
Groat (ગ્રોટ) ચાર ફેન્સનો વિક્ષો	Key (કી) કુંચી
Hale (હેલ) નિરોગી	Quay (કી) બંદર
	Kill (કીલ) મારવું

Hail (હેઠાં) નમરસર	Kilm (કોલ્ન) બજા
Hare (હેર) સસણું	Lac (લેક) ખાય
Hair (હેર) વાળા	Lax (લેક્સ) નરભ
Hall (હોલ) એટરડા	Lade (લેડ) બાંગે ભરવા
Haul (હોલ) નોરથી એચ્યું	Laid (લેડ) સુક્ષું
Hart (હાર્ટ) સાયર, હરણું	Lanch (લેન્ચ) નાંખ્યું
Heart (હાર્ટ) અંતઃકરણ	Launch (લોન્ચ) દરીઆમાં
Heel (હીલ) નમતું, પગનું તળ્યાંયું	Launch (લોન્ચ) નાંખ્યું
Heal (હીલ) રોગ મટાડવો	Lane (લેન્ન) ગલી
Here (હીથર) અહીંથાં	Lain (લેન્નિન) lie નું ભૂતકૃદાન
Hear (હીથર) સાંભળયું	Leaf (લીફ) પાંદડું
Herd (હર્ડ) ટોળું	Lead (લેડ) હોંયું
Heard (હર્ડ) સાંભળ્યું	Lead (લીડ) ધાતુ, શીથુ
Hie (હાઈ) દોકાન જગ્યું	Lie (લાઈ) જીડું એંગાવતું
High (હાઈ) ઉચ્ચું	Leak (લીક) કાણું, ફાડ
I (આઈ) હું	In (ઇન) અંદર
Eye (આઈ) આંખ	Joust (જુસ્ટ) બોડા ઉપરની
Inn (ઇન) ધર્મશાળા	સરતમાં રંગાનવું
Just (જરટ) વાળબી	Limbs (લિમ્બ) અવયવ
Levy (લેવી) એકદું કરવું	ઝડપી કળા
Ascent (અસેન્ટ) ઉદ્ધય,	Bit (બિટ) કટોડા
અદ્ધયું તે	

Assent [अेस्सेन्ट] कम्युल करवूँ	Beat [बीट] भारवुँ
Ate [एट] खाइ	Beef [बीफ] साकनुं नाम छे
Eight [ऐट] आइ	Bow [बो] तीर
Aught [ओट] कांઈ पछ वरतु	Beau [बो] इक्कड, अफुउआज
Ought [ओट] लेखाए	Bee [बी] भधभाखी
Bad [बड] नहाड, अराअ	Be [बी] थनुँ
Bade [भेड] द्वरमाझ्युँ	Beer [बीर] जख्तो ८१३
Bale [भेत्र] सामाननुं गाउँ	Bier [बीर] ननामी, काडवी
Bail [भेळ] लभीतपर छेडवूँ	Bell [भेल] घंट
Baize [भेज] लुगडानीकेक लत	Belle [भेल] अफुउआज ली
Bays [भेज] अभानी	Berry [भेरी] लीयानागुँ ओर
Sweet ball [स्वीट बैल] लाङु	Bury [भेरी] दाटवूँ
Birth [बर्थ] जन्म, अवनार	Berth [बर्थ] वदाणमां सतानी
bawl [भोक्ष] रोनुँ, जुम पाही	• • जव्या
Bate [भेट] धटाएवूँ	Bight [आइट] होशानारा
Bait [भेट] बद्धमां लरावेलु लघु	Bite [आइट] करउनुँ
Bare [भेर] खुल्लु, नाशुँ	Blew [भेल्यु] वापु
Bear [भेर] दिँ, लध जनुँ,	Blue [भेल्यु] आद्यमानी
• सदन करवूँ.	Bore [ओर] नीधिवूँ, शारवूँ
Base [भिठ्स] पापो	Boar [भिंर] सुर्च, फुक्कर, बुँड
Bass [भिम्स] अंडीर, अवार	Bough [आउ] धाढी
Bay [भे] अभान, राट्टु, बुढ	Bow [बाउ] वाणवूँ, नमस्कार
Borne [भोर्न] अमेलु, लध गणेलु	करवा.

Bey [बे]	हुक्करानमें सुगो	Bourn [बोर्न]	नारा
Been [बीन]	बेनु भूतदृष्टि	Brays [ब्रेज]	अधिधाती गडे
Levee [लेवी]	सवारती मुखाखाल		लुंक्तुं ते.
Bean [बीन]	शींग	Braze [ब्रेज]	पहेलावयुं,
Brake [ब्रेक]	शाख नरम करवाना सांचा		रेख देवुं
Use [युस]	वापरनु	Stare [स्टेर]	ताकीने लंघुं
So [सो]	अंतुं	Stair [स्टेईर]	पर्याप्तीयु
Sow [सो]	वाचनु	Steel [स्टील]	पाकाः
Sew [सो]	सीचनुं	Seal [सील]	चारतुं
Sole [सोल]	पण्डु नगायुं	Toz [टोज]	पगनुं टेरुं
Soul [सूल]	आत्मा	Vane [वैन]	करकरनुं भोजने
Sore [सोर]	सुर्जेतुं	Vain [वैन]	होगट
Soar [सोर]	उच्च अथवुं	Vain [वैन]	ग्रीष्माचारी
Stake [स्टेक]	झाकडाती झुंगी	Vale [वैल]	भाष्य
Steak [स्टेक]	तपावेला भांसतीपरी	Seize [सीज]	पकड़तुं
Rote [रोट]	जोग्ही छात्या	See [सी]	लंघुं
Wrote [रोट]	लभ्या	Sea [सी]	समुद्र
Rot [रोट]	छाली ऊरुं	Seen [सीन]	देखाँया
Wrought [रोट]	लभ्या	Scene [सीन]	देखात्
Ruff [रफ]	फाली ओड़ी ज्वलनी	Seine [सीन]	भाष्यकी पकड़वानी जग
Rough [रफ]	अड़भयुं	Sent [सेन्ट]	भोक्तव्य
Road [रोड]	दरतो	Sceni [सेन्टी]	सेप्तम लेवी

Sutler [सूटलर]	ખરુકરમાં જોરાએ	Cent [सેન્ટ]	સોડમ
	વચ્ચનાર	Sere [શીઅર]	ફરજાગેલું
Sale [સેલ]	વેચવું તે	Shear [શીર]	કાપવું
Sail [સેલ]	દાંતરવું	Sign [સાઇન]	નિયાન
Sane [સેન]	નિરાગી	Sine [માઇન]	લિનાય
Seine [સેન]	નદીનું નામ	Signet [સાઇનેટ]	નાનો મિઠો
Satire [સેટાર]	રામ કીડા	Sheer [શીર]	નિર્ભા
Satyr [સેટાર]	વનદેવતા	Sink [સિન્ક]	ઢૂળવું
Scat [સ્કેટ]	હર જ	Cinque [સીન્ક]	પંલે
Skate [સ્કેટ]	પહેરવાના ઝુ	Throne [થ્રોન]	દાનપાદન
Seal [સીલ]	સિફો	Thrown [થ્રોન]	ફૂંકવું
Ceil [સીલ]	ઘેપ રેવો	Too [તુ]	વળા, પળુ
Seed [સીડ]	બી	Two [તુ]	બે
Cede [સીડ]	આપી રેવું	Toe [ટો]	અંગુડો
Seem [સીમ]	દેખાનું	Tow [ટો]	બેંચી કાર્ફ રજુ
Seam [સીમ]	સીમણું	Tun [ટન]	દાઢનું પીપ
Seas [સીઝ]	સમુદ્રો	Ton [ટન]	૨૦ હંડેલો
Sees [સીઝ]	દેખે છે	Ewes [યુસ]	ગેડી, ઘેડી
Practice [પ્રેક્ચરિસ]	મધ્યાર્દો	Reck [રીક]	સંભાળ રાખની
Practise [પ્રેક્ચરિસ]	કરવું	Wreck [રેક]	ભાંગવું
Primer [પ્રાઈમર]	પહેલી ચોપડી	Wreak [રીક]	વેર વાળવું
		Reek [રીક]	ધૂમાડો

Pray [प्रे] માર્થના કરવી	Rest [રેસ્ટ] આરોગ્ય
Prey [પ્રૈ] શિક્ષણ	Wrest [રેસ્ટ] કુંદાળી લેવું
Prays [પ્રૈઝ] માર્થના કરે છે	Rime [રાઇમ] ચીરો
Praise [પ્રૈઝ] વખતાણ કરવાં	Rhyme [રાઇમ] ક્લિનિયા
Quire [ક્વાઇર] ધા	Ring [રીંગ] વીઠી
Choir [ક્વોઈર] ગાનાર મંદિર	Wring [રીંગ] ફુલ્ખી કરવું
Prize [પ્રાઇઝ] ધનામ	Rode [રોડ] સ્વારી કરી
Pries[પ્રાઇઝ] ચુપકુથી તપાસેછે	Road, [રોડ] રસ્તો
Rain [રેઈન] વરસાદ	Rite [રોઈટ] સંરક્ષાર ચિહ્ન
Reign [રેઇન] જાજ કરવું	Right [રાઇટ] અંદે
Rein [રેઇન] દાખલવું	Write [રાઇટ] લખવું
Raise [રેઝ] ઉચ્ચકરું	Wright [રાઈટ] કારીમર
Rays [રેઝ] કિરણો	Raze [રેઝ] જમીનદોસ્ન કરવું
Rap [રેપ] જિતાવળી ભારવું	Row [રો] દાર
Wrap[રેપ] આસપાસ ચીંદાળવું	Rood [રૂડ] જંગલી
Rapt [રેપ્ટ] શુદ્ધતાન	
Rapped [રેપ્ટ] ટોરો ભારો	Room [રમ] ઓરઠી
Wrapped [રેપ્ટ] કષપટાયો	Rheum [રેમ] જલેખમ
Reed [રીડ] બૃ	Root [રૂટ] મુળીઓં
Read [રીડ] વાંચવું	Route [રૂટ] રરોનો
Red [રેડ] રાતું	Rose [રોઝ] શુદ્ધાંખાંનું ફુલ
Read [રીડ] વાંચયું	Rows [રોઝ] દાર
Need [નીડ] જરૂર	Roes [રોઝ] માણકીનાં ફુલ

Knead [नीड]	શુદ્ધાં, ટોકું	Pallet [પેલેટ]	હરભી પણારી
New [-નુ]	નવું		
Knew [-નુ]	જાણ્યું	Pannier [પિનિયર]	ચિતારાનું પારીઓ
Night [નાઈટ]	રાત	Panel [પિનાલ]	જાડણનો બોખડો કટોા
Knight [નાઈટ]	માનનો ઘિતાળ	Pause [પ્રાઉઝ]	આટકાનું
Not [નોટ]	નહિ	Paws [પોઝ]	પંચ
Knot [નોટ]	ગાડ	Peace [પીસ]	સલાહ
No [નો]	નહિ	Piece [પીસ]	કઢોા
Know [નો]	જાણ્યું	Peak [પીક]	ટોચ
None [નન]	એકે નહિ	Pique [પીક]	જાટોા
Nun [નન]	સાધૂડી	Peel [પીલ]	છોત
Nose [નોઝ]	નાક	Peal [પીલ]	ધંટની દીઠી
Knows [નોઝ]	જાણે છે	Peer [પીર]	ઉમદો માણુસ
Ore [ઓર]	કાચી ધારુ	Pier [પીર]	ડંડા
Oar [ઓર]	હલેસાં	Pencil [પેન્સિલ]	સીસાપેન
O'er [ઓર]	ઉપર	Pensile [પેન્સિલ]	કુલાં
Our [અવર]	આપણું	Place [પ્લેચ]	જગ્યા
Roe [રો]	માણસીનાં ઈડો	Plane [પ્લેન]	રંગી
Hour [અવર]	કલાક	Plain [પ્લેન]	લીસું
Pale [પેઇલ]	રીકું	Please [પ્લીઝ]	ખુલ્લી થતું
Pail [પેઇલ]	જાડણાનું વાસણ	Pleas [પ્લીઝ]	આજુણ ફરવી

Pane (પેઠન) ફાદરી તકતી

Pain (પેર્ચન) દુઃખ

Pare (પેર) લાખતું

Pair (પેર) લોડ

Pear (પેર) ફળ, જમણા

આજે થોડા થોડા વેચાણુપર હતા Few horses were for sale
to-day. (ઇથું હોસ્ટિંગ વેર હોર સેધલ કુ-ઝ)

વહાણો ઝડપથી હુંકારે છે Ships sail swiftly. (શીપ્સ સેધલ
સ્વીફ્ટલી)

ને શરીરે તંડુરસ્ત નથી He is not sane in his body.
(હી છજ ગેટ સેન છન હીજ મોડી)

ફ્રાન્સમાં સીન નથી છે There is a river Seine in France.
(ધીર છજ આ રીવર સીન છન ફ્રાન્સ)

તેણું છટાક વચન લખ્યો He wrote a satire. (હી રોટ એ
સેટાયર)

જંગલી લોક બન હેઠને પુલે છે Savage tribes worship satyr.
(સેવેજ દાઈન્સ વર્ષાપ સેટાયર)

અગર સ્કેટ ભાજકી ખાય છે An alligator eats, Scates.
(એન એલીગેટર છટસ સ્કેટસ)

મુસાહરો પરદ્દપર ચાલવાના લોડ પઢેરી ચાલે છે Travellers
walk on ice with skates. (દ્રોવેલ્સ • વોલ્ડ ઓન
અલ્ગેટર વીથ સ્કેટ્સ)

આચી પણે જાખનો સિંહો છે I have a seal of war. (આચ
લેર એન્ને સીલ એલ વર)

Pole (પોલ) સોટો

Poll (પોલ) માંથાનો પાણીનો લાગ

Pore (પોર) છિદ્ર

Pour (પોર) રેઝનું

મારા ધર જ આપરે આત્માળુ છે My roof is ceiled. (આપ
જુ દર સીકાડ)

તેઓંમે ખી વાયાં છે They have planted seeds. (હે સેવ
લેનેડ સીકસ)

ભર્યા બંગ્રેજને આપણુ Broach was ceded to the English.
(ઓચ વોઅ રીડેડ કુ ધ ઈંગ્રીશ)

હુ મોદું ટાંકું છું I veil my face. (આપ નેર્ખિ આપ ઇઝસ)
આ લુગડાની ચાળ કીર્યી છે The wale of this cloth is
fine. (ધી વેલ ઓફ ધીસ ફલ્લાથ રૂક ફાર્ન)

હુ શોક કરું છું I wail. (આપ વેઘલ)

તે પ્રપંચથી લાંઘ જતો He won the battle through
sleights. (હી વન ધી એટલ કુ રસાઈસ)

હુ ધણો ધીમો છું I am very slow. (આપ એમ કેરી રહ્યો)

આ જાપર જંગલી ફળો છે There are wild fruits on the
tree. (હેર આર વાઈલ રૂસ ઓન ધી ટી)

હુ તેમ કરીશ I will do so. (આપ વીલ કુ સે)

હુ ખીજ વાણું છું I sow seeds. (આપ સો સીકસ)

હુ લુગકું સ્ટેનું છું I sew a cloth. (આપ સો એ ફોલથ)

તેનો મુખ્ય હક હતો His right was sole. (કીંઠ રાઇટ
વોઝ સોલ)

દેહમાં આત્મા છે There is soul in the body. (હેર ધર
સોલ ધન ધ ખાડી)

માંરી આંખ હુઃખ્યા આરી છે I suffer from eye-sore.
(આપ સાર્દ રોમ આપ સોર) .

તે હંચો બળો He spared in the sky. (હી સોઈ છીન
ધી રકાય)

હું અર્પિયર લુગાં સુકું હું I hung my clothes on stake.
(આઈ દનગ માય કલોાસ ઓન રેક)

આ તપાનેલા ભાંસની પેટી છે This is a steak. (ધીમ ધજ
એ રેક)

તેઓ તાકીને જુદે છે They stare. (ધે રેર)

હું મેડાયર હું I am on the upstairs. (આઈ એમ ઓન
થ અપસ્ટર)

આ ગજવલ છે This is steel. (ધીમ ધજ સ્ટીલ)

તેઓ ચોરી જાય છે They steal. (ધે સ્ટીલ)

તમારું પગખું હુકું છે Your step is short. (યોર રેપ દાઝ હોઈ)

આ ઘોડા હું વેચું હું I sell this horse. (આઈ સેલ ધીમ હોર્સ)

આ ભોંયણું હુકું છે This cell is deep. (ધીમ સેલ દાઝ ડીપ)

મેં તેને ગોકલ્યો છે I have sent him. (આઈ હંસ સેન્ટ ધીમ)

મને શુદ્ધાર્યની સુગંધ આપે છે I scent a rose. (આઈ સન્ટ ધીમ
એ રેઝ)

મેં આ હૈક્યું છે I have thrown this. (આઈ હેવ થ્રોન ધીમ)

દોડા હૈક્યો Throw the ball. (થ્રો = ધી આંદો) *

મારા પૈઠમાં હુંબે છે I have pain in my stomach.
(આઈ હેવ પૈઠમ છીન માય સ્ટમ્પ)

આ બધુ સારે છે This is too good. (ધીસ ઈજ કુ શુડ)

મારે બે પગ છે I have two feet. (આઈ હેવ કુ ફ્રીટ)

આ દાડતું પીપ મોટું છે This tub of wine is very big.
(ધીસ ટાપ એલ વાધન ઈજ વેરી બીગ)

૨૦ હંડ્રેવેટનો કન થાય છે Twenty hundredweights make
one ton. (કુંનેની હંડ્રેવેટસ મેચક વન ટન)

કું આ ચોપડી વાપરે છું I use this book. (આઈ યુસ
ધીસ ષુક)

આ ધેરીઓ દોડે છે These ewes run, (ધીજ યુસ રન)

લશકરનો મોખરો The van of the army. (ધી કન એલ
ધ આર્મી)

તું બધુ મગરાય છે You are vain. (યુ આર વેન)

શરીરની રગોમાં લોહી વહે છે Blood flows through veins.
(બલક ઇલોઝ કુ વેચન્સ)

આ પથ્થરની ખીચુ છે This is a vale of a rock. (ધીસ
ઇજ એ વેલ એલ એ રેક)

તેણે પોતાના ચાકરને પેસા આપ્યા He gave money to
his servant. (ધી જેવ ભની કુ સીજ સર્વનંદ)

આ તેના કરતાં વધારે સીધું છે This is primmer than that.
(ધીસ ઈજ માઈભર બેન ષિટ)

હવે કું પહેલી ચોપડી વાંચની થર કરે છું Now I begin to
read primar. (નાઉ આઈ બીગીન કુ રીડ પ્રાઈમર)

કું તમને ત્યાં આવવાની પ્રાર્થના કરે છું I pray you to come
there. (આઈ પ્રે યુ કુ ક્રમ ધેર)

સીંહ સિકારપણ રહે છે The lion lives upon his prey.

(ધ લાયન લીજ અપીન હીજ પ્રે)

તે આર્થના કરે છે He prays. (હી પ્રેઝ)

કું તમારાં વખાણુ કરે છું I praise you. (આઈ પ્રેઝ યુ)

મારા ભરમાં ચાર ધા કાગળ છે I have four quires of paper.

(આઈ હેવ ફાર કરાઓર્ડ્સ એફ પેપર)

અર્દેયાની ટોળી ગાય છે The choir sings. (ધી ક્વાયર સીંગ)

કું તમને મનામ આપીશ I will give જું યુ એ પ્રાઇઝ)
વીજ ગીત યુ એ પ્રાઇઝ)

તે ચુપકીથી જુએ છે He spies. (હી સ્પાઇઝ)

આ રસ્તો સાંકડો છે This road is narrow. (ધીસ રેડ
ઘડ નેરો)

આ માષશીનાં ઈડાં મુશેલાં છે These roes are dead. (ધીસ
રોડ આર ડેડ)

હીદુસ્તાનના ધાર્યા રસ્તા હાથ આન્યા Many roads to India
were discovered. (મેતી રોડ્સ કુ મન્ડીઆ વેર ડીસ્કવર્ડ)

કાગડાની લાર કાળી હોય છે Rows of crows are black.
(રોડ એફ કોળ આર ડ્યાલ્ક)

આર રૂડનો એક એકર હોય છે Four roods make one acre.
(ફોર રૂડ્સ એકર વન એકર)

આ લોકો જંગલી છે These people are rude. (ધીસ પીપલ
આર રૂડ્સ)

તેણે પોતાના હાથ ઉચ્ચા કર્યા He raised his hands. (હી
રેઝન્ડ લીઝ રૂસ)

સર્વના કિરણુ પૂછ્યાપર પડે છે The rays of the sun fall upon the earth. (ધ રેઝ ઓફ ધ સન ફોક્સ અપોન ધ અર્થ)

તેમણે ચંદેરના બાદ જમીનહોરત કર્યો They razed the ramparts of Chandery. (નુ રેજડ ધ રેમપાર્ટ્સ ઓફ ચંદેરી)

હું તમને નંદલી ભારીશુ I will rap you. (આઈ વીલ રેપ યુ)

તેઓ શરીર ઉપર કાળા કામળા વીઠાળે છે They wrap themselves in black blankets. (દે રેપ દેમસેલ્વસ ધન ડલેક ડલેન્ક્રસ)

આ પટો ટેાઇ પાસેથી ખુંચાની લીધલો છે This waist-band is rapt from some one. (ધીસ વેસ્ટ-એન્ડ છજ રેપ ફ્રોમ સમ વન)

તેઓએ તેના માથામાં ટકારો ભાર્યો They rapped him in his head. (લ રેપ હીમ ધન લીઝ હેપ)

તેઓએ ડાળા પહેર્યા They wrapped themselves in twigs. (દે રેપ દેમસેલ્વસ ધન ટીગ્સ)

મારી પાસે બદ્ધની કલમ છે I have a reed-pen. (આઈ હેવ એ રીડ-પેન)

હું દાંચું હું I read. (આઈ રીડ)

આ રાતો રંગ છે This is a red paint. (ધીસ છજ ઓફ રીડ પેઇન્ડ)

લેખ વાગ્યુ છે He has read. (હી હેડ રેડ)

મારે ઇવા જવાની ટેવ છે I have a practice of taking a walk. (આઈ હેવ એ પ્રેક્ટીસ જોડુ ટેક્ચિં એ વોક)

ઇવા જવાની ટેવ પાડો Practice to take a walk. (પ્રેક્ટીસ કુ ટેક્ચક એ વોક)

હું લાં આવત I would come there, (આઈ વૃડ કમ ધેર)

બળદને બુઝરે બાધા Tie the oxen to the yoke. (ટાઈ ખ ઓક્સન કુ ધ યોક)

ઈડામાં પીળો માંવા હોય છે There is yellow substance in eggs. (ધેર ઈજ પલો સખસફન્સ ઈન એંગ્ગ)

યુ આડ યુરોપમાં છે Yew is found in Europe. (યુ ઈજ હાઉન્ડ ઈન યુરોપ)

આ તમારી ચોપડી છે This is your book. (ધીસ ઈજ ધ્યાર લુક)

મારી પાસે બોટવો છે I have an ewer. (આઈ હેવ એન બોર)

તમે મુર્ખ લાગો છો You seem to be a fool. (યુ રામ કુ ભી એ મુલ્લ)

શેતરંજમાં દોરાની લીલાઓ હોય છે Chess contains seans. (ચેસ કન્ટેઇન્સ સીએસ)

દુનિયામાં ધણા સમુદ્ર છે There are many seas in the world. (ધેર આર મેતી રીડ ઈન્ડ ખ વર્લ્ડ)

તે અધીક્ષતી જુબે છે He sees minutely. (હી સીડ માઝ-યુટાલી)

વાધી શિગર પોનાતો પકડે છે Tigers seize their prey.

(ટાગમ સીડ દૂર હો)

તેઓ હોય ગુજે છે They see him. (થે રી હીમ)

દિનિયામ થાં નાની બંદું છે Pearls are found out from a sea (પર્વત ચાર ક્ષાઉન્ડ આઉટ ફાન્ડ એ રી)

મેં હાજ નંગા છે I have seen the park. (આઈ લેવ રીત થી પાર્ક)

આ હેણાવ રણિઅભંગ છે Thi, is a charming scene. (ધીસ ધડ આ ચંમિંગ રીન)

આ જળમાં લોટની ગોળાંઓ છે There are small balls of flour in this net. (ધર આર સ્પેશ બેસ અંડ ઇલોર છન ધીસ નેટ)

આ એરડી પહોળા છે This room is broad. (ધીસ ઇમ ધજ પ્રોાંડ)

મને બહુ ટાંક વાય છે I feel too much cold. (આઈ રીલ કુ મચ ટોલ્ડ)

આદનાં સુણ ઉડા હોય છે Roots of trees are deep. (રૂટ્સ એદ ટ્રીજ આર ડીપ)

ગુલાબ સુગધીદાર હોય છે Rose is fragrant. (રોજ એડ રૂગડાન્ડ)

ખારવો માણરું ચલાને છે, The sailor rows a boat. (ધ સેચનર રોઝ એ બોટ)

આ છોકરાએ શાહદો ગોખ્લો કાઢ્યા This boy rote the words. (ધીસ જોય રોટ ધ વર્ડ્ઝ)

મેં પાડ લખ્યો I wrote the lesson. (આઈ રોટ ધી લેસન)

આ ફળો ડોહી જગે These fruits will rot away. (ફીજ કુટ્ટસ વીલ રોટ અવે)

તેણું ધારું કામ કર્યું He wrought very hard. (હી રોટ વેરી હાર્ડ)

તમે આ ધનુસ્યને વાળો Wild this bow. (વીલ ધીસ બો)

આજે યાંદ્રા પવન છે There is cold weather to-day.

(ઘર દક્કા કોલ વેપર કુંઠે) :

તે આવશે કે નહિ તે જાણુંતો નથી I do not know whether he will come or not. (આઈ કુંઠાટ તો વેપર હી વીલ કમ એર નોટ)

મહીનાનાં ચાર અડવાડીઓં હોય છે Four weeks make a month. (કોર વીક્સ મેટ્ટક એ મન્થ)

કું નખોલા છું I am weak. (આમ એમ વીક)

તેઓ જીત્યા They won. (ધે વન)

ઓક ચોપડી લાવા Bring one book. (ભીગ વન લુક)

તે જંગલમાં રહે છે He lives in the wood. (હી લીઝ ઇન ધ પુડ)

તેને જરા ધક્કો લાગ્યો He suffered a slight stroke. (હી સફર્ડ એ સ્ક્રાફ્ટ ર્ટ્રોક)

અંદની કળા વધે છે અને ઘટે છે The moon wakes and wanes. (ધ સુન વેચકસ એન્ડ વેચન્સ)

આ ચાકુ બાગેલું છે This wain is broken. (ધીસ વેદાન કુંજ ડ્રાઇન)

તમે પૈસા ગુમાવો છો You waste money. (કુ વેસ્ટ અની)
 સ્લીની ડેડ પાતળી હોય છે Waist of a lady is thin. (વેસ્ટ
 ઓઝ એ લેડી ઇજ થીન)

તેઓ મારી રાહ જુંગે છે They wait for me. (ધે વેસ્ટ
 ફાર મી)

આ લાર બાળ લારે છે This weight is very heavy. (ધીસ
 વેચટ ઇજ વેરી ડેલી)

મારી દુકાનમાં થોડો સામાન છે There is little ware in
 my shop. (ધેર ઇજ લીટલ વેર ઇન માય શોપ)

કુવાના પથરા દોરડાથી ધસાય છે Stones of wells wear
 away by ropes. (સ્ટોન્સ ઓઝ વેલ્સ વેર અવે
 નીય રોપ્સ)

દરિયાનું મોનું The wave of the sea. (ધી વેવ ઓઝ ધ સી)

આ રસ્તે જાઓ Go by this way. (જો આય ધીસ વે)

આ સ૊નું લેખો Weigh this gold. (વે ધીજ જોઈડ)

વાંદો વનમાં રહે છે Tigers live in a wood. (ટાઇગર્સ લીવ
 ઇન એ વુડ)

અંગ્રેજ લોડો એક અમુક ટોપી પહેરતા The English-men put
 on ruffs. (ધ ઇંગ્રેશ પુટ ઓન રફ્સ)

મારો કોટ ઘડથયડો છે My coat is rough. (આય કોટ
 " ઇજ રદ) :

આ પુષ્પ કરમાયેણું નથી This flower is not sere. (ધીજ
 કુશાવર ઇજ નોટ સીઅર)

મુત્તાર મીથુણતીથી મેળના કાણ્યા પુરે છે Carpenter ceres tables (કાર્પેન્ટર સીઅર્સ ટેબલ્સ)

આ પાણી ચોખું છે This water is sheer. (નીચું વાટર ધૂક શીઅર)

આ જાડ કું કાખું છું I shear this tree. (આઈ શીઅર ધીચું ટ્રી)

લેણું ચોડી છથારતો કરી He made some signs. (હા મેટ્ડ સમ સાઇન્સ)

મારી પાસે તારો સિફ્કો છે I have a signet. (આઈ હેને એ સિગનેટ)

નાના હંસ મોતી ખાય છે Ciggnets eat pearls. (સિગ્નેટ્સ દટ પર્લ્સ)

હું પાણીમાં દૂષું છું I sink in the water. (આઈ સીક હન ધ વેટર)

મેં આવા કાંઈ પદ્દાડ કરી જન્યો નહોંંતા I never saw such a sion before. (આઈ નેવર સાં સચ એ સ્ન્યુયન બિંઝાર)

મેં ચુલ્લાખની કલમ વારી છે I have planted a graft of rose. (આઈ હેને ઐનેન્ટેડ એ ગ્રેફ ઓઝ રેઝ)

તેણું હો મોહું હતું Its size was big. (હું સાઇઝ વાળ બીજ)

તેણું થણ્યા નીસાસા મૃજયા He cried with deep sighs. (હું શાદ્ય વીથ ડીપ સાઇઝ)

તેની ચોપડી હુંઠી ગમ His skull was broken. (હિં સ્કલ
વાજ ઓફન)

આ નદીમાં નાના મછવા છે There are sculls in this river.
(ધેર આર સ્કલ્સ મન ધીમ રીવર)

વાંદરાની પુંછડી લાંબી લોય છે Tail of a monkey is long.
(ડેઢાંક ઓફ એ મન્કી છઙ લોંગ)

મારા બેનરમાં અડુ જરૂરીઓં છે There are many tares in
my field. (ધેર આર મેની ટેર્સ મન માર શીલ)

હું ચોપડી દાડી નાખીશ I will tear the book. (આમ
વીજ ટેર ધી ચુક)

આ પાકીટ બાંધનાર નમે છો You are a tiey of this
pocket. (યુ આર એ ટાઇ ઓફ ધીસ પેકિટ)

તમે આંસુ કેમ પાડો છો ? Why do you shed tears ?
(વાલુ કુ યુ રોડ ટીઅર્સ !)

આ છોકરા મને ચીડયે છે These boys tease me. (ધીમ
(હોયસ ટીજ મી)

આદ ઘણી જનની હોય છે There are many sort of teas.
(ધેર આર મેની સોટ ઓફ ટીજ)

આ કુતરી ધથુણાર વીયાય છે This bitch teems many a
time. (ધીસ બીચ ટીમ્સ મેની એ ટાઈમ)

આ જોસણ મોંટ છે This team is large. (ધીસ ટીમ છંક
લાર્જ)

આ જાઓ Go there. (જો ધર)

તેમનાં ધર અહીં છે Their houses are here. (હેર હાઉસીસ આર હીઆર)

તેણે દંડા ફેંક્યો He threw the ball. (હી શુધ ખાત)
આ ગલીમાંથી જાઓ Go through this lane. (ગો શુધીસ લેન)
તે ગાઢીપર બેઠો He sat on the throne. (હી સેટ ઓન ધ ઓન)

હું ચાર ટકે રૂપીઆ જાઓ I borrowed money at four percent. (આર પોંગડ મની એટ ટ્રેન્ડ પરંસન્ટ)

આ ટ્રેન્ડ હું ચાહું છું I like this style. (આઈ લાઇક ધીસ રટાન્ડ)

બાબલમાંડપની સામુદ્રધૂતી અરથતાનમાં છે There is a strait of Babalmandap in Arabia. (હેર ટ્રેન્ડ એ સ્ટ્રેટ ઓછું બાબલમાંડપ ઇન અરેબીયા)

નિયાળથી રીધા ઘેર જાઓ Go straight home from school. (ગો સ્ટ્રેટ હોમ હોમ રૂલ્ય)

આ રકમનો સરવાળો કરો Sum up this term. (સમ અપ ધીસ ટર્મ)

મારી પાસે કેટલીક ચાપડીઓ છે I have some books. (આધ હેવ સમ ખુક્સ)

સવારમાં સૂર્ય ઉગે છે The sun rises in the morning. (ધ સન રાઈશીસ ઇન ધ મેર્નિંગ)

આરે બેં છોકરા છે I have two sons. (આધ હેવ ડુસન્સ)

લાસ્કરમાં હું ખોશાક બેચું છું I am a sutler. (આઈ એમે
ઓ સટલર)

આ છોકરું પેલા કરતાં વધારે ખુંદું છે This boy is subtler
than that. (ધીસ બોય ઇજ સટલર ધેન ધેટ)

આ ડેરી બંધુ મીરી છે This mango is very sweet. (ધીસ
મેરો ઇજ વરી સ્વીટ)

તમારો પરિવાર બહુણો છે Your progeny is wide. (એરો
ગ્રેગની ઇજ વાઇડ)

આ ગ્રીણા ઘીરા તીણા છે These spikes are sharp. (ખિડ
સ્પાઇક્સ આર શાર્પ)

હું એ રૂપીચા ડર લઈ છું I pay a tax of two rupees.
(આઈ એ ટેક એક હું રૂપીઅ)

હું એક વાત તમને કહીશ I will tell you a tale. (આઈ
વીક્ષ ટેલ મુ એ ટેલીશ)

મુખાકાતને લગતાં વાક્યો.

ડોડ છે Knock (નોક્સ)	સખામ Compliments
ગૃહસ્થ Gentleman (જે-ટલ્મેન)	(ડે-પ્લીમેન્ટમ)
એકલો Alone (એલોન)	ભૂલતું Fail (ફેલ)
સુખી Happy (હેપી)	બોયબતું Enjoy (એનજોય)
ખૂશી Glad (ગ્લેડ)	તર્થીઅત Health (હેલ્થ :)
મળતું Meet (મીટ)	દવા, રસ્તુ Climate (ક્લાયારમેન્ટ)
પછી After (આફ્ટર)	સાહેર Country (કાન્ચરી)

પણ Also (એકસે)	સદ્ગ Agree (એગ્રી)
છોકરો, ચોપરો Boy (ભોય)	ખમર News (ન્યુસ)
ખુશી Chair (ચૈર)	કંઈ નથી None (નાન)
અહેનત Trouble (ડ્રાફ્ટ)	ખાલુ Cup (કપ)
બેડક Seat (સીટ)	ચા Tea (ટી)
બાળ Side (સાઇડ)	ગલાસ Glass (ગલાસ)
પસંદ કરવું Prefer (પ્રીફર)	દાઢ Wine (વાઈન)
જોખ રહેવાને To stand (કુ સ્ટેન્ડ)	હોટલ, વીશી Hotel (હોટલ)
ખંડા Whole (ડાલ્સ)	રહેવું Stay (રસે)
ફુલંગ Family (ફેમિલી)	ઉતરવું Put up (પુટ અપ)
સારી પેટ Well (ઉર્વલ)	રહે છે Reside (રીસાઇડ)
કંડા Uncle (અંકલ)	થાડા A few (એ ફ્યુ)
આસિન્હાં Kind wishes (કાઇન્ડ જીવીશીસ)	ઠેકાણુ Address (એંડ્રેસ)
પદ્ધતીઆધ્યી Mrs. (મીરીસિસ)	ધૂટા Part (પાર્ટ)
પેતાનું ગુજરાન ચલાવે છે	હિતાવળ Hurry (હરી)
Gets her living (મેટસ દર લીવિંગ)	ધાંડું કામ Pressing business (પ્રેસ્ઝિંગ બીજનેસ)
સીનીને By sewing (ભાય સોએંગ)	દુંકી Short (શોર્ટ)
હાજર Present (પ્રેઝન્ટ)	ભાડું Hire (હાયર)
દુષ્પા Respects (રીસેપેક્ટ્સ)	મુલાકાત Visit (વીજીટ)
આંશિકમેન Coachman (ડૉયમેન)	પદકદ્યું Agreed (એગ્રીડ)
કાંઈવું Drive (ડ્રાઇવ)	કાણું કરવું Accept (એક્સેપ્ટ)
આરતો Slow (સ્લો)	માંગવું Demand (ડીમાન્ડ), પુરવું Sufficient (સરીશીયન્ટ)
	આના Anna (એનાન)

જુઓ, બારણું ડાણ ટોક છે? See, who knocks the door?

(રી, હુ નોકસ ધી ટોર ?)

જુઓ, ત્યાં કોણ હતું? See, who was there? (સી, હુ વોડ ધર ?)

કોઈ ગૃહસ્થ મને ભગવા માંગે છે A gentleman wishes to see me. (એ જેન્ટલમેન ઉચીરાસ હુ સી મી)

તેને કહો અંદર આવે Tell him to come in. (ટેલ હીમ હુ કમ ઇન)

હુ એકદોખ હું I am alone. (આઈ એમ એલોન)

ભલે આવ્યા, સાદેય Welcome, sir. (ઉવેદકમ, સર)

હુ તમને ભગવાથી ખુશી હું I happy to see you. (આઈ એમ હેપી હુ સી યુ)

હુ તમને ભગવાથી ધણો ખુશી હું I am very glad to meet you. (આઈ એમ વેરી ગંડ હુ મીટ યુ)

મેં તમને ધણો હાલાંકિ જેવા I saw you after a long time. (આઈ સો યુ આઇટર, આ લાંગ રાધમ)

તમે કેમ છો? How do you do? (એઉ હુ યુ હુ)

સારી પેંડ Very well. (વેરી ઉવેદ)

હુ આશા રાખું હું જે તમે પણ સારી પેંડ કરો I hope you also are well. (આઈ હોપ યુ એક્સો આર ઉવેદ)

ઈ, ઉપકાર થયો Yes, thank you. (યમ, થેન્ક યુ)

હુ તમને જેઠને ધણો ખુશી હું I am very glad to see " you. (આઈ એમ વેરી ગંડ હુ સી યુ)

ઓકરા, એક ખુરશી લાવ Boy, bring a chair. (ઓય, ઝીંગ એ ચેર)

આ ગૃહસ્થને ખુરશી આપો Give this gentleman a chair.

(ગીવ ધીસ જેન્ટલમેન આ એર)

તમે પોતે મણેના ના હા॥ Do not trouble yourself. (હું
નોટ દ્રાગલ બોર્સેલ્ડ)

ખુરશી લઈને લાં બેસા Take a chair and sit down
there. (ટેઇક આ એર એન્ડ સીટ અભિન ધેર)

મહેરાની કરીનો તાં બેસો Please take your seat there.
(પ્લીઝ ટેઇક ગોર સીટ ધેર)

મહેરાની કરીને બેસો Please sit down. (પ્લીઝ સીટ અભિન)

મારી પાસે બેસો Sir by my side. (સીટ બાય માય સાઇડ)

હું ઉંઘો રહેવાનું પણ કરે છું I prefer to stand. (આઈ
પ્રીફર કુ રહેણ)

આઈ કાલે હું તમને મળના આવ્યો હતો I had come to meet
you yesterday. (આઈ હેડ કમ કુ મીટ યુ યસ્ટરડે)

તમે કયારે આવ્યા ? When did you arrive ? (ઉંહેન ડીડ
�ુ એરાઓ ?)

ગઈ કાલે સાંજના Yesterday evening. (યસ્ટરડે ઇવનિંગ)

તમે એકલાજ આવ્યા કે ? Have you come alone ? (હેવ
કુ કમ એલોન ?)

તમે ડાની સાથે આવ્યા ? With whom did you come ?
(ઉનીથ કુમ ડીડ યુ કમ)

હું મારાં બધાં હુકુમ સાથે આવ્યો છું I have come with my whole family. (આઈ હેવ કમ જીવીમ ભાગ હોવ હેઠીલી)

સાહેબજી, તમારી પોતાની મંબાળી લેને Good bye, take care of yourself. (ગુડ બાય, ટેઇક કર ઓઝ ચેરસેલ્ફ)

આડીવાન, મને કોચમાણે હાંકી જા Coachman, drive me to Colaba. (કોચમેન ડ્રોઝવ મી હુ કોચાંબા)

જખદી હાંક Drive fast. (ડ્રોઝવ હાસ્ટ)

આસ્તે હાંક Drive slow. (ડ્રોઝવ સ્લો)

આડીમાંથી પેઢી વસ્તુઓ બહાર લાવો Bring out those things from the carriage. (ખોંગ આઉટ પોઝ થોંગ રોમ ધી કરેજ)

તેઓને ઉપર લઈ જાઓ Take them up-stairs. (ટેઇટ હેં અપ-સ્ટેર્સ)

પેડી મંબાળી Take care of the trunk. (ટેઇક કર ઓઝ ધી ટ્રાન્ક)

આડીવાળાને ભાડું આપો Pay the hire to the driver. (પે ધી લાયર હુ ધી ડ્રોઝવર)

તમે એને શું, આપનાનું નક્કી કર્યું છે? What have you agreed to pay him? (વેટ હેવ મુ એગ્રીડ હુ પે ધીમ)

શે' તેને અરદ્ધો રૂપીઓ પછિયો છે I have agreed to pay him half a rupee. (આઈ હેવ એગ્રીડ હુ પે ધીમ હાલ એ રૂપી)

તે નથી બેતો He does not accept it. (હી કા નોંધ
એકસેપ્ટ છુટ)

તે શું માગે છે ? What does he demand ? (ઉનોટ કા
હી ડીમાન્ડ ?)

તે એક રૂપીઓ માગે છે He demands a rupee. (હી
ડીમાન્ડ આ રૂપી)

નહિ, અરદો રૂપીઓ પુરતો છે No, half a rupee is quite
sufficient. (નો, હાંડ આ રૂપી હંચિ કવાઈ સરીશીઅન્દર)

આ રૂપીઓનું પરચુરણું લાવો Bring change of this
rupee. (ભીગ ચેન્જ એંડ ધીસ રૂપી)

તેને દશ આના આપો Pay him ten annas. (પે હીમ
ટેન ગોનાઝ)

એને કહો કે જાઓ Tell him to go away. (ટેલ હીમ કુ
ગો અવે)

તમે મને કહી શકો કે તે ક્યાં રહે છે ? Can you tell me
where he lives ? (કેન યુ ટેલ મી ઉંહેર હી લીઝ ?)

મારી સાથે આપો, હું તમને ત્યાં લઈ જાઉ Come with me,
I will take you there. (કમ ઉવીથુમી, આપુ ઉનીથ
ફેલ યુ ઘેર)

માં કરણે, હું પોતે જધશ Thank you, I will go myself.
અંક યુ, આધ ડિવીલ જો માયસેલ્ફ)

હવે મારે તમારાથી ખુલા પડતું જોઈએ I must part from you
now. (આઈ મસ્ટ પાર્ટ કોમ યુ નાઉ)

તમે ધાર્યી ઉતાવળમાં છો You are in a great hurry.
 (યુ આર દાન આ એટ હરી)

મને ધાર્યું કામ છે I have a pressing business. (આઈ હેવ
 એ પ્રેસિંગ બીઅનોસ)

પાંચ વાગને મને રોકાણું છે I have an engagement at
 five o'clock. (આઇ હેવ એનેન એન્જેન્ભેન્ટ એટ ફોલ્વ
 એંડ કંકાણ)

એક ગાડી મળાવા હંડ ફોર એ કારીઝ (સંન્ડ હાર આ કરેજ)
 તે તૈયાર છે It is ready. (એ એફ રેડી)

આ વસ્તુઓ માડીમાં નાણો Put these things in the
 carriage. (પુટ ધીમ થીંગ્સ એન ધી કરેજ)

આ કુદી મુખ્યાકાન મારે અમે તમારા ઉપકાર માનીએ છીએ We
 thank you for this short visit. (ઉન્ના થેન્ક યુ
 કાર ધીસ શેર્ટ વારીએ)

બેર બધાને મારી સખામ કહેણે Present my compliments
 to all at home. (પ્રેઅન્ટ માય હોમેલીમેન્ટ્સ કુ ઓખ
 એટ હોમ)

તમારી માને મારા પ્રષ્ટામ કહેણે Present my respects to
 your mother. (પ્રેઅન્ટ માય રીસ્પેક્ટ્સ કુ યોર મધર)

તમાર બાપને મારી ધર્યી ધર્યી સખામ કહેણે Give my best
 compliments to your father. (જીવ માય બેસ્ટ
 એન્જેન્ભેન્ટ્સ કુ યોર ફોલ્વર)

આ દેશની હવા તમને માફક આવે છે હો ? Does the climate of this country agree with you ? (એ ધી ક્રાઇમેટ ઓફ ધીસ કન્દ્રી એગ્રી ઉવીથ યુ ?)

સુરતની હવા મને શરીરી નથી The climate of Surat does not agree with me. (ધી ક્રાઇમેટ ઓફ સુરત એ નોટ એગ્રી ઉવીથ મી)

ધીએ યુ ખાંડર ? What other news. (ઉંવાટ અખર ન્યુઝ્ર ?)

કંઈ જાણુવા નેગ નથી None worth mentioning. (નન ઉર્વર્થ મેન્શનનીગ)

ઓક પાલુ ચા પીશો ? Will you take a cup of tea ? (ઉવીલ યુ ટેચ આ કપ એફ ટી ?)

નાલિ, માફ કરો No, thank you. (નો, થેન્ક યુ)

તમે કંઈ હોટલમાં રહો છો ? In which hotel do you stay ? (એન ઉવીથ હોટેલ કુ યુ સ્ટે ?)

તમે ક્યાં ઉત્તરેલા છો ? Where have you put up ? (ઉંહેર હેન યુ પુટ અપ ?)

મારા ભિન્નને ત્યાં At my friend's. (એટ માય ફેન્ડાફ)

તમારે ભિન્ન ક્યાં રહે છે ? Where does your friend reside ? (ઉંહેર એ ચેર કે-ન રીસાઇડ હો)

થોડા દિવસ અમારે ત્યાં રહો Stay a few days with us. (રહે આ ઇન્દુ એજ ઉવીથ અસ) . . .

તમે મને મીરટર "એ" નુ ડેક્સન્સ આપી શકશો ? Can you give me the address of Mr. A. ? (એન યુ ગીવ • મી ધી એડ્રેસ એફ મીરટર એ ?)

તમારું અહોપાં કેમ આવતું થયું ? What has brought you here ? (ઉવેસ્ટ હેડ પ્રોટ કુ હીઅર ?)

ધરમાં બધાં કેમ છે ? How are they all at home ? (દાઉ આર ધે ઓલ એટ હોમ !)

તમારું ફુરુંણ કેમ છે ? How is your family ? (દાઉ ચાજ ચોર ફેમીલી ?)

બધાં સારી પેઠે છે All are well. (ઓલ આર ઉવેલ)

તમારા કાકા કેમ છે ? How is your uncle ? (દાઉ ચાજ ચોર અંકલ ?)

તે જેમ છે તેમજ છે He is just the same. (હી ચાજ જરસ્ટ ધી સેધમ)

હું તેને સારુ દિલગીર છું I am sorry for him. (આઈ એમ સારી ઝાર હીમ)

બોધનની વહુ ક્યાં છે ? Where is Mrs. John ? (ઉનહેર ચાજ મીસીસ જોન ?)

તેણી હમણુંનું ખાહેર ગઈ છે She has just gone out. (શી હેડ જરસ્ટ ગોન આઉટ)

તેણી સીનીને પોતાનું મુજરાન ચલાવે છે She gets her living by sewing. (શી જેટસ હર લીવીંગ બાય સોઝિંગ)

તેણીને મારી સભામ ડલેલે Give her my compliments. (ગીવ હર માય પ્રોમ્પ્લિમેન્ટ્સ)

તેણીને મારી દુલા ડલેલે Remember me to her. (રીમેમ્યર ની કુ હર)

હું ખુલ્લીશ નહિ I shall not fail. (આઈ શેષ નોટ ફેરલિ)

તમે સારી તખીએત ભોગવો છો ? Do you enjoy good health ? (હું કું અનજોય ગુડ હેલ્થ ?)

એટલામાં જબી રણા ? Did you finish eating so soon ?
(ડીડ હું શીનીશ એટિંગ સો ચન)

મને જમતાં બહુ વાર લાગતી નથી I do not take much time to finish my dinner. (આઈ હું નોટ ટેક અચ ટાઇમ કું શીનીશ માય ડીનર)

ઓઝિમાં આવો છો ? Do you come to the office ?
(હું હું કમ કું ધ ઓઝિસ ?)

હા, તેને જવા હો વખત થયો છે Yes, let him go it is time. (ધસ, લેટ હીમ ગો, લેટ છક ટાઇમ)

અભિજાન પરચુરણ વાક્યો.

હું સુતો હું I am in bed. (આઈ એમ ધન એડ)

તે કાળી પિલાડી હતી It was a black cat, (બેદ વોંડ એ બલ્ક ટેટ)

ઓલ તે કુના આગળ છે The pail is at the well. (ખી પેલ છક એટ ધી ઉવેલ)

તખાવમાં હેઠું છે There is frog in the pond. (ધેર છક એ રોગ ધન ધ પાંડ)

તે ખુરશી ઉપર બેડો He sat on the chair. (હી સેટ ઓન • ધી એર)

આજે રજી છે There is leave to-day. (ધેર ઈજ લીવ હુ-ં)

મને મદદ કરો Help me. (હેલ્પ મી)

તમે ક્યાં હતાં ? Where were you ? (ઉનહેર વેર હુ ?)

તે પંચાં છે It is a 'an. (એ ઈજ એ હું)

હું મારું ઘડીઆગી સજ કરાવવા ધારું છું I intend to have my watch repaired. (આઈ એન્ટર્પેન્ડ કુ લેવ મારું ઉર્બાય રીપર્ડ)

તમારું ઘડીઆગી ગાંન જંણા હો Let me see your watch. (લેટ મી રી થાર દાય)

તમારું ઘડીઆગી અરોગ્ય આલે છે Your clock goes well. (થાર કંખાક ગાંગ ઉંનલ)

રડતા નહિં Do not weep. (કુ નોટ વીપ)

ઉધી જાગો Go to sleep. (ગો કુ રશીપ)

મારો ડગલો તે પેટીમાં છે My coat is in the box. (મારું કોટ ઈજ એન ધી પોકસ)

મારો ડગલો ઉનનો અનેલો છે My coat is made of wool. (મારું કોટ ઈજ મેટાડ એદ ઉવુલ)

તે આપણું યાદ મટાડે છે It keeps us from the cold. (નિટ કુઓસ અસ મોસ પી ટ્રેડ)

કેશવ ઉંબા રહે છે અને ગાયને અવરાવે છે Keshav stands and feeds the cow. (કેશવ સ્ટેન્ડડ એન્ડ ફીડ્ડ ધ મારું)

જે સથણું હું કરું છું તું જુઓ છે He sees all that I do. (હી સીજ એલ ધેર આઈ કું)

ને સંઘળાની મને જરૂર છે તે મને આપે છે He gives me all
that I need. (હી ગીજ મી ઓાખ ધેટ આપ નીડ)

તે કલમ ચુસ્તા નાદિ Do not suck the pen. (કુ નોટ સક
ધી પેન)

મને અંતર લે Tack me in. (ટક મી છન્હ)

ભગત પાસે ભમરડો છે Bhagat has a top. (ભગત હેંડ એ ટોપ)

મારી બણેન નિશાળે જાય છે My sister goes to school.
(માય રીસટર ગોંડ કુ રફુલ)

તમારા સાગાનું નામ શુ ? What is the name of your
brother in-law ? (ઉંહેઠ એઝ વ નેંબિ ઓાદ મેર
અધર છન-લો ?)

મારા એક કાકા મદારા ગયા છે One of my uncles has
gone to Madras. (વન એદ માય અન્કલસ હેંડ ગોન
કુ મદારા)

તે અણુ ટકા બાજ આપે છે He gives three percent
interest. (હી ગીજ શ્રી પર્સેન્ટ ઇન્ટરેસ્ટ)

શીતા વાડાજ ગાઈ Sita went to Wadaj. (સીટા વેન્ટ કુ વાડાજ)
કોઈ કંડ છે કે તેણુ ગામ કયુ Some say that he committed
sin. (સમ સે ધેટ લી કન્નેડ રીન)

લિસાણતા ઘોટાળો Garbling of accounts. (ગાંધીજ એાદ
એકાઉન્ટ્સ)

મને મારા કાકા તરફથી અગર મળો I came to know of it
through my uncle. (આમ કેમર્સ કુ નો એાદ ઇંઝ
માય અન્કલ)

તેમાં તેને આડ કાખની ખોટ આવી He lost eight lacs there by. (હી લોસ્ટ એથી લેક્સ ધેર બાય)

તે કઈ ભાષા બોલે છે ? What language does he speak ?
(ઉચોટ લેન્ગ્વાજ કંડ હી સ્પીક ?)

એ તમારી પોતાની છે ! Is it your own ? (છટ ધસ ચોર આન !)

હીંદુ અને પારસી ટેટલીક બાળતમાં મળતા છે The Hindus and Persees are alike in some respects. (હી હી-દુઝ એ-ન પારસીસ આર એલાઇક ધન સમ રીસ્પેક્ટ્સ)

મેં દાતણું પાણી કર્યું I cleaned my teeth and washed my face. (આઈ કલીન માય ટીથ એન્ડ વાશ માય ફેફલ્સ)
જુહું બોલવું ચરમ ભરેલું છે To lie is shameful. (હુ લાઘ ધંજ શોધમણુલ)

જે શબ્દ કહેા તે વિચારીને કહેા Whatever you speak, think and speak. (વાટએવર યુ સીક થિન્ક એન્ડ સ્પીક)

એમાં તમારી મોટી ભૂલ છે There you are much in the wrong. (ધેર યુ આર મય ધન હી રોંગ)

કરશો તેવું પામશો You will reap what you sow. (ય ડુકિશ રીપ ઉંવાટ યુ સો)

હું અંદર હું I am in. (આઈ એમ ધન)

આગળ ચાલો Go on. (જો ઓન)

તે મારી ટોપી છે It is my hat. (છટ ધજ માય હેટ)

તે મારી પંખો છે It's my fan. (ધટ ધજ માય ફેન)

નાદથા આગળ જાઓ Go to the map. (જો હુ ધ મેપ)

તમે તમારે વચન ક્યારે પાણશો ? When will you fulfil your promise? (ઉન્હેન ઉચ્ચીલ યુ કુલશીલ યોર પ્રોમીસ ?)

અવિચારનાં પરિષ્ઠામ ધણું ખરાખ નીપજે છે The consequences of indiscretion are very bad. (ધી ડાન્સીકવન્સીડ એંડ ધન્ડીરકીશન આર કરી એડ)

થોડાને ટેટલા પગ હોય વાર ? How many feet has a horse ? (હાજ મેની રીટ હેડ એ હોસ ?)

મારી ઉપર ભરોસો રાખો Trust upon me. (દૂર અચેતન મી)
તમે હવે નથીએ ક્યારે જશો ? When will you go to the river now ? (વહેન ઉચ્ચીલ યુ જા હુ ધ રીવર નાઉ)

શક્રો ઇને છે Sakra is crying. (શક્રા છક ફાંગિ)

શામળદામ નાલ્લ છે Samldas is bathing. (સામળદામ છક બંધીન)

આ દુક્ષાયનુ વર્ષ છે This is a year of famine. (ધીસ દુજ એ દુઅર એંડ ઇમીન)

આ કાગળની ઉપર શીરનામું કરો Kindly address this letter. (કાધનું એંડુસ ધીસ લેટર)

નિશાળને લગતાં વાક્યો.

નિશાળ School (રકુલ)	નાકરણુ Grammar (આમર)
રણ Leave (લીન)	લેડળુ Spell (સ્પેલુ)
અસો એ ઐન્ડ-એ	શબ્દ Word (ઓર્ડ)
વર્ષ Class (કલાસ)	પાઠ Lessons (લેસન્સ)

માસ્ટર Teacher (મીચર)	શીખવું Study (સ્ટડી)
હસ્કન Hand writing (હેન્ડરાઇટિંગ)	અદ્દલે Instead (એન્સ્ટેડ)
જ્ઞાન Knowledge (નોઝિંગ)	રમતું Playing (પ્લેયિંગ)
બરાબર Properly (પ્રોપર્લી)	કક્કડો Piece (પીસ)
ખરાબ Badly (એડલી)	ચાંક Chalk (ચાંક)
શીખે છે Learns (લર્ન્સ)	બ્લાડીંગ Board (બોર્ડ)
ઓલી જાગો Repeats (રીપ્લાય)	બ્રાથ્બોન Bag (બેગ)
શરૂ કરવું Begin (બીગનિન)	અંકિયો Inkstand (ઇન્કસ્ટન્ડ)
વારા ફરતી By turns (વાય ટર્નિંગ)	નરમ Post (સાઇટ)
ચુક્કા Missed (મીસડ)	ચાલ્ચો Do (દુ)
કાઢેલી Torn (ટોણી)	ચક્ક Ruler (ચક્કર)
મુક્કતું Lay (લેચે)	શાળી ચુરાવાતો કાગળ Blotting paper (અલેટીંગ પેપર)
તરજુમો Translation (ડ્રાન્સલેશન)	ચાંક Penknife (પેનનાઇંક)
શીખ્યો Learnt (લર્ન્ટ)	પગાર Pay (પે)
પદ્ધતર પાટી Slate (ગ્લેટ)	ઘંટે Bell (બેલ)
લખાવવું Dictate (ડિક્ટેટ)	વ.ગે છે Is ringing (એઝ રીંગિંગ)
નિશાગે જાઓ Go to school. (જો હુ સ્કૂલ)	સાહેબજી Good bye (ગૃહ ભાગ)
તમે નિશાગે નથી જતા કે? Are you not going to school? (આર હુ નોટ જોઈયા હુ સ્કૂલ ?)	

આજે મને રાત છે I have leave to day. (આમ હેણ
લીવ કુ-દે)

તમે કઈ નિશાળે જાઓ છો ! Which school do you attend?
(ડિવીય સ્કૂલ કુ યુ એટેન્ડ !)

તમે ક્યા વર્ગમાં છો ! In what class are you ? (ક્ષેત્ર
ઉંવોટ ક્લાસ આર યુ !)

તમે તાં કું શાળા હો ! What do you learn there ?
(ઉંવોટ કુ લાં ધર !)

તમારા માસ્ટરનું નામ કું છે ? What is the name of your
teacher ? (ઉંવોટ કર ધી નોંબ ઓફ ગોર ટીચર !)

મને તમારા હસ્કન જરૂરો Show me your hand-writing.
(જો મી યોર હેન્ડ રાખ્ટીંગ)

તમારા હસ્કન સાચા નથી Your hand-writing is not good.
(યોર હેન્ડ રાખ્ટીંગ કંજ નોટ ગુડ)

એ મારા હસ્કન નથી This is not my hand-writing.
(ધીસ છજ નોટ માય હેન્ડ રાખ્ટીંગ)

તમને કાઈ અંગ્રેજ જ્ઞાન છે ? Have you any knowledge
of English ? (હેવ યુ એની નોલેજ ઓફ ઇંગ્લીશ ?)

અંગ્રેજ કાણ જાણે છે ? Who knows English ? (કુ નોઝ
ઇંગ્લીશ ?)

તમે અંગ્રેજ બોલો હો ! Do you speak English ? (કુ યુ
કુપીક ઇંગ્લીશ ?)

ખાલ્સે બોડુ Very little. (બેરી લીલા)

હું અંગ્રેજી જાણુતો નથી I don't know English. (આપ ટોન્ડ તો ઈંગ્રેઝ)

હું બરાબર બોલ્યુ છું કે ? Do I speak well ? (હું આપ સ્પીક ઉંબલ કે ?)

તમે બરાબર બોલો છો You speak properly. (યુ સ્પીક પ્રોપરલી)

તમે બરાબર નથી બોલતા You do not speak badly. (યુ હું નોટ સ્પીક બેંડલી)

પાડીયા તરફ જુઓ Look to the board. (લુક કુ ધી એર્ડ)

તમારો હાથનો અહીંયાં છે Here is your bag. (હીયર છન બેર એગ)

મને થાડો કાગળ મને શાહી આપો Give me some paper and ink. (ગીવ મી સમ પેપર એન્ડ ઇન્ક)

અડીઆમાં શાહી નથી There is no ink in the inkstand. (ધેર છન તો ઇન્ક છન ધી ઇન્કસ્ટાન્ડ)

મને સીસપેન આપો Give me a pencil. (ગીવ મી આ પેનભિન)

આ સીસપેન વળ્યી નરમ છે This pencil is very soft. (ધીસ પેનભિન દજ વેરી સેફટ)

મને એક કલમ આપો Give me a pen. (ગીવ મી એ પેન)

આ કલમ ચાલશે ? Will this pen do ? (ઉંચિલ ધીસ પેન હું ?)

ના, એ નહિ ચાલે No, it won't do. (તો, છન ઉંચોન્ડ હું)

મને તમારા હાથમાંની કલમ આપો Give me the pen of your hand. (ગીવ ધી પેન એન્ડ યોર હન્ડ)

મને ચેલી રૂલ આપશો ? Will you give me that ruler ?
 (ઉચ્ચીલ યુ ગીવ ભી ધેટ રૂલર ?)

મહેરખાની કરીને શાહી ચુંચવાનો કાગળ આપો Give me a
 piece of blotting paper please. (ગીવ ભી આ
 પીસ ઓછ બ્લેટિંગ પેપર ક્લીઝ)

તેણે મારું ચાડુ ક્યાં મુક્યું છે ? Where has he put my
 pen-knife ? (ઉંહેર હેજ હી પુટ માય પેન-નાઇફી ?)

આ રહ્યું નમારું ચાડું Here is your pen-knife. (મીયર છજ
 યોર પેન-નાઇફી)

માસ્તર કથારે આવશો ? When will the teacher come ?
 (ઉંહેન ઉલીલ ધી ટીચર કમ ?)

માસ્તરે તમને શું કહ્યું ? What did the teacher tell you ?
 (ઉંબેટ ટીડ ધી ટીચર ટેલ યુ ?)

“જી” એ મારી પેન લીધી છે ‘G’ has taken my pen.
 (“જી” હેજ ટેકન માય પેન)

તેને નમારી કલમ આપો Give him your pen. (ગીવ હીમ
 યોર પેન)

તમને તમારા વ્યાકરણું ગરજ છે ? Are you in need of
 your grammar ? (આર યુ ઈન નીડ ઓછ યોર પ્રામર ?)

નાહિ, મને લેની ગરજ નથી No, I am not in need of it.
 (નો આધ એમ નોટ છન નીડ ઓછ ઈટ)

તમે આ શબ્દની જોડણી કેઢું કરો છો ? How do you spell
 this word ? (હાઉં કુ યુ ર્પેલ્ ધીસ ઉવર્ડ ?)

મારી ચોપડી માણે કીધી છે ? Who has taken my book ?
 (હું હેઠળ માય શુક !)

આ ગ્રાહકરણ કેન્દ્ર છે ? Whose grammar is this ? (હું આમર મજા ધીમ !)

મારા ટેબલની ઉપરથી ચોપડીઓ લાંબા Bring the books from my table. (ખેંગ ધી શુકુસ સ્રોમ માય ટેબલ)

તમે તમારી ચોપડી રૂમ ન લાવ્યા ? Why did you not bring your book ? (ઉચાલ ડીડ નુ નોટ ખીગ યોર શુક !)

શું તમે હમેશાં એટલું જખાની લાંબા છો ? Do you always write so fast ? (હું યુ જ્ઞાનાંદ્રિય રાષ્ટ્ર સ્ના ફાસ્ટ !)

તમે તમારો પાક કયારે કરો છો ? When do you prepare your lesson ? (ઉંહના હું યુ પ્રીપેર યોર બેસન !)

રોજ સહજવારે Every morning. (જેવરી મોરનિંગ)

હું રમવાને બાહ્યાં શીખું છું I study instead of playing.
 (આઈ સ્ટડી ઇન્સ્ટેડ ઓફ પ્લેઇંગ)

ચાકનો કકડો લાવો Bring a piece of chalk. (ખીંગ આ પીમ ઓફ ચાક)

મેં તે ટેબલ ઉપર મુકી છે I have laid it on the table.
 (આઈ હેવ લેડ છટ ઓન ધી ટેબલ)

આ ચોપડી મારા ટેબલ ઉપર કોણે મુકી ? Who laid this book on my table ? (હું લેડ ધીસ શુક ઓન માય ટેબલ ?)

આ કોઈ સારી ચોપડી છે ! What a nice book is this !

(ઉર્ગાંત આ નાઈસ લુક છું ખિસ !)

આ તરબુભો ધજો સારો છે This translation is very good.

(ધીસ ટ્રાન્સલેશન એજ દરી શું)

માણે પાડ શીખ્યો છું I have learnt my lesson. (આઈ
ડે લાન્ડ માય લેસન)

તમારો પાડ ધંધો કુંડો છે Your lesson is very short.
(યાર લેસન એજ દેરી ફાર્ટ)

તમારી ચોપડી ઉંઘાડો Open your book. (ચોપન યાર લુફ)

તમારો પાડ શિખો Learn your lesson. (લન્સ માર લેસન)

આ ચોપડી તમારી છે કે ? Is this book yours. (એજ ધીસ
લુક દર્શાવ્યું)

હા, તે મારી છે Yes, it is mine. (યસ, એ એજ માઈન)

તે અરાણ ના કરતા Do not spoil it. (કુ નોટ ર્યોઝલ એજ)

આ ચોપડીનો મને એક રૂપાંશો બેડો This book cost me
one rupee. (ધીસ લુક કોન મી વન રૂપી)

તમારી રલેટ લો Take up your slate. (ટેઇલ અપ યાર રલેટ)

હું તમને લખાઉં તે લખો Write down what I dictate
to you. (રાઈટ ડાઉન ઉર્ગાંત આ ડિક્ટે હુ શુ)

તમે કેમ નથી લખતા ? Why do you not write ? (ઉથાં
કુ શુ નોટ રાઈટ ?)

મારી પાસે પેન નથી I have no pen. (આઈ ફૈન નો પેન)

તે લખતાં શીખે છે He learns how to write. (હી લન્સ
. એજ કુ રાઈટ)

હું વાંચતાં શીખું છું I learn how to read. (આઈ લર્ન લાઉ કુ રીએ)

તમે અંગ્રેજ સમજો છો ? Do you understand English ?
(તુ યુ અન્ગ્રેડ ઇંગ્લીશ ?)

હું તે થોડું સમજું છું I understand it a little. (આઈ આન્ગ્રેડ હટ આ લિટલ)

તમે અંગ્રેજ વાંચ્યા છો ? Do you read English ? (તુ યુ રીડ ઇંગ્લીશ ?)

તમે આ વાંચી શકો ? Can you read this ? (તેણ યુ રીડ ધીસ)

નાહિં, હું વાંચી શકો નથી No, I cannot read. (નો, આઈ નેન્ટાટ રીએ)

તમારે અંગ્રેજ શીખતું બનાયો You should learn English.
(ચુ ગ્રેડ લર્ન ઇંગ્લીશ)

હું અંગ્રેજ શીખું છું I learn English. (આઈ લર્ન ઇંગ્લીશ)

તમારો નંબર કેટાંમાં છે ? What is your number ? (ઓઝી નંબર નાંબર ?)

આ તમારી જગ્યા છે This is your place (ધીસ માર દાર પ્લેચ)

આજે કોણી વારી છે ? Whose turn is it to-day ? (તું ટર્ન એટ હટ કુ-ં ?)

તમારી વારી કુારે આવે છે ? When does your turn come.
(ઓઝ-ફેન કાં દાર ટર્ન કમ ?)

તમે તમારી વારી ચુક્ક્યા છો You have missed your turn.
(તુ હેવ મિસ્ડ માર ટર્ન)

મારી ચોપડી ફૂટેલી છે My book is torn. (માય ભુક પજ ટૉર્ન)

આ ચોપડી લો Take this book. (ટેક ધીસ ભુક)

ટેબલ ઉપર મુકો Lay it on the table. (લે એટ ઓન ધી ટેબલ)

હુકાનને કાગતાં વાક્યો.

અસલ Original (ઓરિજનલ)	ખડ Wheal (વુદ્દીટ)
ઘડનું Mend (મેન્ડ)	ચાન્દો Higher (દાયર)
ક્રમનું Important (સમર્પણનું)	ઝુલ્યા Mistaken (મીસ્ટેકન)
થોડો Due (ડ્યુ)	ટ્રાટ Court (કોર્ટ)
કર્ડીન્ડ Debt (ડેટ)	માગનાર Creditor (કેડિટર)
ઇસ્ટમાન Installments (ઇન્સ્ટાલમેન્ટ્સ)	શરાફ Banker (અનકર)
શેક Cheque (ચેક)	અન્ડોર્સાંડ Endorsement
ભાગ, શારી Share (શરી)	ટ્રાન્સ્ફર Transfer (ટાન્સફર)
નોટ Note (નોટ)	ચલણી Currency (કરુન્ઝી)
સહી રૂપી Sign (શ્રાન)	બ્રેકર Broker (બ્રેકર)
દ્વાલી Brokerage (બ્રેકરેજ)	પ્રદાન Percent (પ્રદાન)
ધારા માટું As usual (અંજ યુગનલ)	ભાવ Rate (રેટ)
હુદી Exchange (ઓફસેન્સ)	નેમનું તેમ Steady (સ્ટેડી)
મંદી Dull (ડલ)	ધર્યા Trade (ડ્રેડ)
મોસમ Season (સીઝન)	ઉધીનું લેનું Borrow (બાંન્ચ)
મુદ્દત Fixed period (અરીક્સડ પીરીઓ)	જામી Residu (રેસિડ્યુ)

મેલ Mail (મેલ્ડી)	અભ્યરી Inquiry (એન્ડવાયરી)
વાતો ઉતારવો Iusure (દનસ્થું)	આઉટટીઓ Agent (એજન્ટ)
બિલીંગ English (ઇંગ્લીશ)	બંગલો Bungalow (બંગલો)
આપવું Grant (ઘાન્ડ)	લીનેરી Safe (સાફ્ટ)
નીકળો Get out (ગેટ આઉટ)	નિપાઠ Depoy (રીપાય)
મજબૂત કરવું Hasten (હાસ્ટન)	અદર જવાનો રસ્તા Litter road (એન્ટર્નલ્સ)
અદર Inside (એન્સાઇડ)	માગવું Bring (બેંગ)
તોલવું Weigh (ઓંદ)	દિલેવાળી Delivery (ડિલીવરી)
માફ Pardon (પાર્ડન)	તાર આરીએ Telegraph office (ટેલ્ફોન આરીએ)
તાર Telegram (ટેલીગ્રામ)	બેંક, ચેંટી Bank (બેંક)
તહવાર Holiday (હોલીડી)	આકર્ષ રન્ધો Employed (એમ્પાઈસેડ)
ખાડ Closed (ક્રોઝાડ)	આકરી કરવો Serve (સરવ)
આકરી Service (સરવીસ)	શંભાળથી Carefully (કર્રકુલી)
સર્ટિફિકેટ Certificate (સર્ટિફિકેટ)	શનીવાર Saturday (સેટરડે)
તારીખ Date (ડેટ)	ધરી કરો Fold up (ફેલ્ડ અપ)
તારીખ નથી Bears no date (બેર્સ નો ડેટ)	પરખીંણ Envelope (એન્વેલ્યુપ)
ભીડો Enclose (એન્કલ્ડેઝ)	પુરતી રીતે Sufficiently (સાફ્ટિશાન્ડ-રીટી)
ધારવું Require (રીક્વાયર)	દાંબ Light (લાઇટ)
સીઝ કરવું Seal (સીઝ)	ટ્રાન્સફર નાંખવું Post (પોસ્ટ)
લાઘ Wax (ઓવેક્સ)	

નોંધાયું Registered (રજિસ્ટરડ) દ્વારાના પેસા Postage
ચશમા Spectacles (સ્પેક્ટેક્લ્સ) (પેસ્ટેજ)

સમજાવવું Explain (ઓફસાલેન) તાર File (ફાઇલ)
નકલ Copied (કોપીડ) ટેબલ Desk (ડેસ્ક)

આજનું ન્યુઝ પેપર ક્યાં છે ? Where is to-day's news-
paper ? (ઉંહેર દખ કુ તેજ ન્યુસ-પેપર ?)

તમે પણ ન્યુસાંપર વાંચ્યું છે કે ? Have you read that
news-paper ? (હેવ યુ રેડ પેપર ન્યુસપેપર ?)

તીલેગી ચાડ્સાઈથી અંધ કરો Shut the safe carefully.
(શાર વી સેફ્ફ કેરપ્લી)

માંદાય, ભારે એ દાડાની રજા જોમણે છે Sir, I want leave
for 10 days. (સર, આઈ ઉનોન્ટ લીવ હોર કુ તેજ)

મારે આહેર જવું છે I wish to go out. (આઈ ઉનીશ કુ
ગો આઉટ)

તમે ને આપો છો ? Do you grant that ? (કુ કુ આન્ટ ઘેર !)
કુને અક્ષું છું I do grant it. (આઈ કુ આન્ટ ઘટ)

તે ચીઠી ઢાગું લાધ જાય છે ! Who takes away the note ?
(કુ કુ કુ ચાંચ ધી ગોટ ?)

દોષ કાર્ય નર્સું નથી No one takes it away. (નો વન
એટકસ કટ આવે)

તે સીપાંદ સાથે મોકદો Send it with the sepoys. (સેન્ડ
કટ ઉનીથ ધી સીપાંદ)

તમને એટલું મોકું કેમ થયું ? How is it you are so late ?
(કાંઈ દખ ઘટ કુ આર સો લેટ ?)

તમે વદેશા કેમ નહિ આવ્યા ? Why did you not come earlier ? (ઉન્ડાય હીડ કુ નોટ કમ અર્વાયર ?)

મારે જરા કામ હતુ I had some business. (આપ હેડ સમ બીજનેસ)

તમે હમેશાં મોદ્યા આવ્યા છો You always come late ? (કુ એલ્યુનેજ કમ લેટ ?)

આ હુંઠી મહીનાની ભુદ્ધતાની છે This Li'l is payable a month after date. (ધીસ બીજ છજ પેઓખલ આ મન્થ આફટર ટેઈટ)

મને હજ તે માલ પહોંચયો નથી I have not yet received the goods. (આપ હેવ નોટ યટ રીસિવ પી ગુડ્ઝ)

હું તેને તાર કરું છું I am going to telegraph him. (આપ એમ ગોઝિંગ કુ ટેલ્યીમાસ હીમ)

તમે તમારા માલનો વામો ઉત્તરાયો છો : Have you insured your goods ? (હેવ કુ ઈન્સર્ચુર્ડ યોર ગુડ્ઝ ?)

મેં વામો ઉત્તરાયો નથી I have not insured them. (આપ હેવ નોટ ઈન્સર્ચુર્ડ થીમ)

તે વિષે હું આરા આખતીયાને લખીશ I will write to my agent about it. (આપ ઉવીલ રાઇટ કુ માય એજન્ટ એન્યાઉટ દ્યા)

શું મેલ આગ્યો છો ? Has the mail arrived ? (હેલ પી , મેલ એરાઇડ ?)

વિલાપતનો મેલ ક્યારે આવશે ? When will the English mail arrive ? (ઉંહેન ઉવીલ ધી ઇંગ્લીશ મેલ એચાઈવ ?)

મેલની ખર્ચ કહાડો Make an inquiry for the mail.

(મેલક એન છનકવાયરી હોડ ધી મેલસ)

એ મેલ આવે તો કામગીણ બંગલે લાવને If the mail arrives bring the letters to my bungalow. (દાદ ધી મેલસ એરાઇવન ધીંગ ધી લેટસ્ કુ માય બંગલો)

વિલાયતનો મેલ આવ્યો છે The English mail has come.
(ધી ઈંગ્લીન મેલિં હેલ કમ)

આજનું ન્યુસ પેપર આપવાની મહેંદ્રાંની કરશો? Will you kindly give me to-day's news-paper? (ઉંબાન યુ કાઈન્દ્રાંની ગીર મી કુ-ટેઝ ન્યુસ-પેપર ?)

તમે તેવી સારી નોકરી કરો You served him well. (ય સર્વ ધીમ હુંદેલ)

માં નમાં સરટિફિકેટ દેખાડો Show me your certificate. (જો મી યાર સરટિફિકેટ)

તમે શું પમાર લેણો? What pay will you accept. (ઉંબાન પે ઉંનીલ યુ એક્સોટ ?)

સાઈ, કાંચ આવને All-right come to-morrow. (એચિં રાઈટ, કમ કુ-મોરો)

આ કામ શુભાગણી કરો Do this work carefully. (કુ ધીં ઉનક કેન્કુલી)

આ કયું વર્ષમ છે? What year is this? (ઉંબાન દાયર દાંડ ધીસ ?)

આ કેયા મહિનો છે? What is this month? (ઉંબાન દાયર ધીસ મહિના ?)

આજે દિનાંથી તરીખ ? What is the date to-day ?

(ઉચેટ છક ધી તેણું કુંઝ ?)

આજે દશમી છે To day is the tenth. (કુંઝ છક ધી ટેણું)

આજે શુષ્ઠી વાર છે ? What is the day of the week to-day ? (ઉચેટ છક ધી તે શુષ્ઠી ધી કુંઝ કુંઝ ?)

આ કોણ લાભું છે ? Who has brought this ? (કુંઝ લેણ બીજું ?)

આ ચિહ્ન કેમનું લાભું ? Who brought this note ? (કુંઝ ધીજ નોટ ?)

તેને પુછો કે તારી નમનું ? Ask him what is his name ?
(આરા હીમ ઉચેટ છક વીજ નોટમ ?)

તેને કહો કે ઉનો રહે, કું જવાબ કર્યું છું Tell him to wait,
I am writing an answer. (ટેથ સીમ કું ઉચેટિં,
આઈ એમ રાષ્ટ્રીય એન એનસર)

ઓફિસમાં જણો Go to the office. (ગો કું થ ઓફિસ)

કું ઓફિસમાં જણ છું I am going to the office. (આઈ
ઓફિસ કણ ધી ઓફિસ)

ગેરી ઓફિસ કણાં છે ? Where about is his office. (ઉન્હેર
ઓફિસ કણ ધીં ઓફિસ ?)

કું આજે ઓફિસ કિયારીં છે ? Is the office open to-day.
(છક ધી ઓફિસ ઓપન કું તે ?)

અણે કું રળ છે ? Is there leave to-morrow ? (અણું પીર
ધીં કું મેરા ?)

આજે હીનું લાગિનો તહેવાર છે To day is a Hindu Holiday. (કૃ-કે દાજ આ હીનું લાગિનો)

આજે રજી નથી There is no leave to-day. (ધેર એ નો લીફ કૃ-કે)

આજે મને રજી નથી I have no leave to-day. (આજ એ નો લીફ કૃ-કે)

આમારે અલે રજી છે We have leave to-morrow (ની દેવ લીફ કૃ-માર્ગે)

કાંચે હીનું લેખિનો તહેવાર કરો To morrow wa, a Hindu holiday. (કૃ માર્ગ વાર આ હીનું લેખિનો)

બેંક ગંઘ છે The bank is closed. (ધી બેંક દાજ કલેજડ)

તમે ક્યાં નોકરી છો ? Where are you employed ? (કિંદર આર યુ એમેપ્લાયડ ?)

તમારો પગાર શું છે ? What is your pay ? (ઉંટાટ એ ગોર પે ?)

મૈં ભાગી નોકરી છોડી છે I have left my service. (આજ દેવ લેછટ ભાગ ભર્યામ)

તમને નોકરી મળી કે ? Have you got employment ? (ડેવ યુ જોટ એમાણ્યમેન્ટ ?)

હા, છો Yes, you may take it. (ધેર યુ મે ટેક એ)

તમે દ્વાક્ર છો કે ? Are you a broker ? (આર યુ એ બ્રોકર્સ ?)

તમે શું દ્વાક્રી લેશો ? What brokerage will you take ? (ક્લેન્ટ બ્રોકરેજ ક્લીન યુ ટેક ?)

ખરા માટેક દરા રતા Ten percent as usual (ટેન પ્રેસેન્ટ
ઓઝ રુજવલ)

કુંઈના શું ભાવ છે ? What is the rate of exchange. +
(ઉવોટ દર ધી રેટિં ઓઝ એક્સચેન્જ ?)

આજે બજાર કેમ છે ? How is the market to-day ? (હાજે
દર ધી મર્ક૆ટ કુ-ડે ?)

એમનું તેમ છે It is steady. (ઈ ઈઝ સ્ટેડી)

તમને આજે કાંઈ લોધાયે છે ? Do you want anything
to-day. (કુ કુ ઉવોન્ટ એનીથીંગ કુ-ડે ?)

મને કાંઈ લોધાયું નથી I do not want any-thing. (આજ
કુ નોટ ઉવોન્ટ એનીથીંગ)

ઘઉનો શું ભાવ છે ? What is the rate of wheat ?
(ઉવોટ દર ધી રેટિં ઓઝ વિન્ફીટ ?)

ભાવ હાજ અંબો છે It is higher now. (હિં દર હાપર નાઇ)

આ કાંઈ મોસમ નથી This is not the season. (ધીમું દર
નોટ ધી સીઝન)

કુ નાણાં વ્યાજે કાઠવા માયુ છું I want to borrow money.
(આદ્ય ઉવોન્ટ કુ એરો મની)

આ હુંડીની ડેટલી મુદ્દત બાફી છે ? How much longer is
this bill to run ? (હાઉ મય લોંગર દર ધીમું બીલ કુ રન)

તમે ભારો એક રીકાર્ડસિંહ કે ? Will you accept my cheque ?
(ઉનીથ પુ ઓક્સેપ્ટ માય ચેક ?)

આ એક લ્યો Take this cheque. (ટેચે ધીલ્ય એક)

તમે મને પણંચ આપશો ? Will you give me a receipt?
 (ઉનીંસ મુ ગીવ મી આ રીસીટ ?)

હું તમને પણંચ આપશો I will give you a receipt. (આઈ
 ઉનીંસ ગીવ મુ આ રીસીટ)

આ બીજી ઉપર તમારી સહી નોંધએ This note will want
 your signature. (ધીસ નોટ વીજ ઉવોન્ટ યોર સિગનેચર)

આ હોર મારા નામપર અદાયી આપો Get this share trans-
 fferred on my name. (જેટ ધીસ હોર ડાન્ફર્ડ ક્રેન
 માય નોંધમ)

મને દશ રૂપીઓની નોટની પરચુરણ નોંધએ છે I want change
 for a 10 Rs. note. (આઈ ઉવોન્ટ ચેન્જ હોર આ
 ટેન રૂપીઓ નોટ)

રોકડા આપું કે નોટ ? Shall I pay in cash or notes ?
 (રંસ આઈ એ ઈન કંશ યોર નોટસ ?)

મને પાંચ રૂપીઓ રોકડા નોંધએ છે I want five rupees in
 cash. (આઈ ઉવોન્ટ ફાઇવ રૂપીઓ ઈન કંશ)

મારી પાંચે બધી ચ૱ચણી નોટ છે I have all currency notes.
 (આઈ લેવ ઓલ કરનસી નોટસ)

આ બેંકની નોટ કેવાં રૂપીઓની છે ? How much is this
 bank-note worth ? (દાઉ મથ છક ધીસ બેંક નોટ ઉવર્ક્ષ ?)

મને રચ્ચાની કરી અદીયાં સહી કરો Please sign here. (ખીજ
 સાઈન હીયર)

જરા મને કલમ આવશો? Will you just give me a pen?

(ઉરીથ યુ જરટ ગીર ભી આ પેન ?)

હું આ કલમ લઉ? May I take this pen? (ગે બાઈ ડે
ધીસ પેન ?)

આ કાગળ ટપાકમાં નાણો. Post this letter. (પોસ્ટ ધીમ ફટ્ર)

તમે મારો કાગળ ટપાકમાં નાંખશો? Will you post my
letter? (ઉરીથ યુ પોસ્ટ માય ફટર ?)

તે કષેણે જણો નોટાએ. It must go to-morrow. (નાઈ મસ્ટ
ગો કુ મારા)

મારે તે રજુસ્ટર કરાવશો છે. I wish to have it registered.
(આમ ઉરીચ ટુ હુંડ્રા માટ રજુસ્ટર)

મેં તે રજુસ્ટર કરાયો હાનો. I have got it registered.
(આમ હાનો નોટ કર રજુસ્ટર)

આ કાગળને પોસ્ટ ઓફિસમાં લઈ જાયો. Take this letter
to the Post-office. (ટેક ધીમ ફટર હું ભી પોસ્ટ ઓફિસ)

તમે તે કાગળ ટપાકમાં નાણો કે? Have you posted that
letter? (હં યુ પોસ્ટેડ બંદ ફટ ?)

તમે ટપાકના પેસા આપા નથી કે? Have you not paid
the postage? (લય યુ નોટ પેસડ ધી પોસ્ટેજ ?)

ટપાકના પેસા આપો. Pay the postage. (એ ધી પોસ્ટેજ)

આ કાગળ ઉધાડો. Open this letter. (આમન ધીસ ફેંદર)

મારા અશમા મારા ટેચિપરથી લાંબા . Bring my spectacles from my desk (અરીગ માય ટેક્ટેક્સ રોમ માય ટેક)

બેરામજી, તમે યુ કરો છો ? Byramji, what are you doing ? (બેરામજી, ઉવોટ આર યુ દુંડા ?)

તમે તમારો કામગી લખ્યો હો ? Have you written your letter ? (દેણ ગુ રીટન વાર હો ?)

નાં, હમણ્ણા હુ તે લખ્યુ છું No, I am writing it now. (તો આઈ એમ રાઈટિંગ હું નાં) .

આંસા દાણો યું કરતા હતા ? What were you doing all day long ? (ઉવોટ હુ ગુ હુ ન આવ તે હેંગા ?)

આ કાગળ કોણું લખ્યા છે ? Who has written this letter ? (હુ હેંક રીટન ફીસ હે ?)

આ કાગળમા તારીખ હે This letter bears date. (ધીમ લટર ફર્સ્ટ હે)

તે દાઢે તારીખ કે હતી ? What was the date on that day ? (ઉવોટ વાર ધી હેડ બોન ધટ તે ?)

તમારા લુગડાંની ધડી કરો Fold up your clothes. (હેડિં અપ યોર કલેર્સ)

આ કાગળ પરથીડામાં બીડાં Enclose this letter in an envelope. (એનક્લોઝ ધીસ એટર ધા એન અન્ક્લોપ)

આ કાગળ તેના કામગીમાં બીડો Enclose this letter in his letter. (એનક્લોઝ ધીસ લેટર ધન લીઝ લેટર)

તે પરખીડાં ઉપર સરનામું કરો। Write down the address on that envelope. (રામટ પ્રષ્ટન ધી એટેસ શોન ઘેટ એનવલોએ)

કામગી ઉપર હું હોનું સરનામું કરે ? To whom shall I address the letter ? (હું હુમ શોન આઈ એટેમ ધી લેટર ?)

અમારે અરથા આનાનાલી ડીક્ષીટ જોઈએ છે। We want a half-anma stamp. (વી ઉંવાન્ટ આ હાફ-એના સ્ટેમ્પ)

આને તેટલાની ડીક્ષીટ લાગશે ? How much stamp will this require ? (લાઉ મચ સ્ટેમ્પ જિરિયા મીસ રીકવાયર ?)

આ કાગળને ડીક્ષીટ પુરતી ચોડી છે કે ? Is this letter sufficiently stamped ? (એજ મીસ લેટર સદ્ગિયિયન્ટલી સ્ટેમ્પ ?)

તમે તેને સીઁબ ક્રીધું છો ? Have you sealed it ? (દંડ યુ સીઁબ નેડે ?)

કાગળને સીઁબ ક્રીધું નથી The letter is not sealed. (ભી લેટર એજ નોટ સીઁબ)

દીંગ અને લાખ લાંગા Bring a light and a sealing wax. (ધીંગ આ લાખટ એન્ડ આ સીઁબિંગ ઉનેક્સ)

તમે લુણ્યા છો સાહેબ You are mistaken sir. (યુ આર મિસ્ટેકન સર)

હું પણ લુણ્યો હનો I was also mistaken. (આપ ઉંવોડ ઓલસો મિસ્ટેકન)

આજે મારે ડારટમાં આવતું છે I have to come to the court to day. (આપ હેઠળ હું કમ હું ખી કોર્ટ હું-કે)

હું ડારટમાં હું I am in the court. (આપ એમ છન ખી કોર્ટ) તમારે હેઠળ હેઠળ હું છે ? How much are you in debt ? (હાજ મય આર યુ ડાન હેઠ ?)

તમારો હેણુદાર કોણ છે ? Who is your creditor ? (હું એક ગોર કેરીટર ?)

હું ધર્ષણ કરજણાર હું I am very much in debt. (આપ એમ વેરી મય ડાન હેઠ)

તમારી પાસે મારે શું નીકળતું હું ? How much did you owe me ? (હાજ મય ડીડ યુ ઓ ભી ?)

મારી પાસે તમારું કાંઈ નીકળતું નથી I owe you nothing. (આઈ ઓ યુ નથીંગ)

અમારે વળું હાતા ભરવાના છે We have to pay three installments. (વી હેઠ હું પે શ્રી ઇન્સ્ટોલમેન્ટ્સ)

તમે તમારું દેનું કેમ નથી આપતા ? Why don't you pay your debts ? (ઉચાય ડોન્ટ યુ પે યોર ડેટ્સ ?)

તમે આંકડો પાછો આપશો ? Will you give me back the bill ? (ઉચીબ યુ જીવ ભી એક ખી ખીફ ?)

પેબો રણું આંકડો There is the bill. (ઘેર છું ખી ખીફ)

આ માણુષ નાણાંગી છે This man is a banker. (ધોરણ
મેળ દિન આ મેન્કર)

આજ તંત્તી કાગળ મળ્યો છે He has received a letter
to-day. (હી દિન રિસાઈડ આ લેટર ફૂંકે)

આ કાગળ બંધું કામનો છે This letter is very useful.
(ધોરણ લેટર છાડ વર્દી બુગ્રફુલ)

મોહન તાં દિન છે ? Is Mohan there ? (છે મોહન થિએ ?)

નાદિ, સાંકેય, તે ધેર જાયા No, sir, he went home. (ના,
રહ દી ઉંચનાં હોમ)

કું તંત્તી બોલાવતા મોકદું ? Shall I send for him. (શોભ
બાઈ સેન્ટ ફોર હીમ)

હા, તંત્તી બોલાવતા ગોકરન્યા Yes, send for him. (હા, સેન્ટ
ફોર હીમ)

તમે તંત્તી બોલાવતા મોકદ્યા ? Have you sent for him ?
(દેખ યુ સેન્ટ ફોર હીમ ?)

મેં નને બોલાવતા મોકદ્યા નથી I have not sent for him.
(આઈ નેન નોટ સેન્ટ ફોર હીમ)

એ વિંં કું તંત્તી કહેવડાનું ? Shall I send him a word for
that ? (શોભ આઈ સેન્ટ હીમ આ ઓવર્ડ ફોર ધંદ ?)

મેં તંત્તી કહેવડાનું છું I have sent him a word. (આઈ
દેવ સેન્ટ હીમ આ ઓવર્ડ)

નયારે તે આવે ત્યાર મારી પાસે માંકલાનો. Send him to me
when he comes. (સેન્ટ હીમ કુ મી ઉંઝેન લીકેના)

હું પોતે તમને લખીશ I shall write to you myself.
 (આઈ રોક રાઈટ કુ યુ માથ્સેલ્ડ)

.. તમે તે કર્યારે કરશો ? When will you do it ? (ઉંહેન ઉવીલ કુ કાઈ ?)

તે આજે કરતું ન જોઈએ It must not be done to day.
 (ઈટ મરટ નોટ બી જન કુ-કે)

આ ચીઠી બોગીલાલ પાસે લઈ જાઓ Take this note to
 Bhogilal. (ટેઇક ધીસ નોટ કુ બોગીલાલ)

હું જવાબને સાર રાદ જોઉકે ? Shall I wait for an answer?
 (રોક આઈ ઉવેચ્છા હોર એન એનસર ?)

હા, જવાબને સાર જોડી થાંગે Yes, wait for an answer.
 (યસ, ઉવેચ્છા હોર એન એનસર)

તમને આજે ચીઠી મળી કે ? Did you receive a note
 today ? (ડીડ કુ રીસીન આ નોટ કુ-કે ?)

હા, મને એક મળી Yes, I did receive one. (યસ, આઈ
 ડીડ રીસીન વન)

મહેરભાની કરીને આ કાગળ વાંચો Please read this letter.
 (ખ્યાલ રીડ ધીસ લેટર)

હમજું હું ખાચ કામથાં છું I am very busy now. (આઈ
 એમ વેરી બીજી નાઈ)

તમે એક મિનિટ રાદ જોશો Will you wait a minute ?
 (ઉવીલ કુ ઉવેચ્છ એ મિનિટ ?)

તમે એટલી ઉતાવળ ડેમ કર્યો છો ? Why are you in such a hurry. (ઉજ્જાપ આર ચુ છન સચ આ હરી ?)

તમને ઉતાવળ છે ? Are you in a hurry ? (આર ચુ છન આ હરી ?)

તે ઉતાવળ કરે છે ? He makes haste. (હી મેઝકસ હેર)
તને કહો કે જરા ઉમો રહો Tell him to wait a little.
(ટેલ હીમ કુ વેચટ આ લીટલ)

ઓક પળ રાહ જુઓ। Wait a moment. (ઉવેચટ આ મોમેન્ટ)
થાબી શકતો નથી I cannot wait. (આઇ કેન્ટન્ટ ઉવેચટ)
જરા અહીં આનો Come for a moment. (કમ હોર આ મોમેન્ટ)

મને આ મમજાવો Explain this to me. (એકસાલેન ધીસ હુ મી)

આ કાગળ તારમાં મુડો File this paper. (ફાઈલ ધીસ પેપર)
તમે તે કાગળની નકલ કીધી હો ? Have you copied the letter ? (દંબ ચુ કોપી મી લેટર ?)

તેની નકલ તો થઈ ચૂકી સે It is already copied. (ડાટ મજ ઓલરેડી કોપીડ)

આ કાગળની નકલ કરો Copy this letter. (કોપી ધીસ લેટર)
અસલ ડાપી ક્યાં છે ? Where is the original Copy ?
(ઉનહેર છાજ ધી ઓરીજિનલ કોપી ?)

મંહરાણની કરીને ચ.િ સરનામું વાંચો Please read this address. (પલીઝ રીડ ધીસ એડ્રેસ)

તમે તેની ચીછી ઉધાડો છો ? Do you open his note ?
 (કુ મુ ઓપન હીજ નોટ ?)

હું તે ઉધાડું છું I open it. (આએ ઓપન ઇટ)

મને થાડો કાગળ આપો Give me some paper. (ગીવ મી સમ પેપર)

તમારી પાસે કાગળ નથી કે ? Have you no paper ? (લેટ કુ નો પેપર ?)

નાલિ, મારે કાગળ લખયો છે No, I have to write a letter.
 (નો આદા લેટ કુ રાષ્ટર આ લેટર)

હું એક કાગળની રાખ જોઉં છું I am expecting a letter.
 (આએ એમ એક્સપેક્ટિંગ આ લેટર)

મને હમણાંજ તેનો કાગળ પહોંચ્યો છે I have just received
 his letter. (આદા લેટ જરસ્ટ રીસીવ હીજ લેટર)

રૈલ્વે તથા આગામોટની સુસાફીનાં વાક્યો.

આગામીમાં By rail (બાય રેલ)	જાયો છો Train (દાવેલ)
સામાન Luggage (લગેજ)	આગમોટ Steamer (સ્ટીમર)
પાસ થયો Passed (પાસડ)	પહેલી First (ફસ્ટ)
રેલન માસ્ટર Station-master (રેલન-માસ્ટર)	ગાડી Train (ટ્રેન)
આડી-Carriage (ડેરીજ)	પોલ્યાન્ટ્રી Quarter to ten (ક્વાર્ટર કુ ટેન)

ગાડીના વખતની ચોપડી Railway-guide (રેલવે ગાડિ)	સાંચ સાત Half past seven (હાર્ટ પારટ સેવન)
ઉપડું Start (સ્ટાર્ટ)	ખાંધો Pack up (પેક અપ)
આવનું Enter (એનટર)	લઈ જનું Carry (કરી)
કાંઈજ નહીં None at all (નન એટ ઓઝ)	સંભાળથી Carefully (કરકુલી)
રોકાયલી Engaged (એનગેજડ)	લાગે છે Seems (સીન્સ)
ઉભી રહી Stopped (સ્ટેપ્ડ)	વળતસર Just in time (જરૂર હાં રાખમ)
પહેંચનું Reach (રીચ)	ઉતાવળી Haste (હેરટ)
વર્ગ Class (ક્લાસ)	બાકું Fare (ફેર)
વદાણું સુવાનો આરડો Bearth	કમાન Captain (કેપ્ટન)
ક્રાથળો Bag (બેગ)	રોકાયલું Engaged (એનગેજડ)
ઉપડું Start (સ્ટાર્ટ)	કારલારી Steward (રક્ષક)
ઉતારણો Passengers (પેસેન્જર્સ)	અંગ્રેજ English (ઇંગ્લિશ)
વહાણું Vessel (વેસલ)	પવન Wind (વીન્ડ)
કહે છે Is called (ઇઝ ડોલ્ડ)	સફર Voyage (વાગેજ)
તોણાની Rough (રહે)	તોણાન Storm (સ્ટોર્મ)
શાન્ત Smooth (સમૃધ)	રહેણું Remain (રીમેન)
દમણું Just now (જરૂર નાઈ)	હેઠે Below (ભીલો)
તુટક Deck (ડેક)	નારણો Break-fast (બ્રેકફાસ્ટ)
વહાણની ઓરડો Cabin (કુલીન)	આગામીએપર્સ On board (ઓન અફર્સ)
ઉપડું Set off (સેટ એફ)	

માઇલ Mile (માઇલ)	દ્વારા Sea (સી)
વહાચું ઉપર On board (ઓન બોર્ડ)	આદત Suebjct (સભજેક્ટ)
શીકું Pale (પેછથ)	કિનારો Coast (કોસ્ટ)
દરિયો જાગ્રત્તો Sea-sickness (સી-સીકન્સ)	દીવાદાંડી Light-house (લાઇટ-હાઉસ)
	બાર્બર Harbour (હાર્બર)

દાખલ બાજુએ છીએ Are entering. (આર એન્ટરિંગ)
તમે આગાડીમાં આવશો કે આગામેટમાં ? Will you come
by rail or by steamer ? (ઉનીલ યુ કમ બાય રેલ
ઓર બાય સ્ટીમર ?)

હું આગાડીમાં સુરત જણિ છું I am going by rail to
surat. (આઈ એમ ગોઈંગ બાય રેલ હુ સુરત)

પુનાની જાડી ક્યારે ઉપરે છે ? When does the train for
Poona start ? (ઉન્હેન કા ધી ટ્રેન ફોર પુના સ્ટાર્ટ ?)
સચારના નવ વાગ્યે At nine in the morning. (એટ નાઈન
એન ધી મોર્નિંગ)

બીજી જાડી ક્યારે ઉપડશે ? When will the next train
start ? (ઉન્ન વીજ ધી નેકસ્ટ ટ્રેન સ્ટાર્ટ)

રાતના આઠ વાગ્યે At eight in the evening. (એટ એચ્ટ
એન ધી એવનિંગ)

આ વસ્તુઓ બંધો Pack up these things. (પેક અપ
બિંગ બંધો)

પેટીને કળ દીધી છે The trunk is locked. (ખી ટ્રાન્ક છત લોક્ડ) આ સંભાળીને લઈ જાઓ Carry this carefully. (કેરી ખીસ કેરપુલી)

વખત થઈ ગયો It is past the time. (ઘટ છત પારટ બી ટાઇમ) મોંઢ થયેલું લાગે છે It seems to be late. (ઘટ સીમ્સ કુ બી લેઇટ)

હવે વખત શુમાવવા નહિ જોઈએ No time should be lost now. (નો ટાઇમ શુડ બી લોસ્ટ નાઉ)

આલો આપણે જલદી ચાલીએ Let us walk fast. (લેટ અસ ઉંવાક ફારટ)

દરેક ચીજ તૈયાર હતી Every-thing was ready. (એવરી, થોંગ વોઇ રેડી)

તમે વખતસર આજ્યા નથી You are not just in time. (યુ આર નોટ જસ્ટ ઇન ટાઇમ)

ઉતાવળ કરો અને તમારી ટીકાટ આપો Make haste and give your ticket. (મેઠક હેરટ એન્ડ ગીવ યોર ટિકિટ)

મને મુંબાઈની એક ટીકાટ જોઈએ છે I want a ticket for Bombay. (આધ વોટ આ ટીકિટ ફોર બોમ્બાઇ)

ભાડું શું છે ? What is the fare ? (વોટ છત બી ઇસ ?)

તમે કયા વર્ગમાં બેસો છો ? What class do you travel in ? (વોટ કલાસ કુ યુ ટ્રાવેલ ઇન !)

ફક્ત પાંચ મિનિટ Only five minutes. (એન્ની ફાઈવ મિનિટ્સ)

આપણે લાં કેટલે વાગતે પહોંચીશું ? At what o'clock shall we reach there ? (એટ વોટ ઓક્લેઅ રોલ વી રીચ ધેર ?)

આપણે સાત વાગતે સુરત પહોંચીશું We shall reach surat at seven o'clock. (ઉની રોલ રીચ સુરત એટ સેવન ઓ'ક્લેઅ)

દ્વે પછીના સ્ટેશનનું નામ શું ? What is the name of the next station ? (વોટ છજ ધી નેઇમ ઓઝ ધી નેકરટ સ્ટેશન ?)

શું આ છેલ્લું સ્ટેશન છે ? Is this the last station ? (પૂર્ણ ધીસ ધી લાસ્ટ સ્ટેશન ?)

હા, આ છેલ્લું રેશન છે Yes, this station is the last. (યસ, ધીસ સ્ટેશન છજ ધી લાસ્ટ)

આપણે ખણ્ણા જાણી આપી પહોંચાંના We arrived very soon. (ઉની એરાઈડ વરી સુન)

આગગાડી હમણાંન આવી The train just arrived. (ધી ટ્રેન જાસ્ટ એરાઈડ)

મારો સામાન કયાં છે ? Where is my luggage ? (ઉંહેર ઈજ માય લગેજ ?)

તમારો સામાન ઓ રહ્યો Here is your luggage. (હીનર ઈજ યોર લગેજ)

તમે ક્રમાન છો ? Are you the Captain ? (ઓયાર યુ ધી ક્રેપ્ટન ?)

હું મારો એરડો નેઇ શકીશા ? Can I see my berth. (તેન આઈ સી માય બર્થ ?)

મને ઓરડો ભગણો ? Can I get a berth ? (કેન આઉં ગેટ આ બર્થ ?)

આ ઓરડો રોકાયલો છે કે ? Is this berth engaged ?
(છક ધીસ બર્થ એન્જેઝડ ?)

હું તમને અધા ઓરડો બતાવીશ I will show you all the berths. (આદ્ય વીલ શો યુ ઓલ ધી બર્થ્સ)

મને એક સારો દેખાડો Show me a good one. (શો મી આ ગુડ વન)

લાં કાંઈ જગ્યા છે કે ? Is there any room there ? (કિં ધેર એની ઇમ ધેર)

આ મારી જગ્યા હેંડે ? Is this my seat ? (છક મીસ માં સીટ ?)

તમારે સાંડ જગ્યા કરો Make room for you. (મેસ્ક રમ ફેર યુ)

આ જગ્યા રોકાયલી છે This seat is engaged. (ધીસ સીટ છક એન્જેઝડ)

મહેરાનાની કરીને જગ્યા ખસો Please move a little. (પ્લેઝ મુલ આ લીટલ)

અહીંયાં જગ્યા નથી There is no room here. (ધેર છક નો ઇમ હીયર)

તમારી ટીકાટ ક્યાં છે ? Where is your ticket ? (ઉન્હેર છક ગેર ટીકાટ ?)

મને તમારી ટીકાટ દેખાડો Show me your ticket. (શો મી ચેર ટીકાટ)

મારાં દેસ્ત પાસે મારી ટીકાટ છે My friend has got my ticket. (માય રોન હેંડ જોટ માય ટીકાટ)

ગાડી થું કામ ઉભી રહી છે ? Why has the train stopped ?

(વાય હેઠ ધી ટ્રેન સ્ટોપ !)

આ ગાડી દરેક સ્ટેશન ઉપર ઉભી રહે છે This train stops at every station. (ધીસેં ટ્રેન સ્ટોપ એટ એવરી સ્ટેશન)

આપણને અહીંથાં ગાડીએ અદ્ભુતી પડશે ? Shall we have to change carriages here ? (રોક વી હેવ કુ ચેન્જ કરેણું હીયર ?)

આપણને અહીંથાં ખોડી થતું પડશે ? Shall we have to wait here ? (રોક ઉભી હેવ કુ વેટ હીયર ?)

આપણને અહીંથાં કેટલો વખત ખોડી થતું પડશે ? How long shall we have to stop here ? (હાઉ કાગ રોક ઉભી હેવ કુ સ્ટોપ હીયર ?).

હું બીજી વર્ગની ટીકિટ લઈશ I will take a second-class ticket. (આધ વીજ ટેક્ક આ સંકંડ કલાસ ટીકિટ)

એક પુનાની ટીકિટ આપો Give me one ticket for Poona. (ગીવ મી વન ટીકિટ ફોર પુના)

તેનો રામાના પાસ થયો કે ? Is his luggage passed ? (ઘડ હીજ લગેજ પાસડ ?)

જદ્દાન થું છે ? What is the duty ? (વોટ સ્ટાફ ધી ડયરી ?)

મારે સ્ટેશન માસ્ટરને મળતું દારુ I wished to see the station-master. (આઈ વીસડ કુંસી ધી સ્ટેશન-માસ્ટર)

ઉનારણ કરો અને ગાડીમાં તમારી જગ્યા લો Make haste and take your seat in the carriage. (મેઝાં હેરટ એન્ડ હેપ્પ એર સીટ ઈન ધી કેરણ)

આલો આપણે જઈને આપણી જગો લઈએ Let us go and take our seats. (સેટ અસ ગો એન્ડ ટેઇક અવર સીટ્સ)

તમારી પાસે રેલ્વે ગાઈડ છે ? Have you got a railway guide ? (હેવ યુ ગોટ આ રેલ્વે-ગાઈડ ?)

ગાડી ક્યારે ઉપડે છે ? When does the train start ?
(ઉંહેન ડાં ધી ટ્રેન સ્ટાર્ટ ?)

દશ મીનિટમાં ઉપડશે It will start in ten minutes. (ધોં
વીલ્સ સ્ટાર્ટ ધન ટેઇન મીનિટ્સ)

પેલો તમારો સામાન છે કે ? Is that your luggage ? (ધક
ઘેટ યોર લગેજ ?)

પુનાની ગાડી કઈ ? Which is the train for Poona ?
(વીચ ધક ધી ટ્રેન ફોર પુના ?)

મને ગાડીમાં આવવા હો Let me enter the carriage.
(સેટ મી એન્ટર ધી ફેરેન્સ)

આપણે આગષ્ટોટપર નાસો કરીશું ? Shall we have Breakfast on board ? (રેલ ઉંબી હેવ બ્રેક-ફાસ્ટ ઓન બોર્ડ ?)

શું ઉપડવાનો વૃખત થયો હે ? Is it time to start ? (ધક
ફટ થાઇમ હુ સ્ટાર્ટ ?)

આપણે ક્યારે ઉપડીશું ? When shall we start ? (ઉંહેન
રેલ ઉંબી સ્ટાર્ટ ?)

તે અર્દીયાંથી ડેટા માઈલ હતું ? How many miles was it
from here ? (હાઉ મેની માઈલ્સ વેન્ડ ઈટ ફોર લીધર ?)

તમારો સામાન કથા છે ? Where is your luggage ? (હેર
ઇજ યોર લગેજ ?)

તે ક્યારોનો વહાણું ઉપર છે He is already on board. (હી
ઇજ ઓલરેડી ઓન બોર્ડ)

તે ઉપરી જવાની તૈયારીમાં છે He is going to start. (હી
ઇજ ગોઈંગ કુ સ્ટાર્ટ)

દરીએંા ખરાઅ દેખાનો નથી The sea does not look rough.
(હી શી ડા નોટ લુક રહે)

સફર લાંઘી થશે નથી The voyage will not be long.
(હી વાયેજ વાખ નોટ થી ક્લાગ)

તમે ડેવા રીકા દેખાએંા છે ! તમને શું થયું છે ! How pale you
look ! What is the matter with you ! (હાજિ
પેઇલ યુ લુક ! વાટ ઇઝ ધી મેટર વીથ યુ !)

મને હાક નથી I do not feel well. (આઇ કુ નોટ રીલ કેવ)
હા, મારે શું કરનું નેચુંએ ? Yes, what must I do ? (યસ,
વોટ મરટ આઇ કુ ?)

કારલારીને તેની પાસે મોકલ્ને Send the steward to him.
(સેન્ડ ધી રફ્યાર્ડ કુ હીમ)

મારો ડેથળો ઓદરહીમાં રાખો Keep my bag in the berth.
(ક્રીપ માય એગ ઇન ધ અર્થ)

આપણે ડેટને વાગતે નીકળાયું ? At what time shall we
start ? (એટ વોટ ટાઇમિં શેલ વીન્સ્ટાર્ટ ?)

તેમાં ધણ્ણા ઉતારણો છે ? Are there many passengers?
(આર ધિર મેની પેસેન્સર્સ ?)

આ વહાણુને શું કહે છે ? What is this vessel called ?
 (વોટ દત્ત ધીમ વેસલ કોઈ ?)

તે સારું વહાણ છે ? Is it a good vessel ? (દત્ત દત્ત આ
 ગુડ વેસલ ?)

આપણે કરાંચી ક્યારે પહોંચિયું ? When shall we reach
 Karachi ? (નહેન શેખ વી રીચ કરાંચી ?)

ખવન આપણી તરફેખુમાં છે કે ? Is the wind favourable to
 us ? (દત્ત ધી વીન્ડ ડેવરેઅલ હુ અસ ?)

સફર તોકાની થગે કે ? Will it be a rough voyage ?
 (વીલ માટ બી આ રફ વાયેજ)

નહિ, તે શાંત થગે No, it will be smooth. (નો, એ વીલ
 બી રમુધ)

હમણું તોકાન થગે There will be a storm just now.
 (મેર વીલ "ની આ રંડાઈ જણ્ઠ નાડિ)

તમે તુનાં ઉપર રહેશો ! Will you remain on deck ? (વીલ
 હુ રીમેના એન ડેક ?)

નિ, હુ લેકે જમણથ No, I shall go below. (નો, આચ શેખ
 ગો બીનો)

હુ મારી ઓરડીમાં જણાથ I shall go to my cabin. (આચ
 શેખ ગો હુ માર ડેનીન)

દ્વિતીય વર્ષના મહિના.

મહિના	દીવસ	મહિના	દીવસ
January જાન્યુઆરી	૩૧	July જુલાઈ	૩૧
February ફેબ્રુઆરી	૨૮	August ઓગસ્ટ	૩૧
March માર્ચ	૩૧	September સેપ્ટેમ્બર	૩૦
April એપ્રિલ	૩૦	October ઓક્ટોબર	૩૧
May મે	૩૧	November નવેમ્બર	૩૦
June જૂન	૩૦	December ડિસેમ્બર	૩૧

૬૨ ચાચ્યું વર્ષ ૩૬૬ દીવસનું હોય છે, તંતે લીપ-ઇયર (Leap-year) કહે છે. તે વર્ષમાં ફેબ્રુઆરીના ૨૯ દીવસ છે, માટે ને સાનને ચારે (૪) લાગતાં કાંઈ ન વધે તે સાથના ૩૬૬ દીવસ હોય છે, પણ ને સેકાને ચારે લાગતાં કાંઈ વધ્ય તો તે વર્ષના ૩૬૫ દીવસ નેમકે ૧૯૦૦ની સાત એટલે ઓંગણીસસું સંકું થયું માટે ૧૯ ને ચારે લાગતાં ૩ વધશે માટે નેના ૩૬૬ દીવસને બદલે ૩૬૫ થાય છે.

આંકુળિતમાં વપરાતાં ચિનહેણ.

+ વતા=Plus (ખસ)	- ઓંણ=Minus (માધનસ)
× ગુણા=Into (ખંડુ)	÷ લાગ્યા=Divided by (દીવાઈડ થાય)
= બરોઅર=Equal (ખંડિતસ)	

વારનાં નામ.

સોમવાર Monday (મન-ડે)	શુક્રવાર Friday (ફ્રિયડે)
મંગળવાર Tuesday (ટ્રિજન્ડે)	શનિવાર Saturday (સેટરન્ડે)
ઝુખવાર Wednesday (વેડનેસ્ડે)	રવિવાર Sunday (સન્ડે)
ગુરુવાર Thursday (થર્સડે)	

અહું રાશી અને દ્રતુઓ.

અહો Planets (જ્યોતિષ)

શુરુ (યુહુર્પતિ Jupiter (જ્યુપિટર)	ચંદ્ર Moon (મુન)
પૃથ્વી Earth (અર્થ)	બુધ Mercury (ભરકુરિ)
મંગળ Mars (માર્સ)	શनિ Saturn (સેટન્)
શૂક્ર Venus (વેનસ)	સૂર્ય, રવિ Sun (સન)
	કેતુ Comet (કોમેટ)

રાશીઓ.

કંયા Virgo (વર્ગા)	કક્ક Cancer (કેન્સર)
કુંભ Aquarius (એકંવરિયરા)	અલ્યા Libra (લીલા)
ધન Sagittarius (શોગીટરીયમ)	માફર Capricorn (કેપ્રિઓન)
મિથુન Gemini (જેમીની)	નીત Pisces (પીસીઝ)
મેઝ Aries (એરિઝ)	ભૂષભ Taurus (ટોરસ)
શૂક્રિક Scorpio (ડોષપીઓ)	સિંહ Leo (લીઓ)

અસ્તુ Season (સીઝન)

શિયાળો Winter (વીન્ટર)	ઉનાળો Summer (મન્ડર)
પાનખર (શરદ) Autumn (એટમ)	ચોમાસુ Monsoon (મેનસુન)
વસ્ત્રત Spring (સ્પ્રિંગ)	

Idiomatic Sentences (ઇଡିଓମେଟିକ ଶୈନ୍-ସୀଇସ)

- ତେ କାମମାଂ ସୌଥି ସର୍ବୋପରି ଛେ He is set the head of his work. (ହି ଏଜ୍ ସେଟ ଧି ହେଉ ଓହାଇ ହିଅ ବର୍କ)
- ତେଣୁ ଵୈଦନୋ ଧିନେ ଶରୀରୀ କର୍ତ୍ତା ଶରୀରୀ He began the profession of a doctor. (ହି ବିଜେନ ଧ ପ୍ରେଫ୍ରେସନ ଓହାଇ ଏ ଡେକ୍ଟର)
- ମେଂ ତମନେ ଭଗ୍ନବାନୋ ଲାଭ ଲାଭ ଲାଭ ଲାଭ I embraced the opportunity of seeing you. (ଆଖ ଏମ୍ବିଶ୍ରେଷ୍ଠ ଧି ଓହାପରଚୁନିରି ଓହାଇ ରୀଧିଗ ଥିଲା)
- ତେ ତମାରୀ ଭାଗଣ୍ଠି ହା ପାହରେ He will entertain your proposal. (ହି ପିଲ ଏନ୍ଟରଟେଇନ ଯୋର ପ୍ରୋପେଜଳା)
- ହବେ ଏବେ ବାଧ୍ୟତ ପଢ଼ନୀ ମୁହଁଙ୍କା Let the matter go now. (ଲେଟ ଧି ମେଟର ଗୋ ନାହିଁ)
- ତେବେନେ ତୁକଶାନ ଭମନୁଂ ପଡ଼ନୁଂ They were very much handicapped. (ଧେ କେର କେରି ଭଯ ହେନ୍ଡିକାପ୍ଡ)
- ବିଣାରୀନେ ଧିନେ ଲଗାଡ଼ନାମାଂ ଆବ୍ୟୋ ହତୋ The Vagrant was sent to the work house. (ଧି କେଗରନ୍ଟ ବୋଇ ସେନ୍ଟ କୁ ଧି ବର୍କ ଲାଇସ)
- ତେନୀ ଭକ୍ତରୀଥି ତୁକଶାନ କୁରନାନେ ଶୁନ୍ହେଗାର ହତୋ He was guilty of a practical jock. (ଧି ବୋଇ ଗ୍ରିଲ୍ଲି ଓହାଇ ଏ ଗ୍ରେକ୍ଟିକଲ ନୋକ)
- ଅମେ ପୁରିକ୍ଷାମାଂ ଏନେ ହାତାଥ୍ୟୋ We distanced him in the examination. (ଧି ଡିସ୍ଟନ୍ସନ୍ ହିମ ଧନ ଧି ଏକଅଭିନେଶନ)
- ତେଣୁ ତମନେ ମାଇ ନ କର୍ମୀ He prepared an accusation against you. (ହି ଡିପର୍ଶ ଏନ ଏକମୁକ୍ତେଶନ ଅଭେଧନ୍ସଟ ଥିଲା)

તે હેકાણું આણુંનો He served him right. (હી સર્ડ હીમ રાઇટ)
 તે તેનો શુન્હો છે It lies at his door. (ઇટ લાઇઝ એટ
 હીંગ ડોર)

ખધી વાત વાળી દેવામાં આની હતી The whole matter was
 hurried up. (ધી હોલ્સ મેટર વોઅ લરશ અપ)

મારી પ્રમાણિક બાબતથબતને વિપ શંકા ઉત્પન્ન થઈ My honesty
 was called in question. (માય હોનેસ્ટી વોઅ કોલ થન ક્વેશન)

હું તે જાણતમાં પડવા છચ્છું હું I like to entertain into
 details. (આઈ લાઇક હુ ઓન્ટરટેઇન છન્કુ ડીટેઇલ્સ)

આ અશક્ય છે This is out of question. (ધીઝ છજ આઉટ
 ઓફ ક્વેશન)

તે નકારો થઈ ગયો હતો He was low on the shelf.
 (હી વોઅ લો ગોન ધી સેલ્ફ)

તેઓ ગોળા ધાલે એવા છે They are formenters of
 quarrels. (ધે આર ફોર્મેન્ટર્સ ઓફ ક્વોરલ્સ)

મેં ઉંઠું નીસારો મુક્યો I heaved a deep sigh. (આઈ
 હેંડ ઓફિપ સાઇ)

તે કરવાની મહેનતમાં કાંઈ બાકી ન રાખતા Leave no stone
 unturned to do that. (લીવ નો સ્ટોન અનટર્ન
 હુ હુ ધેટ)

વિદ્યાપાન ખુખ કરો Drink deep at the fountain of
 learning. (હીંક હીપ એટ ધી મૂજનેન ઓફ લર્નિંગ)

તમે થાડીઆ છો You are a back-biter. (યુ આર એ
બેક-બાઈટર)

તે ઉધે ભસ્તડે ચોકમાં પજો He fell headlong into the
square. (હી ફેલ હેડલોંગ ફાન્ડુ ધી ર્કવર)

એક એકને વટાળે એવા છે One is just as bad as the
other. (વન ધર બરસ એક એક ઓઝ ધી અધર)

એનાં વખાણું સહ કરે છે His praise is in every body's
mouth. (હીથ પ્રેઇસ દંડ છન એવિંદ્ર એડિન ભાઉણ્ય)

તે આજબદનો છે He is a man of yesterday. (હી દંડ
એ મેન આઝ પરટરડે)

તેના પાસ થવાનાં કારણું શાધી કાઢા જદુ અમગાં નથી The
reasons of his passing are not far to seek.
(ધી રીજન્સ એઝ હીજ પાસીગ આર નોટ ફાર કુ સીક)

તમારે નુકસાન લરી આપવું લેછએ You must make good
of the loss. (યુ મરસ મેચક ગુડ એઝ ધી લોસ)

તમે મને દિગ્નાનો ધતન કરો You tried to impose upon
me. (યુ ટ્રાઇડ કુ ચમ્પોઝ અપોન મી)

દાયનાં કર્યા દેયે વાયાં He was caught in his own snare.
(હી વાઝ ટ્રેટ ધન હીજ એર રન્દે).

મારું મેત કર્યાં ન આચ્યું ? Would I were dead ! ? (યુડ
આઈ વેર ટેડ)

જ્યાં લોહ ત્યાં આગની આગણ, ધીજું કાઈ ખણે નહીં રે Turn
where I would, I see nothing but fire. (ટન
ઓર આઈ કુડ, આઈ સી નથીં અટ ફાયર)

તેથી તો અનું લોહીજ હિય ગરું ને હું It chilled the very marrow in his bones (છટ ચિંહ એ વેરી ગેરા ઈન ઈંજ ઓન્સ)

તમે તે હું મેં લાદને એમ કોણતા હોય વાડું ? You ought to be ashamed to speak in this manner.
(હું એટ હું આ એશેઝન્ડ કુ રપીક છન ધીસ મેતર)

હું તેને જારી અણી ઉપર રાખીએ I will take all possible care of him (આજ વીજ ટેને ઓખ પોસ્ટીયા કેર એપ્લ હીમ)

આણીજ અથવા સપાદ તો All his puffings ended in smoke. (એવા હીઠ પણી-જક એ-ટેક છન રમ્પાક)

તે થર જાળ્યાને તીરથ કરે એવો છે He is over-extravagant (હી છજ એવર એક્સ્પ્રેન્સન્ટ)

તે નારદીઓ છે His business is to blow up animosities between men (હીઠ ખીંગનેસ છજ હું જણો અપ એનીકોસીરીઝ ભીટથીન મેત)

બુજરાતી તથા હાચેલ હકેચતો.

પ્રમાણિકપણું કોઈ સરસ રીત છે Honesty is the best policy. (એનેસી છજ ધી મેરસ્ટ પોલીસી)

શાસ્યાને સહન એ word to the wise is sufficing.
(એ વર્ડ હું ધી વાધું છેલ શાસ્યાસીંગ)

થર તેવા ચેલા As is the master so are his pupils.
(એઝ છજ ધી અસ્તર, સ્ટો આર હીઠ ફ્લૂપિસ)

કુખનો સાથી તેજ ખરો બિત્ત A friend in need is a friend indeed. (એ રોંડ છની નીડ ચીજ એ રોંડ કન્વિડ)

માર્ગયા વયર મા આપે નહિ A closed mouth catches no flies. (એ ક્રોઝડ માર્ગય ક્રોઝ ના ઇલાઈડ)

ધરનાં અાકરા ધંટી આટે આને પાડોશાને આપો Charity begins at home. (બેરીઠી બીગાન્સ એટ હોમ)

વખતે સૌ શાખે; અરસરનાં ગીત અરસરે ગતાપ Every thing is good in its season. (એવંદી થોંગ મન ગુડ છન રાસ સીઝન)

વહેલો તે ખહેલો First come, first served. (ઇસ્ટ કમ ઇસ્ટ સરન્ડ)

જર ચાહે સો કરે Gifts break rocks. (ગીર્દસ એક રોક્સ)

આપ અલા તો જગ અલા Good mind good find. (ગુડ માઇન્ડ ગુડ ફાઇન્ડ)

નાણી લોચને ખાગમાં પડું He cuts his feet with an axe. (હી કટસ હીજ શીટ વીષ એન એક્સ)

સૌ ડાઢ પૈસાનું સયું છે Friends are plenty when the purse is full. (રોંડ આર પ્લેન્ટી ગ્લેન હી પર્સ ચન્ડ કુલ્ય)

પંચકી લક્ષી એદ એકડા બોજ Many hands make light work. (મેની હેન્ડ્સ મેદ્ફક લાઇટ વર્કુ)

કાસ્તરીથી મોઢળા તે ધાર્સનીથી મોઢળા Out of debt out of danger. (આઉટ એદ ડેંડ આઉટ એદ ડેનજર)

આડો એહે તે પડે He who digs, falls. (હી કુ કીંગ્સ, હોલ્સ) અધૂરો ધડો અજાય ધણો Empty vessels sound much. (અમૃતી વંસાસ સાઉંડ મય)

આપ કુથ ગયા સેં જમ કુથ ગઈ Death's day is doom's day. (ડેથ ટે ડૉમ કુન્સ ટે)

સુખે સોનું, દુઃખે સાંભરે રામ A man remembers gold in prosperity and God in adversity. (આ મેન રીમેન્સ જોલ્ડ બન પ્રોસેરીડી એન્ડ ગોડ છન એડવરસીડી)

ચુનેલો સાપ જગાઓ To rip up the old sores. (કુ રીપ અપ ધી ઓલ્ડ સોર્સ)

ઉંડ ગામાં એરો પ્રધાન A heron among hundred crows is a king. (એ હેરન અમંગ હન્ડું ક્રોક ઇઝ એ ક્રીંગ)

ન્યાર કોટવાદને દો Roguery supplants justice. (રૈગરી ગાપલેન્ટ્સ કર્સિસ)

મેં નેછો ટીલું કરું Fortune goes by favour. (ફોર્ચુન જોક વાગ ફેવ)

મ જાય ત્યાં છરાય One who goes has inconveniences and comforts here and there. (નાનાનીયાનરીઓ દુષ ધનકન્યાનીઓ સીએ નાના કાર્યાલાય દુષ ચેર કોલ્યોન)

મરતાને સૌ ભારે If a man once fallen all will tread upon him. (ધૂ એ મેન વન્સ હૂલન એફાલ વીલ ટૂ અપોન હીએ)

શુંડાથી જીત નાસે Tit for tat. (ગીત ફોર ટેટ)

મેં તેવો તમાચો Treat a man as he deserves. (ગીત
ઓ મેન એઝ હી ડીજરવ્સ)

મારે તેની તરવાર Might is right. (માઈટ ઇજ રાઈટ)

માગનારને પણ ગરવું ન ગમે Life is sweat. (લાઈફ ઇજ રાઈફ)
યથા રાજ તથા પ્રાળ Like father like son. (લાઇફ ઇલ્લાર
લાઇફ સાન)

રાજનોં ગમતી દાખલી અંનો આખ્યાં વાખ્યાં || બંધાયી Fair is not
fair but that which pleases. (ફેફર ઇજ ન્યૂટ ફેફર
બંદ ધેર વીચ પ્લેઝેઝ)

રાધના પ્લાઝ રાને ગયા Every rouge is out rouged at
last. (એવરી રોગ ન્હિ આઉટ પ્લાઝ એટ લાસ્ટ)

રામ નામ જરૂરના પગથા ભાખ અપના God in his tongue
devil in his heart. (ગોડ મન હીજા ટંગ હેરીખ હીજા
હીજ હાર્દ)

રાજ વાળાં ને વાંદરા [અરાયાર] A kings'favour is no
inheritance. (એ ક્રીન્જ ઇન્ફર ઇજ નો ઇનહુરીયાન્સ)

રોનો જય અને મુખ્યાની ખાયર ભાવે A barren sow was
never good to pigs. (એ બેરન સો વોઝ નેવર ગુડ
કુ પીઝ)

અજનનું ખાતું ને અખાહિ સુતું He is as free as the wind.
(હી ઇજ એઝ હી એઝ ધ વીન્ડ)

અન્ને પુરી વિશેષા Necessity is the mother of invention,
(નેસેન્શન અ અન્ને એન્નેશન)

મેરનાં દાં કાંઈ ચીતરવાં પડે ? A good face needs no paint ? (એ શુક ફેલસ નીડાં નો પેઇન્ટ)

માયું આપે તે ભિત્ર A friend in need is a friend indeed. (એ રેન્ડ છન નીડ ઇજ એ રેન્ડ ધનાડિં)

મોટા એટથા ખાટા The finest shoe often hurts the foot. (ધ ફાઇનેરટ રૂથ ઓઝન ફેટસ ધ મુટ)

માઘા વિના મા ન પીરસે A closed mouth catches no flies. (એ કલોડડ માઉથ ડેફીઝ નો ઇલાઈઝ)

હેડ મીઠાશ ને પેટમાં પાળી God in his tongue devil in his heart. (ઝાડ છન હીજ ટંગ ! તેવીં છન હીજ હાઈ)

મોટાનાં નસીબ ભોટાં Fortunes favours the brave. (ફેરચ્યુન્સ ફેલર્સ ધ ષ્રેષ્ઠ)

મસ્કરીની ઘસ્કરી થાય Jesting lies bring serious sorrow. (જેસ્ટીન્ગ લાઇઝ ધીગ સીરીઅસ સોર્ટા)

હેઠાં નેછને હીલું કરવું For a mischievous dog a heavy cloog. (ફેર એ મીટ્ચીવીનીઅસ ડૉગ આ હેવી કુંગ)

મન ચંગા તો કથરોટમાં ગંગા Nothing is impossible to a willing mind. (નથીંગ ઇજ છન્હોસીબલ કુ એ વીલીંગ માઈન્ડ)

મન હોય તો ભાગંબ જવાય When the will is ready,, feet are light. (હેલ ધ વીલ છાજ રેફી, શીટ આર લાઇટ)

પત્ર લોછ પાથરણું તારણું Cut your coat according to your cloth. (કદ ધાર કોટ અનોરડીંગ કુ યોર લોષ)

પત્રે માછવાં ભારે, ને મ્હેંટે રામ મુખારે God in his tongue, and devil in his heart. (ગ્રંથ ઈની લીઝ ટંગ, અનોર તેવીસ કન લીઝ હાર્ટ)

શુદ્ધચે બધી ચુપ, ન બોલવામાં નવ શુદ્ધ Silence is the chief virtue. (સાઇધવન્સ ઇજ ધી ચીર્સ, વરચ્ચુ)

દુઃખપર ધામ To apply salt to a wound. (કુ અંપાઠ સોલટ કુ એ વુન્ડ)

દાન આવે ત્વારે સોકણી મારીએ Strike the iron while it is hot. (રાંદુક ધી આવની જાહેર કે લીઝ હોલે)

માણુસનું ખારનું, કથરનું કરનું Man proposes, God disposes. (મેન પ્રોપોન્સીઝ કોડ વિરોધીઝ)

મારે તેણી તરવાર, હરામીના બે લાગ Might is the only right. (માઘટ કંઈ ધી એનાણી રાઈટ)

મ્હોં લોઈને દીકું થાણ Fortune goes by favour. (હેરચ્ચુન શોઈ થાણ હેવર)

બાંધી મુડી લાખની A closed fist is equal to a palm. (એ ક્લોઝડ ફીસ્ટ કર કાઉન્સ કુ એ પામ)

બીજાણીનું હસનું થાણ, ને ઉદ્દનો કુરુ જાળ Boy's play is death to the bird. (બીજાણ પ્રેરે હુક કેર કુ ધી હુડ્ડ)

ખૂબું આણુસ તખુખું પાણો A drowning man catches a straw. (એ ડ્રાઇનિંગ મેન હેચીઝ એ સ્ટ્રો) .

સેતું લેય કરી. ને ભાગ્યસ લેય વરી Live with a man,
and you will know him. (લીવ વીથ એ મેળ, એન્ડ
યુ વીલ નો લીમ)

સૌ પોતાનાં વખાણુ ગાય Every one blows his own
trumpet. (એવરી વન જોક હીજ ઓન ટ્રમ્પેટ)

રંઘમાં ભંગ Play ending in a fray. (એ એન્ડીંગ ધન એ રેંગ)
રૂપની રડે ને કરમની ખાય Beauty weeps and fortune
enjoys. (રૂપુની વિશુદ્ધ એક હોરસ્યુન એન્જોય)

બોણસા આના ઓર બહેમે રહેના Bread at pleasure drink
by measure. (ફ્રોડ એટ પ્રોફર ટૂંક ખાય મેઅર)

દમડી દમડી કરલાં રૂપીઓ થાય Many littles make a
mickle. (મેની લીટસ મેચ્ક એ મીકલ)

નેવો દેશ તેવો દેશ In Rome do as a Roman does.
(ધન રોમ કુ એઝ એ રોમન ડે)

શાગે નો નીર નાદ તો નાડા I will either make shaft or
both of it. (આચ વીલ છખર મેચ્ક શાફ્ટ ઓર એચ
ઓફ ને)

લાગે લાકડા છારે High wind blows on high hill. (આચ
વીન્ડ "લોઝ ઓન હાઈ વીથ)

દોબનો શોખ નાદ Avarice knows no bound. (એવરીસ
નોઝ નો બાંકિંગ)

નામ મોટાં ને દર્દીન પોટાં Great indeed but rogues.
(શ્રીટ છાંફીંગ એન્ડ રોગ્સ)

નાળે અકોડે મેડી વાળ A little pot is soon hot. (એ
શીટલ હોટ છક સુન હોટ)

પેસો અચાન્ગો તેણે પેસો મેળાન્ગો A penny saved is penny
gained. (એ પેની સેઝ છક પેની ગેઇન)

આગામણાને જાહી પંચાયત A great ship needs deep
water. (એ બેટ રીપ નીડક ડીપ વેટ)

આજા હાથ રંગિયામળું Many hands make light work.
(મેની હેન્ડક મેદક લાઈટ વર્ક)

આમણુંની ખુલ્લ દામળુંમાં What is got in the country
is lost in the shire. (બેટ છક જોઈ દન ધી કંદ્રી
છક લોટ છન ધી શાયર)

અવલોકનની ટેવ વળી સારી છે The habit of observation
is very good. (ધ હેચીટ ઓફ ઓફરવેશન છક
વરી ગુડ)

આડ લેવાં દુળા As is the tree so is the fruit. (એજ છક
ધ દી સે છક ધ દુલ)

સાન સોયાણુંને બેનર વંડે Too many cooks spoil the
broth. (કુ મેની કુક્સ સોયાણ ધ ઓથ)

અણુ તાતણે અળાઓ Union is strength. (મુનિષન છક રફ્ફુઅ)
ટકાની તોઢી ને દણુ મુંડામળું Great toil little work. (બેટ
ટોઇલ લીટલ વર્ક)

ટોડ નિશાળીબાને વનરણું ઘળું A bad work man quarrels
with his tools. (એ.એડ વર્ક મેન ક્વોરલ્સ વીલ
નીંબ કુલ્સ)

Iથો દીકરો દેશાવર બોગવે, ડાઢી વહુ સુલામા એસે All lay load
on a willing horse. (બોગ લેં લાડ ઓન એ
વાલીનું હોર્સ)

અ લગ ચાસ, તથ લગ આશ While there is life there
is hope. (જ્ઞાનજ્ઞ ધેર છક લાઈ ધર છત હોપ)

વા ખાપ તેવા બેટા અને વડ તેવા ટેટા As is the tree so
is the fruit. (બંઝ છજ ધી ટી સો છજ ધી કુણ)

(i) ધરીએ બેસીએ તેના જીન ગાઈએ It is an ill guest
that never drinks to his host. (એ ચીજ એન
ધર બેસ્ટ ધેર નેવર ફ્રીન્ડસ કુ ધીર હોપાટ)

(ii) ભાઈના મોસાળીઓં તેવાં બેનનાં જીન તોઠ લત. (જીન
ક્રોર ટેટ)

જ તેવાં ભાજન When you are at Rome, do as
they do in Rome. (નેન યુ આર એટ રોમ કુ એન
ધી કુ ધન રોમ)

I વાણ ત્યાં તુખ્યાં Like priest like people. (લાંક
ગ્રીસટ લાંકડ પીપલ)

II નર જીવા યાએ Those who live longest will see
most. (વિાજ કુ લીન લો. બેસ્ટ વીલ સી મેરાટ)

દાંડાં પાંદરા વેન્ના બેરી આંખળા The better day the
better deed. (ધ બેસ્ટ ટે ધ બેસ્ટ ટીડ)

I મેળા નાંએ તેદ્દું ગલ્યું થાએ Plenty makes dainty.
(ખરી મેહદસ છનીડાએ)

એ પીએ શરાં ઉસકા ખાન અગ્રાં Counsels in wine
seldom prosper. (કાન્સેલ્સ ધન વાઈન સેફામ પ્રોસપર)

નંનો અહીં ખપ તનો ત્યાં પણ ખપ A bad thing never
dies. (એ એડ થીન્ગ નેવર ડાફાન)

જેવા મંગ તંચા રંગ A man is known by the company
he keeps. (એ મેન દાન ગોન બાય ધ હાંપની હી કોઝુસ)

કાંકર કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સર્વાયર ભગાય Many a
little makes a muckle. (નેની એ લીટલ મેન્ડેસ
એ મકલ)

કુલાર કરતાં ગંધા આલ્યા Fools rush in, where angles
fear to tread. (પુલ્સ રશ ધન ન્હેર અન્ગલ્સ શીલાર
કુદે)

કાડિને છણ અને હાથાને મણ In the ant's house, a little
dew makes a great deluge. (ધન ધી એન્ટ્સ
દાઉસ, એ લીટલ ડાય મેન્ડેસ એ એટ ડીલ્યુજ)

કરકસર એ જીને ભાઇ છે Economy is a great revenue.
(ધાકાનોમી ધર એ એટ રેવન્યુ)

કમણેર અને ગુર્સા બોન A little pot is soon hot. (એ
લીટલ પોટ ધર સૂન હાટ)

ખાડે હંદર અને બાખવે લોારીગ One sows, another reaps.
(વન સેઝ અનબાધર રીપમ) • • •

ખાળે, કુચા અને દરવાળ મોહગા Penny wise, and pound
foolish. (પેની વાઈન એન્ડ પાઉન્ડ પુલીશ) .

આથે પીધે દીવાળી અને ઉગરે જીવાટ Burning the candle at both ends. (જુન્નિંગ ધ ફેન્ડલ એટ એથ એન્ડલ)

બોટો ફૂફીઓ અણક ધણો Empty vessels make most sounds. (ગોર્પઠી વેસલ્સ મેન્ડિક મોર્ટ સાજિન્ડાન)

આગ તં ખાય Quick at moat, quick at work. (ફીંક એટ મોટ, કાંચક એટ વક)

આઓ તેનું પોઢો નહિ Cast no dust in the well that gives you water. (કાર્ટ નો કાર્ટ ફન ધ લેસ રીટ ગીંજ યુ વોટર)

ઉનાનળા મો બાવળ ને ધીરા સા ગંભીર He that goes softly goes slowly. (હી પેટ ગોઝ સેફિટ્થી ગોઝ રહ્યોલી)

જાટના મેંનો જાંખડું Look before you leap. (લુક એંડાર યુ લીપ)

જીના પાણીઓ કાંઈ ધર જીજવાનું નથી You cannot kill a dog with a bone. (યુ કેન નોટ છીલ એ ટોગ વીથ એ પોણ)

જીર જિશાડીનો મેળ Like dog and cat. (જાઈક ટોગ એન્ડ ડેલ)
જીજરું એટલું દુખ ના દેખ All is not gold that glitters.
(આલ ઈઝ નોટ ગોડ રીટ ન્લીટરસ)

અંતે ધમો જય Virtue will shine at last. (વરચ્યુ વીલ શાંન એટ લાસ્ટાન)

આમણુંની મુંજ દામણમાં To rob Peter to pay Poul.
(કુ રોચ પીટર કુ પે પોલ)

જીથું આંદળા છે Love is blind. (લવ ફલ અનાઇન્ડ)

કરણી તેવી પાર ઉત્તરણી, વાવશો તેનું લખુશો। As you sow, so shall you reap. (જેણ હુ સો, સો શેષ હુ રીપ)

અથ ડોલ્લ દીકી છે ! કાશની વાત અથ જાણો Many a slip between the cup and the lip. (મેળી એ રહીપ બીટવીન ધી ક્રિપ એન્ડ ધી લીપ)

કૃપાળે કૃપાળે જુદી ભતિ Many men, many minds. (મેળી મેળી માઈન્ડ્સ)

કામ એટલો અર્થ Keep no more cats' then will catch no mice. (ક્રિપ નો માર ડેટસ ધિન વીજ ડેય નો માઈસ)

GUIDE TO TELEGRAPH.

તાર વિષે ગુચના-અને નમુનાઓ.

ઇંગ્રેજ સરકારના રાજ્યમાં સુખદાયક સાધનોમાં સંદેશ મોકલાનું સાધન ધાર્યાનું લોકપ્રિય છે. કુંક રામયમાં મોકલવાના સંદેશ તાર મારફત રવાના થાય છે, તાર મારફતે સંદેશ એ રીતે મોકલાય છે. ધાર્યોજ જડાનો તાર Urgent (અન્ઝન્ટ) અને દીકનો તાર Desired (ડીર્ડ). અન્ઝન્ટ તારનો દર રૂપીયા જે છે, અને તે તુરતજ રવાના થાય છે, પણ અન્ઝન્ટ તાર કેટલા રવાના કરવાના હોય તેટલા રવાના થઈ ગયા પણીથી ડીર્ડ તાર રવાના કરે છે. એટલે અન્ઝન્ટ કરતાં તેને વધારે વખત લાગે છે, અને તેનો દર એક રૂપીએ છે.

અન્ઝન્ટ તારમાં મોકલનાર તથા લેનારના નામ જાવે ભાર

શબ્દો જાય છે, ત્યાર પણી દરેક વધારાના એક શબ્દે એ આપાં વધારે આજું પડે છે.

ડિઝેડ તારમાં મોકલનાર તથા લેનારના નામ સાથે અપર શબ્દો જાય છે, અને ત્યાર પણી દરેક વધારાના એક શબ્દે એક આનો વધારે લે છે.

'તારણ' હોય.

To.	જાં મોકલવો હોય તે } From જાંથી મોકલવો
Station.	ગેશનનું નામ. } Station સ્ટેશનનું નામ.
To.	જેને તાર મોકલવો હોય } From જેણે તાર મુક્યો
Person.	તેનું નામ } Person તેનું નામ.

મોકલનારના ડેકાણ્યાની જરૂર નથી કારણું કે શબ્દો વધી જાય તો પેસા વધારે અપયા પડે છે, પરંતુ લે જવાય ભંગવવો હોય તો જે માણુસને તાર મુક્યો તે માણુસે મોકલનારનું ડેકાણ્યું આપવું, પોસ્ટ ઓફિસમાં મુક્ખાના તારના કારમાં છેક છેઠે તાર મુકનારનું નામ, ડેકાણ્યું તથા હોહો લખવાનું હોય છે એટલે લે તાં તાર મુકાને તો ડેકાણ્યું લખવાની જરૂર રહેતી નથી.

"ને સ્થળે પોસ્ટ 'ઓફિસની સાથે તાર હોય છે ત્યાં રેફેરી તાર 'ઓફિસમાં તાર મુકાના કરતી પોસ્ટ ઓફિસમાં તાર મુકાવવાની

વહેલાં પહોંચે છે ડેમકે રૈલવેના તારનું કામ પૂર્ણ થાય ત્યાર પણી
તાર સુધ્દાની અવડ ભળે છે.

તાર લખવાના ગણેના.

બંઘાય ૧૭૪ માં છે, ખરીદ છે ? જવાય આપો.

Asks Bengal for 174, buying ? Reply.

(આરક્ષસ બેંગાય હોર વન સેવની હોર, બાઈંગ ? રીપ્લાય.)

૧૮૬ થી ઓછે વેચતા ના.

Don't sell less than 186.

(ટોન સેલ લેસ ધિન વન ઓઈની સીક્ષણ.)

૨૦૦ હંડ્રેટ અગસ્ટ કાવેરી ઓપર ચદ્રાની છે.

Shipped 100 cwts linseed on steamer "Kavery."

(શીઓડ વન હન્ડ્રેડ હંડ્રેટ લીન્સીડ ઓન સીમર "કાવેરી"

જાળ તેજ છે, ઓફિસવાખાઓની લેવાલી છે.

Market strong, Officewala buying.

(માર્ક્યાટ સ્ટ્રોંગ, ઓફિસવાખા બાઈંગ)

જાળ વધે છે, મીલવાળાઓ ખરીદે છે.

Market going up, Millowners buying.

(માર્ક્યાટ બેઝિંગ અપ, મીલઓનર્સ બાઈંગ) ?

ખારનું બજાર ટકેલું છે.

Yarn market is steady.

(યાર્ન માર્ક૆ટ ટક રેસી)

ચતુરની લેવાલી નથી, લાય એાણ છે.

No demand for yarn, Price lowered.

(નો ડીમાન્ડ હેર યાર્ન પ્રાઇસ લોવર્ડ)

બજાર મંદું છે, ખરીદનાર નથી.

Market dull, No buyers.

(માર્ક૆ટ ડલ, નો બાયર્સ.)

બજાર ધાંસું તોજ છે, ૧૦૦ ઇપીઓનો માન ખરીદો.

Market brisk, buy 100 rupees worth.

(માર્ક૆ટ ભીરક, આય વન હંડુડ ઇપીઓ વર્ધ.)

જલગામનો શું લાય છે, ૨૦૦ ગાંસડી લોઈએ છે.

What price Jalgam ? Want 200 Bales.

(વોટ પ્રાઇસ જલગામ, વાન્ટ કુ હંડુડ ઐસ્સ)

ચોરસો ખાંડી જલગામ ૧૭૫ થી વચ્ચે.

Sold 400 candies Jalgam at 175.

(સેલેડ હંડર હંડુડ કેન્દ્રીઓ જલગામ એટ વન સેનની હાઈન)

સો ખાંડી અર્દ્ય ૩૦૫ માં ખરીદી.

Bought hundred candies Broach at 305.

(વોટ હંડુડ કેન્દ્રીઓ બોય એટ થી હંડુડ એન્ડ હાઈવ)

૨૦૦ ખાંડી જેપોરના ૧૪૦ ના ભર્યે કાયાલો કરતા નહીં.

Do not contract for 200 candies Jeypore at 140,
(ડુ નોટ ડોન્ટેક્ટ હેડ ડુ ૬-ડરેડ જેપોર એટ વન-ફોર્ટ)

અજાર મજબૂત છે, ૧૮૫ આં ખરીદો.

Market strong, buy for 185.

(મારકેટ સ્ટ્રોંગ, બાઈફેર વન-એચર્ટી -ફોર્ટ)

અજાર મંદુ છે. કેમાણુ સાતસોનું છે. ખરીદતા ના.

Market dull, Sales 700, Don't buy.

(માર્કેટ ડલ સેલ્સ સેવન હંડ્રેડ. ડોન્ટ બાય)

મોતીલાલને મોકદો તેનું ધારુ જરૂરનું શામ છે.

Send Motilal, want him badly.

(સેન્ડ મોતીલાલ ડોન્ટ હીમ મેડલી)

કું તમને જખુ લાં સુધી તમે ખરીદ કરનો.

Purchase until further order.

(પ્રચેર અનટીલ ફર્થર એર્ડર)

બાલભાઈ કપાં છે જવાય આપો તમારા તાર મળ્યા.

Where is Balabhai, Reply Soon, Received telegram.

(બેંક ડાચ બાલભાઈ રીપ્લાય સુન રીસિવર ટેલીગ્રામ)

રૂ. ૨૦૦૦ ની હુંડી મોકદો,

Send Hundia for Rs. 2000.

(સેન્ડ હુંડી હેર ડુ થાઉન્ડ)

રૂ. ૧૦૦ ની હુંડી સ્વીકારનો.

* Accept Hundia for Rs. 100

(ઓપ્પોફ હુંડી હેર ફ્લીઝ વન ફંડ્રો)

ઝતો અનલર કેમ છે એકદમ જવાબ આપો.

How is cotton market, reply at once.

(હાઉ ધક કોટન માર્કેટ રીપાય એટ વન્સ)

ચુનીલાલ આવો, તમારી ભાતુશી માંઠી છે.

Come Chunilal your mother sick.

(કમ ચુનીલાલ, યોર ભધર સીડ)

મગનલાલની બેન ભરી ગણ છે, તેને અમર આપો.

Inform Maganlal his sister died.

(ધનદેશાર્થ મગનલાલ હીજ સીસ્ટર ડાઇડ)

કાઢાને કેમ છે જલહિથી જવાબ આપો.

How is uncle reply soon.

(હાઉ ધક ગંકલ રીપાય સુન)

પી. આને છ વાગતે આગ્રો છે.

P. arrived to-day at six.

(પી. એરાઇન્ડ કુ-ટે એટ સીક્સ)

પી.ની વડુંએ આને સુવેચા છોકરાનો જન્મ આગા પણી પ્રાણું
સુકી દીધો.

Mrs. P. expired to-day after giving birth to a
still-born son.

(મીસીમ પી. એક્સપાર્ટ કુ-ટે આઇન્ટર ગીનીગ બર્થ કુ એ સિલ્ફ
કોર્ન સન) .

તમારા તુકદાનથી અન્ત દીલગીર છું.

Heart-felt sympathy for your loss.

(હાઈ-સીમ્પથી હોર યોર લોસ)

મરણની ખબર સાંભળો ધણો દીક્ષાગીર થયો છું.

Very sorry to hear death news.

(વેરી સોરી કુ લીધર ટેચ ન્યુસ)

મગન ધણો ધારતી ભરેલી લાલતમાં છે, તાવ હોશ કરતો વધુ.

Magan dangerously ill, Fever worse than ever.

(મગન તેનજર્સલી છલ, શીવર ઉવર્સ ધેન એવર)

ફુલચંડ આજે સવારે ગુજરી ગયો, દીક્ષાગીર ન્યું.

Fulchand died this morning, Sorry for him.

(કુલચંડ ડાઇડ ધીસ માર્નિંગ, સોરી હેર લીમ)

હું શુદ્ધારે મેલમાં ઉપડીશ, રેલન ઉપર આવણે.

Starting by Friday mail, attend station.

(સ્ટાર્ટિંગ બાય ક્રોઝડ મેલ, એટેન્ડ સ્ટેશન)

સવારના છ વાગતાં મુંઅઈ પહેંચયણું, સ્ટેશનપર આવણે.

Arriving Aombay 6 A. M. receive at station.

(એરાઇવીંગ ઓઅએ સીક્સ એ. એમ. રીસીવ એટ સ્ટેશન)

મુક્કદમાની ૧૦ મી તારીખ મુદ્દત પડી છે.

Case postponed to 10th.

(ડેસ પોસ્ટપોન્ડ કુ ટેન્થ)

મુક્કદમો માંડી વાળ્યો, આવતા નાલિ.

Settled the case, don't come.

(સેટલ ધી ડેસ, ટોન્ટ કમ)

મુક્કદમો તેની તરફણુમાં ચુક્કાયો છે.

Case decided in his favour.

(ડેસ ફિસાઇડ છન લિએ ટેનર)

મણીલાખને જલદી મોકલો, કામ અટકો પડ્યું છે.

Send Manilal soon, business stopped.

(સુન્દ ભનીલાખ સુન ખીજનેસ રટોડ)

રવિવારે ઉપડને, ખંડું તૈયાર છે.

Start on Sunday, everything is ready.

(રટાઈ ઓન સનડે, એવરીથિંગ ધક રેડી)

કંઈ થયું છે ? કંઈ ખખર નથી.

Anything wrong ? No information.

(એનીથિંગ હાગ ? નો ઇન્ફર્મેશન)

આજે સાંજે તમે સહિસલામત મુશ્કેલ આવો પહોંચ્યા.

You reached Bombay safe this evening.

(યુ રીચ જામે સેટ્ડ ધીસ ઇવનીંગ)

તાર મળ્યો, સોમવારે નીકળું છું, રેશન ઉપર માળને.

Telegram received, starting Monday, receive station.

(ટેલીગ્રામ રીસીવ, રટાઈંગ મન્ડે, રીસીવ રેશન)

હરીઆ મોકલો, માદ પહોંચ્યો, હવા સારી છે, ખંનર ટોક્યું છે.

Send money, goods received, weather fair, market steady.

(સુન્દ ભની, ગુડક રીસીવ, વેધર ઇંડર, મારકેટ રેડી)

પહેલી તારીખ મુહૂર્ત છે, જલદી આવને, કપડા લેતા આવને.

Mahurat fixed first, come soon, Bring clothes.

(મહૂરત રીકર્ડ, કમ સુન, ખીગ કલોાસ)

પિતાજ સહિસલામત મહોંચ્યા છે, રાધાને છોકરો આવ્યો, તખિયત સારી છે.

Father arrived safe, Radha delivered Son, both healthy

(દ્વાખર એસિધન સેટ્ટા, રાધા હીલીકર્ડ સન, ખોધ હેઠળી)

મહારાજા સાહેબ શુક્રવારે અમદાવાદ જયા, સાંજે આવનાર છે.
 Maharaja gone Ahmedabad Friday, returns evening.
 (મહારાજા જોણ અહેડેઝાઓ ક્રાઇટ રીટર્ન છતનીંગ)
 હુંડી આવી, શીકારવા ના પાડે છે, ખુલાસો લખનો. ભાલ મોકલ્યો છે.
 Draft received, refuses to accept, explain, goods sent.
 (ડ્રાઇટ રીસીવ, રીટ્યુઝીઝ કુ એક્સેપ્ટ, એક્સ્પ્લાન, ગુડ્ઝ સેન્ટ)
 મા યાત્રાએ જય છે, પાણી વળતાં સુરત ઝાવણો, તળિયત સારી છે.
 Mother going pilgrimage, shall stop Surat
 returning, health good.
 (મધ્યર જોઈએ પીલાધીમેજ, શંક સ્ટોપ સુરત રીટર્નિંગ, હેલ્થ ગુડ)

દુષ્ટેણુમાં કાગળ તથા સરનામાં લખવા વિષે.

શરૂઆતમાં કાગળની વાંદર મલકાય નીચે પ્રમાણે લખવો
 Sir, કામકાજ માટે અગ્રણ્ય ભાગુસને, વધુ અમલદારીને તથા
 દુકાનદારીને લખવું.
 Dear Sir, એળખાણુવાળા ભાગુસને લખવું.
 My dear Sir, જરા વધારે એળખાણુવાળા હોય તેને લખવું.
 My dear Mr..... } અથવા } મિત્રાએ એક ભીજને લખવું.
 Dear Mr..... }
 વેપારી પત્ર વહેવારમાં નીચે પ્રમાણે લખવું.
 Messers..... & Co.

**કાગળ લખી રહા પછી લખીતંગની ઉપર
નીચે પ્રમાણે લખવું.**

ને કાગળનાં ભથાળાં ઉપર Sir, કરી લખ્યું હોય તો કાગળ
લખી રહા પછી Sir, કરી લખવું પણ ને Dear Sir, લખ્યું
હોય તો કાગળ લખી રહા પછી પણ Dear Sir, કરવું નેછો.

Yours truly } અનન્યા શખ્સોને અને સાધારણ
Yours faithfully } કામકાજમાં લખવું.

Yours sincerely અથવા Yours most sincerely
દ્રોગ મિત્રને લખવું.

Yours affectionately સગાને લખવું.

Yours respectfully પોતાના કરતાં ચઢતી પડિ વાળાને લખવું.
દાખલા તરફિ એક નોકરે પોતાના શેડને અથવા એક દુકાનદારે
પોતાના ધરાકને લખવું. Yours લખતી વર્ખને ‘દુ’ એચોર્ટોશીની
નિશાની ડાઢી નહિ નેમકે:- Your's નહિ, પણ Yours લખવું.

ડ્રાઇ છોકરીને લખવું હોય તો I am, Miss, Your most
obedient servant લખવું

છોકરાંસે અથવા છોકરીએ પોતાના બાળ અથવા માને Your
loving (son અથવા daughter) લખવું.

અથવા Your affectionate and dutiful (son અથવા
daughter) લખવું.

બાઈએ પોતાના બાઈને અથવા બહેનને Your most
affectionate brother લખવું.

મહેને પોતાની ઘેણને અથવા પોતાના બાખને Your affectionate sister લખતું.

જાપિ પોતાના છોકરા અથવા છાડીને I am, your affectionate father લખતું.

માઝે પોતાના છોકરાને અથવા છાડીને I am, your affectionate mother લખતું.

પરબીડીયાં ઉપર નામ તથા ઠેકાણું લખવા બાબત.

પરબીડા ઉપર Mr. અને Esq. એકજ ધર્યુને લખતું નહિ, પણ Mr. અથવા Esq. એક લખતું જેમણે:-Mr. Motilal Lallubhai અથવા Motilal Lallubhai Esq.

હવડા નોકરો અને નાના દુકાનદારો સિવાય સર્વને Esq. જ લખતું.

ને ધર્યુને કાંઈ ડીઓ મેળવણી હોય તો તે ધર્યુનું નામ પહેલાં લખી પણી Esq. અને લાર પણી નેની B. A. અથવા M. A. ને કાંઈ ડીઓ હોય તે લખણી જેમણે:-N. Johnson Esq. B. A. લખતું પણ N. Johnson B. A. Esq. લખતું નહિ.

દાકતરો Dr. Pitambardas Kuberdas L. M. & S. લખતું પણ નામની આગળ Dr. લખેલું હંવાથી Mr. અથવા Esq. લખતું નહિ.

કેચ પણ લાગીદારોની પેટીને Messrs,.....
.....& Co. લખતું.

ને ધર્ષણીને આગળ મોકલવો હોય તેના નામની પહેલાં care
of આગું નહિ પણ કુંકમાં c/o. બખીને તે ધર્ષણીનું નામ લખવું.
સરનામું કરવાનો નીચેનો નમુનો જુઓ.

Keshavlal Narandas Patel, Esq.
c/o Moti Hamam's Pole-- Ahmedabad.

Sir, Honourable, Raobahadur, Khanbahadur,
Raosaheb, Khansâheb વગેરે ખીતાંઓ ધરાવનારાજોને તેમના
નામની આગળ તેમના ખીતાં લખવા.

મહેરથાન સાહેં,

અમે ધર્ષણી મુશીથી જગ્યાદીએ છીએ કે નીચે મુજબ માલનું
ખાડું રેલવે ગુડ્સથી અમારા સરનામે મોકલી આપણું.

૫૬ ગુજરાતી બાકુરણ,

૫ ગ્રોસ હોલ્ડર્સ.

તમારી શુભેચ્છાનું છુનલાલ ડી.

Sir,

I have the Pleasure to advise despatch of a
parcel, to my address by Railway Goods, contents
as under.

56 Gujarati Grammar,
4 Gross holders.

Yours faithfully,
Chhaganlal D.

સુલાકાતનું તેડું.

Mr. Maneklal,

Please make convenient to see me to day
In my Office between 10 A. M. and 3 P. M. as
I have some important matter to communicate
to you.

Yours truly,
Chhotalal C. Shah.

મી. માણેકલાલ,

મહેરભાઈ કરીને આજે સવારના ૧૦ થી સાંજના ૩ સુધીમાં
મારી ઓપરીમાં મળી જયાની ગોડવાળું કરેને, કારણ મારે ઓક
અગત્યની બાબત નમતે જણાવારી છે.

તમારો સાચો મિત્ર,
છોટાલાલ સી. શાહ.

સુલાકાતનું તેડું ખીજું.

My dear Motilal,

The moment this reaches to you, come to my
house, as I want to speak to you immediately.

Yours truly,
Sakralbhai M.

મારા વ્યાસા મોતીલાલ,

આ ચીઠી પહોંચતાંને વાર મારે દેર આવવા સારું તરન નીચ-
ળાંને ડેઝે મારે તમારી સાથે જલદી કાંઈ વૃત્ત કરવાની છે.,

લી. તમારો સાચો મિત્ર,
શક્રાભાઈ એમ.

કામ માટે રજા.

Sir,

Some urgent business prevents me from attending the School to-day, I hope, therefore, you will excuse me for the absence. I shall attend School to-morrow.

I am,

Yours obediently,

Chimanlal D.

સાહેન,

જિલ્લાના કામ સારુ આજે મારાથી રકુદમાં આવી શકાશે
નહિ તેથી હું આશા રાખું છું કે, મારી ગેરહાજરીને માટે તમે મને
માટે કરશો. કાંચે હું નિશાળે આપીશ.

હું છું, તમારો તાખેદાર,

ચીમનલાલ ડી.

દેશાવર જવા માટે રજા.

Sir,

I am going to Bombay this morning and my brother Mr. P. is to accompany me. Will you have the goodness therefore, to grant him leave for a week.

I am,

Yours faithfully,

Chhotalal K. Mehta.

સાહેણ,

આજે જોગેરના હું સુંખાર જનાર છું, અને મારો લાઇ ભી. પા. મારી સાથે આવે છે. તથી મહેરાણાની કરીને તેને એક અડવા-
ડીયાની રજી આપશો ?

હું છું તમારો વિધાસુ,
છાટવાચ કે. મહેતા.

Sir,

:

I am sorry to say that my father is very ill so I can not leave him alone. I am therefore compelled to be absent from school to day; but I send my exercise book with Lallu and hope to be able to come to tomorrow.

Your obedient pupil
Mahasukh.

મહેરાણ સાહેણ,

હું દીકળીરીથી જણાનું છું કે મારા બાપા ધણા માંદા છે તેથી એકલા મુકાય એમ નથી, તેથી મારે આજરોજ વેરેદાનર રહેવાની જરૂર પડી છે; પણ મેં મારી પાડમાળાની નોટ લખ્યું સુધી મોકળાની છે, અને હું આશા રાખ્યું છું કે આવતી કાંલે નિશાળે આવીશ.

તમારો તામેદાર, વિધાર્થી,
મહાસુખ.

Dear Mr. Madhu,

Will you favour us with your company at a family dinner on Thursday next at 5 o'clock?

Yours truly,
Bhogilal.

પ્રિયભાઈ માધુ,

આતના મંગળવારે ખાંચ ગાગે ઉનાંથી વખતે તમો પદ્ધારી
અમેનો આભારી કરશે।

લી. તમારો સાચો મિશ.
બોગીલાલ.

સીકની રજ માટે ચીકું બીજુ.

Sir,

As I have been suffering from headache since my return from office yesterday evening, I am unable to attend office to-day. I hope therefore, you will be kind enough to excuse me for my non-attendance.

I remain, sir,
Your most obedient servant,
L. C. Shah.

સાહેન,

ગઈ કાલે સાંને ઓછીસમાંથી પાછે ઇથો લારનું મને ભાયું
અઠી આન્ધું છે, તેથી આને હું ઓછીસમાં આવી શકનો નથી, તે
વાસ્તે હું આશા રાખું છું કે, મારી ગેરહાજરીને માટે તમે મહેરબાની
કરીને મારુ કરશો।

હું છું, તમારો તાખેદાર સેવક,
એલ. સી. શાહ.

સીકની રજ માટે ચીહ્નો પ્રીણ.

Sir,

I have been suffering from indigestion for several days. The doctor recommends a change. Will you, therefore, kindly grant me leave of absence for a week?

I am, Sir,
Your obedient servant,
Manilal U.

સાહેબ,

ધથુંક ફદાડા થયા મને અજરણ થયું છે. ડાક્ટર લવા હેરાયદાલ કરવાની ભવાભય કરે છે, તેથી તમો મહેરાની કરીને મને આડ દીવસની જેરહાજર રહેવાની રજ આપશો !

હું ખું, સાહેબ તમારો તાનેદાર સેવક,
મણીલાલ યુ.

જવાબ.

My dear, Sakrabhai M.

You must pardon me for not coming over now, as I am at present engaged in business, which I cannot leave off, I will however try to see you to-morrow.

Yours sincerely,
Motilal N.

મારા જ્ઞાના શક્રાલાઈ,

હમણું મારાથી અવાય તેમ નથી માટે માઝ કરનો. કેમકે હાજ
હું જે કામમાં રોડાયલો છું તે હું પડતું મુકી શકું તેમ નથી. અનશે
તો હું તમને કાલે ભગ્નાશ.

લી. તમારો મિત્ર,
મોતીલાલ એન.

સીકની રજ માટે ચીકું.

Sir,

Please pardon for my absence to-day as I
am laid up with fever. I hope to attend School
to-morrow.

I remain, Sir,
Your obedient pupil,
B. L.

સાહેબ,

મહેરભાતી કરીને આજે મારી જેગદાનરીને માટે મને માઝ
કરને, કારણ મને તાવ આપે છે. હું આવતી કાલે નિશાળે આવવાની
આશા રાખું છું.

હું છું સાહેબ,
આપનો તાણેદાર શિષ્ય,
પી. એલ.

Messrs Motilal & Co.

Dear Sirs,

Kindly send Me three yards of Maslin
matching the sample, for which the bearer will pay.

Yours faithfully,
Trikamlal.

મેસર્સ મોતીલાલ એન્ડ કુ.

મહેરખાન સાહેબ.

મહેરખાની કરી ઉ વાર ભલભલ આ નમુના માટેક મોકલને.
નેની કીમત આ ગીણી લઘ આવનાર આપશે.

તમારો સાંચો.

નીકમલાલ

To,

The Secretary of the New English School
Ahmedabad.

Sir

Having seen your advertisement in the Praja-Bandhu for a second master for your school, I beg to apply for the post.

I have been educated at the Surat school, having been a student in that institution for over seven years.

I passed the School Final Examination of the Bombay University in 1901.

For the last two years I have been an assistant master in the Nariad school. I am 23 years of age.

I enclose copies of testimonials from the Head master of the Surat school, and from the Head master of the Nariad school.

I am, Sir,
Yours faithfully,
Madhavjee.

મહેરખાન અમદાવાદ ન્યુ ઈંગ્લીશ સ્કુલના સેકેટરી સાહેબ,
અમદાવાદ.

સાહેબ,

તમારી નહેરખાડ પ્રાણાંનું પત્રમા ભીજન મારતરને વારતે
નોંધને હું તમોને તે જગ્યા વારતે અરજ કરે છું.

એ સાત વર્ષ સુધી સુરતની નિશાળામા નિશાળામા તરફ
કણવણી લીધી છે.

હું ૧૯૦૧ માં સુધી ઈંગ્લીઝાની ગુલ ફાઇનલની પરિદ્ધામાં
પાસ થયો છું. એ વરસથી હું નડીયાદ સ્કુલમાં મદદનીય શિક્ષક
તરફ નોકરી કરે છું. આરી ઉમર ૨૩ વરસની છે.

મને સુરતની નિશાળા અને નડીયાદની નિશાળા મહેતાળનાં
સર્વિસીએટ અંગેથાં છે તે આ સાથે મોકલું છું.

હું છું સાહેબ,
તમારી તાથેદાર,
માધવજી.

વાંચવા આપણી ચોપડી પાછી મંગાવવા સાર્ન.

Dear Mr. Harilal,

Will you be kind enough to send me the book which I lent you? If you have not yet read it, I beg you will return it as soon as you finish it, because I have promised to lend it to my friend.

Yours truly,
Maganlal H.

જાના લિખાબ,

મેં કે ચોપડી તમને વાંચવા આપ્યી હતી તે ભહેરથાની કરીએ
પાછી મોકલશે! નો તે હજુ તમે વાંચ્યો ન હોય તો જેવી તે પુરી
કરો કે તરત ભહેરથાની કરીએ મોકલી આપને. કેમકે મેં તે એક
મારા ભિન્નને આપવાને વાયરો દીધ્યા છે.

શ્રી. નમારો ભિન્ન, મગનલાલ અન્ન.

ઓસ્ટ માર્ક્ઝ્ટે ચોપડી વેચાતી મંગાવવા સાર્ન.

Sir,

Will you have the goodness to send to my address by book-post, a copy of the Vidyut Kumar? Postage stamps to the value of eight annas, are herewith enclosed in payment.

Yours obediently,
J. P. Shah.

સાડેઅ,

મહેરાની કરી ખુક પોરટ મારછને ભારે સરનામે “વિદુત
કુમારની ચોપડી” ની એક નકલ મેણ્ટશે? તેની ઈમનને પેટે
આડ આનાની ટ્યાબની રીક્ષીઓ આ જાથે ણીરી છે.

તમારી નામેદાર,

ને. પી. શાલ.

પૈસા ઉઠીના લેવા સાર્વ.

My dear, Somchand,

Pray favour me with a sum of ten rupees
by the bearer as I am in urgent need of the
sum, but will repay it whenever you please to
make a demand.

Yours most sincerely,

Fulchand N.

માગ વાતાવા સેમયંદ,

આ ચીઠી લાવનાર થાયે દરા રૂપીઓ ઉઠીના મોંદસવાની
મહેરાની કરણે કેમકે લમણાં મને જરૂર છે પણ તે તમે જ્યારે
માગણો તારે પાણ આપીય.

લી. તમારો મિશ.

પુસ્તયંદ એન.

**Letter written by a poor man to his
daughter:**

My dear Mani,

I Having now commenced earning a living for yourself, by your own industrious exertions, I cannot better discharge my duty than by giving you such humble advice as I am competent to do.

In the first place, carefully avoid all impatience of speech for that will be sure to displease even the kindest of your employers, remember that it is your duty to submit to your superiors, even though their commands may appear harsh.

Be strictly attentive to cleanliness and industry, otherwise you will never preserve any place long, which alone will be sufficient to ruin your character.

Do not, when sent on an errand, stay or go elsewhere for yourself, without first asking leave of your Mistress.

Endeavour, by the most scrupulous attention and willing alacrity, even to anticipate the wishes of your employers. This may obtain you their

love and protection, a constant desire to please being the best way to ensure success.

Should there be any children in the family you may serve, treat them with the greatest tenderness and with proper respect; for it may so happen, that in the course of life those very children may become your employers, or best friends.

If there are male servants in the family behave to them with friendly civility, but on no account suffer them to treat you with too much familiarity.

Above all, be honest. It is a solemn duty you owe to those who entrust you with their property, and remember that you will be equally culpable in defrauding them of even a single penny, as in robbing them of a thousand guineas. One breach of honesty will ruin your character for ever and break the fond hearts of your aged parents.

Pray pay attention to what I have now said, and accept my dear girl, the prayers and blessings of your affectionate father.

Dahyabhai.



ગુજરાતી અંગ્રેજ શાહીનો જથો.

વનસ્પતિ.

અગમો Parsley (પાર્સ્લી)	કાળુ Pumpkinred (પમ્પકીનરેડ)
આમલી Tamarind (ટેમરિંડ)	ખટુમણાની ભાળ Sorel (સોરેલ)
કાળી Cabbage (કેબેજ)	ગોખણી ભાળ Purplain (પર્પલેન)
કંદા Onions (અનીયન્સ)	આગર Carrot (કેર)
ચાળાનીભાળ Spinnang (સ્પિનેંગ)	થાંગ Bean (થીન)
દુર્ધી Gourd (ગોર્ડ)	ફરેંચબેન્સ French beans (ફરેંચ બીન્સ)
પાન Betel leaf (બીટલ લીફ)	કુલ્લાંગી Cauli-flower (કુલ્લી ઇલાંગ)
મદ્દાંગ Mint (મિન્ટ)	ભીડા Lady finger (લેડી ફીંગર)
આદુ Ginger (ગિંગર)	સેકદાની સાંગ Guilandina moringa (ગીલાંડિના મોરિંગા)
કૃથમીર Coriander plant (કુરીયેન્ડર પ્લેન્ટ)	ફાટારા Potatoes (પેટેરોઝ)
મરચાં Chillies (ચીલીઝ)	ભૂંડુ કાળુ Pumpkin white (પુંપકીન અલાદ)
મેસ્ટાની ભાળ Fenugreek plant (શીનથીક પ્લેન્ટ)	મુળો Radish (રેડીશ)
લસ્સુણ Garlic (ગારલીક)	રનાળું કંદ Yam (ધામ)
લીલી આ Lemon-grass (લેમન આસ)	ખાલુ મરચું Capsicum (કેપ્સિકમ)
માંગરિયાં Sweet potatoes (રસીટ પેટેરોઝ)	

ચુરણુ Yam (યામ)	બંગળુ Brinjal (ભીજામ)
સવાની ભાજા Fennel plant	સાલીત Salad (સેલેડ)
એક જાતનું કંપ Turnip (તરફિય)	

શરીરનાં દર્દો Bodily Diseases. (બોડીલી ડિસેઝેસ)

અધામણુ Looseness of bowel (લુઝનેસ ઓફ બોવલ)	અછાપા Chicken pox (ચીકન પોષા)
અલુરણુ Dyspepsia (ડીપી-પેપરિઅન્સ)	અધેગનાયુ Paralysis (પેરેલીસીઝ)
અધ્વર્યાંગ રહી ગંભેરું Paralytic (પેરેલીટીક)	અકલપાત Heart burn (હાર્ટબર્ન)
અધ્વર્યાંગ રહી ગંભેરું Paralystic (પેરેલીટીક)	આભવાયુ Flatulence (ઇલેટફલેન્સ)
અળાઈ Prickly heat (પ્રોક્લીહાઇ)	આંટણુ Corn (કોર્ન)
આંજલી Sty (રદ્દાઈ)	ઉદ્રી Alopecia (અલોપેસીઝિય)
આકારી Vomit (વોમિટ)	પ્રધાન Springtide (સ્પ્રિંગટાઇડ)
ઉટારીઓ Hooping cough (કુપીન્ગ ક્રીસ)	ઉલટ આવરી Keck (કેક)
ઉલટી Vomit (વોમિટ)	કાં Phlegm (ફ્લેગમ)
ઉભળા Jaundice (જિન્ડાઇસ)	પાંગર Pang (પેંગ)
ઉંડમાણ Angina (એંગ્નિના)	ટાંલ Leprosy (લેપ્રોસી)
ખરજણું Scurvy (એસ્કર્વી)	ખજ Consumption (કુન્ફિયસન)
ખસ Itch (એચ)	ખિંચ Pimple (પિંપલ)
ખાંસી Cough (કૉફ)	ખૂંડો Brau (બ્રાઉ)
	અધ્યાય Measles (મીસલ્સ)

શુદ્ધું Ulcer (અબસર)	ફહીક Dread (ટેચ)
લા Sore (સાર)	ચુક Colic (ઢાલીક)
* ચાંદી Venereal disease (વનારીઅસ ડિગ્રીસ)	દમ Gasp (ગાર્સ્પ)
ચેડ Infection (ઇન્ફેક્શન)	જલદર Diopsy (ડોઝસા)
જરૂર Wound (વીન્ડ)	દીમદુ Tumour (ટ્યુમર)
લંગનું દરદ Lumbago (લંગન્ગા)	તાર Fever (ફીવર)
તરિયાં તાર Tertian (ટર્ટેનિન)	ધાન વાળું Spermatorrhea • (ક્રિસ્પેર્ટોરીઆ)
દાદર Ringworm (રીંગવોર્મ)	નાડું Guinea worm (ગ્રીનિંગામ)
નામૂર Fistula (શીરકુલા)	પથરી Gravel (ગ્રેવલ)
પરમાર્ગો Gonorrhœa (ગનરીઆ)	પદ્ધતિન Hemiplegy (હિમીલેગ્ઝ)
પાકું Anthrax (અનથ્રેક્સ)	પડું Pus (પસ)
ચેટમાં દુઃખનું તે Stomach ache (સ્ટોમાંક એક)	પિટા Choler (હોલર)
ફેર Fainting (ફેફાન્ટિંગ)	ક્રેષ્ટી Vesicle (વેસિકલ)
મરડો Dysentery (ડિસેન્ટ્રી)	અંખોણ Constipation (કોન્સ્ટિપ્શન)
માયું દુઃખનું Head-ache (હેડ એક)	મસા Wart (વાર્ટ)
ભ્રાન્ટિન Black-leprosy (બ્લેક-લેપ્રોસી)	મુણ્ણાયુ Epilepsy (એપિલેપ્સી)
ચેસોઝા Wen (વેન)	રૂધાપાન Boodshed (બૂધાશેડ)
લોલીઅસાં Dysentery (ડિસેન્ટરી)	રખપુણી Catarrh (ટેટાર્ઝ)
	લાંબીનું વલેનું Hemorrhage • (હેમોરેજ)
	અપાયુ Tremor (ટ્રેમોર)

શાખાદારીઓ તથા કાર્ડીગરે.

આપા Nurse (નર્સ)	આઇટીઓ Agent (એજન્ટ)
ઉચ્ચાધી કરનાર Bill Collector (બિલ કલેક્ટર)	કદીઓ Wood cutter (વુડ કટર)
કઢીઓ Bricklayer (બ્રિકલેયર)	કળ્યાણી Cultivator (કલ્યાણિટર)
કંદુંઓ Grain dealer (ગ્રેન ડીલર)	કલ્યાણ તિનર Tinner (ટિનર)
કખામ Butcher (બુર્ચર)	કંપાર્સિથ Coppersmith (કોપરસિથ)
કાપડો Drapper (ડ્રાપર)	કારભારી Manager (મેનેજર)
કુંભાર Porter (પોર્ટર)	કાન્ટરકામ કરનાર Sculptor (સ્કુલ્પ્ટર)
કાંતનાર Spinner (સ્પીનર)	અગ્નનારી Treasurer (ટ્રેઝરર)
ખખર આપનાર Reporter (રીપરર)	ખવાસી Sailor (સેલર)
ખાચુળ Cowherd (કાંકડ)	ગર્દાની Singer (સિંગર)
ખાડી Sanke-charmer (સ્નેકચારમર)	ઘરીબાળી Watch-maker (વોય મેન્ટર)
ખોલાવાલો Groom (મુખ)	ખોલા શાખનાર Horse breaker (હોર્સ બ્રેકર)
ગર્ભી Druggist (ડ્રગ્સિટ)	ધાંચી Oil man (ઓલ મેન)
અમાર Cobbler (કોબલર)	ગીરન્ડોર Embroiderer (એમ્બ્રિડર)
પિલાર Painter (પૈન્ટર)	ગ્રાપરી બાંધનાર Book-binder (બુક-બિન્ડર)
ચ્યાપડી નેચનાર Book-seller (બુકસલીટર)	ગોદી Astrologer (એસ્ટ્રોલોગર)
જંબરી Jeweller (જુલેઝર)	ડાય Mid-wife (માડ ડીષરી)
તાળાંડુંચી જનાવાર Lock-smith (લોક-સ્મિથ)	

दूधवाला Milk-man (भीक्कमेन)	तरज्जुमो करनार Translator
हरश Tailor (टेलर)	(दान-सं-लेटर)
◆ हुक्कनार Shop-keeper (शोपक्षिपर)	दबाव Broker (ब्रिकर)
धवडायनारी आया Wet-nurse (वेटनर्स)	देखरेख राखनार Inspector (छन्हरेपेक्टर)
विारी Washerman (वाशरमेन)	दिल्ली Laundress-Washer woman (दीनां भ-वोरार वुमन)
नक्करी इन्ग्रेवनार Engraver (एनग्रेवर)	नक्कशा, ड्रॉन पाउनार Draftsman (ड्राइट्समेन)
बाबूवरी बंगाळ Banker (बैंकर)	नणीच्या चापनार Tiler (टाईलर)
नागवंध Shoer of horse (शुचर ओड होर्स)	लरीआरो Baker (बैकर)
पाथरी थांधनार Turban maker (टर्बन मेकर)	पीलगे Carder (कार्डर)
कंडींगा Peddler (पेडलर)	भणरची Cook (कुक)
भाणी Gardner (गार्डनर)	भाणी Fish monger (भीश-मॅंगर)
भेंची Shoe-maker (कु-मेकर)	बरवाड Shepherd (सेपर्ड)
रामेश्वरी Watchman (वोयमेन)	भंडोंगा Clerk (क्लार्क)
सृकडी बिपाठ Soldier (सोल्डर)	रामगाळी Dancig-girl (उनभीय गर्ल)
लुटार Blacksmith (ब्लॅक्स्मीथ)	रंगांडा Dyer (डायर)
वल्लकर Weaver (वीवर)	लीझाडिवाला Auctioneer " " (ओक्सुनीअर)
सिपाह Sepoy (सिपाह)	दैदा Doctor (डॉक्टर)
सोनी Goldsmith (जिंडमीथ)	दिश्क Teacher (टीचर)
काहिम Governor (गवर्नर)	कुत्तार Carpenter (कार्पेन्टर)
कालम Barber (भारणर)	देलडी Porter,Cooly (पोर्टर, कूली)

કેદ્દિનાં નામો Some names. (સમ નેટ્વર્ડ)

આરસાલ્ફાથુ	Marble (માર્બલ)	અક્રૂદ A cornelian (એ કોરન્નિયન)
અક્રૂદ Elient (ઇલીન્ટ)		પર્સાળુ Coral (કોરલ)
પોપરાજ Topaz (તોપાઝ)		માંગું રૂબુ Ruby (રૂબુ)
માર્ફી Pearl (પર્લ)		લીન્ડમ Emerald (એમરિન્ડ)
હીંગાકુંડી Small diamond (રમાણ ડાયમન્ડ)		દીર્ઘી Diamond (ડાયમન્ડ)
અનાજ Grains (ગ્રેન્સ)		અડન્ડ, મિચ Vetch (વેચ)
કાંગું ગ્રાનુલી Granule of rice (એન્યુલ આન્ડ રાઇસ)		કાંગું Gruel (ગ્રુલ)
કુંદળ All kinds of pulse (આન્સ કાણ્ટન્ડ કુંદળ પલ્સ)		ધડુ Wheat (ન્ડીટ)
અણ્ણા Grams (એમ્બ્રે)		ચાખા Rice (રાઈસ)
ઓર્બ Barley (બાર્લી)		બુન્દાર Holcus sorghum (હોલ્કસ સોર્ગુમ)
શુદ્ધું Bran (ખાન)		દાળ Pulse (પલ્સ)
નાનારી Millet (માલેટ)		મસૂર Lentil (લેન્ટિલ)
		વટાણ્ણુ Pease (પીઝ)
		મકાદ Maize (મેચાદ)

મુખ્ય રંગો Chief Colours. (ચીફ કૉલર્સ)

અસ્થમાની Azure (એસુર)	છાંડું Grey (ગ્રે)
દ્રાગું Black (બ્રેક)	ધાંગું White (જાંબાટ)
પચરંગી Variegated (વરીગેટેડ)	પીંગું Yellow (યેલો)
બદામી રંગનું Tawny (ટોનિ)	ભુરું Brown (બ્રાઉન)
લાલ Red (રેડ)	લીંગું Green (ગ્રીન)

મુખ્ય માર્ગદીર્ઘા Chief Metals. (ચીફ મેટલ્સ)

કલાં	Tin (ટીન)	બોલ મેટલ	Bell metal (બેલ મેટલ)
ટેપરણરાત્રા	German silver (જર્મન સીલવર)	ઝિસ્કાન	Zink (ઝિન્ક)
તાંકુ	Copper (ક્રાપર)	બ્રિસાન	Brass (આસ)
પોલાંડ	Steel (સીલ)	સિલવર	Silver (રીલિયર)
લાંદુ	Iron (આરન)	મેન્ગનાન્ડ	Magnet (મેન્ગનાન્ડ)
સોનુ	Gold (ગોલ્ડ)	લીન્ડ	Lead (લીન્ડ)

વરસની કાળુંદ્રા Seasons of the year.

(સીઝન્સ એન્ડ ધી થીયર)

વરસની કાળુંદ્રા	Seasons of the year	ઉનદાંના	Summer (સમર)
યોનિન્સ	(સીઝન્સ એન્ડ ધી થીયર)	પાનખર	કાર્તુન (ઓટોમ્ન)
ચામાણું	Rainy season (રાન્સન્સ શીકન)	નિયાંના	વિના (વિનાન્ડ)
		વરન	સ્પ્રિંગ (સ્પ્રિંગ)

Relationship. (રીલિશનશીપ)

કાકી	An aunt (એન આઉન્ટ)	કાકા	An uncle (અન અન્કલ)
જમાઈ	Son-in-law (સન એન-લો)	હસ્તુંદી	Husband's sister (હસ્તુંદુંસ રીલિસ્ટર)
પિત્રાંદ	A cousin (એ કાનીન)	યુન	Son (સન્ન)
દીકરી	Daughter (ડુટરી)	પાપ	Father (ફાથર)
પૌત્ર	Grandson (ગ્રાન્ડસન્)	ભાઈ	Brother (બ્રાથર)
બેન	Sister (સીસ્ટર)	બાળેન, જાનિન	Nephew (નેફ્ચ્યુ)
ભાણુંભાનિં	Niece (નીચ)	માભા	Maternal-uncle (મેટરનલ અન્કલ)
માઝા	Mother (મથર)		

भाभाज Maternal uncle-	भाभी Maternal aunt
in-low (मेट्रनल अन्कल-इन-लो)	(गेट्रनल आन्ट)
भाभीज Maternal aunt-in-	भासो, कुंवा Uncle (अन्कल)
law (मेट्रनल आन्ट-इन-लो)	डैट्ट Aunt (आन्ट)
दादी Grand-father (आन्ड-फाफर)	बाई Flotulent (फ्लोट्युलेन्ट)
शरदी सणो अम Cold (कोहर)	सीतापा Small-pox (स्मोक्स-पोक्स)
वामुजोगा Hysteric (हिस्ट्रिक)	हांझु Asthama (ओस्थमा)
ग्रन्थ वंदना Throe (थ्रो)	शंतापान Delirium (डेलीरिअम)
संधीया Joint (गाउट)	हेड्गी Gasp (गेस्प)

हथियारे अने अौजारे Tool and Implements.

(हुज एन्ड इंजिलीमेन्ट्स)

अंडा Razor (रेगर)	आदी Awl (आउल)
आर Goad (गोड)	अरण्ण Anvil (अन्वील)
कटार Dagger (डेगर)	करवन Saw (सा)
कातर Scissors (सीजर्स)	कानस File (फाइल)

शरीरना भाग्या Body's Parts. (बॉडी'स पार्ट्स)	
आंख Eye (आई)	मन्त्राशय Kidney (कीडिनी)
आंगनी पांचलु Eye-lash (अंगलेश)	धुनी Ankle (अनाकल)
आंखना ऊँगो Eye-balls . (आई औल्डम)	चामडी Skin (स्क्रीन)
जड़खु जो खु Jow (जो)	छानी Chest,Brest (चेरेट प्रिस्ट)
जुल Tongue (टंग)	आंगनी Finger (फिंगर)
स्तनती नीकी Nipple (तीपक्ष)	आंगन Pap (पेप)
	लोग Thigh (थाई)

આંતર્દળ Bowels (ઓરેલ્સ)	ધાતુ Crown of the head (છાંન ઓઝ મી ડેટ)
કપાથ Forehead (ફોર્ઝેડ)	દાણનું Palate (પેંસેટ)
કન્દમર Waist (વેસ્ટ)	દાઢું The fleshy part of the leg (ધી કલંશા પાર્ટ ઓઝ ધી લેગ)
કલેણુ Liver (લિવર)	દૂઠણું Knuckles (નકલ્સ)
કાન Ear (ઇયર)	જાંબુ Jaw-bone (જન-ખાન)
કાંડ Waist (વેસ્ટ)	નૂરી Navel (નવસ)
કાંબી Elbow (એલ્બો)	નલી Spleen (સ્પ્લીન)
અંભો Shoulder (શેડ્લર)	અંખાઓ Whiskers (ઉલ્લિસ્કર્સ)
ખુંધ Hump (હંપ)	દાદ Molar-teeth (માલર-શીથ)
ગરુદન Neck (નેક)	દાઢી Beard (બીપર્ડ)
ગળું Throat (થ્રોટ)	દાંતના પારા Gums (ગમ્સ)
ગાથી Cheek (ચોક)	દાંત Tooth (ટુથ)
ગુંગળી Lock of hair (લાંદ ઓઝ હેર)	દાંતો Teeth (ટીથ)
ખુંટણું Knee (ની)	દ્રષ્ટિ Trunk (ટ્રસ્ક)
નાખ Nail (નેચલ)	

કુળ કણાતી Fruits. (ખૂસ)

અખરોટ Walnut (વાણટ)	અંનાચિ Pine apple (પાણા-એપલ)
ઓળુર Fig (ફીગ)	કભરખ Averrhoa-carambola
સીતાકુણ Custard apple (કરટદાં એપલ)	(અંવરરાથી-કરટદાંએપલા)
કરમદાં Corinda fruit રૂડેશીના કુદ)	કાકડી Cucumber (કયુકબાર) કાશ્ય Cashew-nut (કેશ્યુનાટ) કાસમીસ Raisins (રેન્ઝિન્સ)

કરી Mango (મેન્ગો)	કેળુ' Plantain (પ્લેન્ટાઇન)
ખજૂર Date (ડેટ)	તરણુચુ Melon (મેલન)
ઘારેક Dry date (ઝાપ ડેટ)	આરોગ્યા Chirongia sapida (ગીરોનજુઆ સેપીડા)
ચીભાડું Musk-melon (મસ્ક-મેલન)	જરણાબુ Apricot (ઓપ્રિકૉટ)
નાખુ Rose apple (રોઝ એપલ)	તરણુચુ Water-melon (વેટર મેલન)
દાઢ્ખુસુ Grapes (ગ્રેપ્સ)	નાળ્યાંબો Cocoanut (કોકાન્યુ)
દાડમ Pomegranate (ગ્રેમ્પ્રેનેટ)	પપીયા Papaya (પાપાયા)
નારંખી Orange (ଓરાঁজ)	પિસ્ટાચીનુ Pistachio-nut (પિસ્ટાચો નટ)
પપેનાસ Pompel moose (પોપકુ-મુસ)	અદમાં Almond (ઓફન્ડ)
જામછી Guava (જવાવા)	માદાંબિંડું Maize (મેઝ)
લીધુલું Lemon (લેમન)	સાફર્ચાંડ Apple (શેપલ)
ઓરા, આલું Plum (પલમ)	શરરીરી Sugarcane (શુગર-કેલન)
મોસાંગી Mosambique (મોઝામિંગી)	સંતુર Mulberry (મલબરી)
સંંનંગી દેણુ' Banana (અનાના)	સીંગાડી Trapa hispinosa (ટ્રેપા અલ્સ્પીનોસા)

ધર્મબૂનાં નામો Articles of Jewels.

(આર્ટિફિલ્સ એન્ડ જુબેલ્સ)

અંગુઠી Thimble (થિમ્બલ્સ)	કંકાં Anklets (ઓંક્લેટ્સ)
કંકું Hoop (કુપ)	કંદું Armlet (અર્મ્લેટ)

કંડી Neeklace (નેક્લેસ)	કાંદી Silver ornament (સીલર ઓર્નામેન્ટ)
ગાંઠળ Platting (પ્લેટિંગ)	ચુંબગીઓ, A bell (એ બેલ)
ધૂઘરીઓ, A bell (એ બેલ)	ચુંદો Bracelet (આસ્ટ્રેટ)
જાડાન Inlaying (ઇન્લેઇટિંગ)	ફોર્ના Thread (ફ્રેડ)
રેષો Gold plate (ગોહડ લેટિંગ)	પોલેંચી Wristlet (રીસ્ટલેટ)
બંગડી Bangle (બેન્ગલ્સ)	માણુંકા Beads (બીડ્સ)
માદળાયું Amulet (એમ્યુલેટ)	ગીનાઅરી Enamelled (એનેમેલ્ડ)
નુસ્કી Nosing (નોઝ-રીન્ગ)	નીંઠી Ring (રીન્ગ)
શરૂગાર Apparel (એપરેલ)	માંકળાં Anklets (એ-કલેટ્સ)
, કાંસડી Collar (કોલર)	

રાશી Constilations (કોન્સ્ટિલેશન્સ)

કન્યા રાશી Virgo (વીજો)	કર્ક રાશી Cancer (કેન્સર)
કુંભ રાશી Aquarius (એકુંબરીન્સ)	તુલા રાશી Libra (લીબા)
માઝર રાશી Capricorn (ક્રીડિનાન)	ધન રાશી Sagittarius
મિથુન રાશી Gemini (જેમ્મિની)	(શેન્પિટ્રીઅસ)
ગીન રાશી Pisces (પિસ્સીઝ)	મેર રાશી Aries (એરિસ)
વરખ, તૃપ્તલ રાશી A bull (એબુલ)	તૃપ્તલ રાશી Taurus (ટેરસ)
સિંહ રાશી Leo (લીઓ)	શૃંગિક Scorpion (સ્કોર્પિઓન)

સ્વાહો Taste (ટેસ્ટ)

અમૃત Ambrosial (એમ્બ્રોઝિઅલ)	કાર્બુર્ટું Bitter (બિટર)
કાર્બાશ Bitterness (બિટરનેસ)	અદાશ Acerbity (એસ્કર્બાશ)
અદાંબ Acerb (એસ્કર્બ)	

Human Food and Luxuries.

(હુમન કુડ એન્ડ લક્કરીઝ)

અથાટુ Pickle (પીકલ)	કરી Curry (કરી)
કેંબુક Dough (ટા)	ખુદ્ધપોચ Hotchpotch (હોથપોચ)
કયળાર કરણી Mince (મીન્સ)	સુગર Sugar (સુગર)
ટેલી Treacle (ટીકલ)	ધારી પુરી Wheaten cake (= કીટન કેક)
બાઉની પીર Faumeity (ફુમેન્ટી)	

Stuffed and Fried.

(સ્ટેફ્ડ એન્ડ ફ્રિડ)

આ Tea (ટી)	અશા Whey (વેઝ)
દાઢ Pulse (પાય)	સર્દી Curd (કર્ડ)
ધાણી Parched grain (આર્થ ઓફન)	દુષ્પ Milk (મીલ્ક)
ચની ચેસે (ચીજ)	ધાન Corn (કોર્ન)
વાટી Water (વાટ્ટ)	પદ્ધતાન Pastry (પાસ્ટી)
બુરી Bun (બન)	પાસ્પ Thin-crisp-cake (થીન-ક્રિસ્પ-કેચ)
ચોળી Cake (કેક)	મદ્દાટ Cream (ક્રીમ)
માઘણ Butter (માઘણ)	મલ્લિંસ Pudding (પુડ્ડિંગ)
મેંટ્રો Pulp (પલ્પ)	મણ Honey (હેણી)
મુરઘણી Jelly (જેલી)	મીઠાઈ Sweetmeat (સ્વીટનીટ)
રોટલી Bread (બ્રેડ)	શાયુ Mustard condiment (મસાદ ટો-ટીમેન્ડ)

લાગ અનીલો સભાસ.

સ્વી પુરુષોનો સાચો સલાહકાર.

યુવાન હંપતિઓને સંસારલીલાનું રહસ્ય સમજીવનાર.

અસલી સાચિત્ર કોકશાલ્.

અનેક સંસ્કૃત દિંગી, ઈશ્વર તેમજ જુદી જુદી ભાપાઓમાં
લખાયેલા ડોકશાલ સંબંધીના અચો ઉપરથી નેયાર કરાનેલું આ
ગુજરાતી પુસ્તક અનુપર્ય અને અદ્વિતીય છે. શ્રી પુરુષોના જેઠ,
લમની આવશ્યકતા, ઘણયોંના મહિમા, વીયનો અનુભૂત બંદ
સંયોગ વિધિ, ગર્ભાધાન વગેરે, સાસારિક વિષયોના માગણું
વિવિદ ઉપરાંત, સ્વી પુરુષને થના અનેક રાગો, નેના બક્ષણ
ધરગયું દેશી તથા વિલાપતી ઓપદ્ધાતું વર્ણન રજેરદ્યા આ પુસ્તક
હેડે કુદુંઅમાં રાખવા લાયક નેયાર કરાયું છે સંસારમાં નવગત
સુખ અનુભવવું હોય, દિલાંયુષ્ય પ્રાપ્ત કરી નિરોળી જીવન ગુણરાત્રિ
હોય, ચેતી અને લઠીલાં દર્દોના બોગ થઈ પડી ડોકટરો અને લક્ષોનોંનાં
સંદર્ભો ઇપિયુલ ખવડાની નિરારા યથા હોલ, તથા એવા ન્દોથી
સાંજ ખવા ધિયોણા હોંના તો આ અથ જરૂર મગાવા ઉપરંધા
વિષય ગુજરાતીક સુદરિયાં અને આ પુસ્તકની ખાસ રોલા એ

૧૮૫૩૮૩. ૧-૧-૦

સાંજલીલ બુલા માહામ બુકસંસ્કૃત
માલા નુમાન પ્રિસે રાસીરાડ—અમદાવાદ

